

એ મેળે

સિદ્ધગિરિમંડળ શ્રી આહિનાથાય નમઃ,
(શ્રી આત્મ-કુમલ-દાન-પ્રેમ-જાંબૂલિ
જૈન અંથમાળા-૪૩)

શ્રી ગિરિરાજ-સ્પર્શના



-: લેખક-સંચાલક -

સચ્ચારિત્રયૂદામણિ સિદ્ધાંતમહોદ્ધિ પૂજયપાદ આચાર્યદેવ
શ્રીમદ્બ્રિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજનાપદુપ્રલાવક
આગમપ્રેરણ પ્રવચનપદુ પૂજયપાદ આચાર્યદેવ
શ્રીમદ્બ્રિજ્ય જાંબૂલિશ્વરજી મહારાજના શિષ્યરલ
પૂજય મુનિરાજ શ્રી ત્યાનંદવિજયજી



વીરસંવત ૨૪૮૮, આવૃત્તિ ખીલ, પ્રત ૧૦૦.
વિકભસંવત ૨૦૧૮ [પ્ર. આ. ૨૦૦૦]

કિં ભતી સહૃદયોગ



-: પ્રકાશક :-

આર્ય શ્રી જબુસ્વામી કેન મુક્તાભાઈ આગમમહિર
શ્રીમાધીવાળા, ડાલોઈ (વડોદરા)

વંદન હો તપસ્વીને

“તપગુણુઓપે રોપે ધર્મને, ગોપે નવિ જિનઆણુ;
આસવલોપે નવિ ડાપે કદા, પંચમ તપસી તે જાણ.
ધન ધન શાસન મંડન મુનિવરા

૫૧ ઉપવાસના ઉત્કટ તપસ્વી જ્યોતિર્વિદ પંચ. શ્રી. રૈવત વિજયજી
ગણ્ણિવર, સં. ૨૦૧૮ ના મહાન તપસ્વી. ઉદ્ય. જન. વિઘા-
શાલા, સાવરકુંલા [સૌરાષ્ટ્ર]

-: ઉદ્ઘારદાતા :-

રૂ. ૧૦૦૦) રાહ અમરેતલાલ ભવાનભાઈ
માલણુવાળા. (હાલ-પાલનપુર)

-: સુદ્રક :-

અરવિદ્ધ પ્રિન્ટિંગ પ્રેસ, સીધીવાડ, હળવા સામે,
જમાલપુર, અમદાવાદ.



सिद्धांतमहोऽधि दव्यानुयोग—कर्मसाहित्य चितनशील
पू० आ० श्रीमद्विजयप्रेमसूरीथरल महाराज

નિવેદન

‘શ્રી ગિરિરાજ સ્પર્શના’ ની આ ભીજુ આવતી પ્રસિદ્ધ કરતાં અમોને ધણો આનંદ થાયે છે. આ પુસ્તકની પહેલી આવતીની એ હઙસ નકલ સંવત ૨૦૧૬ માં પ્રગટ કરવામાં આવી હતી, તે થૈડા વખતમાં જ ખલાસ થઈ ગઈ હતી, બાદ હિન-પ્રતિહિન તેની ધણી માર્ગણી આવવા લાગી, આથી આ ભીજુ અવૃત્તિ પ્રગટ કરવામાં અવે છે.

હાલમાં અનેક પ્રકારનાં પ્રકાશનો બધાર પડી : હચું છે, તેમાં આ પ્રકાશન શ્રી શત્રુંજ્ય મહાતીર્થ વિષે અનેક પ્રકારની માહિતીવાળું હેવાયા યાનિકો માટે વિશેષ માર્ગદર્શક થઈ પડેલું છે. એ ને મહાતુલાવેએ આ પુસ્તક વાચ્યું છે તેઓને વાંચતાં વાંચતાં પોતે સાક્ષત શ્રી ગિરિરાજની સ્પર્શના કરી રહ્યાનો અનુભવ થયેલો છે. નવા વાચકે ને પણ જરૂર તેવો અનુભવ થરો એવું અમારું નથી માનવું છે.

આ અખુંય પુસ્તક પૂજ્યપાદ [સિદ્ધાંતમહોદ્ધિ આચાર્યભગવંત શ્રી મદ્વિજ્ય પ્રેમસ્કુરીધ્યરજી મહારાજ સાહેબના પદ્મલાકર આગમપ્રશ પૂજ્યપાદ અચર્યદૈવ શ્રી મદ્વિજ્ય જ પ્રેમસ્કુરીધ્યરજી મહારાજ સાહેબના શિષ્ય. રતન પૂજ્ય મુનિરાજ શ્રી નિત્યાનંદવિજ્યરજી મહારાજે, પૂ. પ. શ્રી રૈવતવિજીબળ્ગણ્યવરની પ્રેરણાયા, શ્રી સિદ્ધ-ગિરિજીના શિતળ છાયામાં તૈયાર કર્યું હતું. આ ભીજુ આવતીમાં તેચ્ચોશ્રીએ અનેક સુધારા વધારા કરી આપ્યા છે. ઉપરાંત શ્રી નવાખું પ્રકારી પૂલ પણ દાખલ કરીને પુસ્તકને અધિક સુંદર કરેલ છે. આ માટે પૂજ્ય મુનિવરોને ખૂલ્ય

આભાર માનીએ છીએ. પહેલી આવૃત્તિ વખતે અમે લાવના પ્રદર્શિત કરી હતી કે “લવિષ્યમાં આ પુરતકની હિન્દી અને ગુજરાતી આવૃત્તિઓ પણ પ્રગટ કરવા લાવના રાખીએ છીએ.” લાવના અમાણે આજે અમે આ ગુજરાતી આવૃત્તિ પ્રગટ કરવા લાયશાળી થઈએ છીએ; આ અમાણે હિન્દી આવૃત્તિ પણ પ્રગટ કરવા લાવના રાખીએ છીએ. શ્રી સિદ્ધાંગ્રિલુની યાત્રા કરવા જતાં વાયો આ પુરતક સંચે રાખશે તો યાત્રામાં વિરોધ આહલાદ આવશે.

વિરોધ આર્થિકી જાંખૂસ્વામિ જૈન સુક્તાબાધ શાનદાં-હિરને પચીસ વર્ષ થતાં હોઢ સંવત ૨૦૧૮ ના કાર્તિક વદ ચોથથી અગ્રિયારસ સુધી શેઠ શ્રી છગનલાલ દક્ષીંદ્ર તઃક્ષી ઉજવાયેલા રજત મહોત્સવ તથા પૂજય મુનિ રાજશ્રી દેવભક્તવિજયજી મહારાજને ચાલુ એકાત્તર ૫૦૦ આયંભીલ, તથાપૂજય મુનિરાજકી લભિધસેનવિજયજી મહારાજે સંપૂર્ણ કરેલા નિરંતર ૫૦૦ આયંભીલ અને પૂજય પ્રતિની સાધીએ શ્રી કલ્યાણશ્રીજી (ઉલોર્ધવાળા) ની શ્રી નવકારમંત્રના ૬૮-ઉપવાસ, શ્રી વર્ધમાનતપત્રની ૭૫ જ્ઞાણોએ વગેરે અનેકવિધ તપશ્ચયોજો આહિની યાદગારિ નિભિતે આ પ્રકાશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ પુરતક પ્રેસમાં જ્યાતાં ડેટલાઇટ ટાઇપો ઉડી જણા પ્રાપ્ત્ય છે તેથી રહી ગણેલી ભૂલો વાયોજોએ સુધારીને વાંચના ચિનાંદિ છે.

આ દ્વિતીયાવાર્તિ પ્રેગટ કરાવવાનો સંપૂર્ણ લાભ
માબાધના ભાનિક ધર્મગ્રેની શેઠ અમૃતલાલ ભવાનજી
તરફથી અહેંથી કરાએલ છે. તેઓનો જીવન પરિચય આ
સાથે જણાવી તેઓને આ સ્થળે જાખાર ધન્યવાદ આપી અમે
આ નિવેદન પુરં કરીએ છીએ.

સંવત ૨૦૧૮ ભાદ્રવાવદ ૧૦ } આપ્ય શ્રી જનેન. મુ. અ. મ. ના.
રવિવાર તા. ૩-૬-૧૨ } માનદ મંત્રી શા. જયતિ-
શ્રીમાળાનગો, ડાલોઠી } લાલ ઘાસુલાલ વડજગાળા

એ બોલ

‘શ્રી ગિરિરાજ સ્પશ્નિના’ ની પહેલી આવૃત્તિ
શ્રીસિદ્ધ ક્ષેત્રમાં પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક પૂજ્ય ગુરુહેવ આ-
ચાર્યાહેવ શામદ્વિજ્ય જાંથૂસુરીશ્વરજી મહારાજ સાહે-
બની આસાથી લખવાની ક્રિયા કેશેલી. તે વખતે
શ્રી સિદ્ધક્ષેત્ર અંગે પ્રેગટ થયેલ સાહિત્ય વર્ગેરનો આધાર અને
બીજુ ટેટલીક પુછપરછ કરીને સરળ ભાષામાં લખવાનો પ્રયત્ન
કર્યો હતો. મારો તે પ્રયત્ન સફળ થયો અને ધાર્થાને આ મુંહ
ઉપકારક થઈ પડી નેથી થોડાજ વખતમાં તેની આ બીજી
આવૃત્તિ રોયાર કરવાનો અવસર આપ્યો, તેથી આનંદ
અનુભવુ છું.

આ આવૃત્તિમાં ટેટલાંક પણલાં, મુલીઓ, વગેરેની વિરોધ
પરિચય કુંકમાં જણાયેલ છે, ને ॥ વાયકેને તે તે સ્થાનેનો
વિરોધ ખ્યાલ આવી કું તથા નવાણું પ્રકારી ખૂબ ઉમેરી
છે. બધું લખાણુ પૂજ્યપાદ ઉપકારી ગુરુહેવ આચાર્યાહેવ

શ્રીમદ્વિજયજીયસુરીધરજી મહારાજે તપાસી લઈ સુધારા
વધારા તથા ભાર્ગ દર્શન આપ્યું છે, તે બદલ જેઠેલો ઉપકાર
માનું તેટલો આછો છે.

આ પુસ્તક તૈયાર કરવામાં ને જે અંથોનો સહારો
લીધો છે તે તે અંથોના લેખકો, પૂજય-પંન્યાસજી મહારાજ
શ્રી વર્ધીમાનવિજયજી ગાણ્યુવર, તથા પૂજય જયેતિર્વિદ
શ્રી રૈવતિર્વિજયજી ગાણ્યુવર આદિ ગુરજ્ઞાતાઓને યાદ કરી
આ પુસ્તક પૂજયપાદ ઉપકારિ ગુરુહેવ આચાર્યદ્વિષી
મદ્વિજયજીયસુરીધરજી મહારાજ સાહેખને સમર્પણ
કરી હૃતાર્થતા અનુભવું છું.

સંવત-૨૦૧૮, વે. સુ. ૭ ગુરુવાર


શ્રી વિજદાનસુરીધરજી શાનમંહિર } સુનિશ્ચી નિત્યાનંદ
કાળુપુર રોડ-અમદાવાદ } વિજય

ઉદ્ઘારણીલ ધર્મગ્રેમા શ્રીઅમરતલાલ ભવાનજી ભાઈનો જીવનપરિચય

ગુજરાતમાં પાલનપુર નજીક માલાણ નામનું
સુંદર ગામ આવેલું છે; ત્યાં ધીરધારનો ધોધો કરતા
શેઠ ભવાનજીભાઈ બેચરભાઈ રહેતા હતા. તેમને
સુશીલ ધર્મનિષ્ઠ કુંબરભાઈ નામનાં ધર્મપત્ની હતાં.
ગામમાં શ્રીજિનમંહિર ઉપાશ્રો પણ હતા. આ ધર્મ-
શીલ દંપતી પૂજય હેવ-ગુરુની ભક્તિ સુંદર રીતે
કરતા હતા.

તેઓને શ્રી અમરતલાલ, કુચરાલાલ અને
વેલચંહભાઈ નામના ગણું પુત્રો હતા. મોટા

આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાલ લેનાર



માલણ (પાલણપુર) નીવાસી ઉદારદીલ ધર્મજ્ઞમી
શ્રોઠ અમરતલાલ ભવાનગુભાઈ

નેત્તાને એકાંક્ષા પ્રદાન કરીને કૃત જીવિતનું કરીને
જેઠી આપોને એકાંક્ષા કરું હોય તો એવી 'અમૃત' જીવિતનું
દૈનિક જીવિતનું પણ એવી કરીને કરીને એકાંક્ષા
ને વિનાન સુધીના રોકડુંફેનો. સુધીનું એવી
બૃદ્ધિની જીવિતને જીવિતની જીત એવી નથી.

‘હુ ત્રિશ પ્રાણી જીવિત જીતું જીતું જીતું
નાભાળાનાનેને દેખેદ્વારું હું જીવિતુંનેદેખીનીટો
બ્રહ્માણ ચિલે બાની ૧૩.૨ એટાનુંનું ૧૮૮૧ ત્રિશ દેશ
સુધીનાન ફરજિયાને જીતે જીતોને જીવિતું જીવિતનું
જીતું નથી જીવિતનાનાનેને જીતું

‘હુ જીવિતું

બ્રહ્મ નાભાનું હોયાં કરીને જીવિતું જીવિતું
હુ બ્રહ્મ બિશ્વાં ૧૪૧૩ જ્યાયોનીય હું હું હું હું
બ્રહ્માનું બ્રહ્મ નાભાનું જીવિતું જીવિતું
હુ બાળિયિની જીતે એકાંક્ષા જીતે જીતે
હુ નાનાનીની જીતે બાળિયાની નોંધીની. જીતે
જીતે જી માનુષની જીતે જીતે જીતે જીતે
જીતે નાનાની નોંધી જીતે જીતે જીતે
જીતે ૨૦૦૨ નાનાની જીતે જીતે જીતે
નાનાની જીતે જીતે ‘હુ જીવિતું માનુષનું
નાનાની જીતે જીતે’ જીવિતું જીવિતું
જીતે માનુષનું જીતે જીતે જી જીવિતું જીવિતું
જીવિતું જીવિતું જીતે જીતે જીવિતું જીવિતું
જીતે જીતે જીતે જીતે જીતે જીતે

હતા તેઓ, પૂજયશ્રીને આગહપૂર્ણ વિનંતિ કરી પોતાના માલાણ ગામે લઈ ગયા હતા, ત્યાં તેમણે પૂજા પ્રલાવના સાધનીક લક્ષ્ણ વળેરેનો લાલ સારો લીધો હતો, ખાંથી પૂજયશ્રી બાલારામ પદ્ધાર્યા, ત્યાં પણ તેમણે શ્રીસંઘસંક્રિતનો લાલ લીધો હતો. તે વખતે પૂજયશ્રીના ઉપરેશથી તેઓ કેટલાક વ્રત નિયમોમાં જોડાયા હતા અને સંતોષવૃત્તિ ધારણ કરી શાસનનાં શુલ્ક કાર્યોમાં પોતાની લક્ષ્ણીનો સહૃદ્ય કરવાનું ઉદાર લાવથી પ્રિયુંઠિત કર્યો છું.

આ યછી તેઓ વખતો વખત પૂજય ગુરુદેવબા વંદન તથા ઉપરેશનો લાલ લેતા રહ્યા છે, અને પાલતમુર્માં પદ્ધારતા અન્ય પૂજય ગુરુદેવાની પણ લક્ષ્ણ તથા ધર્મની સેવા પ્રલાવના કરતા રહી પોતાની ધર્મ લાવનામાં અભિવૃદ્ધિ કરતા રહ્યા છે.

પૂજયશ્રીના શિષ્યરલન જ્યોતિવિંદ પૂજય પંન્યાસજી મહારાજ શ્રીરૈવતબિજયાલ ગણ્યિવરેની ખાસ પ્રેરણાથી શ્રી અમરતલાલભાઈએ ‘શ્રી ગિરિરાજ સ્પર્શાના’ ની આ બીજી આવૃત્તિના પ્રકાશનમાં (૩.- ૧૦૦૦) એક હજારું દાન કરી શુલ્કસંક્રિતનો લાલ લીધો છે, તે બહાર ધન્યાઓ સારે આમો દેખ્યોમાં આભાર માનીએ છીએ.

પૂજય ગુરુદેવનું ચાતુર્માસ પોતાના ગામમાં

(માત્રણ) કરાલી પોતાના કુદુંખીએ આદિ અનેક ધર્મ પામે એ શુલાશયથી પૂજયશ્રીની નિશ્ચામાં શાસનભક્તિનાં અનેક સુંદર કાયોને લાલ લેવાના શુલ મનોરથો લાઈ અમરત-લાલ સેવી રહ્યા છે, અને તે માટે પૂજય ગુરુહેવને વિનંતિ કરવા તેઓ અમદાવાદ આવ્યા હતા અને તેમની એ વિનંતિ સતત ચાલુ છે. અમે ઈચ્છિએ છીએ. કે તેમના એ મનોરથો સર્ફણ થાય.

આ રીતે લખિયમાં પણ તેઓ ઉદાર હીલથી જિનશાસનમાં જાનાદિ પ્રભાવનાનાં ઉલ્લબ્ધ ધર્મકાર્યો કરવામાં પોતાને મળેલી લક્ષ્મીને અધિકાધિક અદ્વય કરવા સુંદર આરોગ્યપૂર્વક શક્તિમાન રહેણા, એવી અમો શાસનહેવ પ્રત્યે પ્રાર્થના કરતા આ જુવન પરિયય આપી વિરભીએ છીએ.

લીઠ પ્રકાશક

શ્રી ગિરિરાજ સ્તુતિ

“લાગે છે આ દિવસ સધળો આજ આનંદકારી,
હેઠી શ્રંગો સિદ્ધગિરિ તથું, સૌખ્ય સૌનંદ્યકારી;
આત્માનંદી ગુરુગુણુભૂષણ, ભક્તિ ભાવેશી પૂર્ણ;
તે માટે શ્રીગિરિવર કરો, પાપ સધળાંજ ચૂર્ણ.”
“સંસાર ઘોર અપાર છે તેમાં બૂડેલા લવ્યને,
હે તારનારા નાથ શું ભૂલી ગયા નિજ ભક્તાને;


મારે શરણ છે આપનું, નવિ ચાહતો હું અન્યને,
તો પણ પ્રભુ મને તારવામાં, દીલ કરો શા કારણે.”

“ભયથી અનેકો ગાલરો, ચિહુ દિશાએ રખડતો,
આધારથી અળગો થયેલો, આપ વિષુ હુઃખ પામતો;
ધારક અનંતા વીર્યના, હેનાર જગતને,
હું નાથ! ભવ અટવી ઉતારી, કરો હવે નિર્બંધ મને?”

“નિભસ્ય વિનના કમળ ઘીલે, તિમતુજ વિષુ માહરી,
હેવે કદી નાં સુક્રિય ભવની, માહરી એ આતરી;
નેમ મારનાચે મેધને:નેધ, તેમ હેઠી હું આપને,
નાચ કરું હુરખાઈને, મનમાં ધરી શુલ લાવને.”

ધન્યા દૃષ્ટિરિયં યયા વિમલયા દૃષ્ટો ભવાન્પ્રત્યહं,
ધન્યાઽસૌ રસના યયા સ્તુતિપથં નીતો જગત્વત્સલઃ ।
ધન્યં કર્ણયુગં વચોમૃતરસः: પીતો સુદા યેન તે,
ધન્યં હૃત્સતતં ચ યેન વિશદ્દસ્ત્વન્નામન્ત્રો ધૃતઃ ॥

શ્રી સુધર્માસ્વામી ગ્યાનબંદર ઉમરા સુરત કેન્દ્રાભેદી વ્યાપક ઓર્ગાનિઝેશન



અનુક્તમણુકા

નં	વિષય	પૃષ્ઠ.
(૧)	નિવેદન ...	૩
(૨)	એ બોલ ...	૪
(૩)	શેષશી અમરતલાલનો જ્વનપરિચય	૬
(૪)	ગિરિરાજ સ્તુતિએ ...	૮
(૫)	અનુક્તમણુકા ...	૧૧
(૬)	શુદ્ધિપત્રક	૧૪
(૭)	સમર્પણ	૧૬

વિષાગ પહેલો

(૧)	શ્રી ગિરિરાજનો મહિમા ...	૧
(૨)	શ્રી શત્રુંજ્ય સેવનથી થતાં ફળો
(૩)	ધાત્રા કરવાથી મળતું ફળ ...	૮
	૧-સુશર્માની કથા ...	૧૦
	૨-ત્રિવિક્રમ રંગની કથા ...	૧૧
	૩-૪-મેરા-સિહ ...	૧૫
	૪-ઉંસ ...	૧૭
(૪)	શ્રી સિદ્ધગિરિભાં તપનું ફળ ...	૧૮
(૫)	શ્રી તીર્થીકર અગ્રવાંતોનું આગમન ...	૧૯
(૬)	શત્રુંજ્ય મહાતીર્થના થયેલા ઉક્કારે ...	૨૧
(૭)	” ” ઉક્કારેનું વર્ણન ...	૨૨
(૮)	ગિરિરાજ ઉપર મેઝે ગયેલાનાં નામો ...	૪૨
(૯)	ગિરિરાજના ૧૦૮ ઉત્તમ નામો ...	૪૩
(૧૦)	શત્રુંજ્ય મહાતીર્થ ક૬૪ ...	૪૫
(૧૧)	તીર્થયાત્રાનો પ્રભાવ ...	૬૦

- (૧૨) યાત્રા કેવી રીતે કરવી જોઈએ ? ૬૩
 (૧૩) માનસિક, વાચિક, કાચિક પવિત્રતા કેમ રાખવી ! ... ૬૩
 (૧૪) પાલીતાણા શહેર ૬૫
 (૧૫) અનેકોએ કરેલી તીર્થયાત્રા સંબંધી જાણવાને...

વિલાગ અનુભૂતિ

નં	વિષય	પૂછ.
(૧)	સ્ટેશનથી તળેરી	૭૬
(૨)	ગામથી તળેરી સુધીની ધર્મશાળાઓ પગલાં વગેરે	૭૬
	મંદિરો	૭૮
(૩)	આવશ્યક સૂચનાઓ	૮૧
(૪)	દહેરાસરની વિધિ	૮૩
(૫)	પ્રભુને નવઅંગે પૂજા કરવાનું કારણ વરસીદાનનો વિધિ	૮૭
	„ ના ચૌદ અતિરાય	૮૦
	જ શુદ્ધિ ...	૮૪
(૬)	તળેરીથી ગિરિરાજ ઉપર અઠતાં વચ્ચાં આવતાં પગલાં બગેરે	૮૬
(૭)	નવદુંડાનું વર્ણાન દીર બિંદમશી	૧૧૨
	સ્થેર્યંકુંડનો પ્રલાઘ	૧૧૪
	પહેલી પ્રદક્ષિણાઃ... ...	૧૧૮
	સંહસ્રકુટની નિષ્ઠ પ્રતિમાએ	૧૧૯
	૧૪૫૨ જાણવાસે	૧૨૦

નીળ પ્રદ્દિણા	૧૧૬
ત્રીજી "	૧૨૧
રાયણુ વૃક્ષનો મહિમા	૧૨૧
ખરતર વસહિ	૧૨૫
ગ્રામુખજી (સવા સેમાની) કુંક	૧૨૬
(૧) મંદિરોની રચના	૧૨૭
(૬) પ્રતિમાઓની વિપુલતા	૧૩૪

વિભાગ નીંજે

વિષય

					પૂછું
(૧)	નવાણું યાત્રાની વિધિ	૧૩૭
(૨)	" " તુ જણાણું	૧૪૦
(૩)	છંદઅંકમ તપની વિધિ	૧૪૨
(૪)	૨૧ ખમાસમણું	૧૪૪
(૫)	૧૦૮ "	૧૪૮
(૬)	ગિરિરાજની પાંજે	૧૪૮
(૭)	પ્રદ્દિણાઓ	૧૫૬
	૭ દેવકીના પુત્રો	૧૫૦
(૮)	તીર્થભાં થતાં કાર્યના નકરા	૧૫૬

વિભાગ ચોથો

(૧)	પ્રલુ સન્મુખ બોલવાની સુતિઓ	૧૬૮
(૨)	પાંચ ડેકાણુ કરવાનાં ચૈત્યવંદન સૂત્રો સાથે	૧૭૦
(૩)	શ્રી સિદ્ધગ્રિષ્ણનાં સ્તવનો	૧૮૧
(૪)	પાંચ ગૈત્યવંદનો	૧૬૨
(૫)	,, સ્તવનો	૧૬૪
(૬)	,, થોયો	૧૬૭

વિભાગ પાંચમો

(૧)	નવાણુ પ્રકારી પૂજા	૧૬૬
-----	--------------------	-----	-----	-----	-----

શ્રી	મહાવીર જૈન પારષુ	૨૧૪
શ્રી	પાર્વતીન રત્વન	૨૧૫
(૨)	ઉપસંહાર	૨૧૭
	આંખા અતિકારતવન	૨૨૩

શુદ્ધિ પત્રક

ઘૂર્ણ.	લીટી	અશુદ્ધે.	શુદ્ધે
૨	૨-૩-૪	ચોજનો	ચોજનનો
૧૧	"	(મુનિના સુખમાંથી તેના) આ શરૂદ્ધો ઓછા કરવા	
૧૪	૪	ઓધિંપી	ઓધિંપી
+ ૧૨	૬	વરથી	વૈરથી
+ ,	"	શાંત	શાંત
+ ૧૪	૧૦	કોધ	કોધ
+ ,	૧૫	યા	યાં
+ ૧૫	૨	સત્તુંજય	શત્રુંજય
"	૫	પહોળા	પહોળા
"	૬	મયુર	મયુરે
"	૧૫	થચો હતો અને	થઈ
+ ૧૬	૨	પટેજર	પેટલર
+ ,	૪	બચનો	બચનો
+ ,	૫	બચમો	બચમાં
+ ,	"	સમંગસારે	સથંભસાથે
+ ,	૧૪	તર્યાચ	તીર્થાચ
+	આ નીશાનવાળી અશુદ્ધિ કેટલીક બુકોમાં છે. કાના,		

માત્રા, બિંદી કઠી ગયેલ સુધારીને વાંચવી

શુદ્ધિ પત્રક


પૃષ્ઠ	લીટી	આશુદ્ધ	શુદ્ધ
૧૭	૧૭	રહેવા	રહેલા
૧૮	૨	પરદરા	પરદારા
૨૦	૩	ચોવીસમાં	ચોવીસીમાં
૨૨	૫	કુપ્પસહ	કુપ્પસહ
૨૮	૬	ઇશાનન્દ્રે	ઇશાનધન્દ્રે
૨૯	૫	હેવીને	હેવોને
૪૧	૫	નિય	નિલ્ય
૪૫	૬	દાને	દાનને
૪૭	૫	મણ્યા	મણ્યા
"	૧૬	સલળી	સાંખળી
"	"	મંત્રી	મંત્રીએ
"	"	કાયમરહી	કાયમુ
૪૪	૧૧	મળના	મળતાં
૫૫	૫	સિદ્ધ	સિદ્ધ
૫૮	'	છેહી શક્કિ	શક્કિન્દ્રે
૬૪	૬-૮		નોઈએ

સે.... મ.... ર્પ.... એ

સંસારદીપી ભવ-સાગરમાં ઓલા આતી
 લજુમણીપી મારી નારને સંલાળી લઈ
 મુક્કાંનગરી તરફે પ્રયાણુ કરાવ-
 નારા આગમ હિંબાકર પ્રવચન
 પ્રભાવક પુજ્ય શુદ્ધેવ
 આચાર્યેવ

શ્રીમદ્બિજ્ય જંબૂસુરીશ્વરજી મહારાજના।
 કરકમલમાં અક્ષિ લાવે
 —શિશુનિત્યાનંદ.

તपોગંગાધિરાજ, સુવિહિતશિરોમણિ, પૂ. પા.
આચાર્યભગવન્ત શ્રીમદ્વિજયપ્રેમસૂરીધરજી
મહારાજ સાહેબના પદ્ધાલંકાર




પૂ. પા. શાસનપ્રભાવક આગમપ્રેરણ, ઉપકારિ આચાર્ય ગુરુદેવ
શ્રીમદ્વિજયજંખુસૂરીધરજી મહારાજ

ॐ नमः ।

तीर्थाधिराज श्री आदिनाथाय नमो नमः
श्री दान-प्रेम जंबूसूरीश्वरगुरुभ्या नमः

श्री गिरिराज स्पर्शना



(१) श्री गिरिराजने महिमा

श्री शत्रुंजय गिरिराज एटले प्रायः शास्त्रत महातीर्थ. शास्त्रत एटले केहिए कही नहि भनावेलु; अनंता अनंत कालथी विद्यमान अने भविष्यमां पछु अनंत अनंत काल रहेनारु. प्रायः एटला भाटे के, वा श्री शत्रुंजय महातीर्थ प्रभाणुमां वधघट थया करे छि.

આ સિદ્ધગિરિ પહેલા આરામાં એંસી ચોજનનો વિસ્તાર; બીજા આરામાં સીતેર ચોજનો, ત્રીજા આરામાં સાડ ચોજનો ચોથા અરામાં પચાસ ચોજનો, પાંચમાં આરામાં ખાર ચોજનો અને છીવટે છુટ્ટા આરામા સાત હાથ જેટલા પ્રમાણુષાળો રહેશે.

આ તીર્થશું પ્રમાણુ અવસર્પિણી કાલમાં ઘટતું જય છે. જ્યારે ઉત્સર્પિણી કાલમાં વધતું જય છે. આવતી ઉત્સર્પિણીના પહેલા અરમાં સાત હાથ, બીજા અરામાં ખાર ચોજન, ત્રીજા આરામાં પચાસ, ચોજન, ચોથા આરામાં સાંઠ ચોજન, પાંચમા આરામાં સીતેર ચોજન, અને છુટ્ટા આરામાં એંસી ચોજનનો થવાનો, પરન્તુ આ તીર્થનો મહિમા તો એક સરખા રહેવાનો.

શ્રી ઋષલહેવ ભગવાનના વર્ખતમાં ત્રીજા આરાના અંતે આ ગિરિજા મૂલમાં પચાસ ચોજન, ઉપર દર ચોજન અને હંચાઈમાં આઠ ચોજનનો હતો.

અદીક્ષિપ-મનુષ્યકોત્રમાં ધર્મની સામશ્રીવાળા પાંચ મહાવિદેહક્ષેત્રો પાંચ ઐરવતક્ષેત્રો અને પાંચ ભરતક્ષેત્રો છે. (જંબૂદ્ધીપમ ૧ નેલારતાં ૧ ઐરવત, ૧ મહાવિદેહ, ધ્યાતકી ખંડમાં ૨ લરત; ૨ ઐરવત, ૨ મહાવિદેહ, પુષ્કરાર્ધ દીપમાં ૨ લરત, ૨ ઐરવત, ૨ મહાવિદેહ આંવેલા છે.) આ શાખ્યત શત્રુંજય મહાતીર્થ તો આપણે જ્યાં રહીએ છીએ તેજ જંબૂદ્ધીપમાં આવેલું છે, આપણા સીનો જન્મ આ મહાતીર્થની મનોહર છાયામાં થયો છે. તે આપણે મહાન પુષ્યોદય ગણ્યાય.

આ મહાતીર્થનો મહિમા શ્રી કષણલહેલે પ્રબુનાં આદેશથી શ્રી પુંડરીક ગણુધર લગવંતે વિશ્વના ગ્રાણીઓના હિતને માટે સવા લાખ રૂપોક પ્રમાણુ કહ્યો હતો, તે પછી અરમ તીર્થાધિપતિ શ્રી મહાવીરસ્વામીએના આદેશથી શ્રી સુધર્માસ્ત્વામીએ મતુભ્યોનું દુંકું આખુબ્ય જાણીને તેમાંથી જંક્ષેપ કરી ચોવીસ હજાર રૂપોક પ્રમાણુ કહ્યો હતો. ત્યાર પછી ઓ વૈરાઘ્યરસનાસાગર અને સર્વ વિદ્યામાં પ્રવિષ્ટ વિવિધ લભિધવાળા શ્રી ધનેશ્વરસૂરીશ્વરલુએ વહૃણીપુરમાં શાનુંજય મહાત્મ્ય નામના અંથની સુંદર રચના કરી હતી; જે હાલમાં આપણુને મૂળ અંથ તથા લાધાંતર મળી શકે છે.

શ્રી ધનેશ્વરસૂરીશ્વરલુ મહારાજે શાનુંજય મહાત્મ્યમાં કહ્યું કે—

૧ “ધર્મ પામવાની ઇચ્છાથી તમે સર્વ દિશાઓમાં શા માટે લટકયા કરો છો? એકવાર શ્રી પુંડરીકગિરિ (શાનુંજયગિરિ) ની છાયાનો પણ સ્પર્શ કરો, તો બીજું કાંઈ કરવાની જરૂર નથી.

૨ જે તમારે તત્ત્વ જાણવાની ઇચ્છા હોય કે ધર્મ કરવાની ઇચ્છા હોય તો બીજું બધું છાડી દઈ આ શ્રી સિદ્ધગિરિવરનો આશ્રય કરો.

૩ શાનુંજયગિરિ પર જઈને શ્રી જિનેશ્વરહેવનું ધ્યાન કરવું તે અતિ શ્રેષ્ઠ છે, કેમકે તેના જેવું બીજું પરમ તીર્થ કોઈ નથી. લુચોએ લયંકર પાય ઉપાર્જન કરેલું હોય તો પણ પુંડરીકગિરિનાં સમરણુથી સંઘળાં પાપો નાશ પાડી

પણ છે, કીર્તિઓ પણ શ્રી અરિહંતના દર્શનથી સ્વર્ગામી થાયા છે.

૪ અન્ય તીર્થમાં જઈ ઉત્તમ ધ્યાન, દાન, શીલ, પૂજન કુસ્વાસી જે કોઈ મણે છે તેનાથી કંઈગાણું કુણ માત્ર શત્રુનાની કથા સંભળવાથી મળે છે.

નાનાચન્દ્રાદિ તીર્થ ડાપર અનંત તીર્થીકરેને અને અનંત સુનિવરે સિદ્ધિપદને આ મેલા છે અને લક્ષ્મિએ કાળમાં પણ અનંત તીર્થીકરેને અને સુનિવરે મોક્ષસુખમે પ્રાપ્ત કરેણે, આંદે શ્રી શત્રુનાય મહાતીર્થને મોક્ષનિવાસ કરીએ તો કંરણે મિઠું નથી.

(૨) શ્રી શત્રુનાયમાં થતાં કણો:—

૧ શ્રી સિદ્ધગિરિલુને સ્પર્શ કરનારા પ્રાણીઓને શોગ—સૌતાપ—હુઃખ—વિયોગ—હુર્ગંતિ અને શોક થતાં નથી.

૨ દર્શનન અને સ્પર્શનથી સંસારમાં ઉત્તમ પ્રકારનાં બેઝસુખો અને અંતે સુક્ષ્મિતનું સુખ મળે છે.

૩ તીર્થના પ્રલાવથી ગાઠ નિકાયિત કરેનો પણ નાશ થાય છે.

૪ જેએ આ તીર્થની યાત્રા, પૂજા, સંઘની લક્ષ્મિ અને સંઘની રક્ષા કરે છે, તેએ સ્વર્ગલાક્ષમાં પૂજય છે.

૫ પ્રલુને શીતળ અને સુગંધી જગાથી સ્નાન કરાવ-મારા શુદ્ધાર્થી સુગંધિત અને છે.

૬ પ્રલુને પંચામૃતથી સ્નાન કરાવનારા પંચમજીન — ક્રવળાન આમ કરી પાંચમી ગતિ મોક્ષને પામે છે.

૭ પ્રલુને કોશર અને ચંદ્રમથી પૂજન કરનારા અખંડ લક્ષ્મીવાળા થઈ કીર્તિરૂપ સુગંધીના લાગીદાર થાય છે.

૮ પ્રલુને બરાશથી પૂજન કરનારા જગતમાં શ્રેષ્ઠ અને છે અને શત્રુના લયથી મુક્ત થાય છે.

૯ પ્રલુને કસ્તુરી અગરુ અને કેશસથી પૂજન કરનારા અગતમાં ગુરુપદને પામે છે.

૧૦ પ્રલુનુ અર્ચન કરનારા ત્રણે જનુંતને પોતાની કીર્તિથી વાસિત કરી, આ લોકમાં નિરોગી થાય છે અને પરલોકમાં સહૃગતિને પામે છે.

૧૧ સુગંધિ પુણ્યોથી પૂજા કરનારા સુગંધી શરીર વાળા અને ત્રણેલોકને પૂજવા ચોચ્ચ બને છે.

૧૨ સાધારણ ધૂપ કરનારને ૧૫ ઉમવાસ અને હર્ષાદિ મહાસુગંધી પદાર્થોથી માસઅમણું દ્રળ પ્રાસ થાય છે.

૧૩ અખંડ અક્ષત ચઠાવનારને અખંડ સુઅસંપત્તિ મળે છે, અને સધળા મનોરથ પૂર્ણ થાય છે.

૧૪ હીપક પૂજા કરનારા શરીરની શાંતિ દેહિપ્રમાન થાય છે, અને સંસાર સંખંધી અંધકાર નાશ પામે છે. મંગલદીપથી માંગલિકો પ્રાસ થાય છે.

૧૫ નૈવેદ્ય પૂજા કરનારને મિત્રતા વધિ છે.

૧૬ કુલ પૂજા કરનારને મૌકા સુખ પ્રાસ થાય છે.

૧૭ આખૂધણો ચઠાવનાર ત્રણે ભુષનમાં અદંઝર ભૂત અને છે.

૧૮ રથયાત્રા માટે રથ—આપનારને ચક્રવર્તીની સંપત્તિ પ્રાપ્ત થાય છે.

૧૯ પોખરણું કરવાથી કર્મરહિત બને છે.

૨૦ તીર્થમાં અસ્ય આપનારને સર્વ તરફથી લક્ષ્ણી પ્રાપ્ત થાય છે. હાથી આપનારને સારા શીલવાળી સીઁઓ પ્રાપ્ત થાય છે. પ્રલુના પખાય માટે ગાય આપનાર રાજ થાય છે.

૨૧. ચંદ્રવો. છત્ર, સિંહાસન ચામર વગેરે આપનારને ણધી વસ્તુઓ ભવાન્તરમાં પ્રાપ્ત થાય છે. મહેન્દ્ર દેવજ અથવા ધળ ચઠાવનારા અનુત્તર વિમાનમાં સુખ લોગવી શાશ્વતપદને પ્રાપ્ત કરે છે.

૨૨ સોના ઝપા કે તાંખાનાં કલશ કરાવનાર સ્વમેમાં પ્રથું પીડા પામતા નથી. અને શાંખિત મંગળને પ્રાપ્ત કરે છે:

૨૩ આંગાર કરનાર વિશ્વમાં થૃંગારભૂત બને છે.

૨૪ પ્રલું પૂજને માટે ગામ કે વાડી આપનારા ચક્રવર્તી બને છે.

૨૫ દશમાળા ચઠાવવાંથી ઉપવાસ, સો માળાથી છઠ, હળર માળાથી અટુમ, લાખ માળાથી પંદર ઉપવાસ, દશ લાખ માળાથી મહિનાના ઉપવાસનું ઇણ મળે છે.

૨૬ શ્રી શત્રુંજયના માર્ગમાં યાત્રાથે જતા સાધુ સંઘની લક્ષ્ણિ, પ્રલાવના, વૈયાવચ્ચ પ્રમુખ કરતાં ગિરિરાજ દૂર હોય ત્યાં સુધી કોડગણું ઇણ અને ગિરિરાજ સાક્ષાત નજરે પડતાં અનંતગણું ઇણ પ્રાપ્ત થઈ શકે છે.

૨૭ ને ને મહાતુભાવ મુનિઓને અહિં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેમજ નિવોષુ પ્રાપ્ત થયું છે, તે સર્વેને વંદન કરવાનું કૃળ શ્રી પુંડીક ગિરિજાને ભાવસહિત વંદન કરતાં પ્રાપ્ત થઈ શકે છે.

૨૮ અન્ય તીર્થોમાં ઉચ્ચ તપસ્યા તથા ધ્યાનથ૰ બઢે ને કૃળ પ્રાપ્ત થાય છે, તે કૃળ શ્રી શન્મુંજય ગિરિપર પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે.

૨૯ એક કોડ મનુષ્યોને છાન્દિત આહારનું ખોજન કરાવવાથી ને પુષ્ય થાય છે, તેટલું પુષ્ય શન્મુંજય તીર્થોમાં એક ઉપવાસ કરવાથી જ પ્રાપ્ત થાય છે.

૩૦ સ્વર્ગમાં, પાતાલમાં અને મનુષ્યલોકમાં ને કોઈ નામ માત્રથી પણ તીર્થ છે, તે સર્વે તીર્થોને માત્ર પુંડીકગિરિને વંદન કરવાથી જોયા સમજવા. અર્થાત્ શન્મુંજય તીર્થનું વંદન કરવાથી સર્વ તીર્થોને વંદન કર્યાતું કૃળ પ્રાપ્ત થાય છે.

૩૧ અધ્યાપદ ચર્વિત, સમેતશિખરલુ, પાવાપુરી, ચંપાપુરી અને ગિરનાર તીર્થોને વંદવાથી ને પુષ્ય થાય તે કરતાં સોગળું પુષ્ય શ્રી શન્મુંજય તીર્થોને વંદન કરવાથી થાય છે.

૩૨ આ તીર્થરાજને વિષે પૂજા કરવાથી એક ગણ્યું પુષ્ય થાય છે. પ્રતિમાનું સ્થાપન કરવાથી (પ્રતિમા ઐસા ડવાથી) સોગળું પુષ્ય થાય છે. જિનભુવન કરાવવાથી હણરગળું પુષ્ય થાય છે. અને એ તીર્થનું પાલન (રક્ષણ) કરવાથી અનંતગળું પુષ્ય થાય છે.

૩૩ ને સનુષ્ય શ્રી શત્રુંજ્ય ગિરિના શિખરસ્પર જીનેથરની પ્રતિમા બેસારે અથવા ચૈત્ય કરાવે, તે ભરત-શૈવનો લોગવીને એટલે ચહેરવતી થઈને પછી સ્વર્ગ તથા મોક્ષને વિષે વાસ કરે છે. અર્થાતું સ્વર્ગ અને મોક્ષના સુખ ઘરે છે.

૩૪ ને સનુષ્ય શત્રુંજ્ય તીર્થસ્પર પાણીરહિત ચૈવિંડારા (ઇનું લક્ષ્ય એ ઉપવાસ) કરીને સાત અત્રાઓ કરે તે ત્રીજે લક્ષ્ય મોક્ષ પદને ખાંચે છે.

૩૫ અન્ય સ્થાનમાં સુવર્ણ-ભૂસિ કે અલંકારાદિ આપવાથી ન થાય તેટલાં પુણ્ય સિદ્ધગિરિમાં એક ઉપવાસ કરવાથી થાય છે.

૩૬ નેટ્લાં કર્મ સેંકડો સાગરસેપમ સુધી નરકમાં હુંઘ લોગવતાં ન અપે, તેટલાં કર્મ કાર્તિક માસમાં માસખમાણું કરવાથી અપે છે.

૩૭ કાર્તિક પૂનમે માત્ર એક ઉપવાસ કરે તો આજ હતમાના પાપથી મુક્ત થાય છે.

૩૮ કાર્તિક પુણીમાંથે બળવંતતું ધ્યાન કરનાર સર્વ સુખ લોગવી પ્રાંતે મોક્ષને પાંચ છે.

૩૯ કૈરાખ, કાર્તિક અને ચેત્ર સુંદ પૂનમે નેચો સંધ્યા લદ્ધને આવી આદર્શી દાન, તર્ફ કરે છે તેચો મોક્ષ સુખને ઘરે છે.



(3) યાત્રા કરવાથી મળતું ફળઃ—

શ્રી નંહીશર દ્વીપની યાત્રા કરતાં, બમણું ફળ કુંડલગિરિની યાત્રામાં, ત્રણગણું ઇચ્છાગિરિની યાત્રામાં, ચારગણું ગજદંતના તીર્થમાં, આડગણું જંલૂધુક્ષના શાખાત ચૈત્યની યાત્રામાં, ચોવીસગણું ધાતકીખંટના ચૈત્ય દર્શાનમાં છત્રીસગણું પુષ્કરાર્ધના ચૈત્ય દર્શાનમાં, છત્રીશગણું મેરું પર્વતના ચૈત્યયાત્રામાં છત્રીશ હંજરગણું શ્રી સુમેતરશીખરની યાત્રામાં, લાખગણું અંજનગિરિની યાત્રામાં, દશલાખગણું અધ્યાપહતીર્થની યાત્રામાં અને કોડગ ઝ્ણું ફળ શ્રી સિદ્ધાચલતીર્થની યાત્રામાં મળે છે.

શ્રી નંહીશરદ્વીપની યાત્રા કરતાં કોડગાણું ફળ આ તીર્થમે પ્રાપ્ત થાય છે તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે, કે “અહીં જે કુદ્ર અને હિંસક પ્રાણીઓ છે તે પણ ત્રણ ભવમાં ઉત્તમ સિદ્ધિયદ્દને પામે છે. જે અભિય અને પાણી લુચો છે; તે આ તીર્થના દર્શાન પણ કરી શકતા નથી. રાખ્ય વગેરે કદાય મેળવી શકાય, પણ આ તીર્થ મળવું અતિ ફુર્લાં છે.”

આ તીર્થના પ્રલાયે નરકગતિમા જવા ચોખ્ય આત્માએ પણ દેવલોકની ગતિ કેવી રીતે પ્રાપ્ત કરી તે નાચેની કથા વાંચવાથી ખ્યાલ આવી જશે.

૧ સુશર્માની છથા

મહાવિદેહ ક્ષેત્રમાં પગુઆમમાં સુશર્મા નામનો એક મૂર્ખ શિરોમણી આદ્ધારુ રહેતો હતો, તેને એક પત્ની પુત્ર અને પુત્રી હતાં. નગરમાંથી લીખ માંગી લાવી જેમ લા તેમ નિવોહુ કરતો હતો.

એક વખતે તે ગામમાં લીખ માંગવા ગયો, આજો દિવસ ફરવા છતાં કાંઈ પણ ભીક્ષા મળી નહિ, તેથી કંટા જીને ખાલી પાત્રે ઘર આવ્યો. જીને સમજલવવા છતાં શાંત થઈ નહિ, એટલે સુશર્માએ એક પત્થર માર્યો, પત્થર ભર્મસ્થાનમાં વાગવાથી શ્રાડી વારમાં મરણુ પામી ગઈ. પિતાની માતાને મરણુ પામેલી જોઈ, પુત્ર પુત્રી પિતાને કોધથી કહેવા લાગ્યા કે, ‘અરે અધમ આદ્ધારુ તે આ શું કર્યું’. તે મારી માને મારી નાખી.’

પુત્રના વચનથી કોધ પામેલા આદ્ધારુ પુત્ર અને પુત્રાને પણ મારી નાખ્યા. આદ્ધારુ ભાગવા જતા રસ્તામાં ગાયથી સ્થળના પામતાં, ગાયને પણે મારી નાખી.

આ રીતે ઘોર કૃત્ય કરવાથી તેને પકડવા માટે રાજ-પુરુષો તેની પાછળ પડ્યા. આથી લયથી નાસતા સુશર્મા એક ખાડામાં પડ્યો અને તીવ્ર વેદના લોગવી મરણુ પામી સાતમી નરકમાં ઉત્પજ્ઞ થયો.

સાતમી નરકમાં ઘોરતીવ્ર વેદના લોગવી કોઈ વનમાં સિંહ થયો. ત્યાંથી યોથી નરકમાં, પછી ચંડાલ થઈ ઝર્ણી સાતમી નરકમાં, ત્યાંથી દાણિવિષ સર્પ થયો.

એક વખતે રાહડા પાસે મહાત્રતથારી મુનિવર જેવામાં આવતાં એકદમ કુંકાડા મારતો સર્પ મુનિને કરવા હોડ્યો, પણ મુનિને ભય બિનાના જેતાં, સર્પ વિચારમાં પડી ગયો કે, ‘મારા એક કુંકાડાથી મનુષ્યો ભયબીત થઈને નાશભાગ કરી મૂકે છે જ્યારે આ મારાથી જરાયે ગ્રાસ કેમ પામતા નથી ? આમ વિચાર કરતો સર્પ મંદમંદ ગતિએ મુનિ પાસે પહેંચ્યો. તે વખતે મુનિવર વિદ્યાધરોને કહેતા હતા, તે સર્પના મુખમાંથી તેના સાંલાં જવામાં આવ્યું. અને તેથી લઘુકર્મિતાના ચોગે તુરત જાતિ સ્મરણું જ્ઞાન થયું. તેથી સર્પે પોતાના પૂર્વ જવો સાંલાયો અને મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી અનસ્તન કરવાની છંચા કરી. મુનિવરે પોતાના જ્ઞાનથી સર્પની અનશન કરવાની ભાવના જાહી, અનશન કરાવ્યું, એટલે વિદ્યાધરોએ તે સર્પને શ્રી સિદ્ધગિરિજી ઉપર મુક્કી દીધો. સર્પ મરણું પામી ઈશાન દેવલોકમાં સુંહર સ્વરૂપવાળો હેવ થયો.

૨ ત્રિવિક્રમ રાજાની કથા

આ લહતશેત્રની શ્રાવસ્તી નગરીમાં ત્રિવિક્રમ નામે રાજ રાજ્ય કરતા હતા. એક વખતે ઉધાનમાં વૃક્ષ નીચે રાજ આરામ કરતા હતા, તે વખતે એક પક્ષીએ કર્કશ અવાજ કરતા રાજએ બાણુથી પક્ષીને વિંધી નાખ્યું. પડી નીચે પડતાં તડકાડવા લાગ્યું અને થોડીવારમાં મરણ પામી, લીલવના કુળમાં ઉત્પન્ન થયું.

એકબાર એક સુનિખાનો ભેડો થતો પ્રાજ્ઞાએ ધર્મ સાંભળી દીક્ષા લીધી રહ્યો વિવિધ ગ્રાણો કરવા લાગ્યાં. તમનો મલાપએ કેટલીક લખાયો. ઉત્પજ્ઞ થઈ.

ત્રિવિક્રિમિ મુનિવર ઇરતા ઇરતા એક જંગલમાં વૃક્ષ નીચે કાઉસસગળ કરી રહ્યા છે. તાં પેલા પક્ષીનો જીવ ને પીલ થયો છે, તેણે મુનિનો જોયા, પૂર્વ લવનાં વેરથી લીલલાંનો હેઠળ આપવ્યો. તેથી મુનિની કદર્થના કરવા લાગ્યો. આથી મુનિ શર્પાં રસમાં જીવતા હતા છતાં, લીલલ ઉપર છોક અવ્યો અને તેણેદેશ્યા મૂકી, ઓડી વારમાં જ લીલલ લાકડાની જેમ સણળી અયો. ભરણુ પામી તેજ અરવીમાં ડેસરીસિંહ થયો. ત્યાં પાછા મુનિને જોતાં નામ મારવાં, મુનિએ તેણેદેશ્યા મૂકી જ્ઞિંહને મારી નાખ્યો. ત્યાર પછી સિંહનો જીવ દીપડો થયો, ત્યાં પણ મુનિએ દીપડા ઉપર તેણેદેશ્યા મૂકી મારી નાખ્યો. દીપડો મરીને સાંઠ થયો, ત્યાં કર્મ સંયોગે મુનિનો ભેડો થતાં સાંઠ મુનિને મારવા ધરયો. એટલે મુનિએ પાછા તેણેદેશ્યાથી સાંઠને મારી નાખ્યો. સાંઠ મરીને મહાઊરી સર્પ થયો. ત્યાં પણ મુનિની તેણેદેશ્યાને લોગા બની ભરણુ પામી, ગરાણ પ્રાણણુને ત્યાં મુન ઇપે થયો.

ત્રિવિક્રિમિ મુનિ ઇરતા ઇરતા તે જામમાં આવ્યા. ત્યાં પ્રાણણુ પુત્રના જ્વેવામાં આવતા મુનિને લાકડી અને મુણિ વડે મારવા લગ્યો, ત્યાં મુનિએ તેણેદેશ્યા મૂકી પ્રાણણુને મારી નાખ્યો. પ્રાણણુ મરીને પુણ્યયોગે વાણુરસી નગરીમાં મહાખાડુ નામે રાજ થયોં.

એકવાર મહાયાહુ રાજ પોતાના ભહેલને જોએ એઠા
હતાઃ તાં રાજમાર્ગી ઉપરથી જસ્તાં એક મુનિને જેથાં
તેમને થયું કે, ‘મેં આવા મુનિને જેથા છે?’ વિચાર કરતાં
મહાયાહુ રાજને જાતિસ્મરણશુદ્ધાન થયું, તેમાં ત્રિવિક્રમ મુનિનો
કોપથી મરણ પાયેલા, પોતાના સાસ જેવા જેવા સેથી તે
મુનિની શોધ માટે અર્થી શ્વોંક બન્ધાપણે, ‘ચિહ્નાં સંબર:
સિંહો, દીપી, શાસ્ત્રી, ફળી દ્વીજા’ અને અત્યત્રી ષર્જાદેને
જાણુંયું કે, ‘જે કોઈ આ સ્વોંકની પૂર્તિ હરીખાપણે, સેએ
હું કાખ સેનામહેસે આપીશ’ અથી બોકે શ્વોંક પૂર્ણ
કરવા પ્રયત્ન કરવા કાણ્યાં અને અર્થી શ્વોંક જીએબા
લાગ્યા.

એકવાર ત્રિવિક્રમ મુનિ કરતાં કરતાં તે નાશરમાં એક
ભરીબ માણુસના મુખથી આ શ્વોંક સાંલાળ્યે અને તુરત
ઓદ્યો ચેનામીઃ નિહત્વાઃ કોપાત્સ કથાં મહિતા॥ કોણે
આ બધાને કોપથી માર્યા છે, અહો તેણું શું થશો કે,
માણુસે આ ઉત્તરાર્ધ રાજને કદ્મો, રાજાએ પૂછ્યું કે— ‘આ
શ્વોંક કોણે પુરા કર્યો?’ હ્યારે તે માણુસે મુનિનું નામ
જણ્યાંયું.

રાજાએ તુરત તે મુનિ પાસે જઈ નભક્કાર, ડરીને
કદ્મું કે— ‘હુ મુનિરાજ ! મારા તે સર્વ અપરાધીની આપુઃ
ક્ષમા કરો અને મને ધિક્કાર હો, આપના જેવા મહામુનિને
મેં પીડીત કર્યા અને આપના તપનો વારંવાર મેં નાશ
કર્યો છે, પરંતુ હવે મારે લીધી પ્રાપ્ત થયેલા તે કોધર્ઢી
ચંડાળને તમે છોડી હો.’

ત્રિવિક્રમ સુનિએ કહું કે ‘હે રાજન! મને ધિક્કાર છે, હું સાધુ થયો છું છતાં પાપી એવા મેં સાત સાત વાર તમને મારી નાખ્યા. આ મારા અપરાધની તમે ક્ષમા કરો. આવા અકાર્યથી મેં મારું બોધરૂપીવૃક્ષ ઉપેડી નાખ્યું છે. એઠલામાં કેવળી લગવંતતું ત્યાં આગમન સાંલળી અન્ને ત્યાં ગયા. જ્ઞાનથી અન્નેના ભાવને જાણી કેવળી લગવંતે હરમાણ્યું કે—‘હે જીવ અજ્ઞાનથી થયેતા અવિવેકને આખીન બની સુનિને પીડા કરે છે, તેનાં કરતાં અન્ય કેદી પાપી નથી. તીવ્ર તપસ્યા કરતો સુનિ જો મૂર્ખ થઈને છોધ કરે છે, તો તે ચારિત્રિક વૃક્ષને ખાળી નાખે છે.’

હે રાજન! સર્વ પાપનો નાશ કરનારા શ્રી શત્રુંજ્ય તીથેં તુ જા, ત્યાં તપશ્ચીર્યા કરવાથી તને જ્ઞાન અને સિદ્ધિ આપ્ત થશે. માટે આ ત્રિવિક્રમ સુની સાથે શ્રી શત્રુંજ્યાદિ તાર્થાની સમાધિપૂર્વક યાત્રા કર. યાત્રા કરી સંયમ લઈ ત્યાં તપ કરજો.

કેવળી લગવંતની વાણી સાંલળી, મહાખાહુ રાજએ સિદ્ધગિરિલુનો સંધ કાઢી, યાત્રા કરી અને સંયમ લઈ ત્યાં તપસ્યા કરવા લાગ્યો. અંતે શ્રી સિદ્ધગિરિલુના પ્રલાભે ત્રિવિક્રમ સુની અને મહાખાહુ સુનિ કર્માનો ક્ષય કરી મોષે ગયા.



૩ ચોણ

એકવાર શ્રી આહિનાથ પ્રભુ, શ્રી શત્રુંજય ગિરિવર પાસે વ્યાનમાં રહેલા છે એક મધૂર બીજા કેટલાક મધૂરો સાથે આવ્યો અને પોતાના પીછા વઠે પ્રભુને જાણે છત ધરતો ન હોય તેમ લક્ષ્યથી પહોળ કરવા લાગ્યો.

ધ્યાનને અંતે પ્રભુએ મધૂરોને ખોધ કરો વણું દિવસ સુધી પ્રભુ મધૂરો સાથે ત્યાં રાયથું વૃક્ષ નીચે રહ્યા, વૃદ્ધ મધૂરનું મરણ નજીક જાણી પ્રમુચે તેને અનશન કરાવ્યું.

મધૂર ચારે આહારનો ત્યાગ કરી શુભ ભાવનામાં મરણ પામી ચોથા દેવલોકમાં હેવ થયો. પોતાને સ્વર્ગ-પ્રાપ્તિનું કારણ શ્રી સિદ્ધગિરિ તીર્થ છે, એમ જાણી પ્રમુને વંદન કરવા આવ્યો. ત્યાં પ્રભુએ તે હેવને મધૂરહેવ કહીને બોલાવ્યો. ત્યારે ઇંદ્રે પૂછ્યું કે, સ્વામી ! આ મધૂરહેવ કોણું ? પ્રભુએ કહ્યું કે, આને આ તીર્થ ઉપર હેથના સાંલળીશાંત થયો હતો અને જીવ વધ તણું દઈ અનશન વત્તીધું હતું. આ તીર્થના પ્રલાવે મધૂર તીર્થચના ભવમાંથી ચોથાદેવલોકમાં હેવ થયો છે અને આવતા ભવમાં આ તીર્થ ઉપર સિદ્ધિને પામશે.

૪ સિંહ

પ્રતિષ્ઠાનપુર નગરમાં એક પ્રાક્ષાણ દિનપત્રિદિન હિંસામય યજ્ઞ કરાવતો હતો.

એકવાર યસ ચાલી રહ્યો છે, ત્યાં કોઈ મુનિએ કહ્યું કે, ‘ભરત મહારાજાએ ધર્મભય વેદ રચેલા છે, તે વેદના અર્થને બદલીને આ પરેલા પુરુષો હિસાથી હુષિત કરે છે.

મુનિના વચનો સાંલળી આ પ્રાહ્યાણ મુનિને મારવા જતાં વચમા યસ સ્થાંસ સાથે અથડાઈને મરણ પામ્યો. મુનિનાં દર્શનનથી સિદ્ધણિરિ તીર્થ સ્થાનમાં સિંહ થયો.

એકવાર શ્રી શાંતિનાથ લગ્નવાન ધ્યાનારૂઢ રહેલા છે ત્યાં પેડો સિંહ આવ્યો. પ્રલુને મારવા એકદમ કુદો પણ વચમાં પટકાઈ પડ્યો. આમ વારવાર પછડાવાથી સિંહ વિચારવા લાગ્યો. કે—‘વચમાં કોઈ નથી છતાં હું કોઈ કેમ ચૂકી જાઉ છું. નક્કી આ કોઈ મહાન પુરુષ લાગે છે?’ આમ વિચારતા પૂર્વ લવનું સમરણ થઈ ચાંદું. ત્યાં પ્રલુએ તેને પ્રતિઓધ કર્યો, ને કહ્યું કે—‘તેંબું પૂર્વલવમાં પાપકર્મો કર્યા તેથી તીર્થચંગતિમ ઉત્પન્ન થયો છે. હાતમાં તીર્થકરનું સાનિધ્ય મળ્યા છતાં અતિરોષ કરીને નરકની ભાતાતુલ્ય હિસાને કેમ હળ્યું આચરે છે? પૂર્વલવમાં મુનિને મારવા જતા તત્કાલ તેને મરણ તુલ્ય કરી મળ્યું. માટે શું હિસા છોડી હે અને દ્વામય ધર્મને આચર. એહ પામ્યા વગર આ તીર્થની આરાધના કર. તીર્થના પ્રલુને તેને દેવગાત મળશે અને એક અવતારે તારો મોક્ષ થશો.

આવી પ્રલુની આજા થતાં, સિંહ પ્રલુનું ધ્યાન કરવા લાગ્યો. અને મુનિના જેવો શાંત ચિત્તવાળો થયો. આચુષ્યના અંતે શુલ્કલાવમાં મરણ પામી હેવલોકમાં ગયો. ત્યાંથી મનુષ્ય જન્મ પામી મોક્ષમાં ગયો.

(૫) હંસ

કેટલાક મુનિવરો શ્રી સિદ્ધગિરિજી તરફ વિહાર કરી રહ્યા હતા ત્યાં કોઈ જંગલમાં તડકડતો ભરણુસનુખ એક હંસ જોવામાં આવ્યો. એક મુનિએ તે હંસ પાસે આવીને કહ્યું કે ‘હું જીવ! ધ્યાનં. હુઃપદાયક આ સંસારદ્વારા અરણ્યમાં શરણુરહિત અમતો એવો તું શ્રીઅરિહંત લગવંત, શ્રી બ્રિદ્ધલગવંત, શ્રીસાધુલગવંત અને કેવળી—પ્રણીતધર્મ, આ ચાર શરણાનો સ્વીકાર કર. વળી જે જે જીવોની હિંસા કરી હોય નિરાશા હોય, તે સર્વ જીવોને તું અમાવ. શ્રી શત્રુંજય તીર્થનું અને શ્રી આદીનાથ પ્રલુનું સ્મરણ કર.” આ પ્રમાણે કહી મુનિએ તે હંસને નવકાર મહામંત્ર સંલળાવ્યો. મંત્રના પ્રલાવે પીડારહિત થયેલો હંસ સમાધિપૂર્વક મૃત્યુ પામી, સૌધર્મ હેવલોકમાં ઉત્તમ દેવ થયો.

શ્રી સિદ્ધગિરિજી ઉપર પોતાના ઉપકારી મુનિવરતું મોકા જાહી શ્રી સિદ્ધગિરિજી ઉપર આવી નિર્વાણ મહેતસવ કર્યો. પછી ત્યાં રહેવા લોકોની આગળ પોતાનું સ્વરૂપ જણાવી, હંસાવતાર નામે પવિત્ર તીર્થ સ્થાપાને પોતાને સ્થાપન કર્યો.

આ તીર્થને પ્રલાવ કરી પણ નિષ્ઠળ જતો નથી. માટે જો આ તીર્થનું એકાશતાપૂર્વક ધ્યાન, જાપ, સ્મરણ, પૂજન, વંદન, સ્પર્શન કરવું.

શ્રી સિદ્ધગિરિજીના સ્પર્શના માત્રથી ઉત્તમ ગતિ થાય છે એમાં જરાયે શાકા રાખવા જેવી નથી. કેમકે

ચાર ચાર હત્યા કરનાર દફુરહારી જેવા, ચોરી કરનારા, પરદરા લંખ્યા, એનની સાથે લોગ લોગવનારા, હેવ દ્રવ્ય, શુકુ દ્રવ્યનું લક્ષણું કરનારા મહાપાપીઓ પણ આ તીર્થના પ્રભાવે સહૃગતિને પામ્યા છે. 'તો પછી કેંચો સરળ, ન્યાય-વાન, પુણ્યવાન આત્માઓ છે, તેઓના કલ્યાણનું પુણ્યનું જ શું?

એક વાત ખાંસ ધ્યાનમાં રાખવી કે બીજી સ્થાનમા કરેલા પાપોને છેડવા માટે તીર્થસ્થાન છે, પણ જે તીર્થસ્થાનમાં આવીને પણ પાપકર્મ કરવામાં આવે, તો તે પાપકર્મનો તીવ વિપાક લોગવરો પડે છે. હીર્ઘ કાલ સુધી ખંનારમાં પરિબ્રંષ્ણ કરવાનું થાય છે.


(૪) શ્રી સિદ્ધગિરિજિમાં તપ કરવાથી મળતું ઇણ
નવકારથી કરવાથી જે ઉપવાસ કર્યાનું ઇણ મળે છે.

ચૌરિસી	„	ત્રણુ	„	„
પુરિમહુ	„	ચાર	„	„
ઓકાસણું	„	પાંચ	„	„
આચંબીલ	„	ચંદ્ર	„	„
ઉપવાસ	„ એક મહિનાનાં	„	„	„

જે શ્રી સિદ્ધગિરિજિ ઉપર ચોવિહારો છઠ કરીને જાત
ચાત્રાચો કરે તે ગીજે લવે મોક્ષપદને પ્રાપ્ત કરે છે.

આ રીતે કેટલી તપશ્રયા થાય તેનો લાલ કેદ ગણ્ણો,
આ તીર્થમાં મળે છે. માટે પ્રમાદ કર્યા જિવાય અને શક્તિને
ચોપવ્યા સિવાય કેમ બને તેમ વધુ તપ કરવાની લાવના
આ તીર્થમાં રાખવી.

(૫) શ્રી શાનુંજ્ય ગિરિવર ઉપર ઓ તીર્થિકર
અગારનેતાનું આગમન



અતીત કાવમાં શ્રી નષ્ટલસેન પ્રમુખ અસંખ્ય
તીર્થિકરો આ ગિરિવર ઉપર જમબસરી, બાનેક લુચોનો

ઉદ્ધાર કરેલો છે. ભવિષ્યકાળમાં શ્રી પદ્મનાભ પ્રમુખ અસ્તિત્વ
તીર્થીકરો આ ગિરિરાજ ઉપર સમવસરશે. વર્તમાન
ચોવીસમાં એક શ્રી નેમનાથ લગવાંત સિવાય ત્રૈવિસે શ્રી
તીર્થીકર લગવાંતો આ ગિરિવિર ઉપર સમવસરેલા છે.

શ્રી ઋષલહેવ લગવાંત કે આ અવસ્પર્હણીમાં પ્રથમ
તીર્થીકર થયેલા છે, તેઓએ કેવળજ્ઞાન અને કેવળ દર્શનથી
અનંત લાલ જાણી નહ્વાણું પૂર્વવાર (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦
સીટોર લાખ કોડ છટ્ટન હજાર કોડ, આટલીવારને એક પૂર્વ
કહેવાય આવા નહ્વાણું વાર એટલે ૧૬૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦
આટલીવાર) આ ગિરિરાજ ઉપર સમવસર્યા છે. પ્રાય: કરીને
ઝાગણું સુધ ટના દ્વિવિસે પધાર્યા હતા અને રાયણવૃક્ષ નીચે
સમવસર્યા હતા.

શ્રી ઋષલહેવ લગવાન થયા, તે પહેલા અઠાર કોડને
કોડ ગુણીયે તેટલા સાગરોપમ (અસ્તિત્વ વર્ણનું એક
પદ્ધ્યોપમ. અને દશ કોડને એક કોડ ગુણીયે તેટલા પદ્ધ્યો-
પમનું એક સાગરોપમ થાય છે) કેટલા દીર્ઘકાલ સુધી
ખર્મ હતો નહિ. કેમકે તેટલા વખત સુધી લરતશેન્નમાં
યુગલિક કાળ પ્રવર્તતી હતો.

ન્યારે શ્રી ઋષલહેવ લગવાન થયા ત્યારે તેમના
સુખથી શ્રી શાત્રુંજ્ય તીર્થનું મહાત્મ્ય સાંસારી સૌધર્મ
ધન્દ્રના આદેશથી પ્રભુના પુત્ર લરત મહારાજાએ શ્રી સંધ-
પતિલું તિલક કરાવી, પોતાની સંખળી ઋદ્ધિ સાથે શ્રી નાલી-
ગણુધરની નિશામાં સંધ લઈ શ્રી સિદ્ધિગિરિજી ઉપર

આવ્યા હતા, ત્યારે વાર્ધકીરતન પાસે તે વખતે બાવીસ જિનાલય સહિત એક ડાચો શ્રી ઋપલહેવસ્વામીના ગ્રાસાદ અનાવરાવ્યો હતો તે પછી દિનપ્રતિદિન શ્રી શનુંજ્ય મહાતીર્થનો મહિમા વધવા લાગ્યો.

(૬) શનુંજ્ય મહાતીર્થના થયેલા ઉષ્ણારો

(ચાથા આરામાં થયેલા ઉષ્ણારો)

- (૧) શ્રી ઋપલહેવસ્વામીના વખતમાં ભરતચક્વતીનો।
 - (૨) ભરતચક્વતીના વંશમાં દંડનીર્થરાજનો।
 - (૩) બીજી દેવલોકના ધન્દ ઈશાનધન્દનો।
 - (૪) ચોથા " " માહેન્દ્રધન્દનો।
 - (૫) પાંચમા " " અહેન્દ્રનો।
 - (૬) ષષ્ઠિન્દ્રત ધન્દ ચમરેન્દ્રનો।
 - (૭) શ્રી અજુતનાથ પ્રલુના સમયમાં સગરચક્વતીનો।
 - (૮) ષ્યાંતરેન્દ્રનો।
 - (૯) શ્રી ચંદ્રપ્રલ સ્વામીના વખતમાં ચંદ્રયશારાજનો।
 - (૧૦) શ્રી શાંતિનાથ લગવાનના સમયમાં ચકાયુધરાજનો।
 - (૧૧) શ્રી મુનિસુવતસ્વામીના વખતમાં રામચંદ્રજીનો।
 - (૧૨) શ્રી નેમનાથ લગવાનના શાસનમાં પાંડવોનો।
- (પાંચમાં આરામાં થયેલા ઉષ્ણારો)
- (૧૩) શ્રી મહાવીરસ્વામીજીના તીર્થમાં જવડશાનો।

(૧૪) શ્રી ધનેશ્વરસૂરીશ્વરજીના ઉપદેશથી

* શિલાહિત્યરાજનો.

(૧૫) શમરાશા ઓશવાલનો.

(૧૬) કર્માશાનો,

(૧૭) શ્રી હૃષ્ણમહસૂરીશ્વરજીના ઉપદેશથી

વિમલવાહન રાજ કરાવયો.

આમ તો શ્રી શનુંજ્યતીર્થના અસંખ્ય ઉદ્ધાર થયેલા છે. શનુંજ્ય કલપમાં કલું છે કે ‘અસંખ્ય ઉદ્ધારો’ અસંખ્ય પ્રતિમાચો અને અસંખ્ય ચૈચો જ્યાં થયા તે શ્રી શનુંજ્ય મહાતીર્થ ‘જગવંત વરો’.

આ અવસર્પિણીમાં મોટા સોણ ઉદ્ધારા થયા અને સત્તરમો ઉદ્ધાર થશે નાના નાના ઉદ્ધારો તો અસંખ્ય થઈ ગયા છે અને હજુ સંકડો ઉધ્યારો થશે.

(૭) ઉદ્ધારેનું વર્ણન

ભરત ચક્રવર્તીએ કરાવેલો પ્રથમ ઉદ્ધાર.

શ્રી ઋષલહેવ લગવંતને સો પુત્રો હતા, તેમાં સૌથી મોટા લરત મહારાજા. જે હિવસે ઋષલહેવ લગવાનને કેવળજાન ઉત્પન્ન થયું તેજ હિવસે લરત મહારાજાની આચુધ-

* નવાણું પ્રકારી પૂલમાં ચૌદમે ઉદ્ધાર વાયુમંત્રીએ કરાવ્યો એમ છે.

શાળામાં ચક્રતન ઉત્પન્ન થયું. આથી ભરત મહારાજાએ વિચારમાં પડ્યા કે પહેલું પૂજન કોણું કરવું? વિચાર કરતા લાગ્યું કે ચક્રતનની પૂજ આ લોકની ઝડ્ધ અપાવશે જ્યારે તીર્થીકર પરમાત્માની લક્ષ્ણ આવોક અને પરલોકની ઝડ્ધ અપાવશે. માટે પહેલાં તીર્થીકર ભગવાનનો કેવળ જ્ઞાન મહોત્સવ કરવો.

આ પ્રમાણે નક્કી કરી ભરત મહારાજાએ પ્રથમ પ્રલુનો ઉત્સવ કરી પછી ચક્રતનનું પૂજન કર્યું. ત્યારણાદ ચક્રતનની સહાયથી ભરતક્ષેત્રના છ અંડ સાચ્યા.

ભગવાન ગામેગામ વિચરી અનેક લુચો પર ઉપકર કરવા લાગ્યા.

એક વખત આહિનાથ ભગવંત પોતાના ગણુધર આહિ પરિવાર સહિત આ ગિરિરાજ ઉપર આરોહણ કરી રાયણવૃક્ષ નીચે સમવસર્યા. ત્યાં આસન કર્યાચે પ્રલુનું આગમન જાણી દેવતાએચે ત્યાં આવી સમવસરણ રચ્યું. સિહાસન ઉપર એચી પ્રલુચે દેશના આપી. ત્યાર બાદ શ્રી સિદ્ધગિરિવરનું મહાત્મ્ય સંભળાવી પ્રલુઅ અન્યત્ર વિહાર કરી ગયા.

શ્રી પુંડરીક ગણુધર ભગવંત પાંચ કોડ મુનિવરો સાથે ત્યાંજ રહ્યા અને અનશન કર્યું. ચૈત્ર સુદ પુનમના હિવસે પાંચ કોડ મુનિવરો અને શ્રી પુંડરીકસ્વામીલુને ઉવળજાન ઉત્પન્ન થયું અને તેજ હિવસે બધા મોક્ષસુખ પાચ્યા. ત્યાર પછી આ તીર્થ પ્રસિદ્ધ થયું.

જ્યાં માત્ર એક મુનિ સિદ્ધ થાય તે અથ તીર્થ

કહેવાય છે, તો શ્રી શત્રુંજ્યગિરિવર ઉપર આટલા બધા મુનિવચ્ચે સિદ્ધ થયા છે, તેથી તીર્થોત્તમ તીર્થ કહેવાય છે.

એકવાર ભરત મહારાજાએ પ્રભુમુખથી સંઘપતિના પદનું વર્ણાન સાંલળતાં તેમને સંઘપતિ થવાની ભાવના થઈ અને પ્રભુને વિનાંતિ કરતાં, પ્રભુએ વાસચ્યુર્ણનો નિક્ષેપ કર્યો એટલે શકેન્દ્રે હિવ્યમાળા મંગાવી ભરત મહારાજ અને તેમની પત્ની સુલદ્રાના કંઠમાં તે માળા પહેરાવી.

ભરત મહારાજાએ મોટા સંધ અને સુવર્ણના મહિર સહિત શ્રી ગિરિરાજની યાત્રા માટે પ્રયાણ કર્યું. ગામોગામ પડાવ કરતા અને પ્રભુ ભક્તિ કરતા અનુકૂમે સૌરાષ્ટ્રમાં આવ્યા, ત્યાં સૌરાષ્ટ્રના અધિપતિ શક્તિસિંહ ભરત મહારાજનું સન્માન કર્યું.

દૂરથી ગિરિરાજના દર્શન થતાં સંધ સહિત ભરત મહારાજાએ ગિરિરાજની સ્તવના કરી, પછી શ્રી નાલિગણુધરને પૂછ્યું કે ‘આ ગિરિરાજની કેવી રીતે પૂજા કરવી? અને આહી શ્રી કિયા કરવી?’

શ્રી નાલિગણુધરે જણાવ્યું કે ‘જ્યાંથી આ ગિરિવર નજરે પડે ત્યારે પ્રથમ નમસ્કાર કરવો, જે કોઈ ગિરિરાજના દર્શનની પ્રથમ વાત જણાવે તેને કંઈક આપીએ, તેથી પૂછ્યની વૃદ્ધિ થાય છે. દર્શન થતાં ગિરિવરને સોનું, મણિ રતન વગેરેથી વધાવવો, વાહનનો ત્યાગ કરી પૃથ્વી ઉપર આગોઠી પંચાંગ નમસ્કાર કરી પ્રભુના ચરણોની કેમ ગિરિરાજની સેવા કરવી, ત્યાં સંધનો પડાવ નાખી ઉપવાસ કરવો, સ્નાન

કરી શુદ્ધ થઈ સંઘ સાથેના દેવાલયમાં આવી સ્તનાત્ર પૂજા કરવી, પછી સંઘના પડાવની બહાર પવિત્ર જગ્યા ઉપર શ્રી શાનુંનથ સન્મુખ પૂજનો ઉત્સવ કરવો.’

આ પ્રમાણે સાંલળી ભરત મહારાજાએ બધી વિધિ કરી. પછી અનુકૂમે શ્રી ગિરિશાજ પાસે આવી પહોંચ્યા. ત્યાં વાર્ધકી રત્ન પાસે સંઘનો સુંદર પડાવ કરાવ્યો.

બીજે હિવસે ગણથર લગવંત વગેરે સાથે ભરત મહારાજાએ ગિરિશાજ ઉપર આરોહણ કર્યું. સુધર્મેન્દ્ર ત્યાં આવ્યા. બને પરસ્પર લેખ્યા. પછી ઈન્દ્રની સાથે ભરત મહારાજાએ રાયણવૃક્ષની હર્ષથી પ્રદક્ષિણા કરી. ત્યાં ઈન્દ્ર ઋષભહેવ લગવંતની પાહુકા ને પોતે બનાવી હતી તે બતાવી. એટલે ભરતેથરે પાહુકને નમસ્કાર કર્યો.

પછી ઈન્દ્રે ભરત મહારાજને કહ્યું કે ‘આ તીર્થ ઉપર પ્રલુની મૂર્તિ વિના કેાઈ કહી પણ શ્રદ્ધા કરશે નહિ. પ્રલુના ચરણથી પવિત્ર થયેલો આ ગિરિ સ્વયં તીર્થિંપ છે, તો પણ લોકોની ભાવનાની વિશેષ પ્રકારે વૃદ્ધિને માટે અહો શ્રી જિનેશ્વર હેવનો એક લભ્ય વિશાળ પ્રાસાદ થવો જોઈએ. માટે એક ચાર્યાંથી મંડપથી મંડિત એક મહાન જિન-પ્રાસાદ કરાવો.’

ઇન્દ્રની આજાથી ભરત મહારાજાએ હિન્દુ-શક્તિવાળા વાર્ધકી રત્ન પાસે તૈલોક્યવિભ્રમ નામનો ૮૪ મંડપવાળો એક લભ્ય પ્રાસાદ બનાવસાયો, તેમાં પૂર્વ દિશામાં સિંહનાદ પ્રમુખ એકવીજ મંડપો, દક્ષિણ દિશામાં ભરતશાલ પ્રમુખ

એકવીસ મંડપો, પશ્ચિમ દિશામાં મેઘનાદ પ્રમુખ એકવીસ
મંડપો અને ઉત્તર દિશામાં શ્રી વિશાળ પ્રમુખ એકવીસ
મંડપો બનાવરાવ્યા. જિનમંહિરના મુખ્ય ભાગમાં સેંકડો
સૂર્યની પ્રલાની જાણે રાશિ ન હોય તેવી તેજસ્વી રત્નમય
શ્રી કૃપલદેવ લગવાનની ચતુર્મુખ પ્રતિમા, તથા અને આજુ
શ્રી પુંડરીકસ્વામીની મૂર્તિ અને લગવાનની મૂર્તિની પાસે
અડુગ જેંચીને ઉલેલા નમિ વિનમિની મૂર્તિ પણ સ્થાપન
કરાવી. તે સિવાય શ્રી નાલિરાજ, શ્રી મહુહેવી માતા, ચુનંદા,
સુમંગલા, આહ્વી, સુંદરી તથા બીજ ઉલ્લાઙ્ પૂર્વજોની
રત્નમય પ્રતિમા પણ સ્થાપન કરાવી.

લારણાદ બીજ નવીન મંહિરો કરાવીને શ્રી અજિતનાથ
લગવાન આદિ ત્રૈવીસ તીર્થંકરોના પાતપોતાના હેઠ અને
વણ્ણ પ્રમાણે, શાસનહેવતા સહિત રત્નમય બિમ્બો પણ
પદ્ધરાવ્યા.

આ રીતે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર મંહિરોનું
નગર બનાવ્યું.

સધળા બિમ્બોની પ્રતિષ્ઠા વિધિ અંજનશલાકા શ્રી નાલિ-
ગણુધર પાસે કરાવી. તે વખતે વિધિમાં જોઈતી સધળી વરતુઓ
ઇન્દ્ર મહારાજાએ હાજર કરી હતી. પ્રભુની પ્રતિમા ભરાવ્યા
આદ અંજનશલાકા થાય ત્યારે જ પૂજનિક અને છે. વર્તમાનમાં
પણ અનેક સ્થળોએ અંજનશલાકા મહેત્તસવમાં સધળીએ
વિધિ કરવામાં આવે છે.

ગોમુખ નામનો ચક્ષ અને એકેશ્વરી નામની શાસન-

દેવી શ્રી શત્રુંજય તીર્થના રક્ષણુ કરનારા થયા.

શ્રી શત્રુંજય મહાત્મ્યમાં કહું છે કે ‘જે જે દેશમાં કે નગરમાં શ્રી જિનેશ્વર પ્રભુની પ્રતિષ્ઠા થાય, તે તે દેશમાં કે નગરમાં રોગ, હુકળા કે વૈરલાવ ઉત્પન થતા નથી.’

ભરત મહારાજાએ આ અવસર્પિણીમાં શ્રી સિદ્ધગિરિજીને ખેલેલો ઉદ્ધાર કરાવ્યો. છેલે ભરતમહારાજ આરિસાલુવનમાં કેવળજીન પામી, દેવોએ આપેલો સાધુવેશ થહ્યણુ કરી પૃથ્વી ઉપર વિચદી, આચુષ્ય પૂર્ણ થયે મોક્ષમાં ગયા.

દંડવીર રાજાએ કરાવેલો બીજો ઉદ્ધાર

ભરત મહારાજના મોક્ષગમન બાદ છ કોઈ પૂર્વ પસાર થયા તે વખતે તેમના વંશમાં આડમા રાજ દંડવીર નામના થયા. તે શ્રી ઋષલહેવ પ્રભુ ઉપર દફલક્તિવાળા હતા.

એકવાર દંડવીરરાજ શ્રી સંઘસહિત શ્રી સિદ્ધગિરિજીના યાત્રા માટે પ્રયાણુ કરતાં કાશ્મીર હેઠ છેડીને આગળ વધતા વચ્ચમાં એ પર્વતોએ માર્ગ રૂધીલો જણાતા, દંડવીર રાજાએ ઉપદ્રવ કરનાર હેવતાને વશ કરી આગળ પ્રયાણુ કરતાં કરતાં ભરત મહારાજની જેમ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી.

દંડવીરરાજ વગેરેએ શ્રી ઋષલહેવ લગવંતની પ્રતિમા, પગલા, રાયણુવુક્ષ વગેરેની ત્રણુ ત્રણુવાર પૂજા કરી. ત્યારણાં હેવપૂજા, સંઘપૂજા તથા મહોત્સવ વગેરે શુલ કાયો કર્યાં.

શ્રી ઋષલહેવપ્રભુના લુર્ણ થઈ ગયેલા પ્રાસાદો જોઈ દંડવીર રાજને મંદિરોનો ઉદ્ધાર કરવાની લાવના થઈ. ઈન્દ્રની આજા મેળવી શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધાર કરાવ્યો.

ત्यारभाद એજ રીતે શ્રી ગિરનારલુ, આમુણુ, વૈભારગિરિ, અધ્યાયહ અને સંમેતશિખરની યાત્રા કરી ઉદ્ઘાર કરાવ્યો.

અંતે તેઓ પણ આરિસા ભુવનમાં ડેવાળાન પામી અનુવેશ અંગીકાર કરી અર્ધપૂર્વ નેટલો દીક્ષાપર્યાય પાણી મોક્ષ ગયા.

ઇશાનન્દે કરાવેલો વીજો ઉદ્ઘાર

શ્રી હંડ્વીર્ય રાજન્યે ખીજો ઉદ્ઘાર કરાવ્યાને સો સાગરોપમ પસાર થયા બાદ, એકવાર ખીજો દેવલોકના ધન્દ ધિશાનધન્દ મહાવિહેઙ્ક્ષેત્રમાં પ્રલુ પાસે શ્રી શત્રુંજય તીર્થનો ભહિમા સાંલળી કણુવારમાં શ્રી શત્રુંજય તીર્થ ઉપર આવ્યા. ત્યાં વંન-સ્તુતિ કરી અસૂધમહેત્તમવ કર્યો.

અહૃત લગ્નવંતોના પ્રાસાહો કાળના પ્રલાવે લુણુ થયેલા નેઈ ધિશાનેન્દ્રે શ્રીગિરિવિર ઉપર નવા પ્રાસાહો બનાવી વીજો ઉદ્ઘાર કર્યો.

માહેન્દ્ર ધન્દે કરાવેલો ચોથો ઉદ્ઘાર

શ્રી ધિશાનેન્દ્રે ઉદ્ઘાર કર્યા બાદ એકકોડ સાગરોપમ જેટલો કાળ ગયા પછી એકવાર ધણુ દેવતાએ શ્રી સિદ્ધ-ગિરિની ચૈત્રી પુનમની યાત્રા કરવા આવ્યા તે વખતે હુસ્તિસેન નગરમા કોડ હેવીએના પરિવારવાળી, મહાબળવાળી મિથ્યાદાણિ સુહુસ્તિનામની હેવી ઉલ્લી હતી. તે હેવીએ તાલધ્વજ (તળાળ) વગેરે પરના ક્ષેત્રપાલો પોતાને વશ કરી અધું તીર્થ અવ્યવરિથિત કરી નાંખ્યું હતું.

જ્યારે હેવો શ્રી શત્રુંજ્ય તીર્થની નજીક આવ્યા ત્યારે આ દેવીએ માયાથી ધણું શત્રુંજ્યો બનાવ્યા આ જેઠ હેવો વિચારમાં પડી ગયા, અને આશ્ર્ય પામ્યાં. બધા શત્રુંજ્ય ઉપર યાત્રા લક્ષ્ય અફૂઈ મહોત્સવ કરી, જવાની હૃદિશા કરે છે ત્યાં બધા શત્રુંજ્યો અદશ્ય થઈ ગયા. આથી દેવીને લાગ્યું કે નક્કી આપણાથી કંઈ આશાતના થઈ હુશે એટલે આ તીર્થો અદશ્ય થઈ ગયા? અથવા તો શું આપણે ગિરિ રાજથી હુર આવી ગયા? કે તીર્થ સ્વચ્છાં સ્વર્ગમા ચાલી ગયું?

અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્તા ખખર પડી અહો! આ હૃષ્ટ દેવીએ આપણને ઠગ્યા છે. માટે તેને શિક્ષા કરવી જેઠાએ.

તુરત જ હેવોએ મહાઘોર કોપજવાળા તે હેવી ઉપર મુક્તી એટલે કોપાજિની અત્યંત ભળતી તે દેવીએ હેવતાઓની માઝી માઝી અને પ્રલુના ચરણનું શરણું સ્વિકાર્યું ત્યારે તેને છાડી અને કંદું જો કરી આવું હૃષ્ટ કાર્ય કરીશ તો તારું સ્થાન રહેશે નહિં. પછી તે હુસ્તિની હેવી કરીથી તીર્થની આશાતના નહિં કરવાના સોણન આઈ હુસ્તિસેનાપુરમાં ચાલી ગઈ

તે વખતે ચોથા હેવલોકના માલિક માહેન્દ્ર નામના ઈન્દ્ર શ્રી શત્રુંજ્યગિરિ ઉપરના પ્રાસાદો લુર્ણ થયેલા જેથા. ‘અહો! આવા જગત હિતકારી તીર્થ ઉપર આવી લુર્ણતા કેમ થઈ હુશે? જરૂર તે હૃષ્ટ હેવીનું જ કાર્ય લાગે છે.’ આમ મનમાં ચિંતવન કરતાં માહેન્દ્ર ઈન્દ્ર વધીકીની પાસે પાસે નવીન પ્રાસાદો કરાવ્યા. અને ખીજ શિખરોનો પણ ઉદ્ઘાર કરી નવા બનાવરાવ્યા.

અહિન્દે કરાવેલો પાંચમો ઉદ્ઘાર

મહેન્દ્ર ઈન્દ્રે ઉદ્ઘાર કરાવ્યાને દશકોઠી સાગરોપમ
નેટલો ગયા પછી એક વખતે ચૈરવત ક્ષેત્રમાં હેથે જિન
જન્મોત્સવ કરી શ્રી નંદીશ્વર દ્વીપની યાત્રાએ ગયા. ત્યાં
આડ હિવસનો મહોત્સવ કરી આ ભરતક્ષેત્રમાં વિમલાચલ-
ગિરિ ઉપર શ્રી આદીનાથ ભગવંતના દર્શને આવ્યા. આડ
હિવસ સુધી ઉત્તમ પ્રકારે લક્ષ્ણ કરી.

તે વખતે પાંચમાં હેવલોકનાં ઈન્દ્ર અહિન્દે પ્રબુના
પ્રાસાદો લુણું થયેલા જોઈ હિવશક્તિથી નવા પ્રાસાદો
કરાવી, પાંચમો ઉદ્ઘાર કરાવ્યો.

ભવનેન્દ્ર કરાવેલો છઠો ઉદ્ઘાર

અહોન્દે કરેલા ઉદ્ઘાર પછી લાખ કાઠી સાગરોપમ
નેટલો કાળ વ્યતીત થયો ત્યારે ચમદેન્દ્ર આદિ ભવનપતિ
હેવલોકનાં ઈન્દ્રો નંદીશ્વર દ્વીપે ગયા હતા, ત્યાં એ વિદ્યાધર
ભુનિરાજે પાસે શ્રી નિદ્રગિરિજિલુનો મહિમા જાંખળતાં
ભુનિરાજેની સાથે શ્રી નિરિશાજ ઉપર યાત્રાએ આવ્યા,
ત્યાં તીર્થ ઉપર રહેલા પ્રાસાદો લુણું થઈ ગયેલા જેતાં
નવા પ્રાસાદો બનાવરાવ્યા. પછી હેવતાએ પોતપોતાના સ્થાને
ગયા. અહીં એક વાત ખાસ સમય લેવી, તે વસ્તુનો સ્વલાપ
લુણું થવાનો છે, હેવશક્તિથી બનેલી વસ્તુ કદાચ અધિક
સમય ટકી શકે. ખાકી તે પણ લુણું તો થવાની જ.

સગર ચક્રવર્તીએ કરાવેલો સાતમો ઉદ્ઘાર

શ્રી અજીતનાથ ભગવાનના વખતમાં ખીજ ચક્રવર્તી
સગરનામે થયા.

સગર ચક્રવર્તી ભરતકોવના છ અંડની સાદ્યાયી અખંડ
રીતે બાગવતા હતા.

એકવાર શ્રી અજુતનાથ બાગવાનના મુખે શ્રી શનુંજ્ય
ગિરિવરનું મહાતમ્ય સાંભળ્યું અને તેમના આદેશથી શ્રી
શનુંજ્યની યાત્રાના મોટો સંઘ કાઢ્યો.

ચક્રવર્તના બતાવેલા માર્ગે સંઘ આગળને આગળ
પ્રયાણ કરે છે. સંઘ માર્ગમાં ફરેક ગામમાં શ્રી જિનેક્ષરદેવની
પૂજા મુનિજ્ઞનોને વહેના, સાધમિકની લક્ષ્ણિ, દાન વગેરે
કાર્યો કરતા શ્રી સિદ્ધગિરિજી પાસે આવી પહોંચતાં ત્યાં
સારી રીતે તીર્થદર્શન નિમિત્તે અફાઈ મહોત્સવ કર્યો.
સિદ્ધગિરિજી આવી પહોંચ્યો. ત્યાં ચૌદ નહીંઓમાંથી તીર્થ-
જળ સેળવી સગર ચક્રવર્તિ વગેરે શ્રી ગિરિજિ ઉપર ચઠી
શાયણવૃક્ષ પાસે આવ્યા ત્યાં ઈન્દ્ર પણ લક્ષ્ણિથી આવ્યા
હતા. ચક્રવર્તિ અને ઈન્દ્ર બન્ને પરસ્પર મળ્યા. ભરત
મહારાજની જેમ તીર્થમાં સ્નાતપૂજાદિ મહોત્સવો કર્યાં.

ઈન્દ્ર સગર ચક્રવર્તિને કહ્યું કે ‘આ શાચિત તીર્થમાં
તમારા પૂર્વી ભરત મહારાજનું પુષ્યને વધારનારું
કર્તવ્ય જાયે. લવિધના ડાળમાં મલિન હૃદ્યવાળા લોકો
મણિ, રન, રસુ અને સુવર્ણના લોકથી આ પ્રાસાદની
અને પ્રતિમાની કદાચ આશાતાના કરશે મારો જન્મની જેમ
તમે પણ આ પ્રાસાદની કંઈક રક્ષા કરો.

આ સાંભળી સગર ચક્રવર્તિ વિચારવા લાગ્યા કે મારા
પુત્રો ગંગા નહીં લાવ્યા, તો હું તેમનો પિતા થઈ, જે

સમુદ્ર લાવું તો તેમનાથી વિશેષ થાડું, નહીં તો માનહીન થાડું.

આમ વિચાર કરી યથોદા દ્વારા સમુદ્રને ત્યાં લાવ્યા ત્યારે ઈન્દ્ર સગર ચક્રવર્તિને કહ્યું કે ‘હે યકી આ તીર્થ વિના બધી ભૂતસૃષ્ટિ નિષ્કળ છે, અષ્ટાપદ તીર્થનો માર્ગ રૂધાર્જ ગયો. હુવે આ તીર્થો પ્રાણીઓને તારનાર છે, પણ જે સમુદ્રના જળથી આ તીર્થ રૂધાર્શો તો પણ આ પૃથ્વી ઉપર બીજું કોઈ તીર્થ પ્રાણીઓને તારનાર મારા જેવામાં આવતું નથી. જ્યારે શ્રી તીર્થંકર હેવ, જૈનધર્મ અને જૈન આગમ પૃથ્વી ઉપર રહેશે નહિ ત્યારે માત્ર આ સિદ્ધગિરિ જ વોકેના મનોરથ સફુલ કરનારો થશે.’

આ સાંલળી સગર ચક્રવર્તિએ લવણ્યદેવને હહી સમુદ્રને દૂકાવી દીધો. પણ ઈન્દ્રના કહેવાથી સત્તનમણીમય પ્રલુની મૂર્તિઓ સુવર્ણ ગુણમાં મુકાવી દીધી અને સુવર્ણની મૂર્તિઓ અને સોનારુપાના પ્રાસાહો બનાવરાવી તીર્થનો ઉદ્ઘાર કર્યો.

આ રીતે સગરચક્રવર્તિએ સાતમો ઉદ્ઘાર કરાવી, બીજા તીર્થોની યાત્રા કરી અયોધ્યામાં ગયા. અંતે દીક્ષા લઈ સંઘળા કર્માનો દ્વારા કરી ઓંતેર લાખ પૂર્વનું આદુષ્ય પૂર્ણ કરી સમ્મેતશિખર ઉપર મોક્ષ ગયા.

બ્યાંતરેન્દ્રે કરાવેલો આઠમો ઉદ્ઘાર

શ્રી અલિનંહનસ્વામીજી પૃથ્વીતળને પાવન કરતા, એકવાર શ્રી શત્રુંઝ ગિરિવર ઉપર રાયણુ વૃક્ષ નીચે સમ-

વસરી સુંદર અકારે દેશના આપત્તા જગ્યાંસું કે ‘આ શ્રી શત્રુંજ્ય ગિસ્ટિવર કામ, કોધ, મહ, માન લોખ, વિષયાદિ અવયંતર શત્રુએનો નાશ કરનાર, સર્વ પાણે દૂર કરનાર, મોક્ષનું લીલાંગૃહ છે, અહીં કલ્યાણુંકંસ જેવા સર્વ કલ્યાણું કારણ અને સુવર્ણ વણ્ણવાળા શ્રી આદિનાથ પ્રભુ રહેલા છે. અરિહંતા મોક્ષમાં ગયે છતે, કેવળજાન રૂપી ધર્મ નાશ પામે છતે, આ તીર્થ જ સર્વ કલ્યાણને કશનારું થશે જેએ તીર્થમાં આવી લક્ષ્ણાથી ભગવાનનું ધ્યાન, પૂજન વગેરે કરે છે, તેએ થોડા જ કાળમાં મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. ઈત્યાદિ દેશના સાંલળી બંતર નિકાયના ઈન્દ્રોએ શ્રી સિદ્ધગિરિજીના પ્રાસાહો જીજું થઈ ગયેલ નેઈ લક્ષ્ણાથી તીર્થના પ્રાસાહોનો ઉદ્ઘાર કરી નવા બનાવ્યા. આ આઠમો ઉદ્ઘાર થયો.

ચંદ્રયશા રાજાએ કરાવેલો નવમો ઉદ્ઘાર

શ્રી ચંદ્રપ્રભસ્વામીના શાસનમાં શ્રી ચંદ્રશેખર મુનિનો પુત્ર ચંદ્રયશા રાજ ચંદ્રપ્રભાનગરીમાં રાજ્ય કરતા હતા. એકવાર શ્રી ચંદ્રશેખર મુનિ ચંદ્રપ્રભા નગરીમાં આવ્યા. ત્યાં ચંદ્રયશા રાજ પરિવારસહિત વંદન કરવા. આવ્યા. ત્યાં મુનિવરના ઉપદેશથી શ્રી ચંદ્રપ્રભસ્વામીના પ્રાસાહ બનાવ્યો. જે ચંદ્રપ્રભાસ (પ્રભાસપાટણ) તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ છે.

ચંદ્રયશા રાજ એકવાર શ્રી સિદ્ધગિરિજીનો સગર-ચક્રવર્તિની જેમ સંધ કાઢી તીર્થાગ્રા કરવા આવ્યા, ત્યાં તેણું જિનપ્રાસાહો જીજું થઈ ગયેલા નેતા સર્વ પ્રાસાહોનો.

ઉદ્ધાર કરાન્નો, તથા શ્રી પુરુંદરીઃ, રૈવત, આયુઅને બાહુ-
અલ્લી વગેરે શિખરનો પણ લક્ષ્ય ના ઉદ્ધાર કરાવ્યો.

છેવટે દીક્ષા અહુંથું કરી એકલાખ પૂર્વ વરસનો
ચારીપ્રયોય પાળી કેવળજ્ઞાન પ્રામણ કરી મોક્ષમાં ગયા.

* ચક્કધર રાજાએ કરાવેલો દૃશમો ઉદ્ધાર

શ્રી શાંતિનાથ ભગવાન શ્રી સિદ્ધગિરિલુભાં ચાતુર્માસ
નિર્ગમન કરી હસ્તિનાપુરમાં પધાયો. ત્યાં શ્રી શાંતિનાથ
ભગવાનના પુત્ર ચક્કધર રાજ જે ત્રણુખંડનું આધિપત્ય
લોભવતા હતા તેમણે ભગવાનને વિનંતિ કરી કે ‘હું પ્રભુ
અને સંધપતિની પહોંચ આપો.’ આ સાંલળી ભગવાને હેવેએ
લાવેલા અક્ષતયુક્ત વાસક્ષેપ, માળા સાથે ચક્કધરના ભસ્તક
ઉપર નાંખ્યો. ચક્કધર રાજએ ત્યાં મહેત્સવ કર્યો. સંધને
આમંત્રણ કરી જ્યાલાવ્યો. ઇન્દ્રે આપેલા દેવાલય સાથે
મંગળ મુહૂર્તે સંધનિકળ્યો. ગામેગામ શ્રી જિનપ્રતિમાને અને
મુનિઓને નમસ્કાર કરતો સંધ સૌરાષ્ટ્રમાં આવ્યો. ત્યાં ચક્કધર
રાજએ તીર્થ અને સંધની પૂજા કરી. અતુફાળે શ્રી શનુંનાય
તીર્થમાં આવી તીર્થયાત્રા કરી મોટો ઉત્સવ કર્યો અને તે
વખતે ઇન્દ્રે પણ આવીને મહેત્સવ કર્યો.

ત્યાં એક હેવે આવી ચક્કધર રાજને કહ્યું કે ‘અનંતા
ભવો વધારનાર તીર્થાચના ભવનું’ ઉત્સંઘન કરી જે હું હેવ
થયો છું. તે શ્રી જિનેશ્વરની અને આ તીર્થની સેવાનું જ

* નવ્યાષ્ટ પ્રકારી પૂજનમા ચક્કાયુધ નામ છે, શનુંનાય
મહાત્મ્યમા અફખર નામ છે.

કુણ છે, હે રાજનૂ! અહીં મરુદેવા નામના શિખર ઉપર જગહીશ તમારા પિતા (શ્રી શાંતિનાથ ભગવાન) નો પ્રાસાદ છે, માટે ત્યાં જઈ હર્ષથી પૂજા કરો.

દેવનું વચન સાંભળી ચક્કધર રાજાએ ત્યાં જઈ પૂજા વગેરે સધળું ઉચ્ચિત કાર્ય કર્યું, ત્યાર બાદ ઈન્દ્રે કહ્યું કે હે રાજનું તમારા પૂર્વનેતું આ તીર્થ કાળયોગથી લ છું થઈ ગયું છે. તમે શાંતિનાથ પ્રભુના પુત્ર છો તો તમારે આ તીર્થનો ઉદ્ઘાર કરવો જોઈએ.

આ સાંભળી ચક્કધર રાજાએ કિનપ્રાસાહોને દલ કરી, સંસાર પંજર લુણું કર્યું.

‘તમે આ તીર્થના લુણોદ્ઘાર કરનાર થયા.’ એમ કહી ઈન્દ્રે પુણ્પુરુષથી હર્ષપૂર્વક વધાવ્યા.

ત્યારબાદ ચક્કધરરાજ ધીજા તીર્થોની યાત્રા ઉધ્ઘાર વગેરે કરતા હુસ્તિનાપુરમાં આવ્યા. શ્રી શાંતિનાથ ભગવાનનું નિવોણ સાંભળી ચક્કધર રાજાએ દીક્ષા અહણું કરી દશહંજાર વર્ષ દીક્ષા પર્યાય પાળી, કેવળ જ્ઞાન પ્રાસ કરી સમ્મેતશિખર ઉપર મોક્ષ ગયા.

શ્રી રામચન્દ્રજીએ કરાવેલો અગ્રીયારમેા ઉદ્ઘાર

અયોધ્યા નગરીમાં દશરથ રાજના પુત્ર રામચન્દ્રજીનું અરિન્ત પ્રસિદ્ધ છે. એટલે અહીંયા લખતા નથી,

રામચન્દ્રજી વનવાસ વસી, રાવણને હુરાવી, અયોધ્યામાં પુનઃ પથાર્યો લ્યારે લરતે મોટા મહોત્સવ પૂર્વક રામચન્દ્રજી, લક્ષ્મણજી, સીતાજી આદિનો પ્રવેશ કરાવ્યો અને રાજ્ય રામ ચન્દ્રજીને સૌંપી પોતે તેમની આજાને અનુસરવા લાગ્યા.

એકવાર આ દેશભૂષણ મુનિ પત્સે પોતાનો પૂર્વભવ સાંલળી ભરતે દીક્ષા લીધી, પછી ગુરુસુપે શ્રી શત્રુંજય જિરિષરનો મહિમા સાંલળી એક હુલર મુનિની સાથે શ્રી સિદ્ધાયળ તીર્થે આવી. શ્રી ઋષદેવ લગ્નવંતની યાત્રા કરી, શ્રી ભરત મુનિએ ત્યાં અનશન કર્યું. અન્તે સર્વકર્મ અપાવી કેવળજ્ઞાન મેળવી હુલર મુનિવરોની સાથે મોક્ષ ગયા.

‘રામચંદ્રજી અને લક્ષ્મણજી શ્રી સિદ્ધગિરિજિલુ ઉપર આવી યાત્રા કરી. મંહિરો લુણ્ણ થઈ ગયેલાં જોતાં, સર્વ મંહિરો ને નવા ખનાવરાવી, શ્રી સિદ્ધાયળજી તીર્થનો ઉદ્ઘાર કરી મહાતીર્થના મહિમાણને પ્રસિદ્ધ કર્યો.

પાંડવોએ કરાવેલો બારમો ઉદ્ઘાર

પાંડુરાજની પત્ની કુંતીએ અનુક્રમે સુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, ગ્રણુ પુત્રોને જન્મ આપ્યો હતો અને માદ્રીએ નકુલ અને સહુદેવને જન્મ આપ્યો હતો. આ પાંચે, પાંડવો તરફે પ્રસિદ્ધ થયા. તેમણે શ્રી સિદ્ધાયળજીનો બારમો ઉદ્ઘાર કરાવ્યો.

આંતે શ્રી ધર્મધોષ મુનિના ઉપરેશથી પાંચે પાંડવો, કુંતી અને દ્રૌપદીએ દીક્ષા લીધી, વિહાર કરતા કરતા પાંડવો જયારે હુસ્તિકવ્ય નગરમાં આવ્યા ત્યારે શ્રી નેમનાથ લગ્નવંતતું નિર્વાણ સાંલળું. એટલે શ્રી સિદ્ધગિરિજિલુ ઉપર આવી અનશન કર્યું. આંતે અંતકૃત કેવળી (કેવળજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણ એક સાથે થાય) થઈ મોક્ષ ગયા.

કૃતકૃતકૃતકૃ
શ્રદ્ધાશ્રદ્ધાશ્રદ્ધા

[પાંચમાં આરામાં થયેલા ઉદ્ઘાર]

જવડશાંએ કરાવેલો તેરમો ઉદ્ઘાર

કાંપિલ્યપુર નગરમાં જવડશા નામે શેડ રહેતા હતા,
તેમને જાવલા નામે પત્ની હતી. તેની કુંક્ષિથી જવડનો જન્મ
થયો હતો.

જવડ બાલ્યવયથી ધર્મપરાયણ હતા. પિતાના મરણ
બાદ પોતાની નગરી (મહુવા)નું ધર્મપૂર્વક સારી રીતે પાલન
કરતા.

એકવાર મુનિના મુખે શ્રી સિદ્ધાચળના મહિમા પ્રસંગે
'પાંચમાં આરામાં સિદ્ધગિરિજીનો ઉદ્ઘાર જવડશા કરાવશે'
આ સાંભળી જવડશાને ખૂબ આનંદ થયો અને મુનિવરોને
પૂછ્યું કે 'આપે તીથોધાર જવડશા કરાવશે, એમ જણાઓયું તો
તે હું કે બીજે કોઈ?' મુનિવરે પોતાના જાનથી જાણીને
કહ્યું કે 'જણારે પુંડરીકગિરિપર હિસા કરનાર, અધિષ્ઠાયકો
પચાસ ચોજન સુધીમાં બધું ઉજજડ કરી નાખશે. જે કોઈ
પચાસ ચોજનની અંદર જશે તેને કપદ્ધિ યક્ષ મારી નાંખશે
ભગવાનની પ્રતિમા અપૂજય રહેવા લાગશે, તો કટોકટીના
સમયે તું પોતે જ શ્રી સિદ્ધાચળજીનો ઉદ્ઘાર કરાવીશ. માટે
તું ચક્કાશરી દેવીની આરાધના કરી, (પ્રલુના કહેવાથી બાહુભ-
વીજુએ કરાવેલ) શ્રી આદીશર પ્રલુના બિરૂને માંગી લે.'

આ સાંભળી તુરત જવડશા ઘેર જઈ પ્રલુની મૂળ
નરી ભલિવિધાન પૂર્વક કુદ્ર હેવતાએને સંતોષ પમાડી, મનમાં

યકેશ્વરી દેવીનું ધ્યાન ધરતાં યકેશ્વરી દેવીએ પ્રગટ થઈને
કહ્યું કે ‘તું તક્ષશિલાપુરીમાં જ અને ત્યાંના રાજ જગન્મહાને
કહેણે ત્યાં અરિહંતનું બિમણ જોવામાં આવશે, પછી મારી
સહાયથી તું ગિરિયાજનો ઉધાર કરાવી શકીશ.’

યકેશ્વરી દેવીનો કહેવા સુજણ તક્ષશિલાનગરીમાં જઈ
પ્રભુના બિમણનું ધ્યાન ધરતાં બિમણ પ્રગટ થયું. એટલે
ભવડશાએ તે બિમણની પંચમૃત વગેરેથી સુંદર પ્રકારે
અલિષેક કરી લક્ષ્મિ કરી. પછી રથમાં સ્થાપન કરી રાજની સહાય
મેળવી નિત્ય એકાખના કરતાં વિશાળ પરિવાર સાથે પ્રતિમાળ
લઈને શ્રી શન્મુંજ્ય તીર્થ તરફ પ્રયાણ કર્યું. અનુકૂળે મહૂ-
વામાં આવતાં ત્યાં ભવડશા શ્રી વજસ્વામીજીને પાસે ધર્મહેશના
સાંભળવા એડા હતા ત્યાં એક દેવે આવી વજસ્વામીજીને કહ્યું
કે પૂર્વે હું મધ્યપાનમાં આસક્તા હતો, ત્યારે આપે મારા ઉપર
ઉપકાર કરી શ્રી શન્મુંજ્ય મહાતીર્થની સમૃતિ કરાવી, પંચપર-
મેષિ પદનો. બોધ આપી, મધ્યપાતનાં પચકખાણ કરાવ્યા હતા,
છતાં હું એકવાર એ ખીએ સાથે મહિરાપાન ડરતો હતો,
ત્યાં આકાશમાં ઉડતા પદ્ધીએ પડકડેવા સર્વનું ઝેર તે ભ્યા-
લામાં પડયું તે મહિરા મારા પીવામાં આવૃતાં મને ઝેર
ચડયું. હું પંચપરમેષિનું સમરણ કરવા લાગ્યો, તથા
મારા નિયમના લાગની તર્થાં હું યસનની નિદા કરતો હું
મૃત્યુ પામી યક્ષનાતિમાં ઉત્પન્ન થયો છું. માર્દાં નામ
કપદિયક્ષ છે. હું એક લાંખ યક્ષનો સ્વામિ છું. અને વિશ્વનોં
ઉદ્ધાર કરવા સર્વથી છું. માટે હું સ્વામિનું! આપ મને
આજ્ઞા કરેમંબો.. ,

શ્રુતશાની વજસ્વામીજીએ યક્ષનું વચ્ચેન આંશળી શ્રીસિદ્ધિગિરિજીને પ્રલાવ કહી અંતે જવડશાને કંણું કે 'હે મહાલાગ તું શત્રું' જયનો ઉદ્ધાર કરાવ તારું ભાગ્ય, હું અને આ યક્ષ સહાયક છીએ.

પછી જવડશા સંઘ કાઢી પ્રયાણુ કર્યું, ત્યાં રસ્તામાં સિધ્ધાગિરિના પ્રથમના દેવોએ જવડશાની પત્ની જ્યમતિના શરીરમાં હાહજનર ઉત્પન્ન કર્યો, તેને વજસ્વામીજીએ દૂર કર્યો. આચાર્ય શ્રીવજસ્વામીજીએ બતાવેલા શુભ મહૂર્તે ભગવંતની પ્રતિમાજીને આગળ કરી ગિરિરાજ ઉપર ચન્દ્રવા માંડયું. ત્યાં મિથ્યાત્મી દેવો ભૂત પિશાચ વગેરે ભાંયકર દૃષ્ટે બતાવવા લાગ્યા. નવા કંપાંદ્યક્ષે તે સર્વ વિક્ષો દૂર કર્યો. પછી યક્ષે ત્યાં રહેલા સુડા, હાડકા, ચરણી માંસ વગેરે અગ્રાચિને દૂર કરી શ્રી. શત્રુંજય નહીના જગથી ધોઈ નાખી, ગિરિરાજને નિર્મણ કર્યો.

રાતે હુષ દેવે, રથમાં લાવેલી પ્રતિમાને શુભ કરી દીધી. સવારે પ્રતિમા નહિ જેતાં. જવડશા અત્યાંત ઐહ પામ્યા. ત્યાં વજસ્વામીએ ઉપયોગ મૂડી નવા કંપદ્યક્ષને તે પ્રતિમા બતાવી, એટલે કંપદ્યક્ષે તે પ્રતિમાં, પાછી લાવી આપી. આ પ્રમાણે વારંવાર થવા લાગ્યું છેવટે, વજસ્વામીજીના આ દેશથી જવડશાએ પ્રભુનું ધ્યાન ધરી રથના પૈડા પાસે સૂઈ ગયો. ચતુર્વિધ સંઘ આખી રાત્રી કાચોત્સર્ગમાં રહ્યા. એરલે તે અસુરોનું ॥ શક્યું નહિ. પછી સવારે વજસ્વામીજીએ મંત્રેવા અક્ષતો નાખી સર્વ હુષ દેવતાઓને સ્થાનિત કરી દીધા.

પછી જાવડશાંએ બુની ભૂતિને અસેડી નવિ પ્રતિમાળને અંદર લાવ્યા, તે વખતે મંત્રથી ક્ષમાલિત થયેલા દેવતાએ કરુણ રહે પોકાર કરતા હતા તેઓના અવાજે ગિરિરાજના દક્ષિણ, ઉત્તર એ વિલાગ થઈ ગયા તથા વજ્ઞસ્વામી, જાવડશા અને તેમની પત્ની સિવાય બધા મરેલા જેવા થઈ ગયા. આથી વજ્ઞસ્વામીથી એથ પાંચેલા નવા કપદિયક્ષે હ્યાથમાં વજ્ઞ લઈ બધા અસુરોને મારવા હોડાયો આથી બુનો કપદિયક્ષ વગેરે સંઘળા અસુરો બ્યાથી નાસી ગયા.

ત્યારથાં પ્રતિમાના અધિકાર્યકોને શાંત કરી મંહિરોનો લુણોદ્વાર કરી નવીન પ્રતીમાને મહામહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠિત કરી, મંહિરો ઉપર ધવનાએ અદાવી. ત્યરથી શ્રી સિદ્ધ-ગિરિજીનો અધિકાર્યક નવો કપદિયક્ષ થયો.

પછી જાવડશા અને તેની પત્ની શુલ ધ્યાનમાં મરણ પામી ચોથા દેવલોકમાં દેવ થયા; ત્યાં પણ શ્રી શનુંજ્ય મહાતીર્થનું સણુરણ કરતા રહેલા છે. ત્યારથી પાછે તીર્થને મહિમા વિકાર પામવા લાગ્યો. જાવડશાએ વિહેમ સંવત ૧૦૮ માં ઉદ્ધાર કરાયો હતો.

બાહુડમંત્રીએ કરાવેલો ચૌહમે ઉદ્ધાર

એકવાર કુમારપાળ મહારાજાએ સોરઠ દેશના રાજ સમર્ને જિતવા ઉદ્યન મંત્રીને મોકદ્યા હતા, તે વખતે તે શનુંજ્ય તીર્થની યાત્રા કરવા ગયા, ત્યાં ઋષભદેવ લગવંતની દ્રવ્ય પૂજા કરીને લાવપૂજા (ચૈત્યવંહન) કરી રહ્યા છે, ત્યાં એક ઉંદર જાળગતી દીવાની વાટ કાણના મંહિરમાં લઈ જતો જેયો તેથી ઉંદર પાસેથી વાટ મૂકાવી.

ઉદ્ઘયન મંત્રીને વિચાર આવ્યો તે, કાણના ભાડિનેં
કોઈ વખત આવી રીતે નાશ થઈ જવાનો સંભવ છે. રાજના
પાપવાપારથી મેળવેલી મારી લક્ષમી શા કામની? માટે મારી
લક્ષમીથી જ્યાં સુધી તીર્થાદિકનો ઉધ્ઘાર ન થાય ત્યાં સુધી
મારે નિત્ય એકાસણ્ણા કરવા પૃથ્વી ઉપર શયન કરવું, અદ્ભુ-
ચર્યાનું પાલન કરવું તાંબુલનો ત્યાગ કરવો, આ પ્રમાણેના
અલિ અહેં લગવાંતની આગળ કર્યો.

યાત્રા છરી નોચે ઉત્તરી આગળ પ્રયાણુ કર્યું. સમર-
સેન રાજસાથે ચુદ્ધ કરતા શત્રુના બાણોથી તેનું શરી
જર્ઝરીત થઈ ગયું: તો પણ ઉદ્ઘયન મંત્રીએ સમર રાજ
ઉપર બાણોને પ્રહાર કરી તેને મારી નાખ્યો અને જિત
મેળવી, દેશ કણને કર્યો.

માર્ગમાં ઉદ્ઘયન મંત્રીને શત્રુના બાણુના પ્રહારની વેહ-
નાથી આંખે અંધારા આવવા લાગ્યા, તેથી છાવણીમાં સુકામ
કર્યો, ઉપચારો કરવા છતાં સાડ ન થયું ત્યારે ઉદ્ઘયન મંત્રીએ
જણ્ણાંયું કે મારા મૃત્યુ સમયે ચાર વસ્તુઓ પૂર્ણ કરવાની
કણુલાત આપો તો મને સંતોષ થાય. ૧ મારા નાના પુત્ર
અંબડને સેનાપતી જનાવવો, ૨ શત્રુંઝય ગિરીવર ઉપર
પૃથ્વરના પ્રાસાદ બનાવવા ઉ ગિરનારણ ઉપર પત્થરના પગ-
થિયા બનાવ ૪ મને નિર્યામણા કરાવનાર શુરૂ મળે.'

આ સાંભળી સાંભત આદિએ 'કણું' કે પહેલા ત્રણું કાર્યો
તો તમારા મોટા પુત્ર બાહુડ પૂર્ણ કરશો, તેમાં અમે સાક્ષી-
ભૂત છીએ અને તમોને નિર્યામણા કરાવનાર સાધુ મહારાજને
હુમણુંજ શોધી લાવીએ છીએ.'

આહુડે પિતાજીની દર્શિઓ મૂળું કરવાની પ્રતિજ્ઞા કરી,
પછી ત્યાં આસપાસમાં કોઈ મુનીરાજ નહિ હોવાથી, એક
વંડ પુરુષને સાધુનો વેષ પેહેરાવી ઉદ્ઘયન મંત્રી પાસે લઈ
જઈ નિર્યામણું કરાવી. મંત્રી સમગ્ર પ્રાણીઓને અમાવાસી
સ્વર્ગો ગયા. પછી વંડ વિચાર્યું કે જગતું જેને સલામો લદે
છે એવા મંત્રીએ પણ ભીખારી એવા મને જે વંદન કર્યું
તે અરેખર આ વેષનોનું પ્રભાવ છે, માટે આ વેષ મને
શરણુભૂત હો.

પછી તે વંડ—સાધુ ગિરનારાજ ઉપર જઈ એ મહિનાનું
અનશન કરી સ્વર્ગમાં ગયો.

આહુડે કુમારપાલ રાજની આશા મેળવી ગિરનારાજ ઉપર
ત્રેસઠ લાખ દ્રાવ્ય અરચી નવા પગથીઆ કરાવ્યા. પછી પર-
દેશનાં કારીગરો બોલાવી બધા મંદિરો પથરના બનાવવાની
શરૂઆત કરી.

શ્રી સિદ્ધગિરિની છાયા(તલાટી) પાસે ઉતારો કરી આહુડ
મંત્રી વગેરે એઠા છે, ત્યાં પણ ફરેક સ્થળોની પેઠે આજુખાજુ
અખર પડતાં અનેક પુષ્યશાળીઓ ઉદ્ધાર કર્યાં નાણું આપવા
વિનવે છે. મંત્રીશ્વર લેવા ના કહે છે એટલે આશહુલ્લરી
વિનંતિ કરી આપે છે ત્યારે હાક્ષિષયતાથી સ્વિકારે છે.

શ્રીસંધંના દર્શનાં તથા પૈસા આપી લાલ લેનારની
હું એટલી જાની છે કે વિશાળ એવા પણ સંધપતિના
તાણુમાં કૃયાંએ માર્ગ દેખાતો ન હતો.

તે વખતે એક લીમા નામનો વણુયો, કે માત્ર છ ઇપીયોનું સુડીનું ધી લઈને ત્યાં આવ્યો હતો, તે ધી બાહુઙાં સૈન્યમાં નેચતાં તેને એક ઇપીયાથી અધિક નહોં થયો. પછી એક ઇપિયાના પુંષો લઇ પ્રબુની પૂજા કરી, તે લીમા શ્રાવક તંબૂના ખારણા સુધી તો આવ્યો, પણ જાડાં અને જરા મહીન કપડાં હોવાથી છડીદાર અંદર પ્રવેશ કરવા હતો નથી. જેથી જાંચાનીયા થઈ રહેલ છે.

જેની દૃષ્ટિ ચારે બાળુ ફરે છે એવા બાહુડ મંત્રીની દૃષ્ટિ ખારણા તરફ ગઈ જોતાં જાણ્યું કે આને અંદર આવવું છે પરંતુ પોળીઆના રોકવાથી આવી શકતો નથી. દ્રારપાળને હુકમ કર્યો કે તેને અંદર પ્રવેશ કરાવ. જેથી તે લીમા કુડલીઆને અંદર ઢાખલ થવા હીધે. સભામાં આવેલા તે પોતાની સ્થિતિને અનુસારે તેમજ ખીજે સ્થળે માર્ગ નહિ હેખાવાથી એક બાળુ પ્રેથમ આવેલાએના જોડા પાસે એઠો. આ વખતે ઉદાર દિવિના મંત્ર શવરે પોતાની પાસે ગાઢી ઉપર એસવા કલ્યું પણ મનમાં સંકોચાતો જોઈ તેના હૃથ પકડી મંત્રીશ્વરે જાતે જાડાં અને જાંખા કપડા વાળા લીમા કુડલીયાને પોતાની પાસે મખમલના તકીયાએ ગોડવેલાં છે એવી દેશમની ગાઢી ઉપર એસાડે છે. સભામાં એઠેલો લીમા કુડલીએ ત્યાં આવેલા સ્વામીલાઈમાંના કોઈ પાંચ તો કોઈ દર તો કોઈ પચચીસ, પચ્ચાસ હજાર જરાવતા જોઈ અનુમોદના કરતો વિચારે છે કે ધન્ય છે આ મહાનુભાવોને કે મહાનુભાવોને ઉધ્ઘારમાં દ્રવ્યનો વ્યય કરી અસાર એવી લક્ષમીવડે સાર એવા લાલને ઉપાજ્ઞન કરે છે. સાચી

ભાવનાવાળા એકલી કોરી અતુચોહના કરી જેસી રહેતા નથી
પણ શકિ અતુસારે અમલમાં મુકી સાર્થક કરી બતાવે
છે. તે પ્રમાણે આ ભીમો આવક પણ આપવાની ભાવનાથી
ખીસસામાં હૃદય નાખે છે અને કાઢે છે. વળી વિચારે છે કે
આ લાજ્યો અને હુનરોની રકમ આગળ મારા આ પૈસા
શા દિસાખમાં. આ ભાવનાથી તરણોર બનેલા તે ભીમા
શ્રાવકને મંત્રીશ્વર પૂછે છે કે કેમ મહાતુભાવ તમારે કાંઈ
આપવાભાવના છે? મંત્રીશ્વરના આ પ્રશ્નથી ઉડો નિશ્વાસ
નાખી વિચાર સાગરમાં દુખકી મારતા ભીમા શ્રાવકને હેર
મંત્રીરાજ કહેવા લાગ્યા, આમાં વિચારમાં પડવા જેવું. કશું
નથી. જેની જેટલી શકિત અને ભાવના હૃદય તે પ્રમાણે પણ
આપી શકે છે. વાતસલ્યભાવના આ વચ્ચનથી ઉત્સાહિત બનેલા
ભીમા શ્રાવકે ખીસસામા જેટલું હતુ તેટલું બહાર કાઢી કહે
છે કે આજે કલિયુગમાં કલ્પતર્ફ એવા શ્રી જિદ્ધાચલ તીર્થ-
ની યાત્રા કરી એક દ્વિપ્યાના કુલ વડે દાહા શ્રી ઋપલદેવ
સ્વામીની પૂજન કરી, તલાટીમાં આવતાં પુષ્યોહયથી શ્રી સંઘના
દર્શન થયા અને મારી પાસે મુકી—મિલકત આ ગજવામાં
થી નીકળી તે છે. જેથી મારી આ નણું રકમ સ્વીકારી
આ સેવકને કૃતાર્થ કરશો. ભીમા શ્રાવકની આ ઉમદા ઉદારતા-
થી અતિ ખુશ થયેલા મંત્રીરાજે તે વખ્તાનું ચાલતું નાણું
સ્વીકારી લઈ વહીમા સૌથી મથાળે (પહેલુ) તેનું નામ
ચડાયું. આ ખનાવથી મહાઠી રકમો ભરાવનાર શ્રીમંત તો
વિચારમાં પડી ગયા કે આ શું! પણ મંત્રીશ્વર ને કોણું
કહી શકે! જેથી એક ધીજના સુખ સામુ જુઓ છે.
વિચારથી મંત્રી તુરત જ કળી જઈ કહી હે છે કે આ અહ્ય

રકમ આમનારના પ્રથમ નામથી તમારાં મન હુઃખાય છે,
પરંતુ મહાતુલાંચો ! ન્યાયે બુદ્ધિથી વિચાર કરાય સે। પણ
સમજુ શકાય છે કે, હું અને તમો કોડો લાખો કે હુંજરો
આપીએ તોએ ધરમાં રાખીને તે પ્રમાણે આપીએ છીએ
જ્યારે આ ભાગ્યશાળી તો ધરનું સર્વોચ્ચ આપી, દ્વારિદ્ર
અવસ્થામાં દાનને પ્રથમ કલ્પવૃક્ષના દ્વારાંત રૂપે બનાવેલ
છે. તો તેનું સુખ્ય નામ એ વ્યાજથી જ છે, એમ તમારે
પણ સમજુ લેલું જોઈએ હવે પ્રથમ નામવાળાને પહેરામણી
કરાવવાના કમ પ્રમાણે મંત્રીશ્વરે ઉમહા પોષાક તથા અલંકાર
(અંડારી પાસેથી મંગાવી) પહેરવા આગહ કરી લક્ષ્ણિ દર્શાવી,
ત્યારે નિઃસ્પૃહ એવો તે ભીમો કુડલીએ સાંદ ના કણી દેતા
કહે છે કે અદ્ય પૈસા આપવાવાળો એવો હું આ ઉમહા
પોષાકનો અધિકારી ન હોઉં. મંત્રીશ્વરના અત્યાગહ છતાં
નિઃસ્પૃહ ભીમા કુડલીએ પોષાક ન લીધો તે ન જ લીધો. પછી
સંઘને તથા સંધ્યપતિને નમસ્કાર કરી તે ભીમો શ્રાવક પોતાના
ઘેર આવે છે.

ઉચ્ચ ભાવનાનું તાત્કાલિક ઝળ :—આ બાળુ ભીમા
શ્રાવકના ધરમાં તેની રીતે પ્રભાતી પ્રભાતીએ અને સાંભે
સાંજી (કડવા—કઠોર શાખા) સંલગ્નાવી કલેશ કરવાના સ્વલ્પા-
વવાળી, એવી પ્રતિકુલા તે પણ આજે ભીમા કુડલીયાની
ઉચ્ચ ભાવનાથી કરેલાં ધર્મના પ્રભાવથી એકાએક સાનું-
કુલા ખની, સ્વામીને આવતા દેખી ઉઠી ઉસી થઈ, બહુ-
માનપૂર્વક મધુર વાણીથી આદર સત્કાર કરી સુખ શાંતિના

સમાચાર પુછી ગરમ પાણી વડે પગ પ્રક્ષાળી આસને એસાડી પડોશમાંથી બોજનની સામગ્રી (ઉધારે) લાવી મિષ્ટબોજન અનાવી સ્નેહપૂર્વક પતિને જમાડવા લાગી. સરળ લીમા શ્રાવકે સંઘપતિની સભામાં બનેલી હડીકત નિખાલસપણે પલીને કહી. તે સાંકળી પરિવર્તન સ્વભાવવાળી ગૃહીણી આનંદપૂર્વક અનુમોદન કરે છે. આવા પ્રકારના વર્તનથી ભીમો શ્રાવક તો અશ્વર્યમુખ બની જઈ વારંવાર સુકૃતની અનુમોદના કરે છે. હવે તેના આંગણુંમાં આંદેલી ગાયે ખીલો ઉખેડી નાંખવાથી ખીલો મજબુત એસાડના માટે જમીનને જરા ઉંડી ખોડે છે એટલામાં ૧૦૦૦૦ દશ હજાર સેનામહોરનો ચર્ચ નીકળે છે. તે સેનામહોરા સાથે લઈ શેડાણીની અનુમતિ મેળવી, સીધો સંઘપતિના તંખુમાં આવે છે, અને તે સધાળી મિલકત ઉદ્ધાર ફરંડમાં લેવાની મંત્રીશ્વરને આળજી કરેછે. લારે મંત્રીશ્વર કહે છે કે હવે ઉદ્ધાર ફરંડનું કાર્ય સમાપ્ત થયું. હોવાથી જરૂર નથી તેમજ આ લક્ષ્મી પુષ્યપ્રલાવાથી મળેલી છે તો તેનો લોગવટો તમો જ કરો.

મંત્રીએ તે સુવષ્ણુ લેવા ના પાડી, ભીમો આશ્વહ કરે રાખે છે ત્યાં રાત પડી. રાતે કયદીયકે સ્વર્ણમાં લીમાને કહ્યું ‘કે હે લીમા ! તેં એક રૂપિયાના પૂણ્ય લઈ શ્રી આદીશ્વર લગવંતની પૂજા કરી, તેથી પ્રસન્ન થઈ મેં તને સુવષ્ણનો ચર્ચ આપ્યો છે, માટે તું ઈચ્છા મુજબ તેનો લોગવટો કર.’

સવારે લીમે મંત્રીએ બાત કરી, પ્રલુની સુવર્ણરત્નો
તથા પૂણ્યોથી પૂજન કરી, પોતાના વેર આવ્યો અને પુષ્ટય
કાર્યમાં પ્રવૃત્ત થયે.

એ વરસે ન્યારે જીણોધાર પૂર્ણ થઈ જવાના સમા-
ચાર મંત્રીને મહ્યા ત્યારે ખખર લાવનારને મંત્રીએ તેને
વધામણીમાં અગ્રીસ સોનાની જુલો આપી શોડીવાર પછી
ઘીન માણુસે આવી પ્રાસાદમાં ડોઈ કારણુથી ચીરાડ પડી
ગયાના સમાચાર આપ્યા, ત્યારે મંત્રીએ તેને ચોસક
જુલો આપી.

પાસે બેઠેલા માણુસોએ કારણ પૂછ્યું, ત્યારે મંત્રીએ
કહ્યું કે ‘મારા જીવતા પ્રાસાર ફાટ્યો તે ઢીક થયુ’ કેમકે
હું તે ફરીથી બીજુવાર કરાવીશ.,

તુરત મંત્રીએ શીદ્વીએને ખોલાવી પ્રાસાદ ફાટી
ગયાનું કારણ પૂછ્યું, શીદ્વીએએ કહ્યું કે ‘અમતીવાળા
પ્રાસાદમાં પવન પેસવાથી અને નીકળવાની જગ્યા નહિ ભણ-
વાથી પવનના જેરથી પ્રાસાદ ફાટી ગયો, જે અમતી વિનાનો
પ્રાસાદ કરવામાં આવે તો કરાવનારને સંતાન થાય નહિ, એવો
શીદ્વશાસ્કમાં ઉલ્લેખ છે,

આ સંભળી મંત્રીએ કહ્યું કે કોની સંતતી કાયમ રહી
છે ? માટે મારે વાસ્તવિક ધર્મ સંતતિ જ હો’ પછી
ઘને જીતોની વચ્ચમાં મજબૂત શીલાએ મુકાવીને તે
પ્રાસાદ પૂર્ણ કરાવ્યો ફરીથી જીણોધારમાં મંત્રીએ એ
કરોડ સત્તાણું લાખ દ્રંબ ખરચ્યું. ત્રણ વર્ષે કામ પૂર્ણ
થયું હતું.

શ્રી હેમચંદ્રાચાર્યને ખોલાવી ભોટા ઉત્સવ અંજ-
નશ્શલાક પૂર્વક સંવત ૧૯૭૧ માં પ્રતિક્રિયા કરવી. ૨ કંડો
૬૭ લાખનો અર્થ થયો હતો.

આચમાં આરાનો આ બીજો ઉદ્ધાર થયો..

પંહરમો ઉદ્ઘાર સમરાશાનો

હિલ્હીની ગાડી ઉપર અદ્ધાઉદીન ખાદ્યાહના પ્રીતિ
પાત્ર દેશળનો પુત્ર સમરશા પાટથુમાં ઉચ્ચ અધિકારી
પદવી લોગનતા હતા. અદ્ધપણાન. સમરસિંહ ઉપર બંધુ
નેચો પ્રેમ રાખતો હતો.

ખેચ્છ લોકોએ શ્રી શત્રુંજય તીર્થનો લંગ કર્યો
તે સમાચાર સંધને મળતાં ભારે આધાત થયો હતો,
દેશલને પણ આ વાત સાંસાગતા મૂર્ઢળી આવો ગઈ હતી

પછી પૂજય આચાર્યશ્રી લિઙ્ગસેન સૂરીશ્વરજી
મહારાજને વાત જણાવી, ત્યારે તેઓશ્રીએ કહ્યું કે
'કલિકાળનો પ્રલાવ છે, શ્રી ગિરિરાજ ઉપર અનેક ઉદ્ધાર
થયેતા છે, જ્યાં સુધી શ્રી શત્રુંજય તીર્થ છે ત્યાં સુધી
અરી રીતે કથું ગયું નથી, માત્ર તીર્થનો ઉદ્ઘાર કરાવનાર
નેઈએ.

આ સાંસાળી દેશને કહ્યું કે 'તીર્થનો ઉદ્ઘાર કું
કરવીશ. મારી પાસે બધી સામગ્રી છે. માત્ર આપશ્રીની
સહાયની જરૂર છે.

દેશલે ઘેર જઈ શત્રુંજય તીર્થના ઉદ્ઘાર માટે ભાગ્ય-
શાળી કાર્યદૃક્ષ સેવા સમરસિંહ (સમરશા)નાં નિમણું કરી

એટલે સમરસિહે તુરત પૂજય આચાર્ય લગવાંત પાસે જઈ
જ્યાં સુધી તીર્થોધાર પૂર્ણ ન થાય ત્યાં સુધીના કેટલાક
અભિગ્રહે લીધા.

શનુંજ્ય તીર્થનો ઉદ્ઘાર કરવો એ મહાનેખમી કાર્ય હતું.
કેમકે ખાદશાહને જે આ વાતની અખર પડે તો મહાન આપત્તિ
આવી પડે તેમ હતું. તેથી સમરાશાહે સુખા અલપખાનની
સહાય અને ફરમાન મેળવી, પછી ગુરમહારાજને વાત કરી
ત્યારે પૂજય આચાર્યને કહ્યું કે ‘તારું લાભ અદીયાતું’ છે,
કેમકે મૂર્તિના દ્રેપી એવા અલપખાને તીર્થોદ્ઘારની રજ આપી.’

ત્યાર પછી સંધની અનુશા મેળવી સમરાશાહે નિસંગ-
પુરના શિવલક્ષ્ણ મહિપાલ રાજને ઝુશ કરી શ્રી આદીશ્વર
લગવાનની નવિ મૂર્તિ માટે ખાણુમાંથી સુંદર આરસ કાઠ-
વાની રજ મેળવી, એ ત્રણુ મોટા આરસ ડાઘવાળા નીકળવાથી
માણુસો અત્યંત જિન્ન થયા એટલે સમરાશાહે અફુમનો તપ
કર્યો. અધિષ્ઠાયકે કહેલા લાગમાંથી જોદતા સુંદર સ્કૃતીક જેવો
આરસ નીકળ્યો. પછી તે આરસ શનુંજ્ય લાવવામાં આવ્યો
તેને ઉપર અદાવતા છ દવસ લાભા હતા. પછી તેમાંથી ઝુદ્રિ-
માન શીદ્ધીએ દ્વારા સુંદર પ્રતિમાનું નિર્માણ કરાયું.

જિર્ણોદ્ઘાર પૂર્ણ થતા પ્રતિષ્ઠા માટે ગામોગામના સંગ્રે
ઉપર આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

પછી સમરાશાને સંધપતિનું તિલક કરવામાં આવ્યું.
પોષ સુદ્ધ ના પાટણુથી સંધનું પ્રયાણ થયું. સંધમા અનેક ગચ્છના
અનેક આચાર્યો, પ્રદર્શ સુનિએ, આગેવાન શ્રાવક-શ્રાવિકાએ
આદ્ધ હજરોની સંઘ્યા હતી.

શ્રી સિદ્ગિરિલુ ઉપર દશ દિવસનો મહાન મહોત્સવ,
યાચકેને દાન વગેરે શુલ કાયો સહિત મૂળ આ. શ્રી વિજય
સિધ્ધસેનસૂરીશ્વરજી મહારાજના હુસ્તે વિકુમ સંવત ૧૩૭૧
મહા શુદ્ધ ૧૪ સેમવારના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી

ત્યાર પછી જુનાગઢ, પ્રલાસપાટણ વગેરે થઈ સંધ
પાટણ આવ્યો આ રીતે શ્રી સિદ્ગિરિલિંગનો ઉધ્યાર કરાવ્યો.

કરમાશાચે કરાવેલો સોણમો ઉધ્યાર

ચિતોડના રાણુા સંઘામસિહના-મંત્રી તોલાશાહે
ચિતોડમાં એ મંદિરો બંધાવ્યા હતા. પછી તોલાશાહના પુત્ર
કરમાશા મંત્રીપદે આવ્યા.

એક વખત અમદાવાદના સુલતાનનો નાનો પુત્ર બણા-
હુરશાહ રીસાઈને ચિતોડ આવ્યો; કરમાશાચે તેને સંભાળી
લીધો અને મોટી રકમની મહદુદ કરી, તેથી તેને ન્યારે ગાંઠી
મળી ત્યારે કરમાશાને બોલાવી 'જે જેઠાચે તે માણી લે'
એમ કહ્યું.

ત્યારે કરમાશાને શ્રી શનુંજ્યના ઉદ્ઘારની લાવના
હતી તેથી ઉદ્ઘાર કરાવવા માટે રક્ષણું અને અસ્યદાન
માંયા. એટલે બણાહુરશાહે સોરહના સુણા ઉપર કરમાશાને
શનુંજ્યના ઉદ્ઘારમાં હરેક જાતની મહદુદ આપવા શાહી કર-
માન લઈ આપ્યું.

આ ઉપરથી કરમાશાચે તીર્થીધ્યારનું કાર્ય શરૂ કરાવ્યું;
સવા કરોડ દ્રવ્યનો ખર્ચ થયો. સંવત ૧૫૮૭ ના વૈશાખ
વર્ષી દુના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી.

આજે જે મૂર્તિં પ્રતિષ્ઠિત છે, તે કરમાશાંએ ઐસાડેલી છે. દરવરસે વૈશાખ વદ દ ના હિવસે વરસગાંઠ ઉજવાય છે.

આ અવસર્પિણીમાં છેલ્લાં ઉદ્ઘાર શ્રી હૃપ્સહસુરિના ઉપદેશથી વિમલવાહુન રાજ કરાવશે.

એકવીસ હુનાર વર્ષના પાંચમાં આરાને છેદે આ ભરતક્ષેત્રમાં છેલ્લાં શ્રી હૃપ્સહસુરિનું આચાર્ય, શ્રી કૃષ્ણ-શ્રીલુ સાધ્વી, નાગિલ શ્રાવક, સત્યશ્રી શ્રાવિકા થશે. છેલ્લાં વિમલવાહુન રાજ શ્રી સિદ્ધગિરિનુંની યાત્રા કરી ઉદ્ઘાર કરાવશે: પાંચમાં આરાના છેલ્લાં હિવસે સવારે ચારિત્રનો ક્ષય; મધ્યાહ્ને રાજધર્મનો ક્ષય, સાંજે અભિનો નાશ થશે. સિદ્ધગિરિનું માત્ર સાત હાથના પ્રમાણુવાળો રહેશે. પછી એકવીસ હુનાર વર્ષનો છુટો આરો શરૂ થશે. પછી ઉત્સપિણી કાળમા પહેલાં અને બીજા આરાના યોતાલીસ હુનાર વર્ષ ગયા પછી ત્રીજા આરામાં શ્રી પદ્મનાલ પ્રભુના તીર્થમાં પૂર્વની જેમ શ્રી શાન્તુંજ્યતીર્થનો ઉદ્ઘાર થશે. પદ્મનાલ પ્રભુની મૂર્તિ વિરાજમાન થશે અને રાયણુ-વૃક્ષ ઉગશે. વૃદ્ધિપામતો પામતો આ ગિરિવિર પાછો એંશી ચોજનના વિરતારવાળો થશે. આ ગિરિશાજ જિનેશ્વર ભગવંતની જેમ ઉદ્ય પામી કીર્તન, દર્શન અને સ્પર્શનથી અનંતા આત્માએનો તારક બનશે. આ ગિરિવિરને સદાકાળ અમારા ત્રિકાળ વંદન હોજે.

(૮) અરિરાજ ઉપર મોક્ષ ગયેલાના કેટલાક નામો-	
શ્રી પુંડરીક ગણુધર	૫ કોડ સાથે ચૈત્રી સુદ ૧૫
દ્રાવિડ અને વારિભિલળુ	૧૦ , , કાર્તીક સુદ ૧૫
શાખા અને પદુભન	૮ કોડ ૫૦ લાખ સાથે ક્રાગણુ સુદ ૮
પાંચ પાંડવો	૨૦ , , સાથે આસો સુદ ૧૫
નમિ અને વિનમિ	૨ , , , "
નારદળુ	૬૧ લાખ , , "
રામ અને લરત	૩ કોડ , , "
સોમયથા	૧૩ , , "
વસુદેવની પત્ની	૩૫ હજાર , , "
શ્રી શાંતિનાથ પ્રભુના	
ચ્યામાસામાં	૧, ૫૨, ૫૫, ૭૭૭ , ,
સાગર મુનિ	૧ કોડ સાથે
ભરત મુનિ	૫ , , "
અન્જિતસેન	૧૭ , , "
શ્રી અન્જિતનાથ પ્રભુનાં	
સાધુ	૧૦ હજાર
શ્રી શાંતિનાથ	" , , "
શ્રીસાર મુનિ	૧ કોડ સાથે
વૈઘણી	૪૪૦૦ , , "
આદિત્યયથા	૧ લાખ , , "
બાહુભલીના પુત્રો	૧૦૮
દમિતારિ	૧૪ હજાર સાથે

થાવચ્ચાપુર	૧	હંજર સાથે
શુક પરિપ્રાજક	૧	„ „ „
થાવચ્ચા ગણુધર	૧	„ „ „
કાલિક	૧	„ „ „
કદમ્બ ગણુધર	૧	કોડ „
સુલદ્ર સુનિ	૭૦૦	„
સેલકાચાર્ય	૫૦૦	„

આ સિવાય અનંતા આત્માએ આ શ્રી શનુંભ્ય ગિરિ-
ઉપર મોક્ષ ગયેલા છે. કંઠરે કંઠરે અનંતા આત્માએ
સિદ્ધ થયા છે. અવિષ્ય કાલમાં પણ અનંતા મોક્ષ જશે.

શ્રી અનુભૂતનાથસ્વામિ અને શ્રી શાંતિનાથ લગ્નાને
સિધ્ધગિરિલુમાં ચોમાસું પણ કર્યું હતું.

(૮) ગિરિરાજના ૧૦૮ ઉત્તમ નામે.

૧ શનુંભ્ય, ૨ ખાહુખલી, ૩ મર્દેવ, ૪ પુંડીકગિરિ,
૫ રૈવતગિરિ, ૬ વિમલાચલ, ૭ સિદ્ધરાજ, ૮ ભગીરથ, ૯
સિધ્ધક્ષેત્ર ૧૦ સહસ્રકમલ, ૧૧ સુક્રિનિલય, ૧૨ સિદ્ધા-
ચલ, ૧૩ શતકૂટગિરિ, ૧૪ દંક, ૧૫ કોડી નિવાસ ૧૬
કદમ્બગિરિ, ૧૭ લોહિત્ય ૧૮ તાલધ્વન. ૧૯ પુષ્યરાશિ,
૨૦ મહાખલ, ૨૧ દ્રદ્ધક્રિતિ, ૨૨ શતપત્ર, ૨૩ વિજ્યાનંદ
૨૪ ભર્તુંકર, ૨૫ મહાપીઠ, ૨૬ સૂરગિરિ, ૨૭ મહાગિરિ,
૨૮ મહાનંદ ૨૯ કર્મસૂહન, ૩૦ કૈલાસ ૩૧ પુષ્પદંત, ૩૨
જ્યાંત, ૩૩ બાનંદ, ૩૪ શ્રીપદ, ૩૫ હૃતગિરિ, ૩૬ શાર્વત-
ગિરિ, ૩૭ અવ્યગિરિ, ૩૮ સિધ્ધશોખર, ૩૯ મહાશય, ૪૦
માલ્યવંત, ૪૧ પૂઢ્વીપીઠ ૪૨ ફુઃખર, ૪૩ સુક્રિરાજ, ૪૪.

મણુકંત, ૪૫ મેડમહીધર, ૪૬ કંચનગિરિ, ૪૭ આનંધદર
 ૪૮ પુષ્પકંદ, ૪૯ જયાનંદ, ૫૦ પાતાલમૂલ, ૫૧ વિલાસ
 પર વિશાળ, ૫૩ જગતારણ, ૫૪ અકલંક, ૫૫ અકર્મક,
 ૫૬ મહાતીર્થ, ૫૭ હેમગિરિ ૫૮ અનંતશક્તિ, ૫૯ પુરુષોત્તમ
 ૬૦ પર્વતરાજ, ૬૧ જ્યોતિરુપ. ૬૨ વિલાસલદ, ૬૩ સુભદ્ર
 ૬૪ અજરામર, ૬૫ ક્ષેમંકર, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણુકંદ,
 ૬૮ સહસ્રપત્ર. ૬૯ શિવંકર, ૭૦ કર્મક્ષય, ૭૧ તમોકંદ
 ૭૨ રાજરાજેશર, ૭૩ લવતારણ, ૭૪ ગાજચંદ્ર, ૭૫ મહોદ્ય
 ૭૬ સુરકંત. ૭૭ અગ્રણ. ૭૮ અભિનંદન. ૭૯ સુમતિ. ૮૦
 શ્રેષ્ઠ. ૮૧ અલયકરં, ૮૨ ઉજ્વળગિરિ. ૮૩ મહાપત્ર. ૮૪
 વિશ્વાનંદ. ૮૫ વિજય લદ ૮૬ ધન્દ્રપ્રકાશ ૮૭ કૃપદ્વિવાસ.
 ૮૮ મુક્તિનિકેતન. ૮૯ ડેવળદાયક. ૯૦ ચર્ચગિરિ. ૯૧
 અષોતર શતકૂટ. ૯૨ સૌંદર્ય. ૯૩ યશોધરા ૯૪ પ્રીતિ
 મંડન. ૯૫ કામુકકામ અથવા કામદાયી. ૯૬ સહુળનંદ.
 ૯૭ મહેન્દ્રદવશ. ૯૮ સર્વાર્થસિદ્ધ ૯૯ પ્રિયંકર.

આ નામો સિવાય શ્રી શાનુંજય મહાત્મ્યમાં પ્રલ્ગિરિ
 નાન્દિગિરિ, શ્રેયઃપદ, પ્રલોઃપદ, સર્વકામદ. ક્ષિતિમંડન
 સહસ્રાણ્ય, તાપસગિરિ. સ્વર્ગગિરિ, ઉમાશંખગિરિ, સ્ર્વણુગિરિ
 ઉદ્યગિરિ અને અર્ણુદગિરિ વગેરે નામો પણું આપેલા જણ્ણાય
 છે વળી ઉપલાં ૯૯ નામ ઉપરાંત ખીંદા દ નામ સહિત
 તેના ૧૦૮ નામ પણું અન્યત્ર કહ્યાં છે.

૧૦ શ્રી શતુંજ્ય મહાતીર્થ કૃદ્ય

શ્રુત-સિદ્ધાંતમાં વણ્ણવેલા અને હેવેદ્રોએ વંદેલા એવા જે તીર્થરાજનાં વિધાપ્રાભૂત નામના પૂવમાં ૨૧ ઉત્તમ નામ કહ્યાં છે, તે (પવિત્ર) તીર્થરાજની અમે સ્તવના કરીયે છીએ. ૧

૧ વિમલગિરિ, ૨ મુક્તિનિલય, ૩ શતુંજ્ય, ૪ સિદ્ધ્યે ક્ષેત્ર, ૫ પુંડરીકગિરિ, ૬ શ્રી સિદ્ધશોભર, ૭ શ્રી સિદ્ધગિરિ ૮ શ્રી સિદ્ધરાજ. ૨

૯ બાહુખલી, ૧૦ મરુહેવ, ૧૧ લગીરથ, ૧૨ સહચ-પત્ર, ૧૪ અઠોટાર શકૂતટ, ૧૫ નગાધિરાજ, ૧૬ સહચકુમલ. ૩

૧૭ ૬૦૫, ૧૮ કેડિનિવાસ, ૧૯ લોહિત્ય, ૨૦ તાલધર, અને ૨૧ કદમ્બગિરિ આ ઉત્તમ ૨૧ નામો સુરનર મુનિઓએ મળીને સ્થાપ્યા છે, તે વિમલગિરિરાજ જ્યવંત વર્તો. ૪

જેમાંના દંકાદિક પાંચ શિખરોમાં હેવતાધિષ્ઠિત રલની ખાણો, ગુરુણો, ઔષધિઓ અને રસ કુપિકાઓ વિધમાન છે, તે વિમલ ગિરિરાજ જ્યવંત વર્તો ! ૫

જે પહેલાં આરાથી માંડી છટ્ઠા આરા સુધીમાં અનુ-ક્રમે ધટ્ટો ધટ્ટો ૮૦, ૭૦, ૬૦, ૫૦, ૧૨ યોજન અને ૭ હાથના વિસ્તારવાળો કહ્યો છે, તે વિમલ ગિરિરાજ જ્યવંત વર્તો. ૬

ને ઋપલબનાથ લગવાનના વારે આડ ચોજન ઉંચો,
પચાસ ચોજન મૂળમાં દશ અને ચોજન ઉપરના ભાગે વિસ્તીર્ણ
હતો, તે વિમલગિરિરાજ જયવંત વર્તો. ૭

જ્યાં ઋપલસેન પ્રમુખ અસંખ્ય તીર્થોકરો સમવસર્યા
છે અને શ્રી સિદ્ધશૈલ ઉપર સિદ્ધ થયેલ છે, તે વિમલગિરિ-
રાજ. જયવંત વર્તો. ૮

શ્રી પદ્મનાલ પ્રમુખ લાલિ તીર્થોકરો જ્યાં આવી
સમવસરશો જેથી તેનું સિદ્ધક્ષેત્ર નામ મશાહૂર છે, એવા શ્રી
વિમલગિરિરાજ૦ ૯

વળી જ્યાં શ્રી નેમિનાથ લગવાન વિના ઋપલદેવથી
માંડી વર્ધમાન પ્રલુ પર્યાંત ૨૩ તીર્થોકર વર્તમાન કાળમાં
સમવસર્યા છે, તે શ્રી વિમલ ગિરિરાજ૦ ૧૦

જ્યાં ભરત ચક્રવર્તીએ કરાવેલું ૨૨ જિનાલય સહિત
શ્રી ઋપલદેવ લગવાનનું ચૈત્ય મણિમય, સુવર્ણમય, અને
રૂપામય, પ્રતિમાઓથી અલંકૃત છે, એવો શ્રી વિમલ ૧૧

વળી જ્યાં બાહુમદીલુએ શ્રી મરુહેવી માતાનું મંદિર
રમણિય અને સમવસરણ યુક્ત કરાવેલું છે, તે શ્રી વિમલ
ગિરિરાજ જયવંત વર્તો ! ૧૨

આ અવસર્પિણી કાળમા જ્યાં સહૃથી પ્રથમ ભરત
ચક્રવર્તીના પહેલા પુત્ર અને પ્રથમ તીર્થોકર લગવાનના
પ્રથમ ગણુધર મહારાજ શ્રી પુંડરીકસ્વામી સિદ્ધિપદને
પામ્યા, તે વિમલગિરિરાજ ૦ ૧૩

ચત્રી પુર્ણિમાંચે પાંચ કોડ મુનિથી પરિવરેતા પુંડ-
રીકસ્વામી જ્યાં નિર્મળ મેલ્ખપદને પામ્યા તે શ્રી વિમલ-
ગિરિ૦ ૧૪

નમિ અને વિનમિ વિદ્યાધરો એ કોડ મુનિ સંધાતે
જ્યાં સિદ્ધપદને વર્યા, તે વિમલ ગિરિચ૦ ૧૫

ચૌદ લાખ મોટ્ટે જય ત્યારે એક સર્વાર્થ સિદ્ધ
વિમાનમાં જય. એવી રીતે ૫૦ લાખ કોડ સાગરોપમ
સુધી સૂર્યયશાસ્તી માંડીને સગર ચક્રવર્તી પર્યાત ઋષલહેવના
વંશનાં અસંખ્ય પદૃપરંપરા-અસંખ્ય રાજાઓ જ્યાં સિદ્ધ
પદને વર્યા તે શ્રી વિમલ ગિરિચ૦ ૧૬-૧૭

જ્યાં ધીજા શ્રી અજિતનાથ લગવાન અને સોળમા
ધર્મ ચક્રવર્તી શ્રી શાંતિનાથ લગવાન ચાંતુર્માસ રહ્યા
તે વિમલગિરી૦ ૧૮

દ્રાવિડ અને વારિભિલ પ્રમુખ રાજાઓ દર્શકોડ
સાધુ સંધાતે ગિરિચ૦ ૭૫ પર સિદ્ધપદવીને પામ્યા, તે શ્રી
પુંડરીકતીર્થ જયવંત વતોં. !૧૯

જ્યાં રામચંદ્રાદિક પ્રણુ કોડ સાધુઓ સાથે અને નારદ
આદિ ૬૧ લાખ સાધુઓ સાથે સિદ્ધ થયા તે શ્રી વિમલ ગિરિ-
ચ૦ ૨૦

શ્રી નેમિનાથ પ્રલુની આજ્ઞાથી યાત્રાએ આવેતા
નંદિષેણ નામના ગણુધરે જ્યાં અજિતશાંતિ સ્તવ કર્યો, તે
વિમળ૦ ૨૧

જ્યાં શાંખ અને પ્રધુમન શ્રેષ્ઠ કુમારો ૮ કોડ મુનિઓ
સંધાતે શિવસંપદાને વર્યા તે શ્રી વિમલગિરિ૦ ૨૨

વળી ભરત, સેલકસ્ટરી, થાવચચાપુત્ર અને શુકાચાર્ય
પ્રમુખ અસંખ્ય કોડાકોડ સાધુઓ સિદ્ધપદને વર્ણી તે વિમ-
લગિરી ૨૩

અસંખ્ય ઉદ્ધારો, અસંખ્ય પ્રતિમાઓ અને અસંખ્ય
ચૈત્યો જ્યાં થયા તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થ જ્યવંત
વતો ! ૨૪

જેમણે જિનપ્રતિમાનો ઉદ્ધાર કરો એવા પાંચ પાંડવો
વીસ કોડ મુનિ સંઘાતે જ્યાં સુજિતપદને પામ્યા, તે વિમલ-
ગિરિજા ૨૫

જ્યાં ચિલણું તળાવડીની નજીફિકમાં રહેલી હેવતાધિ-
ષિત શુક્ષમાં વિરાજમાન કરેલી, ભરત અકવતીર્થો કરાવેલી
પ્રભુ પ્રતિમાને નમસ્કાર કરનાર એકાવતારી થાય છે, એવો
શ્રી વિમલગિરિજા ૨૬

દધિક્ષિત (કોડાનાં) વૃક્ષ સમીપે અને અલગખ દેવ-
ડીની નજીફિકમાં રહેલી તે હેવતાધિષ્ઠિત શુક્ષતું મોકષદ્વારના
જેનું દ્વાર ઉધારીને અફુમ તપથી તુષ્ટમાન થયેલો કપદી
યક્ષ જ્યાં ભરત મહારાજે કરાવેલી મલુ પ્રતિમાને વંદાવે
છે, તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થજાજ જ્યવંત વતો ! ૨૭-૨૮

સંપ્રતિ, વિકલ, ણાહડ, હાલ, પાદલિમ, આમ, અને
દત્તરાજાદિક જેનો ઉદ્ધાર કરનારા થશો, એવો શ્રી શત્રુંજ્ય
મહાતીર્થજાજ જ્યવંત જોતો ! ૨૯

મહાવિદેહ ક્ષેત્રમાં પણ સમ્યગ્દાષિજનો જેનું
સદ્ગ સમરણ કરે છે એવી હકીકત શક્યાનું કાલકસૂરી

સમીપે જણાવો તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થ જ્યવંત
વરો ! ૩૦

નાવડશાચે કરાવેલા ચૈત્ય ઉદ્ધાર સમયે શ્રી અન્જિત-
નાથસ્વામીના ચૈલ સમીપે જ્યાં અનુપમ સરોવર નિર્માણ
કરવામાં આવેલું છે, તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થ જ્યવંત
વરો ! ૩૧

જ્યાં કદ્દીરાજના પુત્રનો પુત્ર મેધઘોષરાજ મરૃદેવી
માતાના શ્રી શાંતિનાથના મંદિરનો ઉદ્ધાર કરશે, તે શ્રી
શત્રુંજ્ય મહાતીર્થ જ્યવંત વરો ! ૩૨

કુષ્પસહસ્રસ્તિના ઉપદેશથી વિમલવાહન રાજ જેનો
છેલ્દો ઉદ્ધાર કરાવશે, તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થ જ્યવંત
વરો ! ૩૩

જ્યારે તીર્થનું માન બીલકુલ ઘટી જશે અર્થાતુ
પ્રમાણમાં તે ખાડુજ અદ્ય રહેશે અને વર્તમાન વીરશા-
સનનો પણ વિચ્છેદ થશે ત્યારે પણ લાવિ પર્બતાલ પ્રલુના
શાસન સુધી જેનું રિખલકૂટ તો (દ્વાહિકથી) પૂજાતું જ
રહેશે, તે શ્રી શત્રુંજ્ય મહાતીર્થ જ્યવંત વરો ! ૩૪

જેમાં નિવાસ કરતા તિર્થચો પણ પાયઃ પાપરહિત
છતા સહૃગતિ પામે છે, એવો શ્રી શત્રુંજ્ય મહાતીર્થ
જ્યવંત વરો ! ૩૫

જે તીર્થના કદ્વપનું નિરંતર વ્યાપ્યાન, ધ્યાન, શ્રવણ
કે સમરણ કરવાથી ત્રીજે લવે મોક્ષ થાય છે, તે શ્રી શત્રુંજ્ય
મહાતીર્થ જ્યવંત વરો ! ૩૬

જેનું નામ સાંભળતાં (યા સંભારતા) જળ, અજિન
સમુદ્ર, રણ, વન, સિંહ હાથી, વિષ અને વિષધર આદિનાં
કુષ્ટભય ફર થઈ જાય છે તે શરૂંજય મહાતીર્થ જયવંત
વતો ! ૩૭

આચાર્ય શ્રી ભદ્રભાહુસ્વામિએ રચેલા કલ્પ થડી,
શ્રી શરૂંજય તીર્થનું મહાત્મ્ય શ્રી વજ્રસ્વામીજી મહારાજે
ઉદ્ઘર્યું. અને શ્રી પાદલિખિત સૂરિએ તેને સંશોધ્યું છે ! ૩૮

તે શ્રી શરૂંજય (મહા) કલ્પ-સ્તવ શુદુ પરંપરાથી
જેમ સાંભળ્યો તેમ જ મેં કદ્યો છે. ઉક્ત સ્તવને લાવથી
લાણુનાર, સાંભળનાર અને સંભારનાર લવ્યોને તેના પ્રલાવે
દ્રવ્ય-ભાવશરૂનો જય કરવાનું સામર્થ્ય શીથી સંપ્રાપ્ત
થાઓ ! ૩૯

(૧૧) તીર્થયાત્રાના પ્રલાવ.

જે તારે એ તીર્થ કહેવાય. નહી ઉત્તરવાના સ્થાનને
દ્રવ્યતીર્થ કહેવાય છે; જયારે સંસારસમુદ્રથી પાર કરાવ-
નારને લાવતીર્થ કહેવાય છે.

જ્યાં શ્રી તીર્થંકર લગ્બવંતના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન
મોક્ષ થયું હોય, તથા જ્યાં જ્યાં તેઓના પવિત્ર પાદસ્પ-
રંથી ભૂમિ પાવત થઈ હોય; આ બધા સ્થાનો આત્માને
સંસાર સમુદ્રથી પાર કરાવનાર હોવાથી તે તે સ્થળોએ
સુંદર ચૈલ્યો, ચરણુ પાહુકા બનાવવામાં આવે છે. આ ભાવ-
તીર્થ-કહેવાય છે. વ્યવહારમાં આ સ્થાવર તીર્થની જ મુખ્યતા
ગણ્યાય છે, સાધુ સાધી, શ્રાવક શ્રાવિકા અને જિતપ્રત્યન
એ જગમ તીર્થ કહેવાય છે.

આ તીર્થો પ્રવાહુથી અનંતકાળથી ચાલુ જ છે, લવે કાળના પ્રભાવે પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઔરવતક્ષેત્રોમાં કોઈ કોઈ વખતે તીર્થનો વિનિષેદ હોય, પણ પાંચ મહા-વિદેહ ક્ષેત્રમાં તો કોઈ કણે વિરહ હોતો જ નથી.

તીર્થસ્થાનો સારામાં સારા રમણીય, કલાયુક્ત, શીર્ષપ-શાસ્ત્રાનુસાર બનાવવામાં લાખે ને કરોડો રૂપીયા ખર્ચવાનું એકજ કારણ હોય છે, કે તીર્થો જેટલા મનોહર તેટલા જેનાર આત્માના લાવમાં અધિક ઉલ્લાસ થાય અને આત્મા કર્મની વધુ નિર્જરા કરી શકે.

તીર્થસ્થાનોનું વાતાવરણ અતિ પવિત્ર સાત્ત્વિક અને શાંતિદાયક હોય છે. એટલે ત્યાં લાવનાએ સારી આવે છે, હુષ વિચારો ચાલ્યા જય છે, કેમકે મનુષ્યોનો સ્વલ્પા છે કે તે જેવા વાતાવરણમાં હોય તેવી છાયા તેના માનસ ઉપર અવસ્થય પડે છે. તીર્થ એ ખરેખર આત્મારૂપી લોઢાને સુવધું બનાવનાર અદ્ભુત રસાયણ છે. માટે જ તીર્થાંકર ભગવંતોએ અને સુનિ પુંગવોએ તીર્થયાત્રા કરવાનો ઉપદેશ આપેલો છે, કહ્યું છે કે:-

“તીર્થાત્રિકોના પગની રજથી રજવાળા થનારા મનુષ્યો કર્મરજથી રહિત થાય છે. તીર્થમાં પરિબ્રમણ કરનારા મનુષ્યો સંચારમાં પરિબ્રમણ કરતા નથી. તીર્થયાત્રામાં દ્વય ખરચ કરવાથી મનુષ્યો સ્થિર સંપત્તિવાળા થાય છે અને તીર્થસ્થાનમાં જઈ શ્રી જિનેશ્વર હેવની પૂન, લક્ષ્મિ આરાધના ફરનારા પોતે પૂજનીક બને છે.

તीર्थयात्रा કરવाथી જીબમાં વૃદ્ધિ થાય છે, દૃષ્ટિ વિશાળ બને છે, ચારિત્ર નિર્મણ બને છે, જીવનમાં ડિલારતા, પરમાર્થ, પરોપકાર પરાયણુતા, સ્વાશ્રયપણું અડતલપણું થાય છે, એક ધીજાનો પરિચય, શુલ્ષસંકારાની લેવડહેવડ થાય છે, તથા આરંલ આહિ પાપથી મેળ-વેલી લક્ષ્મીનો લક્ષ્મિ, સેવા વગેરે કાર્યોમાં સહૃદિયોગ થવાથી તે સહૃદળ બને છે.”

(૧૨) યાત્રા કેવી રીતે કરવી જોઈએ ?

તીર્થયાત્રા સુખ્ય રીતે છ, રો પૂર્વક કરવી જોઈએ.

૧ એકાહારી, ૨ સચિત પરિહારી, ૩ ભૂમિસંથારી
૪ પ્રક્ષયારી, ૫ પાદવિહારી અને ૬ સમુક્તવધારી. આ છાણેના છેડે રી આવવાથી આને છ, રી કહેવાય છે.

૧ એકાહારી—યાત્રા કરનારે એકજવાર લોજન કરવું જોઈએ એટલે, એકાસના કરવા.

૨ સચિત પરિહારો—સચિત એટલે જીવવાળી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. કાચા ઝોણો સચિત મીઠું, લીલું દાતણું. કાચા પાકા શાક વગેરે આવા ન જોઈએ.

૩ ભૂમિસંથારી—પલંગ, જોદાં, હિંડાણો, પાટ, ખાટલા, વગેરેનો ત્યાગ કરી એક સંથારો (ગરમ વસ્તુ) માત્ર પાથરી તેના ઉપર સૂઈ રહેવું જોઈએ.

૪ પ્રક્ષયારો—પ્રક્ષયાર્થનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ યાત્રા દરમ્યાન પુરુષે સ્ત્રીનો સંગ અને સ્ત્રીએ પુરુષનો સંગ કરવો ન જોઈએ.

૫ પાછ વિહારીઃ ઘેરથી યાત્રા કરવા નિકળે ત્યારથી ગાડી, મોટર, રેલ્વે, જેડા આદિ કોઈ જાતનો ઉપયોગ નહિ કરતા ખુલ્લા પગે ચાલીને યાત્રા કરવી જોઈએ.

પગે ચાલીને યાત્રા કરવામાં, રસ્તે આવતા મંદિરો બગેરેના દર્શાનનો લાભ મળે છે. શરીર નિરોગી રહે છે. સાધ્યમિંડલાંજિ બગેરે લાભ મળે છે, લાંના સંઘે સ્થિર થઈ જય છે, બગેરે લાલો ચાલીને સંધ યાત્રા કરવામાં રહેલા છે.

૬ સમ્યકૃતવધારી— જૈનશાસન પામેલા પ્રત્યેક આત્માએ, રાગદ્રોષથી રહિત સર્વજ પરમાત્મા એજ હેવ, કંચન કામિનીના લ્યાગી નિર્ગંથ સાધુ એજ ગુરુ અને જિનેશ્વર ભગવતોએ જાતાવેલા ધર્મ પ્રત્યે જ શ્રદ્ધા રાખવી જોઈએ. જે હેવ ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તો કરેલી સધણી કિયા નિર્ઝણ થાય છે.

યાત્રા કરનારે જેમ ઉપરની છ'રીતું આચરણ કરવાનું છે. તેમ નીચેના છ કર્તાંયો પણ અવશ્ય કરવા જોઈએ.

૧ દાન શક્તિ મુજબ દાન કરવું જોઈએ.

૨ તપ્ય „ તપ્ય કરવો જોઈએ.

૩ દેહવિભૂષા-તીર્થભૂમિમાં પોતાની ભૂમિકા મુજબનો ઉચ્ચિત વેશ પહેરવો જોઈએ. ઉદસટ વેશ પહેરવો ન જોઈએ. આજે વર્તમાનમાં તીર્થ યાત્રાના પ્રસંગમાં પણ જે સિનેમા-નાટકના નટનીટીનું અતુકરણ થઈ રહેલું છે, તે ખરેખર અધઃપતનનો માર્ગ લાગે છે.

મોજશોખ કે કરવા માટે હવા માટે તીર્થ જવાથી યાત્રાને ટકેઈ લાસ પ્રાપ્ત થતો નથી, પણ તીર્થ આશાતના આહિનો દોર કર્મબંધ થાય છે, માટે યાત્રા કર્મની નિર્જરાના જ હેતુ પૂર્વક કરવી જેધીએ.

૪ વાર્ણિક વાહન- પોતાની ભૂમિકાને ચોગ્ય પ્રભુ આગળ ગીત વાર્ણિકના નાદ પૂર્વક લક્ષ્ણ કરવી જઈએ.

સ્તુતિ સ્તવન વગેરે મધુર સ્વરે અને ખીજને વ્યાઘાત ન થાય તે રીતે બોલવા આસ ઉપયોગ કરવો જઈએ. ખીજ સુંદર રીતે બોલતા હોય તો તે સાંસારનાથી પણ આપણને લાસ થાય છે. તેમનું સ્તવન વગેરે પૂર્ણ થાય ત્યારે આપણે બોલવું, આમાં પરમાત્માની વિશેષ લક્ષ્ણ રહેલી છે.

જે વાર્ણિક વગાડતા હોઈએ તે તેના તાલ અને લય પૂર્વક વગાડવું જેધી ખીજની લાવનામાં વૃદ્ધ થાય, હુંદોલાસ વધે.

સ્તુતિ સ્તોત્ર- પ્રભુની આગળ સ્તોત્ર, સ્તવનો કે જેમાં પ્રભુના શુણુગાન હોય, પ્રાર્થના હોય કે આત્માની નિદા હોય. તેવા બોલવા જેધીએ. પ્રભુલક્ષ્ણ પોષાય તથા તેવા સ્તવનો બોલવા જેધીએ.

૬ નાટક- પ્રભુતી આગળ સ્તોત્ર નૃત્ય કરવું, દાંડીયા લેવા, ચામર લઈ નાચવું, વગેરેથી પોતાને પણ ધણો આનંદ આવે છે અને જેનારાઓના ચિત્ત પણ ધણા પ્રકૃતિલિત બને છે.

નૃત્ય-દાંડીયા વગેરે સત્રીઓએ સત્રીની સલામાં-માત્ર સત્રીઓ હોય ત્યાંજ લેવા, પણ જ્યાં પુરુષો, હોય ત્યાં લેવા ચોગ્ય નથી.

(૧૩) માનસિક, વાચિક, કાચિક, પવિત્રતા કેમ રાખવી?

માનસિક પવિત્રતા:-તીર્થયાત્રા કરનારા પ્રત્યેક યાત્રિકોએ મનની શુદ્ધિ ખાસ રાખવી જોઈએ. સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા એ જગ્ગમતીર્થ છે અને શ્રી શાળુંભય ગિરનારજી વગેરે સ્થાવર તીર્થો છે, આત્માને સંસાર સમુદ્રથી પાર કરનાર છે એવી મનમાં સચોટ શ્રદ્ધા રાખવી, જેમ અને તેમ વિષય અને કષાયથી નિવૃત અનવું અર્થાત् વિષય કષાયાને વશ ન થવું.

વાચિક પવિત્રતા:-તીર્થ, સંધ્યાગ્રા, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના અવણુંવાદ પોલવા ન જોઈએ તથા ચાર વિકથા ન કરવી કેમકે સ્ત્રીકથા એ મૈથુન સંજ્ઞાને ઉત્સેજનાર છે, લોજન કથા આહાર સંજ્ઞાને પોષનાર છે, દેશકથા અને રાજકથા એ ભર્ય તથા પરિગ્રહ સંજ્ઞાને પુષ્પ અનાવનાર છે. પરિણામે દાન, શીલ તપ અને ભાવધર્મનું તીર્થ સ્થાનમાં ઘરબળર પાલન થઈ શકતું નથી, માટે વગેરે ઉપર કાળું રાખી તીર્થ તીર્થયાત્રા, સંધ વગેરેના ગુણુનુંવાદ કરવા.

કાચિક પવિત્રતા:- લગવાનની પૂજા કરતી વળતે શરીરશુદ્ધિ ખાસ રાખવી જોઈએ, શરીર ઉપર ચુમડા થયા હોય અને રસી અરતી હોય, તો લગવાંતની અંગ પૂજા કરવી ન જોઈએ, તેમજ મેલા ફાટેલા કે સાંઘેલા- થીગડા-વાળ વરત્રો પહેરવા ન જોઈએ ખમીસ, પાઠહુન, પહેરને પણ પૂજા કરવી ન જોઈએ.

દેરાસરમાં લાંખા પગ કરીને, ભગવાનને પુંક કરીને
કે બેમ તેમ એખબું ન જોઈએ ૮૪ આશાતનાઓમાંથી
કોઈ આશાતના ન લાગે તેમ વર્તબું જોઈએ.

સ્ત્રીઓએ અતુકાલમાં ભગવાનની પૂજા કે દર્શન
કરવા ન જોઈએ તથા આશાતના થઈ ન જય તેનો ખાસ
ખ્યાલ રાખવો.

(૧૪) પાદીતાણું શહેર

શ્રી શત્રુંજ્યગિરિવરની શિતળ છાથામાં પાદીતાણું
શહેર હાલમાં ઝીન્હી સરકારની હુકમત નીચે છે. મહાગુજરાતનું રાજ્ય થતા સૌરાષ્ટ્ર એ મહાગુજરાતમાં લેણુ થતાં
શ્રી શત્રુંજ્ય નીર્થે એ મહાગુજરાતનાં ભૂપણુરૂપ ગણ્યાય
છે. પાદીતાણું પ્રાચીન નામ પાદીમસપુર છે. તેનું નામ
કેમ પડ્યું અને નગર કોણે વસાયું; તેની કુંક હૃકીકિત
નીચે પ્રમાણે છે.

વીર સંવત ૩૭૦ ના અરસામાં મહાયમતકારિક
શાસનપ્રભાવક સિદ્ધપુરૂપ શ્રી પાદલિખતસુરીંબરણ મહારાજ
વિચરતા હતા. શુરુએ અર્પણ કરેલ એકસો આડ ઔષધિઓનો
દેપ ખગને તળિયે લગાડી તેઓશ્રી આકાશમાં ગમાન કરતા
અને નિત્ય તીર્થવંદના કરીને જ ચાહાર વાપરતા, ધીણ
પણ અનેક પ્રકારની સિદ્ધિઓ તેઓશ્રી પાસે હતી.

લેપવિદ્યા શિખવા માટે નાળજુન નામનો એક યોગી
પૂજય આચાર્યશ્રી પાસે આવ્યો. સેવા કરતાં તેણે લેપના
શ્રીવણુમાંથી સધળી ઔષધીઓ સૂંધી સૂંધાને જાહી લીધી

અને લેપ તૈયાર કરી પગે લગાડી આકાશમાં ઊડવા પ્રયત્ન કરતાં થોડે જાંચે જઈ નીચે પટકાઈ પડ્યો, શરીરે થોડી ધૂણ થઈ. આચાર્યશ્રીને ખણર પડતાં કારણું પૂછ્યું. ત્યારે નાગાર્જુને સત્ય હડીકિત જણાવી. આચાર્ય મહારાજે કહ્યું કે, ‘આ તૈયાર થયેલી ઔષધીએ પાણીમાં નહિ, પણ ચાખાના ઘોવણુંમાં લેગી કરવાથી આકાશમાં ઊડી શકાશે.’

આ ઉપકારના બદલામાં નાગાર્જુન ચોગીએ શ્રી સિદ્ધગિરિજીની તળોટીમાં પાદલિપ્તપુર નામનું નગર વસાયું. તે ધીમે ધીમે આખાદીને પાઢ્યું. કેટલાક સમય સુધી સારામાં સારી જહોજહાલી રહી.

વિક્રમના દશમા જૈકામાં પડતી આવી, ગામ તરફાં મારવાડના ઝેડગઠ ગામેથી ગોહિલ જાતિના રજ્યુંત રાનાએ આવીને કેટલેાક ભાગ નવો વસાવીને રહ્યા. તે પણ કેટલાક કાળે ભાંગ્યું. એટલે તેનાથી થોડે ફૂર નવું વસાયું. તે પણ ભાંગતાં ફરીથી પાદીતાણા નામથી વસ્યું જે હાલ વિદ્યમાન છે.

“શ્રી સિદ્ધગિરિજી”

(૧૫) અનેકોએ કરેલી તીર્થયાત્રા સંખ્યે
જાણવા જોગ

૧. ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામીજી લગવંતના પરમ ઉપાસક શ્રી શ્રેણીક મહારાજાએ શ્રી શત્રુંજ્યગિરિવિર ઉપર જુદા જુદા શિખરો ઉપર જિનાલયો ણંધાવ્યાં હતાં.

૨. આ પ્રમાણે ગુપ્તવંશના ભગવં મહારાજયના સાથ સંપ્રતિ મહારાજાએ પૂજય આચાર્યશ્રી આર્યસુહુસ્તી-સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી ભારતમાં સવાલાખ જિન-મંદિરો અને સવાકોડ પ્રતિમાળાએ લસારી હતી. શ્રી શત્રુંજય-તીર્થ અને શ્રી ગિરનારણુર્તીર્થની યાગા કરીને શ્રી શત્રુંજય ઉપર અને આનુભાળુના ગામોમાં પણ શ્રી જિનમંદિરો અંધાર્યાં હતાં.

શ્રી શત્રુંજય જિરિવર ઉપર ચોમુખજી તરફના ભાગને શ્રી મર્દૃદેવ શિખર કહે છે, તેમાં શ્રી શાંતિનાથ લગવાનનું મંદિર અને શ્રી મર્દૃદેવી માતાનું મંદિર, શ્રી સંપ્રતિ મહારાજનાં ગણ્યાય છે, આજે જે મંદિરો છે તે લુણોદ્વાર થયેલાં છે. શ્રી ગિરનારણજી ઉપર સંપ્રતિ મહારાજની દુંક છે.

૩. વલભીપુરમાં ભવ્ય અને મનોહર જિનાલયો અને સાત લંડારો હતાં. અનેક કોટયાધિપતિ શ્રીમંતો વસતા હતા. શ્રી શત્રુંજયની તલાઈનું સ્થાન વલભીપુર ગણ્યાતું હતું. વલભીપુરના શ્રીમંતોએ પણ શ્રી શત્રુંજય ઉપર મંદિરો અંધાર્યાં છે.

વખત જતાં બૌદ્ધ લોકોએ વલભીપુરનો કથનો લીધો હતો તે વખતે જૈનો પંચાસર તેમજ આખુની ઉત્તરે માર-રવાડમાં ગયા તથા ખંભાત અને ભર્દ્યમાં કેટલાક ગયા. ત્યારબાદ મહાસમર્થ વિદ્ધાન પૂજય આચાર્ય શ્રી મલ્લવા-ળીજુએ શિલાદિત્યરાજાની સલામાં બૌદ્ધો સાથે વાદ કરીને બૌદ્ધોને હરાયા, શિલાદિત્ય રાજાએ કેન સંઘને વલભીપુરમાં

મોલાંગ્યો. શ્રીશત્રુંજ્ય તીર્થ કેનોને સ્વાધિન કર્યું. એટ-
લુંજ નહિ પણ શિલાદિત્ય રાજાએ શ્રી શત્રુંજ્યનો ઉદ્ઘાર
કરવામાં સહાયતા પણ આપી હતી.

૪. પૂજય આચાર્ય શ્રી બાપલકુસૂરીશ્વરજીના ઉપરેશથી
કનોજના આમરાજાએ સંધ સહિત શ્રી સિદ્ધગિરિજીની યાત્રા
કરી, તથા જીર્ણ થયેલાં મંદિરેના અમૃક ભાગોનો ઉદ્ઘાર
કરવાનો પ્રયંધ કર્યો. હતો.

૫. સંજાન મંગ્રીની પ્રાર્થનાથી મહારાજ સિદ્ધરાજ
શ્રી ગિરનારજીની યાત્રાએ ગયા હતા, પોતાનાં પિતાના
નામથી બંધાવેલું ભવ્ય મંદિર જેઠ ખુશ થઈ રાજાએ
તેનો ખર્ચ રાજ્ય તરફથી અપાંગ્યો હતો. ત્યાંથી શ્રી સિદ્ધ-
ગિરજીની યાત્રા કરી તીર્થરક્ષણ અને પૂજન માટે ખાર
ગામોની બક્ષીસ કરી હતી. સંવત ૧૧૭૫મા તેનો પદ્ધો
કરી આપ્યાનો ઉલ્લેખ છે.

૬. સંવત ૧૨૮૮ માં મહામંગ્રી વરતુપાલ અને
તેજપાળે શ્રી શત્રુંજ્ય તીર્થની યાત્રા માટે સંધ કાઢ્યો હતો.
તેમાં ૪૫૦૦ ગાડા, ૧૭૦૦ પાતાખી, ૧૮૦૦ ભાંટ, ૧૨૧૦૦
શ્વેતામાર યાત્રીઓ તથા ૧૧૦૦ દિગમાર યાત્રીઓ હતા
૨૧૦૦ મહેતા આ ઉપરાંત ખીંચ પણ ધરા માણુસે
સંધમાં સાથે હતા.

માર્ગમાં ઘીમા નામના એક ગામડીએ આવકે આવીને
સંધને પોતાને લાં પથારવા વિનંતી કરી. તેનો હીન વેષ
જેઠને કોઈ ધારતું ન હતું કે, આ આટલા મોટા સંધની
વ્યવસ્થા કરી શકે. ઘીમા આવક તો આગ્રહ કરી સંધને

પોતાને ત્યાં લઈ ગયો. વસ્તુપાલ આદિ સંધને લોંયરામાં લઈ ગયો. ત્યાં સુંદર પ્રાસાદ જેવું ગૃહમંહિર તથા અદ્ભુત સંપત્તિ જેઈ સૌ આશ્રમ્ય પામ્યા. સૌએ દર્શન-વંહન કર્યો પછી ખીમા શ્રાવકે વસ્તુપાળ મંત્રીને કહ્યું કે ‘હું હવે વૃદ્ધ થઈ ગયો છું માટે આ પ્રલુબુ પ્રતિમાને શ્રી શનુંજ્ય ગિરિધર ઉપર પદ્મારૂપવા સાથે લઈ જાઓ. મંહિર માટે મેં થોડી રકમ કાઢી રાખી છે.’ મંત્રી આ સાંલળી આશ્રમ્ય ચકિત થઈ ગયા, પ્રતિમા સાથે લઈ જવા સંમત થયા.

ખીમાએ ફરીથી વિનંતિ કરી કે ટાઇમ થઈ ગયો છે. તો આપ સૌ મારે ત્યાં લોજનનો લાલ આપો, એમ કહી એક બારણું ઉઘાઉયું તો ત્યાં લોંયરામાં અનેક પ્રકારની રસોઈ તૈયાર રાખી હતી. આ ચમત્કાર જેઈ મંત્રીખરના આશ્રમ્યનો પાર રહ્યો નહિ, સંધ સહિત વસ્તુપાલે ત્યાં લોજન કર્યું. ખીમા શ્રાવકની ધંઢા પૂર્ણ કરી. અને ખીમા-શ્રાવકને સંધમા સાથે લઈ યાત્રા કરી, ખીમા શ્રાવકનો ઉદ્દેશ પૂર્ણ થયો. ધન્ય છે આવા શ્રાવકને અને સંધપતિ-એને વસ્તુપાલે શ્રી સિદ્ધગિરિલુની ખાર વખત સંધ કાઢીને યાત્રા કરી હતી. તેરમી વખતે યાત્રા કરવા નીકળ્યા હતા. ત્યાં રસ્તામાં અંકેવાલિઅા પાસે મરણ પામ્યા હતા તેમનો અભિન સંસ્કાર શ્રી શનુંજ્યલુની છાયામાં કરવામાં આવ્યો હતો.

૭- સંવત ૧૩૧૬ માં શેઠ જગડુશાએ લદ્રેશ્વરથી શ્રી સિદ્ધગિરિલુનો સંધ કાઢ્યો હતો.

૮- સંવત ૧૩૨૦ માં શેઠ પેકડશાહે માંડવગઢથી શ્રી સિદ્ધગિરિલુનો કે વિશાળ સંધ કાઢ્યો હતો.

૯- સંવત ૧૩૪૦ માં જાંઅણુમંત્રીએ માંડવગઢથી અઠી લાખ માણુસેનો વિશાળ સંધ કાઢ્યો. હતો. તેમાં પૂજય આચાર્ય શ્રી વિજય ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ આદિ. વીસ ઉત્તમ આચાર્યો પરિવાર સાથે હતાં. ૫૦૦૦૦ પોઠીયા ૧૨૦૦ ખર્ચયર અને ડાટોં, ૩૦૦૦ સંધતું રક્ષા કરનારા ચાંડીદારો, તથા બીજુ વિપુલ સામગ્રી હતી.

સંધવીએ શ્રી સિદ્ધગિરિજીના શિખરથી શ્રી ગિરનારજીના શિખર સુધીની ચાંદી, સોનુ અને રેશમના પટાવણી છોઠ હાથ પહોળી એવી એક આખી સળંગ ધજ ચઢાવી હતી.

૧૦- બાહુડમંત્રીએ કુમારપાળના પિતા ત્રિભુવનપાળના સ્મરણાર્થે પાલીતાણુની તળેટીમાં ત્રિભુવન વિહાર બંધાવી તેમાં શ્રી સુપાર્વનાથ લગ્બાનની પ્રતિષ્ઠા કરાવી હતી.

કુમારપાળ મહારાજાએ આ વાત બાણી અને તેથી શ્રી શાનુંજયતીર્થની યાત્રા કરવાની ભાવના થઈ. સંધ સહિત યાત્રાચે જવાનું નકટી થયે. ગામેગામના સંચો ઉપર કંકાનીએ મોાકલવામાં આવી.

પૂજય કલિકાલસર્વજી આચાર્ય લગ્બાંત શ્રી છેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ પરિવાર સાથે સંધમાં પધાર્યાં હતાં. અનેક સાધીજી મહારાજે, હજરે શ્રાવક-શ્રાવિકએ જર સામંતો, ૨૪ મંત્રીએ, ૧૭૦૦ કોષ્યાધિપતિ આદિ સંધમાં હતાં. તીર્થયાત્રાની યાદમાં કુમાર વિહાર નામતું માંદિર કુમારવિહાર હાથીપોળની પાસે છે અને હિંજળા-

જના હડા પાસે કુમાર કુંડ બંધાવ્યો હતો. આ ઉપરાંત તીર્થ સેવા માટે ૨૪ ગામનો પદો કરી આપ્યો હતો.

૧૧- સં' ૧૫૧૨ના હુકળ વખતે હડાળાના શેઠ ઘીમા દેદરાળીએ લોઈતું અનાજ પુરું પાડેલું; તેથી ભહમદશાહે જુશી થઈને જૈન તીર્થનું રક્ષણ કરવા વચન આપેલું તેથી મુસલમાનોની લાંગહેડ હોવા છતાં શ્રી શત્રુંજ્યતીર્થનાં મંહિરને જરાપણું તુકશાની આવી ન હતી. બાદશાહે શ્રી શત્રુંજ્યના સંધમાં સહાતુભૂતિ પણ આપી હતી.

૧૨- પૂજન્ય આચાર્યવર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજના ઉપરેશથી દ્વારા બનેલા દીલહીના અકુળ બાદશાહે પૂજન્યશ્રીને 'જગદ્ગુરુ'નું માનવંતું ખીરુદ આપ્યું હતું, વિશેષ મોગવ શહેનશાહતાની અંદર આવેલા શ્રી સિદ્ધાચલજી તીર્થ, શ્રીગિરનારજી તીર્થ શ્રી શિખરજી વગેરે જૈનતીર્થો ઉપર જૈનોની સ્વતંત્રતાનો તથા યાવશ્વારદિવાકરૌ અધ્યાધિત કણજ લોગવટાનો ભરીતો (દસ્તાવેજ) કરી આપ્યો હતો અને ફરમાનો શહેનશાહત તાખાનમ સંધળા મુલકોના સુખાએને મોકદી આપ્યાં હતાં.

૧૩-ત્યારખાદ દીલહીની ગાઢીએ આવેલ જહંગીર તથા શાહજહાંન બાદશાહુએએ પણ એ ફરમાનો કરીથી કરી આપ્યાં હતાં. અમહારાજાના શેઠ શાંતિદાસની શાહી કુટુંબમાં સારી લાગવગ હતી. અકખર બાદશાહ સાથે તેમનો એટલો જથે સંબંધ હતો કે શાહજહાદ જહંગીર શાંતિદાસ શેઠને મામા કહેતા હતા. સંવંત ૧૬૮૬માં શાહજહાંન બાદશાહે શ્રી શત્રુંજ્ય તીર્થ, શ્રી, શાંપેશ્વરજી; શ્રી કેસરીયાળું, અમહારાજા,

સુરત, અંલાત અને રાધનપુરના જિનમંહિરોના કબજો લોગવટાનો અરીતો શેડ શાંતિદાસના નામનો કરી આપ્યો શાંતિદાસ શેડની કાર્યક્રમતા લેઈને ખુશ થયેલા આદરશાહે સંવત ૧૭૧૭માં પાલીતાણા અક્ષીસ આપીને આદરશાહી મહેર સાથે સનંદ કરી આપી હતી. એ સનંદ શાહજહાના પુત્ર સુરાદભક્તે તથા તે પછી ઔરંગજેબે પણ શાંતિદાસ શેડના પુત્ર લક્ષ્મીદાસ શેડને તાજુ કરી આપી હતી.

આ સનંદો આજે પણ મોણુફ છે.

૧૪-શ્રી સિદ્ધગિરિજીના મહિમાથી પ્રેરાઈને પુરાતન કળથી નાણકના તેમજ હુર હુરના ગામોમાંથી અનેક પુણ્યવાનોએ છરી પાળતા મોટા મોટા સંધ કાઢીને શ્રી સિદ્ધગિરીજીએ પુણ્યાત્માના દહાવા લીધા છે. આ પ્રણાદી અત્યારના સમયમાં પણ ચાલુ છે. આવા પેદલ સંવેદામાં સં-૨૦૧૫માં પૂજ્યપાદ સિદ્ધાંતમહેદધિ તપોગંધાધિરાજ આચાર્ય ભગવંત શ્રીમદ્બિજ્યપ્રેમસૂરીન્દ્રરજુ મહારાજની પુણ્ય નિશ્રામાં મારવાડના ચડવાલા ગામેથી શેડ ચેલાજુ વનાજુ વાળાઓએ સંધ કાઢ્યો હતો તે પણ એક નોંધપાત્ર હતો અને હમણાં હમણાં તો ટ્રેઇનેં દ્વારા પણ અનેક લાઘ્યશાળીઓ અનેકને સાથે લાવીને શ્રી તીર્થાધિરાજની યાત્રા કરી કૃતાર્થતા અનુલવે છે.

વિભાગ બીજો

(૧) સ્ટેશનથી તળેઠી

યુગપ્રધાન શ્રી પાદક્રિમસૂરીધરજી મહારાજ વિદ્યા-
સિદ્ધ મહાપુરુષ હતા, તેઓ વિદ્યાના બણે આકાશમાર્ગે
તીર્થયાત્રા કરતા હતા. તેમના શિષ્ય નાગાનુંને શુરુના નામ
સ્મરણ માટે શ્રી શન્મુલ્યની તળેઠીમાં પાદક્રિમ નામે નગર
વસાયું હતું તેજ નગર આજે પાલીતાણા નામથી એળ-
ખાય છે.

પાલીતાણા આવવા માટે રેલવે તથા મોટર અદિના
વિવિધ માર્ગો છે, જેઓને જે માર્ગ અનુકૂળ પડે તેઓ તે
માર્ગ આવી શકે છે.

રેલવે માર્ગો

(૧) મુંબઈ, અમદાવાદ, વિરમગામ, વઢવાણુ, શિહેર
થઠને.

(૨) દિલ્હીથી માર્ગાડ, આણુ, મહેસાણા, વીરમગામ,
રસ્તે.

(૩) મુંખઠીથી અમદાવાદ, ધોણકા, એટાદ, શિહેર
થઠને.

(૪) જમનગર, રાજકોટ વઢવાણુના રસ્તે

(૫) વેરાવળ, જુનાગઢ, જેતલસર, જેતપુર, ધોણા,
થઠને.

(૬) મહુવા, તળાજા, લાવનગર થઠને.

મોટર માર્ગો

(૧) અમદાવાદથી પાલીતાણુની મોટર સર્વિસ ચાહું થયેદી છે.

(૨) કાડીયાવાડમાં ધણુા ગામેમાંથી પાલીતાણુની મોટર સર્વિસ ચાહે છે.

એરોસ્પેન માર્ગ

ભારતના કોઈ પણ વિમાનઘરથી ભાવનગર આવી મોટર કે રૈલવે માર્ગો પાલીતાણુા અવાય છે.

શ્રી શાનુંજ્ય ગિરિવર ચારે બાળુંયેથી ધણું ફૂરથી દષ્ટિગોચર થાય છે. ફૂરથી ગિરિરાજ વિશાળકાય હાથી ઉપર અંભાડી ગોઠવેલી હોય તેવો દેખાય છે. નવ કુંકાના મંદિરો એ અંભાડી જેવા લાગે છે. અને ગિરિરાજ હાથીના આકારવાળો લાગે છે.

સ્ટેશનથી ધર્મશાળાએ આવવા માટે બોડગાડી, બગદગાડી મળી શકે છે. ગિરિરાજની યાત્રાએ આવનારે અને ત્યાં સુધી વાહનનો ઉપયોગ કર્યા સિવાય સ્ટેશનથી ધર્મશાળાએ આવવું અને ધર્મશાળાએથી ચાલીને તળેઠી થઇ ગિરિરાજ ઉપર ચઢવું જેઈએ.

પાલીતાણુા ગામની અંદર સુંદર બેનિનમંદિર આવેલા છે. એક શ્રી ગોડીલુ પાર્થનાથસ્વામીનું અને બીજું શ્રી શાંતિનાથ બગવાનનું એ માળવાળું; એક બીજું બેનિનમંદિર શ્રી શાંતિનાથ બગવાનનું કાપડ બજારમાં છે. કે યતિના કંખજામાં હોવાથી આપણે ત્યાં જતા નથી. એક દિગ્ભાગ નેન મંદિર પણ છે.

ગામમાં મોતીકડીયા વગેરેની ધર્મશાળા ઉપાદ્રથો
પણ આવેલા છે. શોઠ આણુંદળુ કલ્યાણુણુની પેઢી હેરાસ-
રની પાસે આવેલો છે. પેઢી, મંહિરો વગેરેને વહૃવિટ
સંભાળે છે. ચાત્રાળુને પૈસા વગેરે ભરવા માટે પેઢીની એક
શાખા જશકોરની ધર્મશાળામાં રાખવામાં આવેલી છે.

શહેરના રમણીય સ્થાનોમાં મહારાજાના સાહેખને હવામ-
હેલ પંચબીધીનો રેન્ઝે; શૂરવીરોના પાળીયા, ઓવન પૂલ
સાપલીંગાની વાવ, લેરવનાથનું મંહિર ભીડલંજન મહુદેવ
અથ દરણાર હોલ આયંખીલ બુવન; નંદકુંવરભા અનાથા-
થ્રમ; બાલમંહિર; કાનાભાવાની ચેતન સમાધી દ્વારાનામી અખાડો
દાચાત્રયની અરણુપાહુડા, તળાટી આગમ મંહિર, જૈનસોસા-
યઠીમાં કાચનું વગેરે

(૨) ગામથી તળોરી સુધી પગદા, હેરાસરે। ધર્મશાળા વગેરે

ધર્મશાળાએ

૧ દિગમ્બર ધર્મશાળા	૨ સાત ઓરડાની ધર્મશાળા
૩ મસાલીઓની „	૪ ભાવનગરવાળાની „
૫ શોઠ હેમાધીનો હુવેલી	૬ શોઠ હેમાભાઈની „
૭ શોઠ મોતીશાની ધર્મશાળા	૮ હુઠીસીંગ કેશરીની „
૯ અમરચંદ હુઠીસીંગની „	૧૦ ગોરળનું ડહેલુ „
૧૧ ઉજભબાઈની „	૧૨ મોતીકડીઓની „
૧૩ લંડારીની „	૧૪ પીપળાવાળી „
૧૫ જેરાવરમલણુની „	૧૬ મહાજનની „
૧૭ કલ્યુલાઈની „	૧૮ સુરજમલની „

૧૬ રષુરી દેવરાજની	૨૦ નગીનદાસ કપુરચંહની
ધર્મશાળા	ધર્મશાળા
૨૧ નરસી કેશવજીની	, ૨૨ વોઘાવાળી
૨૩ જામનગરવાળી	, ૨૪ મોતી સુગ્રીવાળી
૨૫ વીરભાઈની	,
૨૬ ચાંદલુંબન	, ૨૭ કલ્યાણુ લુંબન
૨૮ ચંપા નિવાસ	, ૨૯ કંકુભાઈની
૩૦ પુરીખાઈની	, ૩૧ ખુશાલ લુંબન
૩૨ મહાજનનો વડો	, ૩૩ શાંતિ લુંબન
૩૪ નરસી નાથાની	, ૩૫ દેવશી પુનર્શીની
૩૬ મગન મોહીની	, ૩૭ લાવસારની
૩૮ ખલ્યાચર્યાશ્રમ	, ૩૯ લુંબન નિવાસ
૪૦ જશકુંવરની	, ૪૧ કોટાવાળાની
૪૨ પનાલાલ બાયુની	, ૪૩ માધવલાલ બાયુની
૪૪ પાટખુવાળાની	, ૪૫ શત્રુંજય વિહાર
૪૬ ઉમાજુ લુંબન	,
૪૭ આત્માનંદ જૈન પંનણી યાત્રી લુંબન	,
૪૮ આરિસા લુંબન ધર્મશાળા	૪૯ આનંદ લુંબન
૫૦ નહાર બીજીંગ ધર્મશાળા	, ૫૧ જૈન લુંબન
૫૨ વદ્દલબવિહાર ધર્મશાળા	૫૩ સુતરીઆ નિવાસ
૫૪ વકીલ ચીમનલાલ છોટાલાલ જૈન ધર્મશાળા	,

વગેરે નાની મોતી ધર્મશાળાએથી પાદીતાણું શહેર રમણીય બનેલું છે. આ સિવાય બીજુ ધર્મશાળાઓ દ્વિસે દ્વિસે બંધાતી જાય છે. તપેટીમાં શાંતિમય લુંબન ગાળવા માટે સુમુક્ષ શાંતિનિકેતન જિરિવિહારમાં આવેલું છે. તથા જુદા જુદા શોડીઆએ પણ ઉત્તરવા માટે બંગલા બંધાવી રાખ્યા

છે. તથા સોસાયરીમાં એક સુંદર આલિશાન જિનમાંહિર પણ
અંધાવેહું છે.

પાઠશાળાએ.

૧. શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળા; ૨. શ્રી સૂક્ષ્મતત્ત્વ એધ પ્રકરણુંહિ પાઠશાળા. ૩. શ્રી હરિબાઈ સંકૃત-પાકૃત પાઠશાળા, ૪. વીરબાઈ પાઠશાળા, ૫. નીતિસૂરીન્દ્રાજુ જૈન પાઠશાળા, ૬. શ્રી બાળુભુદ્વિસિહણ જૈન પાઠશાળા વગેરે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાએને લખુંવા માટે ચાલે છે.

સંસ્થાએઃ:- આ સિવાય શ્રી યશોવિજયજી જૈન શુરુકુલ, શ્રી જિદ્ધક્ષેત્ર જૈન બાતાશ્રમ, શ્રી જિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ, જિનદા સૂર્ય પ્રક્ષયર્થાશ્રમ, જૈન સેવા સમાજ, આયંખીલ લખન, જૈન લોજનશાળા, શેઠ આણુંદળુ કલ્યાણું જૈન એવધાલય, શ્રેયસ્કર મંડળનું ઔવધાલય, પૂજન્ય શુરુદેવ આચાર્ય મહારાજ શ્રી મદ્વિજય જંબૂસૂરીન્દ્રાજુ મહારાજ સાહેબના આશીર્વાદથી, શ્રી યતુવિંધ સંઘની વૈયાવચ્ચ માટે સ્થાપયેલ શ્રી જિદ્ધક્ષેત્ર જૈન ઝી એવધાલય, ગૌરક્ષા, જૈન શ્રેયસ્કર મંડળ, શ્રી લભિયસૂરીન્દ્રાજુ જૈન સેવા સમાજ, દ્વાખાનાએ, પુસ્તક લંડારો, લાયએરીએ, વગેરે અનેક સંસ્થાએ આ મહાન તીર્થ ક્ષેત્રમાં ફાટીદૂઢી રહેલી રહેલી છે.

શાંકરમાં પગલાં

૧. જામવાળીના દરવાળ બહાર ગોડીજુનાં પગલાં છે.
૨. રણુશી દેવશીની ધર્મશાળા પાછળ સરોવરના કંઠે
પગલાં સાથે હેરી છે.

૩. કંકુખાઈની ધર્મશાળા પાસે ચાહુણી ટાંકી પાસે વિજય તળાઈનો ઓટલો છે લાં શ્રી આદીશ્વર લગવાન ગૌતમસ્વામીજી અને શ્રી મહિવિજયજી મહારાજનાં પગલાં છે.

૪. ગોરળુની વાડીમાં જિનદત્તસૂરિજી (દાદાસાહેબ) નું મંદિર છે તેમાં પગલાં છે.

૫. જૈન ભુવનની પાસે દાદાવાડી છે.

૬. નહાર ભીડીંગની આગળ ધૂમરવાળી દેરીમાં શ્રી ઉદ્યાણ વિમલ અને શ્રી ગજવિમલ સુનિષેના પગલાં છે.

૭. આગળ જતાં રાણુવાવની પાસે ડોચા ઓટલા લિપર મેઘસુનિનો સ્તૂપ છે, તેમાં ત્રણ જેડી પગલાં છે.

૮. આગમમંહિરની સામે રરતા વચ્ચે દેરીમાં શ્રી ગોડીજી પાર્વિનાથનાં પગલાં છે.

મંહિરો

જિનમંહિરો

૧. શ્રી ગોડીજી પાર્વિનાથનું

૨. શ્રી આદીશ્વર લગવાનનું

એ માળવાળું

૩. શ્રી સુમતિનાથ લગવાનનું

૪. શ્રી મહાવીર રવામીજીનું

૫. શ્રી આદીશ્વર લગવાનનું

૬. ચોમુખજીનું

૭. શ્રી ચંદ્રપ્રભ રવામીજીનું

૮. શ્રી શાંતિનાથ લગવાનનું

૯. શ્રી પાર્વિનાથ લગવાનનું

કથાં આવ્યું

ગામમાં

ગામમાં

સ્ટેશનની સામે શુદ્ધકુળમાં

વીરણાઈની ધર્મશાળામાં

મેતીસુઅણાની ધર્મશાળામાં

નરશી કેશવજીની ધર્મશાળામાં

નરશી નાથાની ધર્મશાળામાં

શાંતિશમમાં

જશકોરની ધર્મશાળામાં

- ૧૦ શ્રી સુમતિનાથ લગવાનતું માધવલાલની ધર્મશાળામાં
 ૧૧ શ્રી વાસુપૂજય સ્વામીનું પંનણી ધર્મશાળામાં
 ૧૨ શ્રી શાંતિનાથ લગવાનતું આરિસા ભુવનમાં
 ૧૩ શ્રી પાર્વિનાથ લગવાનતું વદ્વલ વિહારમાં
 ૧૪ શ્રી પાર્વિનાથ લગવાનતું ખાલાશ્રમમાં
 ૧૫ શ્રી વાસુપૂજયસ્વામીનું કેન સોસાયટી તળેઠી
 ૧૬ શ્રી આગમમંદિર ચોમુખજી જેમાં પીસ્તાલીસ આગમે
 મૂલ આરસમાં કેઠરાવેલાં છે.
 શ્રી ગણુધર મંદિરઠેણી જેમાં વર્તમાન ચોવીસીના બધા
 ગણુધર લગવાનો પદમૂર્તિઓમાં ઝીરાજે છે.

તળેઠી-આણુંદળ કલ્યાણુંની પેઢીના પ્રમુખ લાલ-
 ભાઈ દ્વારા માતુશ્રી શ્રી ગંગાભાઈએ રૈનકદાર કમાનો-
 વાળું મનોહર વિશ્રામસ્થાન બંધાવેલું છે, જે ભાતાની તળેઠીના
 નામે ઓળખાય છે; અહીંથાં યાત્રા કરીને આવનાર દરેક
 યાત્રાળુંઓને ચોમાસા સિવાયના હિવસોમાં કળીના લાડુ અને
 ગાંડીયાનું ભાતું આપવામાં આવે છે, કોઈ કોઈ વખત
 મેસુર, શીરા, ચાપાણી વગેરે પણ ભાતામાં અપાય છે. ઉકેલા
 પાણી તથા ડંડા પાણીની સગવડતા રાખવામાં આવે છે.

કોઈ ભાઈ જ્હેનને એક હિવસનું ભાતું આપવું હોય
 અગર કાયમી તીથી લખાવવી હોય તો શેઠ આણુંદળ
 કલ્યાણુંની પેઢીમાં નોંધાવવાથી તે પ્રમાણે વ્યવસ્થા થાય છે.



(3) આવશ્યક સૂચનાઓ

૧. શ્રી ગિરિજની યાત્રા કરવા જનારે ધર્મશાળાએથી પગે ચાલીને રસ્તામાં પગલા, જિનમાંહિન આવતાં હોય ત્યાં ઓછામાં ઓછું 'નમો નિષ્ણાણુ,' કહેતાં તળાટીએ આવવું.

૨. તળાટીએ શ્રી ગિરિજન સન્મુખ ચૈત્યવંદન કરી ગિરિજન ઉપર ચઢતા ડાણી તથા જમણી બાળુ આવતા પગલાના દર્શન કરી, બાધુના ફંહેરસરે દર્શનાદિ કરી વચ્ચે આવતાં પગલાના દર્શન કરતા કરતા દાદાના દરથાર સુધી જવું. વચ્ચે કયા કયા પગલા આવે છે, તે આના પછી જાણુનેથી છે; તે ખાન વાંચી જવું.

૩. રસ્તામાં જયણાપૂર્વક ચાલવું.

૪. સાંસારિક વાતચીતો કે ઠુઠુ મશ્કરી કરવી નહિ, અની શકે તો મનમાં 'શ્રી નવકાર મંત્ર અથવા શ્રી યુગાદિ-નાથાય કે શ્રી સિદ્ધગિરિવરાય નમો' જણુતા જવું.

૫. ગિરિજન ઉપર ઘણેં પનન હોય ત્યારે કપડા વ્યવસ્થિત રાખવા અંગ ઉધાડુ થઈ ન જય, તેનો આસ આલ રાખવો.

૬. ગિરિજનના નીચેથી માંડી છેક ઉપર સુધીના કોઇ પણ લાગમાં શુંક અણાઓ, લીંટ નાખવું નહિ, તેમજ

આડો પેસાબ પણ કરવો નહિ. આડો, પેસાબ, થુંક' લીટ વગેરે અશુચી નાખવાથી મહાન આશાતના થાય છે. બહે-નેંએ પેતાના ઋતુકાળના નજુકના દિવસોએ ખાસ સંભાળ રાખવી કે જેથી ગિરિજની આશાતના થઈ ન જય. શ્રી ગિરિજના કાંકરે કાંકરેથી અનંતાચનંત જીવો મોક્ષ ગયેલા છે. કોઈ એવી આતી જગ્યા નથી કે જ્યાંથી મોક્ષ ગયેલા ન હોય.

૭. કેટલાક રામપોળની બારી પાસે, તથા ઘેરીના પગલા છે ત્યાં પેસાબ, આડે જય છે, તો તેથી મહાન આશાતના લાગે છે, માટે ખાસ ઉપયોગ રાખવો. હાજર થતી હોય તો એક કુંડી કે વાસણુમાં નીચેથી રેતી લરીને લઈ જવી. જરૂર પડે તેમાં શાંકા ટાળી તે વાસણુ નીચે લાવી તેમાની રેતી કાઢી નાખવી. આથી આશાતનાના પાપથી અચી જવાશે.

૮. ગિરિજ ઉપર ચઢતા કે ઉત્તરતા કંઈ પણ ખાવું જોઈએ નહિ. તેમજ બીડી વગેરે પીવી નહિ.

૯. શક્તિ હોય ત્યાં સુધી ડોળીમાં બેસવું નહિ, આતીને જ ચઢવું. ડોળીમાં હોસવાથી ડોળીવાળા જે ગિરિજ ઉપર બીડી પીએ, ખાય, આડે, પેસાબ જય તેનું પાપ ડોળીમાં બેસનારને લાગે છે.

૧૦. પૂજા વગેરે કરતા અંગશુદ્ધિ વસ્ત્રશુદ્ધિ અને મનશુદ્ધિ અવસ્થ્ય રાખવી તથા ફેરાસર અંગેની સંધળી વિધિ સાચવવી, (જેનું વર્ણન આગળ આપવામાં આંદ્રું છે.)

૧૧. લગવાનના દર્શાન કે પૂજા કરતા બીજને અંતરાય ન થાય તેના આદ રાખવો.

૧૨. સાધર્મિકજનેની ખની શકે તેટલી સેવા અંગ્રિએત્વી.

૧૩. કોઈને કર્કશ-કઠોર વચ્ચે કહેવું નહિં, કથા-ચોથી હર રહેવું.

૧૪. યાત્રાના હિવસોમાં પ્રહૃદ્યર્થનું અવશ્ય પાલન કરવું.

૧૫. પ્રભુ પાસે મૂડવાના પુણ્ય ઈણ જૈવેદ વળોરે આદર પૂર્વક લઈ જવા.

૧૬. દાન શીલ તપ અને લાવ ધર્મનું સારી રૂતે સેવન કરવું.

(૪) હંહેરાસરની વિધિ

(દશાત્રિક અને પાંચ અભિગમાદિ)

અથમત્રિક ત્રણું નિસિહ્બિ-પહેલી નિસિહ્બિ રહેઠાખેથી નીકળતાં કહેવી જોઈએ. છેવટે દેરાસરના સુષ્પ્ય ભારણા પાંચે તો અવશ્ય કહેવી. આ નિસિહ્બિમાં ઘર-સંસાર સખાંધી કાર્યનો નીષેધ થાય છે. પીછુ નિસિહ્બિમધ્યદાર (રંગ મંડપ) માં કહેવી. આ નિસિહ્બિમાં દેરાસર સખાંધી કામકાજની વાતચીત (ભલામણુ) નો નિષેધ થાય છે. અને ત્રિલું નિસિહ્બિ પ્રભુ સન્સુખ દ્રષ્ટિ રાખી એકાચ ચિત્તથી સ્તુતિ કરી દ્રવ્ય

પૂજા કર્યા પછી ચૈત્યવંહન (ભાવપૂજા) કરતા નિસિહિ કહી છિંછાકારેણુ સંદિસહ લગવન ચૈત્યવંહન કરું? હિંછા. આ નિસિહિમાં દ્રષ્ટ્ય પૂજનો નિવેદ થાય છે.

ધીળ ત્રિકમાં ગ્રાણ પ્રહક્ષણા. જાન, દર્શન,
ચારિત્ર સંબંધી અપાય છે.

ધીળ ત્રિક ગ્રાણ આણામ. ગ્રાણ પ્રકારના પ્રણામ.

૧-અંજલી અદ્ધ. પ્રલુને દેખી એ હાથ જોડવા તે.

૨-અર્ધાવનત. ઉલા ઉલા અદ્ધો અગ નમાવવું તે.

૩-પંચાંગ (એ હાથ એ હીંગણ તથા મસ્તક આ પાંચે
અંગ ખમાસમણું દેતા જમીનને આડાડવા.)

ચોથી ત્રિક પૂજા ત્રિક.

૧- અંગ પૂજા (જલ, વંહન, કેસર, પુષ્પ) ને પ્રલુના
અંગે ધરાય તે.

૨- અથ પૂજા (ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ, ફળ વિગેર)
ને પ્રલુના સંમુખ ધરાવાય તે.

૩-ભાવ પુજા-ચૈત્યવંહન સ્તुતિ વગેરે.

પાંચમી ત્રિક અવસ્થા ત્રિક

૧-છંદાસથાવસ્થા, લેના તે પ્રકાર, પ્રથમ જન્માવસ્થા
સ્નાગ્રાહિ વખતે, ધીળ રાન્યાવસ્થા, અલંકાર પહેરાવવા
તથા અંગ રચનાદી વખતે; ધીળ શ્રમણાવસ્થા ચારિત્ર ગ્રહણ
(દ્વાચાહિ) વખતે.

૨-ફેવલાવસ્થા, અણ પ્રાતિહાર્યાહિ (રચના) વખતે.

૩-સિદ્ધાવસ્થા. પદ્માસન અથવા કાચોત્સર્ગમાં ભોક્ષ પદ્માર્થા તે

છુટી ત્રિક વણુ દિશા વર્જન

જે દિશામાં વીતરાગ બ્રહ્મ બિરાજતા હોય તે સિવાયની દિશામાં જોવાનું વર્જન તે.

સાતમા ત્રિક પ્રમાજ્ઞના ત્રિક અમાસમણું આપતી વખતે ઉત્તરાસનાહથી વ્રણ વળત બુંમિ પ્રમાજ્ઞને કરવું તે.

આડમી ત્રિક આલંબન

- ૧- વણુંલંબન. મૂળ પાઠમાં ઉપયોગ.
- ૨- અર્થોવલંબન જિનેંદ્ર લગ્નવાનની પ્રતિમા સન્મુખ દ્રષ્ટિ રાખી, બોલાતા પાડના અર્થમાં તન્મય થવું તે.
- ૩-ઉલયાલંબન સૂત્ર અને ઉલયમાં ચિત્ત રાખવું

નવમી સુદ્રા ત્રિક. (વણુંસુદ્રા)

૧ ચોગસુદ્રા તે અન્યોન્ય (બનને હાથની) આંગળીઓ મેળવી (કાશાકારે કરી) બંને હાથની કોણીઓ ઉદર (પેટ) ઉપર સ્થાપના કરવી.

૨ જિનસુદ્રા. બનને પગના આગળના લાગમાં ચાર આંગળ અને પાછળ ચારથી કંઈ ઉણુંઅંતર રાખી. ઉભા રહી કાઉસણ કરવો.

૩ સુકૃતાસુકૃતા સુદ્રા. આ સુદ્રામાં બનને હાથ મેળવી (પિલા-ધીપની પેઠે) મસ્તક પ્રદેશો અડાડવા.

હશમી પ્રાણુધ્યાન ત્રિક.

૧- જાવાતિ ચેદચાઈં. - ૨- જાવાત કેવિ સાહુ (મુનિ-વાદન) ૩- જ્ય વીયરાય (પ્રાર્થના સ્વરૂપે) આ ગ્રાણ સૂત્ર વખતે એકાચ્છતાથી મુજૂરાસુકિત મુદ્રા કરવી. અથવા મન વચન, કાયની એકાચ્છતા રાખવી.

પાંચ અભિગમ-૧- સચિત દ્રવ્યનું છોડવું. ૨. અચિતનું ચહુણ. ૩. મનની એકાચ્છતા ૪ એક સાડી ઉત્તરાસંગ. ૫ એ હાથ જોડવા.

વિધિ પ્રમાણે સ્નાન કરી પૂજનાં કપડાં પહેરી અષ્ટ પ્રકારી વગેરે પૂજનાં જોઈતાં દ્રવ્યો તૈયાર કરી વીતરાગ પ્રલુની પૂજ પહેલાં તેમની આજા મસ્તકે ચઢાવવા રૂપે પોતાને લલાટે (મસ્તકે) તિવક કરે. આ અધિકાર ચાલે છે શ્રી જિદ્વગિરિ ઉપર પૂજનો, એટલે અહિ પૂજાલક્ષ્મિ કરવા-વાગ્યાચે અયાનમાં રાખવું જોઈએ કે, નહાયા પછી અશુદ્ધ કપડાંવાળા માળી લોકોને અડકી જે કુલ લેવાનો રિવાજ છે તેના કરતાં પ્રથમથી લેવા કાળજી રાખવા સાથે તે સૂઈ થી પરાવેલા હાર ગનાવેલ પંસદ નહિ કરતાં હાથના ઝુંધેલાં અથવા છુડાં પુંપો લેવાં ઘણુંં પ્રેરા છે.

આ સ્થળો શોડીયા શ્રીમંતોએ ધ્યાન આપવાની ધીના એ છે પોતે પૂજ કરવા તૈયાર થાય લારે પૂજારીઓને થાળ ઉપડાવી સાથે હેરવે છે. પણ તેમનું એવું બને છે કે તે વખતે પૂજારી પ્રલુને નહાવણું કે અંગ લુહણાં, અથવા પૂજા વગેરે જે કાર્ય કરતાં હેઠળ તંને અધુરુ અને જેવી નેતૃત્વી સ્થિતિમાં

મુકીને પણ શોઠ સાહેબોનું આહાન થતાં પ્રાય: શોઠ શ્રી-
મંતોની આજા ઉઠાવવા (લોલ ફશા કે તેવાં ખીજા કારણોને
લઈ) હાજર થવું પડે છે.

(૫) પ્રલુને નવ અંગે પૂજા કરવાનું કારણું.

જલભરી સંપુર્ણ પત્રમાં, યુગલિક નર પૂજાંત,
દૃષ્ટા ચરણ અંગુઠે, દાયક લવ જળ અંત. ૧.

આ ભરતક્ષેત્રમાં ધર્મના નાયક શ્રી દૃષ્ટાહેવ ભગવાન
આ અવસર્પિણીના સુષ્પમ હુષ્પમા નામના ગ્રીજા આરાને છેડે
સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યાવિ મર્દહેવા માતાની કુલ્લીમાં
ઉપન્યા (મધ્ય રાત્રે) પ્રલુનોં જન્મ થયો.

પ્રલુ કલ્પવૃક્ષના અંકુરની જેમ સુખ પૂર્વેક વૃદ્ધિ પામતા.
દેવોએ આણેલા કલ્પવૃક્ષના ઇળ અને ક્ષીર સમુદ્રના જલનો
આહાર કરતા, સુખપૂર્વેક કાળ નિર્ગમન કરતાં. એક વરસના
થયા ત્યારે સૌધમેન્દ્ર પોતાનો (કલ્પ) આચાર જાળી રિક્ત
પાણી (ખાલી હાથે) મહોટા પુરુષ પાસે ન જવાય જેથી સેલ-
ડીનો (સાંઠો) લઈ, જ્યાં નાલિકુલકરના ઓળામાં પ્રલુ બેઠા
છે ત્યાં આંધ્રા. ઈન્દ્ર ‘મહારાજે સેલડી ખાશો’ એમ પુછ્યું,
ભગવાને પણ હાથ લાંબો કચો જેથી ધ્યાનની ઈષ્ટતા જાળી
ઇક્ષવાકુ કુળ અને કાશ્યપ ગોત્રની સ્થાપના કરી. ત્યાર પછી
છ લાખ પૂર્વ ગયા બાદ સુનંદ અને સુમંગલાની સાથે
લગ્ન કરાંધું તેમાં વર સંબંધી કાર્ય સૌધમેન્દ્ર અને કન્યા
પક્ષનું કાર્ય ઈન્દ્રજાળી—દેરાંગનાઓએ કર્યું. ત્યારબાદ ચૌદલાખ

પૂર્વ એટલે જનમથી વીસ લાખ પૂર્વ ગયા બાદ કંઈ કંઈ પડતા કાળના ચિનહુથી પરસ્તપર લડતા યુગકીયાઓને ધનશાર્ડ આપનાર રાજી-મહારાજાની જરૂર પડતાં નાભિરાજ પાસે માગણી કરતાં તેમણે (નાભિરાજએ) કહ્યું કે તમારો રાજ રૂપલ થશે. તેથી તે યુગકીયાઓએ લગવાન પાસે પોતાના રાજ થવા માગણી કરી એટલે સ્વામિ કહે રાજ તો રાજ્યાભિષેકથી સ્થાપન કરાય, એટલે યુગકીડો નહિની પત્રમાં જલ ભરીને જેટલામાં આવે છે તેટલામાં ધન્દ્રનું સિહાસન ડેલવાથી સ્વામ્યાચાર જાણી ઉત્તાવળે આવી સૌધર્મેન્દ્ર રાજ્યાભિષેક કર્યો સર્વાંગે પ્રભુને શાણગારેલા તેઓ (યુગકીડો) એ જેથા. વસ્ત્રાલંકાર વડે સર્વાંગે સુશોભિત એવા સ્વામિને દેખીને વિચારે છે કે હુંએ અભિષેક કર્યાં કરવો ? શાણગારથી સુશોભિત એવા આ શરીર ઉપર તો અભિષેક ન કરાય. એવા વિચારમાં રહ્યા છે એટલામાં જમણું પગનો અંગુઠો ખુદ્દો દેખી જલ અભિષેક કર્યો, જેથી નવ અંગમાં પ્રથમ અંગુઠે પૂજા કરાય છે.

બીજું અંગ જનું (ઢીંચણું)

જનું બણો કાઉસણું રહ્યા, વિચાર્યા દેશવિદેશ;

ખડાં ખડાં તેવળ લઘું, પૂજે જનું નરેશ, ૨.

હીક્ષા દિવસકાગણું વદ ટ (ચૈતર વદ ટ મારવાડની) બીજા વરસની અક્ષય તૃતીયા-વૈશાખ શુદ્ધ ઉ, સુધી એક વર્ષ સુધી પૂર્વના અંતરાય કર્મના ઉદ્યથી આહાર પાણી નહિ મળવા છતાં અહીન દશામાં રહેલા અને એક હજાર વર્ષ સુધી નિદ્રા તેમજ બુમિ ઉપર એઠા કે સૂતા વિના, તપ

અને ધ્યાનમાં તત્પર રહી, ઉલા ઉલા કેવળ જ્ઞાન પામ્યા.
જેથી ખીલ અંગમા જતુ પૂજાય છે.

શ્રીલુ અંગ કર (હાથ) કાંડ

લોકાંતિક વચ્ચે કરી, વરસ્યા વરસ્તીદાન;
કર કાંડે પ્રલુ પૂજના, પૂજે લવિ બહુમાન. ૩.

હરેક તીર્થાં કરનો ગીક્ષા અવસર થતાં પહેલાં એક વરસ્ય
યાંચમાં અદ્ભુ-હેવ-લોકમાં વસ્તુનાર સારરવતાહિ નવ લોકાંતિક
દેવો તીર્થ પ્રવતોવના વિનવે છે. ત્યારથી પ્રલુ વરસ્તીદાનનો
પ્રારંભ કરે છે.

વરસ્તી દાનનો વિધિ એક હિવસમાં ૧૦૮૦૦૦૦૦
એક કરોડ આં લાખ (૮૦ રતિ પ્રમાણ) સોનૈયા દાનમાં
આપે છે તેનું વજન નવ હુલર મણુ થાય છે અને તે વખ-
તના શકૃ (ગાડા) સવા ગણેં ભરાય. એક વરસના સોનૈયાને
તોલ બગ્રીશ લાખ ચાલીસ હુલર મણુ થાય.

એક વરસના દાનમાં ગ્રણસેં કરોડ (ગ્રણુ અખજ) અફુસી
કરોડ અને એંસ્થા એનૈયા થાય, તેમાં એકાશી હુલર
ગાડાં ભરાય. સોનૈયામાં છાપ શ્રીજિનેશવરદેવની અને તેમના
પિતાશ્રીની હોય છે.



વરસીહાનના ચૌદ અતિશાય.

૧. સૌધર્મેન્દ્ર લંડારમાંથી દાન આપવા માટે સેનૈયા કાઢી આપે છે.
૨. ઈશાનેંદ્ર રત્ન જડીત યષિ (લાકડી) લઈ પ્રલુ પાસે ઉલા રહી વિધન કરવા આવનાર અસુર દેવોને હુંકી કાઢે છે. તથા કે મનુષ્યના ભાગ્યમાં ક્લેટલું હોય તેટલું જ તેના મુખમાંથી યોલાવે છે.
૩. લેનારના લાગ્ય કરતાં પ્રલુના હાથમાં વધારે આવ્યા હોય તો અમરેન્દ્ર તેમાંથી કાઢી નાંખે છે.
૪. પ્રલુની મુષ્ઠિમાં લેનારના લાગ્ય કરતાં એછા આવ્યા હોય તો બલીન્દ્ર પુણ્ય કરી આપે છે.
૫. બુગનપતિ ભરતક્ષેત્રના મનુષ્યોને દાન લેવા તેડી લાવે છે.
૬. દાન લેવા આવેલાને વ્યાંતર દેવ તેમના સ્થાને પહોંચાડે છે.
૭. જ્યોતિષિહેવો, વિદ્યાધર મનુષ્યોને દાન લેવા માટે અગર આપે છે.
૮. દાનના પ્રભાવે છ ખંડમાં ખાર વર્ષ સુધી શાંતિ રહે છે.

૯. ચોસકઈન્દ્રો અને દેવો દાન લે છે, તેથી ભાર વર્ષ સુધી કળુંઓ થતો નથી.

૧૦. લંડારમાં સૌનેયો રાજ્યો હોય તો તેના પ્રલાવે ભાર વર્ષ સુધી ધન ખૂટે નહીં.

૧૧. ભાર વર્ષ સુધી યશોગાન થાય.

૧૨. દાનના પ્રલાવે છ માસના થયેલા રોગો મટી જાય.

૧૩. દાનના પ્રલાવે ભાર વર્ષ સુધી નવા રોગો થાય નહીં.

૧૪. મંદ બુદ્ધિવાળાની પણ બુદ્ધિ તીવ્ચ અને.

ચોથું અંગ અંશ (ખલા) ની પૂજા.

માન ગયું હોય અંશથી, હેઠી વીર્ય અનંત;

ભૂજ અળો અવજણ તર્યાં, પૂજ અંધ મહંત. ૪.

માન (અહુંકાર) અને તેના સહકારી કોધ. માયા લોલ એ ચારે કષાયનો વાસ ભૂજા (ખલા, માં ગણ્યાય છે એમ કલ્યું તે બહુધા (અધિક પ્રમાણમાં) કોધ, નારકીના લુલોને માન માનવ લુલોને, માયા તીર્યાને, લોલ દેવાને વધારે હોય છે. આમાં માન, માનવને વધારે હોય છે અને તેનું સ્થાન ખલામાં મનાયેલું છે. તે અપેક્ષાએ, ‘માન ગયું’ હોય અંશથી ‘એમ કહી, ચોથા અંગની પૂજા ખલાની કરાય છે.

પાંચમું અંગ શિર-શિખાની પૂજા

સિદ્ધ શિવા ગુણુ ઉજળી, લોકાંતે લગવંત,

વસિયા તેણે કારણુ લવિ, શિર શિખા પૂજંત. ૫.

આત્માનો સ્વભાવ ઉંચે જવાનો છતાં કર્મ લંચોગમાં
નોડાએલા આત્માઓ નીચે પણ ઉત્તરી જય છે. પરંતુ
કર્મથી રહિત થયેલા આત્માઓને તો ડાચા જવાનું હોય
છે. એરલે કર્મ રહિત આત્માનો સાહિ અનંત લાગે એકજ
સ્થિતિમાં ત્યાંજ રહે છે આ પ્રમાણે સિદ્ધ શિક્ષા ઉપર સ્વ-
સ્વરૂપમાં સાચા અનંત સુખનો આસ્વાહ અનુભવતા સિદ્ધા-
ત્માઓ લોકાંશે રહેલા છે. જેથી શરીરના અઘ્રભાગે રહેલા
શિર-શિખા (પંચમ અંગ)ની પૂજા કરાય છે.

છંડું અંગ ભાવની પૂજા

તીર્થાંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત,
ત્રિભુવન તિલક સમ પ્રભુ, ભાગ તિલક જયવંત ..૬..

છેહ્મા ગ્રીબા લવમાં સર્વ જુવોને શાસન રસિક
ખનાવવાની અપૂર્વ લાવનાથી જિનનામકર્મની નિકાયના
કરી, સ્વર્ગાદ્દિનો એક લવ કરી, જેઓ તીર્થાંકરપણે અવ-
તરી, સમવસરણું મધ્યે રચેલા મણિ જડીત સુવર્ણના
સિહ્નાસન પર વિરાજમાન થઈ ચોત્રીશ અતિશયવંતા પ્રભુ
પાંત્રીશ શુણું યુક્ત વાણી વડે અનેક લભ્ય જુવોને તાર-
વાથી ગ્રસુ લુલનના તિલકસમ થયા. જેથી છંડું અંગમાં
શિખા પૂજાય છે.

સાતમું અંગ કંઠ (ગળા)ની પૂજા

સોળ પહેર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ;
મધુર ધ્વની સુર નર સુણે, તિણે ગળે તિલક અમુલ. ૭

શાસન નાયક, ચરમ તીર્થાધિપતિ પ્રલુ મહાવીરસ્વામી અગવાને કંડ વિવર વડે સોળ પ્રહરની દેશના આપી અનેક જીવોને શાશ્વત સુખના રસીયા અનાવ્યા. તે કંડ પ્રહેશની સાતમાં અંગમાં પૂજા કરાય છે.

આડસુ અંગ હૃદયની પૂજા

હૃદય કમળ ઉપશમ અળો, ખાલ્યા રાગને રોષ,
હિમ દહે વન અંડને હૃદય તિલક સંતોષ .૮,
હૃદય કમળ નામના આડમા અંગમાં ક્ષમા-સમતા
ઉપશમ ગુણ ધારણ કરી, પ્રલુએ રાગ અને રોષ જેવા
મહાન હુર્જય શનુંઓને જીતી લીધા. તેથી આડમા
અંગમાં હૃદયની પૂજા કરાય છે.

નવસુ અંગ નાભિની પૂજા.

રતનત્રયી ગુણ ઉજળી, સકળ સુગુણ વિશ્રામ,
નાભિકમળની પૂજના, કરતાં અવિયળ ધામ .૯
સઘળાએ ગુણોનું સ્થાન, ગ્રણ રતન (જાન-દર્શન-
ચારિત્ર) થી ઉજજવલ એવા નાભિકમળની પૂજથી, પૂજક
અવિયળ (નિશ્ચળ ધામ- મોક્ષ) સ્થાનને પામે છે.

હું એકી સાથે નવે અંગની પૂજનો હેતુ અતાવેછે.
ઉપહેશક નવ તત્ત્વના, તિણે નવ અંગ જિણુંદ,
પૂજે બધુ વિધ રાજું, કહે શુલ વીર સુણુંદ, ૧૦

શ્રી જિનેશ્વર ભગવાન નવ તત્ત્વના ઉપદેશક હોવાથી
જવે અંગ, પૂજવા લાયક છે. એમ પંડિત પ્રવર શ્રી
શુલવિજ્યલુ મહારાજના શીષ્યરત્ન શ્રીમાન વિરવિજ્યલુ
મહારાજ કહે છે.

ઉપર પ્રમાણેની વિધિ સાચવવી. તેને વિધિશુદ્ધિ
કહેવાય છે. આ સિવાય ખીજુ છ શુદ્ધ રાખવાનો આત
રાખવો.

૧. અંગશુદ્ધિ—સાન કરી શરીરને નીર્મલ કરવું.

૨. વસ્ત્રશુદ્ધિ—પૂજા માટે પુરુષે ધોતીયુ અને ઐશ
રાખવો. (ઐશના છેડાના આઠપડ કરી મુખે ખાંધવો.) સ્ત્રીએ
પણ વસ્ત્રો. સ્ત્રીએઓ ઇમાલનાં આઠ પડ કરી મુખે
ખાંધવો. ગંભુર્ડાક, ખમીસ, કે પાટલુન પહેરીને પ્રબુની
મૂળ કરવી ઉચ્ચીત નથી. પૂજાનાં કુપડા જુદાં રાખવા અને
વારંવાર ધોવાનો ઉપયોગ રાખવો, સાંધેલાં, ફાટેલાં કે
મેલાં વસ્ત્રથી લગવાનની પૂજા ઉરવાથી આશાતના લાગે છે.

૩. મનશુદ્ધિ. ભગવાનની પૂજામાં મન સ્થિર રાખવું.
ખીજ વિચારો કરવા નહીં.

૪. ભૂમિશુદ્ધિ. દેરાસરમાં કાને બરાબર લીધો છે કે
કેમ તે લેવું. તથા પૂજાનાં સાધનો મૂકવા—લેવાની જર્યા
પણ કેમ બને તેમ શુદ્ધ રાખવી.

૫. ઉપકરણશુદ્ધિ, પૂજામાં જોઈતા ઉપકરણો કેસર,
સુખડ બરાસ, ધૂપ, ધી, ચાખા, ઝળ, નૈવેદ્ય વગેરે કેમ
અને તેમ ડાચી જતોનાં અને પોતાના ધરનાં વાપરવાં,
વાસણો ઉજળાં ચક્કાટ રાખવા.

૬. દ્રવ્યશુદ્ધિ. શ્રી જિનપૂજા આહિમાં વપરાતું દ્રવ્ય ન્યાયથી મેળવેલું હોય તો ભાવની ખૂણ વૃદ્ધિ થાય છે અને પુણ્ય ધર્મનું બંધાય છે.

ભગવાનની પૂજા ત્રણ પ્રકારે (આંગધૂજ અચ્ચપૂજા અને ભાવપૂજા) કરવાની હોય છે. તેમાં આંગધૂજ. નીર્માચ્ય દૂર કરવા, અલિષેક કરવો, આંગધૂંધણ્ણા, કેસરપૂજા, કુલપૂજા, આંગી વગેરે.

૭. અચ્ચપૂજા. ધૂપ, હીપ, અક્ષત, નૈવેદ્ય, ઇણ, ચામર વીજવા વગેરે. ભગવાનની આગળ રહીને કરવામાં આવે તે.


૮. ભાવપૂજા, ચૈત્યવંદન, સ્તોત્ર, વગેરે.

કેટલાકો પહેલાં ચૈત્યવંદન કરી લે છે અને પછી પૂજા કરે છે. પણ આ રીતે થઈ શકે નહીં. વિધિ પ્રમાણે અધીક્ષિયા કરવામાં આવે, તો ઇંગ આપનાર બને છે. તો દરેક ભાવિક આત્માએ પહેલાં કેસર પૂજા કર્યા પછી કુલ પૂજા કરવી. ત્યાર પછી સાધિયો કાઢી ઉપર નૈવેદ્ય, ઇણ સુકૃતું અને ત્યાર પછી છેવટે ચૈત્યવંદન કરવું. પણ ઉલટ સુલટ પૂજા કરવી નહીં.

(૬) તળોટીથાં ગિરિરાજ ઉપર ચઢતા વચ્ચમાં
આવતાં પગલાં વગેરે

જ્યે તળોટીના પગથાળ પાસે બન્ને બાન્નુ સુંદર હાથી
છે, જમણું હાથના હાથીની પાસે એટકા ઉપર એક દેરી છે.
ઉપર નવ દેરી તેની બાન્નુમાં ત્રણ દેરી છે અને સામે તેર દેરી છે,
તથા ડાણી બાન્નુ ચોકીમાં આરસની દેરીમાં શ્રી આહીશ્વર લગ-
વાનનાં પગલાં છે.

અહીં શ્રી ગિરિરાજને સોના-ડ્રાપના કુલદે યથાશક્તિ
વધાવી તળોટીનું ચૈત્યવંદન કરવું.



ડાણી બાળુથી પગથીયા ચડતાં સામે બાધુનું દેરાસર આવેલું છે. દરવાજની અંદર જમણી બાળુ રતન મંદિરમાં રતનની પ્રતિમાએ. જિરાજમાન કરેલી છે. ડાણી બાળુ સુંદર પાવાપુરીનું જળ મંદિર છે, નાકે મોટા કાઉસસગીઆળુ જણે હમણું ઓલશે નહિ ? એમ લાગે છે. દેરાસરમાં પેસતા જમણી બાળુ શ્રી ગિરિરાજની રચના, ડાણી બાળુ દાદાસાહેબની દેરીએ, પછી આગળ દરવાજની ખાડાર ઘન્ને બાળુ ઓરડીમાં પ્રતિમાળુએ છે. અંદર સુંદર ચોક છે. ઇસ્તી કુલ ૮૪ દેરીઓ છે. મધ્યમાં મંદિરમાં ઉપર નીચે લગવાન છે. સામે શ્રી પુંડરીકસ્વામીનું છે. ખુલ ભાવથી દર્શન કરતાં જવું.

જયતલાટીશી જમણી બાળુના પગથીયા ચડતા જમણી બાળુની છ દેરીમાં કમસર શ્રી ગૌતમસ્વામીનું, શ્રી આદિનાથ અને શ્રી અજિતનાથનું આદિના પગલા છે. દેરીની પાછા ચાલીસેક પગલા ફૂર શુફ્ફામાં હંસવાહિની સરસ્વતીની મૂર્તિ છે. પગથીએ ઉપર ડાણી બાળુની દેરીમાં પગલા છે.

શ્રી ગિરિરાજ ઉપર મંત્રીશર તેજપાણે તેરમાં સૈકાંમાં રસ્તાની પાજ ખંધાવી હતી. હાલ પગથીએ કરવામાં આવેલા છે.

પછી ઉપર ચઢતા પહેલા વીસામા પછી, ધીજ વિસામાની જમણી બાળુ દેરીમાં ભરતચુચુર્તીનાં પગલા ૧૬૮૫માં સ્થાપન થયેલા છે.

આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થાંકર લગવાનના પુત્ર ભરત મહારાજ થયા. જેમણે પૂર્વ લવમાં ૫૦૦-૫૦૦ મુનિ

મહાતમાએની સુંદર પ્રકારે લક્ષિત કરી હતી. તે પુણ્યના થોળો આ અવસર્પિણીમાં પહેલા ચક્રવર્તી થયા હતા. શ્રી સિદ્ગનિરિનો પહેલો ઉદ્ધાર કર્યો હતો. આરિસા ભુવનમાં કૈવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પછી દેવતાએ આપેલો મુનિવેષ અંગિકાર કરી અને જીવોને પ્રતિષ્ઠાધ કરી મોક્ષ ગયા હતા.

પછી સંપાદ જગ્યા આવે છે. ત્યાં આગળ ઇંચા કુંડ સુરતવાળા ધર્માચંદ શેડ સં. ૧૬૮૧માં બંધાવેલો છે. થોડું ક ઉપર ચડતા જમણી બાળુ એક દેરીમાં શ્રી નેમનાથ શ્રી આદીશરણ અને વરદાત ગણધરનાં પગલાં છે.

તેઓ શ્રી નેમનાથ ભગવાનના પહેલા ગણધર હતા. જેઓએ આ તીર્થનો સુંદર મહિમા ગાયેલો તેઓ ભગવાનની સાથે મોક્ષ ગયા હતા.

ત્યાં થી ચઢતાં ખીજ વિસામે જમણી બાળુ ઉંચા એટલા ઉપર દેરીમાં શ્રી આદિનાથ ભગવાનના પગલા છે. બાળુમાં કુમાર કુંડ મહારાજા કુમારપાલે બંધાવેલો છે. પછી સીધાં પગથિયા ચઢવાના આવે છે. તીચે ચઢતા ‘હિંગળાજનો હુડો કેડ હુથ દઈ ચડો; કુટયો પાપનો ઘડો, બાંધ્યો પુણ્યનો પડો.’ એવો હિંગળાજના હડા સામે હિંગળાજ માતાની મૂર્તિ છે.

આ હિંગળાજ હડા માટે એમ કહેવાય છે કે હિંગલાજમૂર્તિનું સ્વરૂપ અંબિકા દેરી છે. એક વખતે હિંગલાજનો રાક્ષસ સિદ્ધ નહીં તરફથી જતા આવતી ચાન્તિકાને

ઉપદ્રવ કરતો હતો. તેથી કોઈ મહાત્માએ ધ્યાન અને તપના ભાગથી અંબિકાને બોલાવી અને હિંગુલ તરફાં થતો ઉપદ્રવ હર કરવા માટે વિનંતિ કરી એટલે અંબિકા દેવીએ હિંગુલ રાક્ષસનો પરાલવ કર્યો એટલું જ નહિ પણ મરણ પામે ત્યાં સુધીની કાર્યના કરી. આથી હિંગુલ રાક્ષસે દેવીના પગમાં પડી એ હાથ જોડીને બોલ્યો કે હે માતા. મારી એક પ્રાર્થનાને સ્વીકાર કરો. આજથી તમે મારા નામે ઓળખાયો અને તીર્થયાત્રાના સ્થળમાં મારા નામથી સ્થાપન થાયો. હું કહીયે કોઈને ઉપદ્રવ નહિ કરાયા.

આ પ્રમાણે તેની વિનંતિને અંબિકા દેવીએ માન્ય-રાખી અને પોતે અદૃશ્ય થતું ગઈ. રાક્ષસપોતે કરેલા કૃત્યનો અહેલો લોગવવા અદ્યોગતિમાં ગયો.

અંબિકાદેવીએ પોતાના લક્ષ્ણોને જલ્બાન્યું કે આજથી તમો મને હિંગુલાદેવી નામથી ઓળખાજો., આ બનાવ પ્રાય: કરાંચી પાસેના હુંગરો પાસે આસ હિંગુલનું સ્થાનક છે. ત્યાં આગળ બન્યો હતો.

અંબિકાદેવી આસ સૌરાષ્ટ્ર દેશની અધિકારી દેવી છે. શ્રી સિદ્ધગિરિનું ઉપર ચડાવવાળા એક ટેકરી ઉપર અધિકિત થઈને રહેવી છે. તેથી આ હિંગુલાજના હડા તરિકે પ્રસિદ્ધી પાઢ્યો છે.

પછી થોડા પગથિએ ચઢતાં સુંદર વિસામે છે. ત્યાં વચ્ચેમાં કલિકુંડ શ્રી પાર્થીનાથ લગવાનનાં પગલાં સંવત ૧૮૩૫ માં સ્થાપન કરેલા છે.

અહીંથી એ રસ્તા પડે છે, નવો રસ્તો પગથીઆવાણો છે. જ્યારે બીજુ બાળુ જુનો રસ્તો છે જુના રસ્તો થોડું ચથ્યા ત્યાં ડાખી બાળુ સમવસરણુના આકારવાળી હેરીમાં શ્રી મહાવીરસ્વામીજીના પગલાં છે. પછી ચઢાણુનો કઠળું ભાગ આવે છે તે પુરો થતા ત્યાં નવો રસ્તો લેગો થાય છે અને જુહો પડે છે. ત્યાં વચ્ચે હેરીમાં શાશ્વતાં ચાર જિન શ્રી રૂપભદ્રે, શ્રી ચંદ્રાનન, શ્રી વારિપેણુ અન શ્રી વર્ધ્માનના કમળ આકારે પગલાં છે બાળુમાં છાલાકુંડ ૧૮૭૦માં બંધાવેલો છે.

નવા રસ્તે આગળ જતાં એક નાની કુંક જેવું આવે છે તે શ્રીપૂજયની હેરીઓના નામે ઓળખાય છે.

ત્યાં તપાગચ્છાલાંકાર શ્રીમાન હેન્ડ્રોસરિલું નામના શ્રીપૂજયે જગ્યા સાકુ કરાવી કેટલાક ઓરડા બંધાવી ધર્મની જગ્યા તરિકે રાખેલી છે અને હેરીઓ બંધાવી છે તેમાં ચૌદ હેરીઓમાં શ્રીપૂજયના પગલાં છે ચાર ખાલી છે. એક હેરીમાં સફેદ આરસની ૧૭ ઈચ્છની સાત ફુણ્ણાવાળી શ્રી પંચાવતીજીની હેવી છે. તેમના ઉપર પાંચ ફુણ્ણાવાળી શ્રી પાર્વતિનાથ લગવાનની મૂર્તિ છે પ્રતિમાલની નીચે એ ડમરુ ધારી અને ઉપર એ ચામરધારીની આકૃતિઓ છે ઉપર એ જિનનેશ્વરની પ્રતિમા છે. ડાખી બાળુ હનુમાનની મૂર્તિ છે, એક હેરીમાં શ્રી મણિલદ્રાલની મૂર્તિ છે વચ્ચેમાં કુંડ છે, તેની ચારે બાળુ હેરીમાં ચાર હેરીમાં શ્રી ગોડીજીપાર્વતિનાથ, શ્રી આહિનાથ, શ્રી ગૌતમસ્વામીજી, અને વિજયધર્મસ્તૂરીશ્વરજીના પગલાં છે.

અહીંથી સામે નજર કરતાં નવે કુંકના શ્રી જિનમંહિદેશનો રમ્ય હેખાવ નજરે પડે છે, એતી નીચે જેતાં આમા

પાલીતાણું નગરનો મનોહર દેખાવ દિણ્ગોચર થાય છે.
પછી થોડું ચઢ્યા પછી સપાટ ચાલવાનું આવે છે આગળ
જાયા ચોતરા ઉપર મોટો ધુમટ બાંધેલી દેરીમાં શ્યામ રંગની
આર ઉલ્લી મૂર્તિંચો છે. ૧- દ્રાવિડ ૨-વારિભિલ્લ ૩-
આઈમર્તા અને ૪ નારદલ્લ.

૧-૨ દ્રાવિડ અને વારિભિલ્લ

લગવાન શ્રી ક્રષ્ણનાથસ્વામીને દ્રવિડનામના પણ
એક પુત્ર હૃતા. તેમને દ્રાવિડ અને વારિભિલ્લ નામે એ પુત્રો
હૃતા બન્નેને પરસપર ખૂણ સ્નેહ હતો.

દ્રવિડ ભિથિલાનું રાજ્ય દ્રાવિડને આપ્યું અને વારિ-
ભિલ્લને એક લાખ ઉત્તમ ગામો જાપી, પોતે લગવાનની
પાસે દીક્ષા લીધી.

કેટલાટ રાઇમ પછી બન્ને વચ્ચે હૈમનસ્ય થયું: પરિ-
શુમે બન્ને ભાઇઓ વચ્ચે તુમુલ ચુદ્ધ થયું: સાત મહિનામાં
કરોડો માણુસો, ॥ નાના થયો છતાં કોઈ ચુદ્ધથી અદકતુ
નથી.

દ્રાવિડ રાજને એકવાર અચાનક સુવલ્લુ તાપસ પાસે
જવાનું થયું. તેમના ઉપહેશથી દ્રાવિડ રાજ પ્રતિષેધ પામ્યા
અને વારિભિલ્લને બમાયા અને તાપસની વાણી સાંલળી
પોતાનું રાજ્ય સોંપવા માંડયું; ત્યારે વારિભિલ્લે હ્યું કે
નરકના દ્વાર તુલ્ય એવા રાજ્યથી સચ્ચું. કહું પણ તમારી
સાથે જ મત અહૃણુ કરીશા.

પછી પોતાના રાજ્ય ઉપર પોતાના પુત્રોને રથાપન કરી રાજ્ય કારકુર મંગીને લગાવી દશકોટી મનુષ્યોની સાથે તાપસી હીક્ષા લીધી.

માથે જરા ધરતા, કંદમૂળ કળાને ખાતા, ધ્યાનમાં લીન રહેતા અને શ્રી ચુગાહિમલુનું નિરંતર સમાણ કરતા લાગેઓ વરસ પસાર થઈ ગયા.

એકવાર એ વિદ્યાધર મુનિનો લેટો થઈ ગયો તેમના મુખેથી શ્રી શત્રુંજ્ય તીર્થનું મહાત્મ્ય અને ઉપરેશ સાંકણી બધાયે કેન હીક્ષા બહુષુ કરી, શ્રી શત્રુંજ્યતીર્થની યાત્રા કરવા ચાલ્યા. શ્રી ઋગ્ભસહેવ લગવાનના ગુણુગાન ગાતા તીર્થની યાત્રા કરી ખૂબ આનંદ પામ્યા.

ત્યાર બાદ માસખમણુને અતે એ વિદ્યાધર મુનિઓંએ શ્રી દ્રાવિષુ મુનિ, શ્રી વારિભિલ્લ મુનિ વગેરે દશ કોડ સાધુઓને ઉપરેશ આપતા કહું કે ‘હે સાધુઓ ! તમે અશુલ ધ્યાનાદ્ધિના યોગથી નરક ગતિને આપનારાં અનંત કર્મો બાધીલા છે. તેથી તમારે આ ક્ષેત્રમાં જ રહેવું. આ ક્ષેત્રના પ્રલાવથી તમે સર્વે કર્માનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામીને મોક્ષ જરો આ પ્રમાણે ઉપરેશ આપી જાની વિદ્યાધર મુનિ આકાશ માર્ગે અન્યત્ર ચાલ્યા ગયા.

શ્રી દ્રાવિષુ મુનિ, શ્રી વારિભિલ્લ મુનિ વગેરે બધા મુનિઓ લગવાનના ધ્યાનમાં લીન બની એક મહિનાના ઉપવાસ કરી લાં રહ્યા અનુક્રમે શુલધ્યાનમાં આગળ વધતા ક્ષપક શ્રેણી માંડી કેવળજ્ઞાન પામી અંતમુહૂર્તમાં દશકોટી સાધુઓ

સાથે કારતક સુદ ૧૫ ના દિવસે લિંગ્દિપહને પામ્યાં.
ભરત મહારાજ મોશે ગયા પછી એક પૂર્વ કોડ વધે
દ્રાવિડ અને વારિભિલલળ મોશે ગયા.

૩-આઈમિત્તામુનિ

પેઢાલપુર નગરમાં વિજય નામના રાજને શ્રીમતી નામે
પત્ની હતી. તેમને એક પુત્ર થયો તેનું અતિમુક્ત નામ પાડ-
વામાં આવ્યું આઠ વર્ષની ઉંમરે શ્રી ગૌતમસ્વામીજી પાસે
દીક્ષા લીધી.

એક વાર એક શોઠને ત્યાં ગોચરી માટે ગયા. ત્યાં
તેમના પુત્રવધુએ મુનિને કહ્યું કે કેમ અત્યારમાં ? ખડુ મેડું
થધ ગયું કે શું ?' શાખદ એ અર્થવાળા હતા ગોચરી તથા
મુનિને લાગુ પડતા હતા. મુનિને તેનો મર્મ સમજુ જવાબ
આપ્યો કે 'મરણ એ નાણી છે તે કચારે આવશે તે હું જાણું તો
નથી. એટલે દીક્ષા લીધી છે.'

એકવાર સાધુઓની સાથે ગામ બહાર ઠદ્દે ગયા હતા
ત્યાં ચોમાસાના લીધે પાણીથી ભરેલાં ખાણોચીયામાં પાતુ.
મૂર્કીને તરાવા લાગ્યા. સાધુઓ આ જેઠને કહ્યું આમ કર-
વાથી જીવની વિરાધના થાય, ખડુપાપ લાગે. બાળ મુનિ સરમાઈ
ગયા પ્રભુ પાસે ઈન્દ્રિયાવહી કરતાં શુલ લાવમાં ચઢ્યા ક્ષપક
શ્રેણી માંડી કેવળજ્ઞાન પામી ધણો ઉપકાર કરી મોશે ગયા.

૪-નારદ

ક્ષારકા નગરીના ઢાહના અને યાદવોના નાશના સમાચાર સાંકણી હુદ્દયમાં હુઃખ પામતા નારદ શ્રી શશ્રુંજ્ય ગિરિવર ઉપર આવ્યા ત્યાં પોતાના અવિરતિપણુંની નિંદા કરતાં અને શ્રી ઋષલદેવ પ્રલુનું ધ્યાન ધરી નારદે તેજ શિખર ઉપર અનશન કર્યું. ચાર શરણું અને ચાર મંગળને સ્વીકારી શુદ્ધલધ્યાનનું ધ્યાન ધરતાં ડેવળજાન પામી મોક્ષ ગયા.

આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં નારદો એકાણું લાખ સાથે આ ગિરિવર ઉપર મોક્ષ પામેલા છે.

(કારતક સુદ ૧૫ મે અહીં મેળો લરાય છે.)

થોડું આગળ જતાં ડાણી બાનુ હીરાભાઈનો કુંડ છે. પછી આગળ જતાં ભૂખણુદાસ, (ભાવળ) કુંડ આવે છે. કે સુરતવળા ભૂખણુદાસે બંધાંગો છે. થોડાં પગથીયા ચદચા પછી જમણી બાનુ ઉંચા ઓટલા ઉપર એક દેરીમાં પાંચ ઉલ્લિ મૂર્તિએ છે. તે પાંચ પાંડવોની નથી, પણ ૧-રામ ૨-લરત ઉથાવચા પુત્ર ૪-શુક્રપરીવાજક અને ૫-શૈલ્કાચાર્યની છે.

૧-૨-રામ લરત

શ્રી રામ અને શ્રી લરત એ દશરથરાણના પુત્રો હતા. પોતાનો પૂર્વલવ સાંકણી દીક્ષા અરુણ કરી હતી. શશ્રુંજ્ય

તीર્થ ઉપર ત્રણુ કોડ સાથે મોક્ષમાં ગયા છે. શ્રીરામ અને શ્રી ભરતનું ચરિત્ર જૈનરામાયણુંમાં પ્રસિદ્ધ હાવાથી વધુ લખ્યું નથી..

૩-થાવચચાપુત્ર

ક્ષારિકા નગરીમાં થાવચચા નામની સાર્થવાહી રહેતી હતી. તેમનો પુત્ર થાવચચાપુત્ર નામથી પ્રસિદ્ધ પાત્રયા. ચુવાન વય પામતાં માતાએ અત્રીસ સુંદર કન્યાએ પરણાવી. સંસારના સુખો લોગવવા લાગ્યા, લગવાન શ્રીનેમનાથની દેશના સાંકણી એક હુલર પુરુષો સાથે હીક્ષા અહૃણુ કરી.

શૈવક નામના નગરના રાજ શૈવકને પ્રતિષ્ઠાધ કરી શ્રાવક બનાવ્યા. ત્યારખાં શુક્રનામના પરિવાજકને પ્રતિષ્ઠાધ પમાડ્યો; એટલે શુક્રપરિવાજકે પોતાના સુર્ખે શિખ્યો સાથે જૈન હીક્ષા અંગીકાર કરી.

થાવચચા પુત્રે પોતાનો અંતકાળ નણુક જાણી શ્રી સિદ્ધ-ગિરિજી ઉપર આવ્યા અને અનશન કર્યું. એક માસને અંતે ડેવળજાન પામી મોક્ષ ગયા.



૪-શુક્ર પરીવાજક

થાવચ્ચાપુત્રના ઉપદેશથી દીક્ષા લીધેલા શુક્પરિવાજક કમે કરીને આચાર્ય થયા હતા. તેઓ પોતાના શિષ્યો સાથે વિચરતા શૈલક નગરમાં આવ્યા. ત્યાં શુકાચાર્ય શૈલક રાજ અને પાંચસો મંત્રીઓને દીક્ષા આપી, અનુકમે ચોંચતા જોઈ તેમને આચાર્યપદ આપી શૈલકાચાર્ય કર્યા.

શુકાચાર્ય લાંબા કાળ સુધી ધણો ઉપકાર કર્યો અને એક હજાર મુનિવરો સાથે સિદ્ધધગિરિ મહાતીર્થમાં કેવળ જ્ઞાન પામી મોક્ષ ગયા.

૫-શૈલકાચાર્ય

આચાર્યપદ પામી પૃથ્વી ઉપર વિચરતા શૈલકાચાર્યના શરીરમાં રોગો ઉત્પન્ત થયા. તેથી બિકિસા માટે તેમના પુત્ર મદુક રાજા ચિનાન્તિ કરી આચાર્યને પોતાના નગરમાં લઈ ગયા અને નિરોગી કર્યા. નિરોગી થત્રા છતાં રસદોહુપતાને આધીન જની શીથીલ થયેલા શૈલકાચાર્યની પંથક નામના વિનીતશિષ્ય ઉત્તમ પ્રકારે સેવા કરતા હતા.

એકવાર ચોમાસી આમણું કરતાં પંથક મુનિએ શૈલકાચાર્યના પગે સ્પર્શ કર્યો શૈલકાચાર્યની નિદ્રામાં ખલેક પડી. પંથક મુનિએ કહ્યું ‘કેચોમાસી આમણું કરવા માટે આપના ચરણનો સ્પર્શ કર્યો; તે આ ભારી અપરાધની ક્ષમા કરો. આ વચ્ચન

સાંભળતાં શૈલકાચાર્યને પોતાની પ્રમાણ દર્શાનો જ્યાલ આવ્યો. આલોચના કરી પરિવાર સાથે શ્રી સિદ્ધગિરિજી ઉપર આવ્યા એક મહિનાનું અનશન કરી પાંચસે શિષ્યો સાથે કેવળ જાન પામી મોક્ષ સુખને પામ્યા.

કુંઠની પાસેના ચોતરા પાસે એક પગલાં છે, તેની પાસે એક દેરીમાં સુકોશલ સુનિનાં પગલાં છે.

સુકોશલ સુનિ

અચોધ્યા નગરીના રાજ કીર્તિધરના તેઓ પુત્ર હતા તેમની માતાનું નામ સહૃદેવી હતું; કીર્તિધર રાજએ ગર્ભરસ્થ પુત્રને રાજ્ય સોંપી હીક્ષા લીધી, ત્યાર બાદ સુકોશલે પણ પોતાની ધારમાતા પાસેથી પિતા મુનિની વાત જાણી, પિતા મુનિની પાસે હીક્ષા લીધી, તેમની માતા સહૃદેવીને પુત્રનો વિદોગ અસહ્ય થઈ પડ્યો, આત્મધ્યાનમાં મરણ પામી, પહાડી જંગલમાં વાધણું થઈ.


એક વખત ખને રાજબિં શ્રીકીર્તિધર સુનિ અને શ્રી સુકોશલ સુનિ તે પહાડ ઉપર વિહૂાર કરતા હતા, ત્યાં આ વાધણે જેયા અને રૈષ આવ્યો અને સુનિઓને ફાડી ખાવા ઢોડી, ત્યાં પિતા સુનિએ પુત્ર સુનિને સાધી લેવાની ક્ષણી સમગ્રાવી, ખને સુનિઓ કાઉસરગ ધ્યાનમાં રહ્યા વાધણે

સુકોશાલ મુનિ ઉપર પહેલો હુંમલો કર્યો. મુનિ અંતગડ કેવળી થઈ મોક્ષમાં ગયા.

સુવણુ—સોનાની દાઢ જેતાં વાધણુ વિચારમાં પડી શ્રી કૃતિધર મુનિએ ઉપદેશ આપ્યો વાધણુ જાતિસમરણ પામી અનશન કર્યું અને હેવગતિ પામી.

પછી આગલ ચાલતા હનુમાનધાટ આવે છે, ત્યાં ડાખી બાજુ ચોતરા ઉપર પૂર્વાલિમુખ શ્રી ઋષભદ્રેવ લગ-વાનનાં પગલાં છે. જમણી બાજુ હનુમાનની ઉલ્લી મૂર્તિ છે. અહીંથી એ રસ્તા પડે છે જમણી બાજુના રસ્તે નવ દુંગમાં જવાય છે. ડાખી બાજુના રસ્તે શ્રી માહીશુરજી દાઢાની મોટી દુંગમાં જવાય છે.

હનુમાનધાટથી દાઢાની દુંગના રસ્તે જતાં વળાંક આગળ જમણી બાજુ દુંગરની લેખડનાં કોતરેલી મૂર્તિઓ છે. ત્યાં પગથીઓં કોતરેલા છે. પછી પગથીઓં ચઢતાં વચ્ચે માં ડાખી બાજુ કોટમાં એક સ્થાનક છે. પછી સામે રામ પોળનો લંઘ કલાતમક દરવાળે દેખાય છે.



નવે કુંકને ફરતો કોટ બાંધેલો છે. અંદર જવા માટે ૧-રામપોળ ૨-ઘેઠીની ખૂારી અને ૩-નવકુંક એમ ત્રણું રસ્તા છે. દરવાને સાંજે બંધ થઈ જાય છે. સવારે જયારે પ્રકાશ થાય ત્યારે ખોલવામાં આવે છે.

શ્રી ગિરિજાજુલ્પર વચ્ચે વિશ્રામ લેવા માટે થોડે થોડે છેણે
વિસામા ખાંધવામાં આવ્યા છે. તથા ઠંડા અને ગરમ
(ઉકાળેલા) પાણીની સગવડ પણ રાખવામાં આવે છે.

રામપોળની અંદર પ્રવેશ કરતાં સામે પાંચ શીખરો
વાળું અને ત્રણ શિખરવાળું એમ એ હેરાસરો આવેલા છે.
આપા ગિરિજાજુલ્પર પાંચ શિખરવાળું આ એકજ હેરાસર છે.

યાત્રિકે ઉપર ખતાવેલ વંહનીય પગલાં વગેરે સ્થાને
દર્શાન-વંહન-પૂજન-ભાવના કરતા ચઢી યાત્રા કરવી.

સમુદ્ર સપાઈથી લગભગ ૧૮૦૦ ફીટ ઊચુ શ્રી ગિરિ-
જાજ તીર્થ છે.

(૭) નવદુંકોનું વણ્ણન દાહાની દુંક

રામ પોળમાં પેસતાં સામે પંથશિખરી મંહિરમાં શ્રી
વિમલનાથ ભગવાન અને આળુના ત્રણ મંહિરમાં શ્રી સુમતિ
નાથ ભગવાન છે. આળુમાં મોતીશાહની દુંકનો અગીચા, મોંટા,
કુંડ, દુંકના કીલ્લાના લાગમાં કુંતાસર દેવીનો ગોખલો છે.

લીસેક પગથિયા ચડયા પછી સગાળ પોળ આવે છે,
અહીં યાત્રાળુંઓની ચીજ-વસ્તુઓ સાચવી રાખવાની વ્યવસ્થા
છે. પાસે એક્ષિસ છે. સામે નોંધણુંડ, સગાળનુંડ વગેરે છે.

વાધણુપોળમાં દાખલ થતાં ડાખી બાળુ એક નાનું શ્રી આહિનાથજીનું મંદિર છે, તેની બાળુ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે, અહીં બીજું ચૈત્યવંહન કરવું. અહીં પ્રભુના દર્શન કરી ચૈત્યવંહન કરતા શ્રી ગિરિજાજ ઉપર ચઢતા લાગેલો અથે થાક ઉતરી જાય છે. મન પ્રકૃષ્ટલ ઘની જાય છે.

ખાદ્યાર નીકળતા નીચેની બાળુમાં શ્રી ગિરિજાજ તીર્થની આધિકારી શ્રી ચક્રવર્તીમાતાની મનોહર મૂર્તિ છે. તથા બામુના ભાગમાં વાધેશ્વરી દેવીની મૂર્તિ છે. આ ઘને દેવીએ આગળ દેવીની સ્તુતિ છરાય તથા આવક-આવિકા પ્રખ્યામ કરી શકે પણ ખમાસમણું દેવાય નહિ.

ડાખી બાળુના મંદિરો ડ-શ્રી નેમનાથની ચોરીનું મંદિર, મૂળનાયક શ્રી સુપાર્વનાથ લગવાન છે. લુલલુલામણીનું મંદિર કહેવાય છે.

મંદિરના ઉપરના ભાગમાં ચોમુખજીના ગ્રણ મંદિરો છે, આખુળની કોરણી જેવું કમલપત્ર તથા નાગપાશનું દૃષ્ય ધૂમટમાં કોતરેલું છે.

તથા વિવિધ પ્રકારના દશથે નેમનાથની ચોરી વગેરે કોતરેલા છે. બાળુમાં મોકષધારી છે. તેમાં સાંદળી ઉલ્લિ છે.

૪. શ્રી વિમલનાથ, ૫. શ્રી અજિતનાથ, ૬. સહસ્રકણ્ણા પાર્વતિનાથ, ૭. મનોહર દેરી, ૮. શ્રી ધર્મનાથજી, ૯. શ્રી ચંદ્રપ્રભસ્વામીજી, ૧૦ શ્રી પાર્વતિનાથ, ૧૧ જગતશેઠજી, ૧૨ શ્રી શાંતિનાથ ૧૩. શ્રી સહસ્રકણ્ણા પાર્વતિનાથ, ૧૪. કુમાર-પાળનું વગેરે મંદિરો આવેલા છે.

જમણી બાળુના મંદિરો:- ૧૫ પંચતીથી (આ મંદિરમાં આગળ સમવસરણું, ડાણા હુંથે સમેતશિખરજી,

જમણ હાથે મેરુ પર્વત, અને ભૂળનાયકનું મંદિર તથા
અષાપદળ) ૧૬. પુંડરીકળ (પંચતીથી મંદિરની સામે
નાના દહેરમાં પુંડરીકળ છે આમાં અડસઠ નાની દહેરીએં
છે આ એ દહેરા નરમી દરમી ટુંકથી પણ ઓળખાય છે)-
૧૭ શ્રી પઞ્ચપ્રલસ્વામીજી, પછી કવડયક્ષનીદેરી, ૧૮ શ્રી મહા-
વીરસ્વામીજી, ૧૯ શ્રી અમીજરા પાર્વતિનાથ, ૨૦ શ્રી ચંદ્ર-
પ્રલસ્વામીજી, ૨૧ શ્રી સંભવનાથજી, ૨૨ શ્રી પાર્વતિનાથ પ્રલુનુ
રમણીય, ૨૩ શ્રી ચંદ્રપ્રલસ્વામીજી, ૨૪ શ્રી સંભવનાથજી,
૨૫ શ્રી અજિતનાથજી, ૨૬ શ્રી પાર્વતિનાથજી, ૨૭ શ્રી
ઋષભનાથજી, ૨૮ શ્રી ધર્મનાથજી, ૨૯ શ્રી મહાવીરસ્વામીજી
૩૦ સો સ્થંભનું ચોમુખજીનું, ૩૧ શ્રી ઋષભનાથજી, ૩૨
પઞ્ચપ્રલસ્વામિની ખાળુમાં શ્રી શાનુંજ્ય મહાત્મ્યના કર્તાં
શ્રી ધનેશ્વર સ્થૂરિજીની એ શિંધો સહિત આરસની મૂર્તિં છે,
૩૩ શ્રી શ્રેયાંસનાથ ૩૪-૩૫ શ્રી સંભવનાથજીના, ૩૬ ઋપલ
દ્વા, વગેરે સુંદર મંદિરો આવેલા છે,

લીંમડાના જાડ નીચે એક દેરીમાં પગલાં છે, ખાળુમાં
એક પાળીયો છે, તેના માટે એમ કહેવાય છે કે-

વીર વિક્રમશી.

પાલીતાણા શહેરમાં ભાવસાર જાતિનો વિક્રમશીનામનો
એક યુવક પોતાના લાઈ અને લાભી સાથે રહેતો હતો.

ઉનાળાના દિવસોમાં એક વખત વિક્રમશી કપડા ધોઈને
હુથમાં ઘોડો અને કપડાં લઈને મધ્યાહ્ન વખતી ઘેર આવ્યો,

ભૂખ પણ ધર્ષી લાગી હતી તેથી હાથ પગ ધોઈને રસોડામાં ગયો, રસોઈને વાર હતી. તેથી તેને ગુસ્સામાં લાલીને કહ્યું કે ‘બપોર થઈ ગયા છતાં હજુ રસોઈ કરી નથી ? મારે શું આવું ? વેર એડા એડા આટકું ચે થતું નથી.’

આવા શબ્દો સાંલળી લાલીએ કહ્યું કે ‘રસોઈને થોડી વાર લાગી એમાં આટલો ગુસ્સો કોના ઉપર કરો છો ? હજુ તમારા લાઈ કમાય છે અને તમારે ટીક છે એડા એડા તાગડધિના કરો છો. બહુ બળ હોય તો સિદ્ધાચળની યાત્રા બંધ છે. તે છોડવોને ! સિંહને મારો તો ખરા શુર્વીર જાગુ’

લાલીનું મેણું સાંલળતાં જ ધોડો હાથમાં લઈને ચાદી નીકલ્યો. અને પ્રતિજ્ઞા કરી ‘જચાં સુધી સિંહને મારી ન નાખું ત્યાં સુધી ઘરમાં પગ ન મુકવો.’

તળેઠી પાસે આવી ભિત્રોની વિદ્યાય લીધા અને કહ્યું કે ‘ઉપર જઈ સિંહને મારીને ધંટ વગાડુ તો જાણુને કે સિંહ માયો છે, નહિતર મને મરી ગયેલો જાણુને.’

વિકમશી ગિરિજા ઉપર ચઢો. ચઢોને સિંહને શોધવા લાગ્યો તો એક જાડ નીચે સિંહઃસૂતેલો પડયો હતો. જુવાને વિચાર્યું કે સુતેલાને કેમ મરાય ? અવાજ કરી સિંહને જગાડયો સિંહ જેવું ઉંચું જેવા જય છે, તેવો હાથમાં રહેલા ધોડાનો એવો ફૂટકો લગાવ્યો કે સિંહ તરફીયા ખાતો નીચે પડી ગયો, અને એલાન થઈ ગયો.

વિકમશી સિંહને મરી ગયેલો જાણી ધંટ વગાડવા માટે હોડયો, જેવો ધંટ વગાડવા જય છે ત્યાં પાછળથી આની

સિંહે અપટ મારી, ચુવાન નીચે પડી ગયો, પણ સિંહની ખોપરી તૂરી ગયેલી હોવાથી ત્યાં ને ત્યાં મરણ પામ્યો. ચુવાનને થયું કેસિંહને તો માર્યો પણ ઘંટ કેમ વગાડવો? બધી શક્તિ એકઠી કરી, ઘા ઉપર કપડાની મજબૂત ગાંડ આંધી દીધી. ધીમે ધીમે ઉલો થઈ જેરથી ઘંટ વગાડવા લાગ્યો.

નીચે રાહ જેતાં લોડો ઘંટને અવાજ સાંભળી ઉપર આવી પહોંચ્યા. જુઓ છે તો એક બાળુ સિંહ મરેલો પડ્યો છે. બીજુ બાળુ વિકમશીનો મૃતહેલ પડ્યો છે.

‘પ્રાણુનો લોગ આપી ચાત્ર ખુલ્લી કરી’ આથી લોડોએ લીંખડાના ઝડની નીચે આ વિકમશીનો પાળ્યાયો. પત્થરમાં બનાવીને રાખેલો છે. ઉપર જવો ત્યારે જેશો તો તે પાળ્યાયો આજે પણ ઉલો છે.

સામે હાથીપોળ આવે છે, બન્ને બાળુ મોટા હાથીએ કરેલા છે. બંને ગોખલાઓમાં ભગવાનની મનોહર મૂર્તિએ છે, ઉપર એક બાળુ પંચપરમેષ્ઠી ચુક્ત એકાર છે; બીજુ બાળુ ચોવીસ તીર્થીકરેથી ચુક્ત ઝીકાર છે, બહારથી ડાખી બાળુ ગલીમાં આગળ જતાં સૂર્યફુંડ આવે છે, બાળુમાં લીમ નામનો કુંડ છે અને એક મનોહર છત્રીવાળો વિસામો છે.

સૂર્ય કુંડનો પ્રભાવ

આલાપુરીમાં વીરસેન નામના રાજને ચંદ્રકુમાર નામનો પુત્ર હતો. તેની અપરમાતા વીરમતી ચંદ્રકુમાર ઉપર દ્વેષ રાખતી હતી. ચંદ્રકુમારના લગ્ન એક ગુણવાન અને બીજુ

સુંદર રાજકુમારી પ્રેમલાલચી. સાથે થયાં હતાં વીચસેન રાજને ચંદ્રકુમારને રાજગાતી ઉપર એકાખ્યો. ચંદ્રકુમાર રાજ બન્યો.

એક વર્ષન વીરમતીએ દ્રેરને દીધે સ્વીચ્છિત્ર દેળી ચંદ્રરાજને કુકડો જનાવી દીધો.

સોણ સોણ વરસનાં દાહાણું વ્યતીત ઘણ ગયાં.

એકવાર પ્રેમલાલચી કુકડાને લઈને શ્રી સિદ્ધગિરિ શુની યાવાએ આવેલી છે, ત્યાં કુકડો અનેલા ચંદ્રરાજને લઈને સૂર્યકુંઠની પાસે આરામ કરવા મેળી છે, ત્યાં કુકડાને પોતાની પૂર્વ અવસ્થા સાંભળી આવી અને વિચારવા લાગ્યો કે અહો ! “તીર્યં ચ અવસ્થામાં સોણ સોણ વર્ષ પસાર થઈ ગયાં, કયાં મારી શુણુાવલી, કયાં માર્દાં રાજ્ય ? કયાં મારાં સુગાં જાંખાંધીએા ? અરે ! શોકય માના પોતેજ વૈરીણી અની, નટોની સાથે દેશ દેશાવર કર્યો, પ્રેમલાલચી મળી, સાથે રહેવા છતાં કેવો વિયોગ ? અરેખર આ રીતે લુલીને શું કરવું ? કોણું કોનું સગું છે.” આમ વિચારી કુકડાએ મરી જવા માટે એકદમ સૂર્યકુંઠમાં જાપાપાત કર્યો.

પ્રેમલાલચી આ નેઈ એકદમ ગલસાઈ ગઈ અને પોણી ઉઠી અરે ! આ શું થયું ! હવે હું કયા જાઉં ! તે પણું કુકડાને અચાવવા સૂર્યકુંઠમાં પડી, કુકડાને પછેવા જતા કુકડાને પગે બાંધેદો હોરા લુર્ઝું થયેદો. તેના હાથમાં આવતા તૂરી ગયો અને આશ્ર્ય વચ્ચે કુકડો મટી ચંદ્રરાજ અની ગયો, બન્નો

તરीને કાંઠે આવ્યા, એક ખીજને ઓળખયા આનંદ આનંદ થઈ ગયો, સુરજુંડનો પ્રભાવ સૌના જગ્યામાં આવ્યો.

પછી જન્મે જગ્યાએ શ્રી આહીંદર લગ્બાનની ખૂબ લાવથી ભર્તિ કરી, રાજ્ય મેળવ્યું હિક્ષા લઈ આત્માનું કલ્યાણ કર્યું. આ સુરજુંડ ઉપર કુકડાની મૂર્તિ રાખેલી છે.

૨


મહીપાલ રાજનો કોઠ અનેક ઉપચારો કર્યા છતાં મટથો ન હતો, તે આ સુરજુંડના જગ્યાના પ્રભાવથી નાશ પામ્યો હતો.

હાથીપોળમાં દાખલ થતાં ડાળી ખાજુ પૂજ કરનારને ન્હાવા માટે ગરમ તથા ઠંડા પાણીની સંગવડ, કપડાં મૂકવા માટે ખાનાં લાઇએ તથા બહેનેને ન્હાવાને માટે એસ-ડીએ બનાવેલી છે. ખાજુમાં કેસર સુખડ માટેનું સ્થાન છે જમણી ખાનુંયે કુલો વેચનારા ઐસે છે.

સનાન કર્યા પછી કુલો વેચનારને અડી ન જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. માણા માટે કુલો ગુથેલા હોય તે જ લેવા. જોયથી પરોવેલા હોય તે ન લેવા.

રતનપોળના દરવાજામાં દાખલ થતાં સામે મધ્ય-લાગમાં શ્રી આહીંદરજી દાદાના સુખ મંહિરનાં દર્શન થાય છે, તે લોંઘતળીએથી ખાવન હાથ ઉંચુ છે, ૧૨૪૫ કુલોનાં મંગળ ચિનહ, ૨૧ સિંહાનાં વિજય ચિનહોથી શોભા રહ્યો છે. ચાર યોગિની અનેદશ દિક્ષપાલો, ઉર તોરણુ, ડર પૂતળીએ,

જર આધાર સ્તંભો, વગેરે શિવપ્યાખને અનુસાર ખંલાતના તેજપાદ સેનીએ અણક ધન ખર્ચી સંવત ૧૬૫૦માં સમરાંયું હતું, તારથી આ સંહિતનું નામ 'નંહિવર્ધન' રાખ વામાં આંયું છે.



નંહિવર્ધન પ્રાસાદ

આ સુખ્ય મંહિને! બાળભંગીએ ૧૨૧૩માં ચોહમો ઉદ્ધાર કરાવેલો, પછી પંદરમા તથા જ્ઞાળમાં ઉદ્ધારમાં આસ વિષે ઝેરકાર થયો નથી, વારંવાર રીપેર કરી થતાં રહ્યાં છે. મૂલ બાંધણી કાયમ છે.

ચોહમા ઉદ્ધાર વખતની મૂળનાયકની પ્રતિમા અનૌકિક અને ચમત્કારીક છે, પંદરમા ઉદ્ધાર વખતે મૂળનાયકજીની પ્રતિમાને ઉડાવવા પ્રયત્ન થયેલો પણ હાઢા ઉઠ્યા નહિ. એટલે તેજ પ્રતિમા કાયમ રાખવામાં રહ્યા.

શ્રી આતીથરળુ દાદાની અતુપમ ભવ્ય જર્યેતિર્મધી
ચમત્કારી મુર્તિના દર્શન કરતાં હૈયું નાચી ઉઠે છે, સંતાપો
બુલી જવાય છે, લાવનાઓ ખળવાન બને છે, ત્યાંથી અસ-
વાતું હીલ થતું નથી. જાણે આ જો દિવસ દાદાની જ્ઞાને જ
એસી રહીએ. અહીં ત્રીજું ચોચવંદન કરવું (ત્રણ પ્રદક્ષિણા
કર્યા ણાદ પણ ચોચવંદન કરાય)

ચારે તરફ દુદ્દર દેરીએ, ૨૬૧૩ પાષાણનાં પ્રતિમાળ,
૧૩૧ ધાતુનાં પ્રતિમાળ, ૧૪૦૦ લગભગ પગલાંની જેડી છે.
મંદિર પાસે કરોટાચારસ જર્દિત ચૌક છે. રથયાત્રાના વરદેઢા માટે
રથ, પાદઘારી, એરાવજુ હાથી-ગ દી વગેરે ચાંદીની સામગ્રી તેમજ
સુવર્ણ મેર વગેરે વસ્તુઓ રાખવામાં આવી છે.

શેડ નરસી કેશવળની દુંકેમાં (સગાળ પોળની અંદર)
મૃળનાયક શ્રી અનંતનાથ લગવાન તેમાં ૭૩૩ પાષાણનાં
પ્રતિમાળ, ૭૨ ધાતુના પ્રતિમાળ છે.

ત્રણ પ્રદક્ષિણા

દાદાના દેરાસરમાં ત્રણ પ્રદક્ષિણા કરવાથી અધી દેરીમાં
રહેલા પ્રતિમાળના દર્શન થાય છે; જીન દર્શન ચારિત્રની
પ્રાપ્તિ માટે ત્રણ પ્રદક્ષિણા હેવાય છે.

પહેલી પ્રદક્ષિણા:- દાદાના દર્શન કરી, રંગમંડપમાં
કરતાં જોખ લાયોમાં દર્શન કરી, જમણી બાળુથી ખાહાર
નીકળ એ કાચની દેરીમાં દર્શન કરી દાદાના મંદિર ઉપર જવાને
દાદદ હૈ. રંગ ઉપર ચાઢી અંદર તથા ખાહાર દર્શન કરી

નીચે આવી નીચેના ખાંચામાં દર્શિન કરી, દાદાના દહેરાસરની દક્ષિણ દિશામાં દરવાજ સામે સહસ્રકુટનું મંદિર છે.

સહસ્રકુટની અંદર ૧૦૨૪ શ્રી જિનપ્રતિમાંએ નીચે મુજબની હોય છે.

૨૪૦ પાંચ લરતક્ષેત્રો અને = ૧૦ ક્ષેત્રમાં

પાંચ ઐરવતક્ષેત્રો ૨૪-૨૪ વર્તમાનકાળના

૨૪૦ પાંચ લરતક્ષેત્રો અને = ૧૦ ક્ષેત્રમાં

પાંચ ઐરવતક્ષેત્રો ૨૪-૨૪ ગધ ચોવીસીના

૨૪૦ પાંચ લરતક્ષેત્રો અને = ૧૦ ક્ષેત્રમાં

પાંચ ઐરવતક્ષેત્રો ૨૪-૨૪ આવતી ચોવીસીના

૧૨૦ ચોવીસે તીર્થ્યંકર લગવંતના ૫-૫ કૃત્યાણુકોના

૧૬૦ પાંચ મહાવિદેહક્ષેત્રના ઉત્કૃષ્ટકાલના

૨૦ " " ૭ધન્ય કાળના

૪ શાખતા જિનના

કુલ ૧૦૨૪

સહસ્રકુટનાં દર્શિન કરી દાદાને કુરતાં દર્શિન કરતાં ઉત્તર દિશા તરફ ૧૪૫૨ ગણુધરનાં પગલાં આવે છે. તે ચોવીસે તીર્થ્યંકર લગવંતોના ગણુધરોના પગલાં છે તેનાં દર્શિન કરવાં.

તીર્થ્યંકર ગણુધરો તીર્થ્યંકર ગણુધરો તીર્થ્યંકર ગણુધરો

પહેલા	૮૪	ચોથા	૧૦૬	સાતમા	૬૫
-------	----	------	-----	-------	----

બીજા	૬૫	પાંચમા	૧૦૦	આડમા	૬૩
------	----	--------	-----	------	----

ત્રીજા	૧૦૨	છટ્ઠા	૧૦૭	નવમાં	૮૮
--------	-----	-------	-----	-------	----

દશમા	૮૧	પંદ્રમા	૪૩	વીસમા	૧૮
અગ્નિયારમા	૭૬	સોળમા	૩૬	એકવીસમા	૧૭
ભારમા	૬૬	સત્તરમા	૩૫	ખાવીસમાં	૧૧
તેરમા	૫૭	અટારમા	૩૩	તેવીસમા	૧૦
ચૌહમા	૫૦	ઓગણીસમા	૨૮	ચોવીસમા	૧૧

કુલ ૧૪૫૨

આગળ ચાલતાં શ્રી આદીશ્વરજીનું દેરાસર (જેને તેંબાં શ્રી સીમંધરસ્વામીજી કહે છે) તેના દર્શન કરવા, આ પહેલી પ્રદક્ષિણા થઈ.

અન્ન પ્રદક્ષિણા

નવા આદીશ્વર ભગવાન કે જે મૂળનાયકજીની નાસિકા વિજાળા પંડવાથી જ્યારે ખાડિત થઈ હતી ત્યારે તેમના સ્થાને પથરવા માટે આ નવા આદીશ્વર ભગવાન, કાઉસ-ગીયા, અને રાયણ પગલા નવાં ભરાવવામાં આવ્યા હતા. પણ દાઢાની મૂર્તિ ઉત્થાપવા જતાં ‘મા’ કરને અવાજ થયો અધિકાયકે રણ. ન આપી, ઉદ્ધાર સુધી નહિ ઉઠાવવાનું જગ્ણાય્યાયી દાઢાની પ્રતિમા કાયમ રાખવામાં આવી અને આ નવા આદીશ્વર ભગવાનની વસ્તુપાળના દર્શનસરમાં ગયા. જૈકામાં સુરતવાળા તારાચંદ સંધવાએ પ્રતિષ્ઠા કરાવી છે, એ દેરાસરથી બીજી પ્રદક્ષિણા થરુ કરવી. નવા શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કરી બહાર નીકળી સાંકડી ગલીમાં દર્શન કરતાં આરસના સુંદર મેરૂપર્વત ઉપર ચોમુખજીના દર્શન

કરી સમેતશીખરજીનાં દર્શન કરતાં રાયણવૃક્ષ પાસેથી નીકળી ગણુધર પગલાંની પાછળાંની બાજુથી દર્શન કરતાં સહાયકિણું પાર્વતીનાથનાં દર્શન કરી જાએ પત્થરનાં પગથિયાં ચડી શ્રી સીમાંધરના સ્વામી નામથી ઓળખાત મંહિરના શિખરમાં ચૌમુખજીના દર્શન કરી, મોટા ચૌમુખજીના ઉપર પણ દર્શન કરી, નીચે ઉત્તરી દેશીઓમાં દર્શન કરી ચોવીસે જિનેશ્વર ભગવંતની જાતાઓનો પુત્ર અહિતનો પર છે. ત્યાં દર્શન કરતાં બીજી પ્રદક્ષિણા પુરી થાય છે.

ત્રીજી પ્રદક્ષિણા

ત્રીજી પ્રદક્ષિણા શ્રી પુંડરીકસ્વામીજીના દેરાસરની આહારના લાગથી શ્રી આદીશ્વર લગવાનના દેરાસરથી શરૂ થાય છે, ત્યાં દર્શન કરી, દેરીઓમાં દર્શન કરતા શ્રી સુમિત્રાનાથ લગવાનનાં દેરાસરમાં દર્શન કરવાં, મોટી લમતીમાં દર્શન કરતાં કરતાં આગળ જાં વીસ વિહરમાનના દેરાસરમાં દર્શન કરવાં. તેમાં જલારામાં વીસ વિહરમાન છે અને રંગમંડપમાં ચોવીસ લગવાન છે. પછી આહાર નીકળી પાછળાં લાગમાં દર્શન કરી અણાપદજીનાં દર્શન કરી રાયણવૃક્ષને ગણું પ્રદક્ષિણા આપવી. રાયણ વૃક્ષનો મહિમા અપરંપાર છે.

રાયણ વૃક્ષનો મહિમા

આ રાયણ વૃક્ષ શાચિત છે, શ્રી આદીશ્વર લગવંતની પાહુકાથી શોલે છે. શ્રી ઋપલહેવ પ્રલુબુ અનેક વખત આ વૃક્ષ નીચે

સમવસરેલા છે, તેથી આ વૃક્ષ તીર્થથી પણ ઉત્તમ તીર્થની કેમ વંદન કરવા ચોગ્ય છે. દરેક પત્ર, ફળ અને શાખા ઉપર દેવતા-ઓના સ્થાનોં છે. માટે પ્રમાદથી પત્ર, ફળાહિ તોડવાં નહિ.

જેના ઉપર ફુઘની ધારા વર્ષે તેના આલોક અને પર-લોક સુખકારી થાય છે

સુવર્ણ, રત્ન કે મુક્તાઇણથી વંદનાપૂર્વક પૂજા કરવામાં આવે તો સ્વર્ગનમાં સર્વ શુભાશુલ કહી આપે છે. આતું પૂજન કરવાથી શાકીની, ભૂત, વેતાળ રાક્ષસાદ્ધિનો વળગાડ પણ ફર થઈ જાય છે. તેમજ કોઈ પ્રકારના તાવ વગેરે પણ આવતા નથી.

આ વૃક્ષનાં સ્વાભાવિક રીતની પડેલાં પત્ર-પુષ્પ કે શાખા લઈ આવી જીવની પેઠે સાચવી રાખવાં, એનાં જગતું સિંચન કરવાની સર્વ પ્રકારનાં અનિષ્ટો નાશ પામે છે.

આ વૃક્ષની પશ્ચિમ દિશા તરફ એક હુર્દાલ રસ કુંપિકા છે, એના રસના ગંધ માત્રથી લોઅંડ સુવર્ણ થઈ જાય છે. અકુમનો તપ કર્યો હોય અને દેવની પૂજા-નમસ્કાર આદ્ધિના ભાવવાળો હોય તેવો કોઈ વિરલ પુરુષ, રસ-કુંપિકા મેળવી શકે છે. જે આ રાયણવૃક્ષ પ્રસર હોય તો બીજુ કોઈ વસ્તુની જરૂર રહેતી નથી.

ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થાંકરો અને આ ચૈવિશીનાં તિર્થાંકરો અહીં આવેલા અને ભવિષ્યકાળમાં કે ને તીર્થાંકરો અહીં આવશે થશે; તે ખધા તેઓ ખધા અહીં સમવસરે છે.


રાયણ પાહુકાનાં દર્શન કરી ચોથું ચૈત્યવંદન કરવું.
તેની બાનુમાં સર્પ-મયુરની આકૃતિઓ છે, જે તીર્થની
સાનિધ્યમાં જાતિવૈરનો ત્યાગ કરી અનશન કર્યાનાં સૂચક છે.

ત્યાર પણી આગળના દેરાસરમાં નભિ, વિનભિ શ્રી
જુખલહેવ પાસે રાન્યની માગણી કરતા હોય તેવા દેખાવની
પ્રતિમાઓ જેડે ભરતેખર, તથા ખાહુખળીજી અને ખાલી
સુંદરી, 'વીરા મોરા ગજ થકી ઉતરો' ના દેખાવની મૂર્તિ છે,
ત્યાંથી આગળ ગોખલામાં વિજય શેડ અને વિજય શેડા-
ણીની મૂર્તિ છે (જેને જમાડવાથી ૮૪૦૦૦ મહાતમાઓને
સૂઝતો આહાર આપ્યા જેટલું ઇણ મળે છે). ચૌદરતન સમાન
ચૌદ પ્રતિમાજુના દેરાસરનાં દર્શન કરી ભમતીમાં દર્શન
કરતા કરતા શ્રી પુંડરીકસ્વામીજુના દેરાસરમાં આવવું,
ત્યાં દર્શન કરી પાંચમું ચૈત્યવંદન કરવું.

ચૈત્યવંદન પાંચ નીચે મુજબ પણ કરાય છે.

(૧) જ્યતલાટી, (૨) શ્રી શાંતિનાથ ભગવાન, (૩)
રાયણપાહુકા, (૪) શ્રી પુંડરીકસ્વામીજી અને (૫) શ્રી દાદાનું
એમ પાંચ ચૈત્યવંદનો સમજવાં, દરેક ચૈત્યવંદન-સ્તવન-થોય
વગેરે ચોથા વિલાગમાં આપવામાં આવેલ છે. સ્ત્રો જ્યા
તલાટીનાં ચૈત્યવંદન સાથે આપેલા છે, ત્યાંથી જેછ ને બધી
કેકાણું ચૈત્યવંદનો કરવાં.

હવે બાકીની દુંડોનું વર્ણન



હતુમાન ધારાથી નવટુંક તરફના રસ્તે જતાં થોડું ચઢતાં જમણી બાળુ એક હેરી છે, તેમાં ભીલડી મેઝે ગયેલી, તેનાં પગલાં સ્થાપન કરેલાં છે. આગળ ચઢતાં તલાટીથી એ માઇલને એ ઇલાંગે આડ દુંડોમાં જવાની બારી છે, તેમાં હાખલ થતાં ડાણી બાળુ અંગારશા પીર આવેલા છે.

મુસલમાન બાહશાહોની સૌરાષ્ટ્રની ચઢાઈએ શ્રી શનુંજ્ય ઉપર ન આવે તે માટે હીર્દદૃષ્ટિ આ કબર રાખવામાં આવેલી છે.

દંતકથા એવી છે કે શાહખુહીનગોરીના વખતમાં
અંગારશા નામના શીરમહમદ જેનું ખીણું નામ હીને હતું
તે થાણુદાર હતો, તેના મરણ પછી અવગતિ થવાથી તેના
આત્માની શાંતિ માટે તેની કષ્ટર કરવામાં આવેલી છે.

મુખ્ય તો તીર્થની રક્ષા માટે કષ્ટર કરવામાં આવી
હોય એમ લાગે છે. લોકો ત્યાં અનેક ભાધા માન્યતાઓ
કરી મિશ્યાત્વની અલિવૃદ્ધિ કરી રહેલા હોય છે, તે પ્રવૃત્તિ
ધર્ણીજ અનિચ્છનીય છે.

૧. ભરતર વસહિ

ચોમુખજીનો દુંકમાં જતાં સૌથી પહેલાં ભરતર
વસહિવની દુંક આવે છે. આ દુંકમાં પેસતાં જમણી
બાજુ શોઠ નરરી કેશવજીની દુંક છે. તેમાં સંવત ૧૬૨૧
માં પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે મૂળનાયક શ્રી અલિનંદન
લગવાન છે આનુભાનુ લમતી છે ઉપર ત્રણ ચોમુખજી છે
સામે વદલલ દુંડ છે આગળ જતાં વચ્ચમાં શ્રી શાંતિનાથ
લગવાનતું પ્રાચીન મંદિર છે, એ પછીનાં મંદિર ૧૬ મી
સહીમાં બંધાયેલાં છે, પ્રતિમાં પાણાણું ૩૬, ધાતુનાં ૨ છે.

૧ શ્રી શાંતિનાથ ૨ મરુદેવી માતા, ૩ શ્રી ચંદ્રપ્રલ-
સ્વામિ ૪ શ્રી ધર્મનાથ, ૫ શ્રી કુંઘનાથ, ૬ શ્રી અજિતનાથ
૭ શ્રી ચંદ્રપ્રલસ્વામિ, ૮ શ્રી ઋપલદેવજી ૯ ચૌમુખજી, ૧૦
શ્રી સુમતિનાથ, ૧૧ સંલવનાથ, ૧૨ શ્રી ઋપલદેવજી વગેરે
મંદિરા છે.

આરસના ૫૪ પ્રતિમાણ અને ધાતુના ૭ પ્રતિમાણ છે..

૨. ચોમુખલુ (સવાસોમલુ) ની કુંડ

આ કુંડનાં શીખરો રૂપ-ત્રણ માટેલ ફુરથી હેઠાય છે.

૨૭૯+૧૧૬ ક્રીટ લાંબા પહોળા ચોકનાં મધ્ય લાગમાં શ્રી આદીશ્વર લગવાનનો ચતુર્મુખ દર+પણ કુટનો લભ્ય પ્રાસાદ છે ૬૬ ક્રીટ ઉંચુ શીખર છે. શ્રી આદીશ્વર લગવાનની ચાર મનોહર લભ્ય મૂર્તિએ સિંહાસન ઉપર સ્થાપન કરેલી છે.

આ દહેરાસરમાં પ્રાય: ૪૮ લાખ રૂપીયાનો ખર્ચ બધો છે. અને ૪૮૦૦૦ રૂપીયાનાં તો માત્ર દોરડાં વપરાયા હતા એમ કહેવાય છે. એને ફુરતાં થીના દહેરાસરો દહેરીએ, પગલાં લમતીએ વગેરે છે.

૧ શ્રી જખસદેવનું મુખ્ય મંદિર, ૨ શ્રી પુંડરીકસ્વામિ ૩-૪ શ્રી શાંતિનાથ, ૫ શ્રી પાર્વનાથ, ૬ સીમાંધરસ્વામિ, ૭ શ્રી અજિતનાથ, ૮ શ્રી આદીશ્વરલુ, ૯ શ્રી શાંતિનાથ, ૧૦ શ્રી પાર્વનાથ, ૧૧ રાયણુ અને ગણુધરનાં પગલાં વગેરે વગેરે મંદિરો આવેલાં છે.

આ કુંડમાં ૫૪૮ આરસની પ્રતિમાળ અને પરધાતુના પ્રતિમાળએ છે.

ચોમુખલુની કુંડની પાછળની ખારી પાછળ પાંડોનું મંદિર, સહસ્રકુટ મંદિર તથા ૧૭૦ કિનેશ્વર અને ચૌહરાજ-લોકના પટો આરસમાં કોતરેલા છે.

૧૧૬૭ આરસનાં પ્રતિમાળએ છે.

સવા મોમાનો દ્રોગનો ધતિહાસ.

વણુથલી ગામમાં પ્રામાણિકતા, પ્રતિષ્ઠા અને શુલ નિધાના મુદ્રાલેખવાળા સવચંદ શોડ વેપાર કરતા હતા, શોડ-શાહુકારો બધા તેમને પોતાની ભીલકૃત આપતા અને જ્યારે જોઈએ ત્યારે પાછી મેળવતા.

એક ધ્યાયોએ વેપારીએ એક ગરાસદારના કાન ભંલેરી કહ્યું કે ‘સવચંદ શોડ જોટમાં છે, મારે તમારી મુડી પાછી મળી રહી !’

ગરાસદારે શોડ પાસે આવી પોતાની બંધી મુડી પાછી માગી, તે ટાઇમે પેઢીમાં એટલી રડમ રેઝડી ન હતી. વહાણો આવ્યા ન હતાં ઉઘરાણી પણ જલ્દી પતે એમ ન હતી, પ્રતિષ્ઠાનો સવાલ હતો, જે ના કહે તો આણડ જથ્ય એમ હતું, શોડને મુંજવણું થઈ, થાડીનાર વિચાર કરી અમદાવ દના પ્રતિષ્ઠિત સોમચંદશોડ ઉપર મોટી હુંડી લખી આપી, લખતાં લખતાં આંસુના એ ટીપા હુંડી ઉપર પડી ગયા, હુંડી ગરાસદારને આપી.

ગરાસદાર નામ પૂછતો સોમચંદ શોડને ત્યાં ગયો, શોડ બહાર ગયા હતા, મુનિમે હુંડી લીધી વાંચી, સવચંદશોડતું ખાતું શોધવા લાગ્યો, પણ ખાતું મદયું નહિ, એટલે ગરાસદારને કહ્યું કે શોડ આવે ત્યારે આવજો

ગરાસદારને શંકા પડી, લાખ હૃપીયાની હુંડી હતી. એ કલાક ફરીને પાછો આવ્યો સોમચંદ શોડ હુંડી હાથમાં લઈ

તપાસના લાગ્યા. ખાતાવહી તપાસરાની પણ સુનિમે કહું કે તેમનું ખાતું નથી.' સોમચંદ શેડની નજર હુંડી ઉપર પડેલા આંસુ ઉપર પડી. અક્ષરો પણ મુજબતા હાથે લખાવેલા હોય એમ લાગ્યું. શેડ બધી વાત સમજુ ગયા. શેડ પોતાને ખાતે રકમ લખીને હુંડીની રકમ ગરાસદારને આપી દીધી.

થોડા દિવસ પછી સોમચંદ શેડનું નામ લેતા કોઈ મહેમાન આવ્યા. શેડ આડતિયા ધારી પોતાના બેર લઈ ગયા, જેખે ગાડીમાંથી ઉત્તરાવી પટારામાં મુકાવ્યું. જરૂરા બાદ વાત નીકળતા શેડને કહું કે 'તમારા રૂપીયા વ્યાજ સાથે લઈ આતું ચુક્તે કરો.'

શેડને આશ્રમથ્ય થયું કે 'સેના રૂપીયા, સેની વાત, મહેમાને યાદી આપી હુંડીની વાત કરી, આપે હુંડી સ્વીકારી, મારી લાજ રાણી હતી.

સોમચંદશેડે કહું કે એ રૂપીયાનો જમે ખર્ચ નાખાઈ ગયો છે; સંકટમાં આવેલા સાધર્મિને સહાય કરવી તે મારી ફરજ હતી, માટે હવે તે રૂપીયા મારાથી લેવાય નહિ, સવચંદશેડે ખૂબ આશ્રહ કરવા લાગ્યા. બન્ને રૂપીયા લેવાની નાયા છે. હવે શું કરવું !

છેવટે નક્કી કરવામાં આવ્યું કે 'આ રકમમાં બીજી રકમ ઉમેરી શ્રી શાંતુજ્ય ઉપર મંહિર બંધવાવું.' શાંતુજ્ય ઉપર ઉચ્ચામાં ઉંચી દુંક બાંધવામાં આવી.

આ રીતે આ ચ્ચાબુખજીની દુંકનું નિર્માણ થયું, તેને સવા-સોમની દુંક કહેવાય છે.

૩ છીપાવક્ષી

આ દુંક લાવસાર લાઈએઓએ સંવત ૧૯૭૧ માં બંધાવી છે. મૂળનાયક શ્રી આદીશ્વર લગવાન છે. દુંકમાં ત્રણ મંહિરો. અને ૨૧ દેરીએ છે કુલ આરસનાં પર પ્રતિમાળુએ છે.

(૧) શ્રી ઋખલદેવ, (૨) શ્રી બ્રેયાંસનાથ, (૩) શ્રીનેમનાથ, (૪) શ્રી અજિતનાથ અને (૫) શ્રી શાંતિનાથ લગવાનની એ દેરીએ સામસામે હતી તે બન્ને દેરીએ નંહિષેણુસૂરીશ્વરણુએ અજિતશાંતિની રચના કરતાં સાથે આવી ગઈ છે. એમ કહેવાય છે અને (૬) શ્રી સુપાર્વનાથ એમ છ મંહિરો છે.

૪. સાકરવક્ષી

આ દુંક અમદાવાદવાળા શેઠ સાકરચંડ પ્રેમચંડ સંવત ૧૯૮૮માં બંધાવી છે. મૂળનાયક શ્રી ચિંતામણીપાર્વિનાથ મોટા પંચધાતુના છે. બન્ને બાળુએ સ્ક્રિક રત્નના સાથિયા છે. દુંકમાં આરસના ૧૭૨ પ્રતિમાળુએ અને ૫ ધાતુના પ્રતિમાળુએ છે.

અહીં ૧, શ્રી ચિંતામણીપાર્વિનાથ, ૨, શ્રી પુંડીકુસ્વામી ૩. શ્રી પદ્મપ્રલસ્વામિ. ૪ પાંડવોનુ મંહિર આ દુંકમા ગણુાય છે.

૫ નંદીશ્વર (ઉજભકૃદ્ધિ) ની દુંક

અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના કૃદ્ધ ઉજભકૃદ્ધિએ આ દુંક સંવત ૧૯૮૮માં બંધાવી છે. આમા નંહિશ્વરદ્વિપમાં આવેલા બાવન જિનાલયોની રચના કરવામાં આવી છે. ચારે બાળુ પથરમાં કારેલી જાળી બનાવેલી છે.

૧ શ્રી કુંઘનાથ અને ૨ શ્રી શાંતિનાથના એ મંહિરો
છે. કુંકમાં રજર આરસના પ્રતિમાળુઓ અને ૪ ધાતુના
પ્રતિમાળુઓ છે.

૬ હીમાલાઇની કુંક

અમદાવાદ નગરથેઠ હીમાલાઇનો આ કુંક સંવત ૧૮૮૨
માં બંધાવી હતી અને સંવત ૧૮૮૬માં પ્રતિષ્ઠા થયેલી,
મુખ્ય મંહિર ઉપર ગ્રણ શિખરા છે મુળનાથક શ્રી અનિત-
નાથ લગવાન છે. ૨ શ્રી પુંડરીકસ્વામિ, ૩-૪ ચૌમુખલુના
મંહિરો છે.

આ કુંકમાં ૩૧૬ આરસનાં પ્રતિમાળુઓ અને ૮
ધાતુના પ્રતિમાળુઓ છે.

૭ પ્રેમવક્તી (મોહી)ની કુંક

અમદાવાદના ધનાઢ્ય વેપારી મોહી પ્રેમચંદ લવળુ-
એ આ કુંક સંવત ૧૮૭૭ માં બંધાવી છે.

મોહી પ્રેમચંદ લવળુભાઈ સંઘ લઈને શ્રી સિદ્-
ગિરિજી આવ્યા હતા, શ્રી આદીશ્વર લગવંત આહિ કુંકનાં
દર્શાન કરી ખૂબ હુંબિંત થઈ ગયા અને એક સુંદર કુંક
અનાવવાની લાવના થઈ, તેથી સુંદર કુંક બંધાવી છે.
મૂલનાથક શ્રી આદીશ્વર લગવાન છે. સામે ૧-૨ શ્રી પુંડરીક-
સ્વામીલનું મંહિર છે.

૩-૪જમણી તથા ડાખી આનુ એ માળના શ્રી સહસ્રાંશુઃ
પાર્વિનાથનાં મંહિર આરસના બંધાવેલા છે. ઉપર ચૌમુખલુ
છે. નીચે બધા પ્રતિમાળુ પાર્વિનાથ લગવાનનાં છે. આખુની

કોરણી જેવા એ સુંદર ગોખલા કરાવેલા છે. આ ગોખલા સાસુ વહુના કહેવાય છે. છતમાં સાસુ વહુની કથા કોતરેલી છે. અને ભાવવહી શાલલાંજુકા પુતળીઓ છે.

૫- શ્રી અનજિતનાથ, ૬-૭ શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિરો છે. ઇરતો કિલ્લો છે.

આ દુંકમાં ૪૬૭ આરસના પ્રતિમાળુઓ અને ૭૩ ધાતુનાં પ્રતિમાળુઓ છે. ૧૪૫૨ ગણુધરનાં પગલાં છે.

નીચેના ભાગમાં કુંડ આવેલો છે. પગથિયાં પાસે શેઠની કુગઢેરી માતા લુની મૂર્તિ છે. માતાલુ બમતકારી ગણુધ છે.

કુંડ પાસે પોણોસો જેટલાં પગથિયાં ઉત્તરતાં ખડાં તમાં કોતરેલી વિશાળ શ્રી આદીધરલુ (અદભદ્ર) દાદાની મૂર્તિ છે ૧૮ કુટ ઊંચી અને. ૧૪॥ કુટ પહોળી છે. ધરમદાસ શેડે સંવત ૧૯૮૬ માં તેની છેદ્વી પ્રતિષ્ઠા કરાવી છે.

૮. ભાવાવસ્તીની દુંક

ઘોધાના દીપચંદસાઈ (હુલામણું નામ ભાવાલાઈ) એ આ દુંક સંવત :૧૯૮૬ માં બંધાવી છે. ૧-મૂળનાયક શ્રી આદીધર લગ્વાન છે, માણ ઉપર ચોમુખલુ વળેરે મૂર્તિઓ છે.

૨-પુંડરીકસ્વામીલુ, ૩-ચૌમુખલુ, ૪-શ્રી વાસુપૂજય સ્વામિ, ૫-શ્રી અનજિતનાથ અને ૬-શ્રી શાંતિનાથ લગ્વાનના મંદિરો છે.

આ દુંકમાં ૧૪૫ આરસનાં પ્રતિમાળુઓ અને ૧૩૨ ધાતુનાં પ્રતિમાળુઓ છે.

૬ મોતીશાની દુંક

મુંબદ્ધમાં મોતીચંહ શેડ વહાણવરાનો ધંધી કરતા હતા
ધીમે ધીમે આડ વહાણે પોતાના કર્યો.

એક વખત વહાણ ચીન તરફે જતું હતું તેમાં દાણું
ચોરીતું અદીણું છે એવો વહેમ સરકારને પડ્યો તેથી તે
વહાણ પુકડવા સ્ટીમરલોંચ મુકી, શેઠને આ વાનની ખખર
પડી, શેઠે સંકલ્પ કર્યો કે ‘જો વહાણ બચી જય તો તેની
કુલ આવક શ્રી શત્રુંજ્ય તીર્થ’ ઉપર ખરચી નાખવી.’

પુષ્ટયચોંગે વહાણ બચી ગયું. બાર તેર લાખ રૂપીયાની
આવક થઈ. એ રકમ શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપર ખરચવા
માટે નુદી કાઢી મુકી.

મોતીશાશેઠ શ્રી સિદ્ધગિરિજી આવ્યા. દુંક બંધાવવા
માટે જગ્યા કોઈ દેખાય નહિ. છેવટે શેઠની નેજર શ્રી મુળ
નાયકજી અને શ્રી ચૌમુખજીની દુંક વચ્ચે એક મોતી ખીણું
ઉપર પડી અને વિચારવા લાગ્યા કે ‘જો આ ખીણું પુરી
ફર્જી તો સુંદર દુંક બંધાવી શકાય.’ ખીણું એટલી બધી
ઢંડી હતી કે નીચે નજર કરતાં આંખે બંધારા આવી જય
શેઠે તો કોઈપણ રીતે ખીણું પુરીને તેના ઉપર મંહિર બંધા
વવાનો નિર્ણય કરી લીધી.

આતમૂહૂર્ત કરવામાં આવ્યું. દેશપરદેશથી મળુરો
બાલાબ્યા. ખીણું પુરવાતું કામ ધમદ્યોકાર ચાલવા લાગ્યું.
પાણીના એક હાંડાના ચાર આના આપીને પણ પાણી મંગા-
વવામાં આવ્યું હતું. ખીણું પુરાઈ ગઈ. તેના ઉપર વિમાન

આકારના સુંદર મંહિરો આને ઉભા છે. મંહિરોના ખાંધકામ એંશીહજારના તો હોરડા વપરાયા હતા.

દહેરાસરોની પ્રતિષ્ઠાના સુધૂરો નજી થયાં, પણ પ્રતિષ્ઠા કરાવ્યા પહેલાં જ શોઠ તો ૧૮૬૮ ના લાદરવા સુદ ૧ ના સ્વર્ગે સિધાવ્યા.

તેમની ભલામણુ મુજબ સોરઠનો સંઘ સંવત ૧૮૬૮ ના પોષ વહી એકમના પાલીતાણુ આવ્યો. સંઘમાં એક હજાર સંઘવીઓ અને સવાલાખ જેટલા યાત્રાળુઓ હતા. બધી વ્યવસ્થા શોઠના મિત્ર અમરચંહ હમણી અને કુલચંહ કસ્તુરચંહ સારી રીતે કરતા હતા.

અધાર દિવસ જાપે ચોખા સુકાયા હતા. રોજના જમણુનો અદ્યતે વણતે ચાવીસહજાર રૂપીયા આવતો હતો. પ્રતિષ્ઠા સંવત ૧૮૬૮ ના મહા વફર ના દિવસે શોઠના પુત્ર ઝીમચંહ લાઈએ કરી હતી.

મંહિરોની રચના

શેઠ મોતીશાની કુંકની રચના નલિનીશુદ્ધમ, વિમાનના આકારે છે. તેના ઇરતો ચાર કોડાવાળો સુંદર કોટ છે. સુખ્ય મંહિરમાં શ્રી આહીશ્વરજી લગ્નવાનની મનોહર મૂર્તિ છે, ઉપરના લાગમાં, બીજે અને ત્રીજે માળે ચોમુખજી પધરાવેલા છે. સામી બાજુ શ્રી પુંડરીકસ્વામીલાલું મંહીર છે. અને બાજુ એ માળના મંહિર છે. સુખ્ય મંહિરને ઇરતાં નાના મોટા મંહિર તથા મોટી ભમતીમાં દેરીએ આવેલી છે, બાંધણી બધી પદ્મતીસરની મનોહર છે.

આણી દુંકમાં કુલ ૧૬ મંહિરો અને ૧૨૩ દેરીઓ છે.

૧-શ્રી પુંડીકસ્વામી, ૨-૩ શ્રી ધર્મનાથ, ૪-૫
ચોમુખજી ૬-શ્રી ઋષલનાથ, ૭-ચોમુખજી. ૮-શ્રી આગ્ની-
ધર્મજી, ૯-શ્રી પદ્મપ્રલસ્વામી ૧૦-શ્રી પાંચનાથ, ૧૧-ગણ-
ધર પગલાં ૧૨-સહસ્રકૃટ, ૧૩ શ્રી સંલગ્નનાથજી ૧૪-શ્રી
સુપાર્થનાથ, ૧૫-શ્રી મહાવીરસ્વામીજી કુલ ૧૬ મંહિરો છે.

બહારના ભાગમાં એક મોટો દુંડ છે કુંડ ઉપર દુંડા-
સર દેવીની મૂર્તિ છે, સામી બાળુથી પંચશીખરી અને ત્રણ
શીખરી (જે રામપોળની અંદર સામી બાળુ આવેલાં છે,)
મંહિરમાં જવાય છે અને ઠાહાર આવી દાઢાની દુંકમાં જવાય છે.

આણી દુંકમાં રજરર આરસની પ્રતિમાણુઓ, ૧૪૩
ધાતુની પ્રતિમાણુઓ અને ૧૪૫૭ પગલાંની જેડ છે.

નવે દુંકમાં થઈ ત્રણ હજાર મંહિરો, ૧૦૬ મંહિરો
૭૩૧ દેરીઓ આશરે ૧૧૨૪૦ આરસના પ્રતિમાણુઓ અને
૭૧૧ ધાતુના પ્રતિમાણુઓ છે. તથા ૮૬૬૧ પગલાં. છે.

શત્રુંજય ગિરિજાજ જયતલાટીથી દાઢાની દુંક અડી
માધ્યંકે છે. આખા ગિરિજાજ ઉપર લગલગ સંવત ૨૦૦૬માં
પગથિયા બાંધવામાં આવ્યાં છે.



(૬) પ્રતિમાઓના વિપુલતા।

શત્રુંજય તીર્થ એટલે હેવનગરી, પ્રતિમાઓની વસ્તી
અને જૈનોનું સ્વર્ગ જૈન મંહિરોની આવી લરચક વસ્તાડત

અન્યત્ર નથી જ. જેના એક ચોકમાં પચાસ હજાર નાની મોટી) અતીમાચ્છો છે. એક એક પ્રતિમાના દર્શન પાછળ અને તેની સાનિધ્યમાં વિધિસિર તણું અમાસમણું અને એક નવકાર મંત્ર લખુટાં એક એક મીનિટ ગણીએ તો કેટલા દિવસ થાય ? અને આપણી લોકપરંપરા મુજબ દરેક સ્થળે વધુ નહિ, તો એકએક નયા પૈસાની લેટ ધરીએ તો કેટલા ઝપિયા થાય ? એ પચાસ હજાર નયા પૈસાનું વળન ૧૬૫ રતલ થાય અને એ પૈસાં ભરેલો શેલો ઉચ્કવા એક મળુર પણ સાથે જોઈએ જ, આ તો એક વિશાળ ચોકની વાત થઈ. પણ આના કેટલાય ચોક ધરાવતા શત્રુંજયના તીર્થસ્થાનનો કયામ કરવો એ સંસારીઓ માટે ખૂણ જ કઠીન કાર્ય છે.

શત્રુંજય ગિરિરાજ કોઈલાં રેખમ હાથીની જેમ ઉત્તર દક્ષિણ લંખાઈને અડીખમ ઉલો છે. એનું શિખર મંદિરાની ખીચાખીય વસાહતોથી કોઈ કલાતમક અંખાડી જેવું શોલે છે. એણે અંકમાં ધારણું કરેલી ખીણેં પણ મંદિરાથી ભરપુર છે. આખોય શત્રુંજય શ્વેતાંભર સંપ્રદાયના અનેક ગચ્છના તેજસ્વી વાવરા ફરકાવે છે.

શત્રુંજય ધામની તીર્થપૂજા માટે સિદ્ધરાજ જયસિંહે બાર ગામનું શાસન કરી આપ્યું, ત્યાંથી લઈને અમદાવાદના નગરશેઠ શ્રી. હેમાલાઇની દૂંક અંધાઈ ત્યાં સુધીની તવારીખ તપાસતાં જૈનોએ અસાધારણું ધર્મ રૂપર્થા કરી કરોડો ઝપિયા ખર્ચી શત્રુંજયનું અલૌકિક નિર્માણ કર્યું છે. પણ આ અધારમાં અમદાવાદે એક શાનદાર ધર્તિહાસ

સર્જાવ્યો છે. શત્રુજયની હસ ટૂડેમાં અર્થલાગની તો અમદાવાદના જ શ્રીમતોએ વચ્ચાવી છે.

શ્રી. શાન્તીદાસ શેડને હૃજરી સન ૧૦૭૦ના રજબ
માસની ૧૦ મી. તારીખે ઔરંગજેબ પાસેથી એક ફરમાન
અણ્યું એમાં શ્રી. શાન્તીદાસની કદરદાની કરવામાં આવી
હતી. અને તે માટે શત્રુજય, જુનાગઢ નાણુકનો ગિરનાર
અને શિરોહી રાજનો આણુ એમ ત્રણે પણાડ લેટ આપ-
વામાં આવ્યા હતા. પર્વતોપર થતા ધાસચારા, સાગ, બળ-
તણુ, પણ આવક ડેમને અપણું કરવામાં આવ્યાં હતાં. આ
ફરમાનમાં અમદાવાડને તેના અમલ માટે ખાસ તાકીદ
કરવામાં આવી હતી. અન્ય રાજાઓ શ્રી. શાન્તીદાસને સાંતાપે
નહિ બદકે તેમને સહાયભૂત થઈને પોતાની કૃપા મેળવે તેની
ખાસ નોંધ પણ છે. ઉપરાંત તે વખતે દરવર્ષે જમીન
બાળીરની સનદ તાળુ કરાવવી પડતી હતી તે નહિ કરવાનો
પણ તેમાં ઉદ્વેખ છે. છેવટે ફરમાનમાં લાણ્યું છે કે, “કે
કોઈ પ્રાંત અને પણાડ અમે (શ્રી. શાન્તીદાસને) સોખ્યો
છે” તે માટે કોઈ હાવો કે આકમણું કરશે તો તે લોકોની
અદૃદુખ અને અસ્વાહની લ્યાનતને પાત્ર હરશે”

(ગુજરાત સમાચાર માંથી)

વિમાગ ત્રીજો

(૧) નવાળું યાત્રાની વિધિ

નવાળું યાત્રા કરનારે નીચે લગેલા પાંચ સ્થળો દરરોજ
ચૈત્યવંહન કરવાં જોઈએ

(૧) ૧. ગિરિજાજ સન્મુખ તળેટીએ. ૨. શ્રી શાંતિનાથ
ભગવાનના દેરાસરે, ૩. શ્રી રાયણ-પગલાએ, ૪. શ્રી પુંડ-
રીકટ્વામીના દેરાસરે, ૫. મૃગનાયક શ્રી આદીશ્વર ભગવા-
નના દેરાસરે તથા એકેક વખતે આ પાંચે સ્થાને સ્નાત
ભણ્ણાવવું જોઈએ.

(૨) નવાળું કરનારે દરરોજ ૧૦ ખાંધી નવકારવાળી
ગણ્યવી. એટલે નવાળું પૂર્ણ થતાં એક લાખ નવકાર પૂર્ણ થાય.

(૩) નવાળું યાત્રા કરનાર મનુષ્યે હમેશાં એ વખત
પ્રતિક્રમણ સચિત્તયાગ અન્ધાર્યાંતું પાલન અને શક્તિ
હોય તો એકાસાણું કરવું, ભૂમિએ સંથારો કરવો, પરે
આદીને જગત કરવી

(૪) ૬૬ યાત્રાએ ગિરિજાજની કરવી. ઉપરાંત ભીલ
બેઠાગની નવ મળી કુચ ૧૦૮ યાત્રાએ કરવી.

(૫) યથાશક્તિ રથયાત્રાનો વરધાડો ચઢાવવો. નવાળું
પ્રકારી પૂજા ભણ્ણાવવી તથા આંગી રચાવવી.

(૬) હંમેશાં ત્રણ પ્રદક્ષિણા તથા એકવાર દાદાળુના
માદિશને કરતી ૧૦૮ પ્રદક્ષિણા હેવી.

(૭) હમેશાં નવ સાથીએ તથા નવ દ્રો તથા નવ નૈવદ્ય
મૂકુવા.

(૮) 'શ્રી શત્રુંજ્યતીર્થ' આરાધનાર્થ કરેમિ કાઉસસગાં
કહી નવ લોગસસનો કાઉસસગ દરરોજ કરવો.

(૯) હમેશા યથાશક્તિ અષ્ટપ્રકારી પૂજા કરવી.

(૧૦) એક વખત ૧૦૮ લોગસસનો કાઉસસગ કરવો.

(૧૧) શક્તિ હોય તો ચડવિહારો છઠુ કરીને સાત.
જાગા કરવી. (સાંજ જાગા કરનાર ત્રીજા લવે મોદ્દો જાય છે.)
પુંડ્રીકળુણું ધ્યાન કરવું, ઘેરીની પાગે, રોહી-શાળાની
પાગે, અને શત્રુંલ નહીની પાગેથી એકવાર તો અવસ્થ
જાગા કરવી તથા બાર ગાઉ, છ ગાઉ ને હોઠ ગાઉની પ્રહ-
ક્ષિણા કરવી. આ રીતે બધી મળી કુલ ૧૦૮ જાગાએ કરવી.

(૧૨) નવ વખત નવદુંકનાં દર્શન કરવાં, નવદુંકમાં
દરેક કુંકના મૂલગાયકની પાસે ચોથ્યવંદન કરવું.

(૧૩) એકવાર ગિરિરાજની પૂજા (તળાટીથી માંડીને
રામપોળની આરી સુધી ને કે પગલાં, પ્રતિમાળાએ છે,
તેની પૂજા કરવી, દુંગર પૂજા કરવી, ધોવરાવવો. જેથી કાંઈ
આશાતના થઈ હોય તો તેનું નિવારણું થઈ જાય.

(૧૪) દરરોજ નવ ખમાસમણાં આ રીતે હુણ બોલીને
દેવાં.

સિદ્ધાચલ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર,
મતુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હળર; ૧
સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢગિરનાર;
શત્રુંલ નહી નાહ્યો નહિ; એનો એળો ગચ્છો અવતાર ૨.

શેતુંણ નહીમાં માહીને, સુખ બાંધી સુખ કોશ,
 હેવ યુગાદિ પૂજાએ, આણી મન સંતોષ ૩
 એકેકુ ડગલું લરે, શેતુંણ સમેચ જેહ,
 ઝખલ કહે લવ કોડનાં, કર્મ અપાવે તોષ; ૪
 શેતુંણ સમેચ તીરથ નહિં, ઝખલ સમેચ નહિ હેવ;
 ગૌતમ સરિખા શુદુ નહિ, વળી વળી વંદુ તેહ; ૫
 જગમાં તીરથ હો વડા. શત્રુંજય ગિરનાર;
 એક ગઠ ઝખલ સમેચસ્યાં, એક ગઠ નેમકુમાર ૬
 સિદ્ધાચલ સિદ્ધિ વધ્યાં, સુનિવર કોડ અનંત;
 આગે અનંતા સિદ્ધશૈ; પૂલે લવી ભગવંત ૭
 શત્રુંજયગિરિ-મંડણો; મરુદેવાનો નંદ;
 યુગલાધર્મ નિવારણો, નમો યુગાદિ જિણુંદ; ૮
 તન મન ધન સુત વહ્નિભા; સ્વગીધિ સુખ લોચ;
 વળી વળી એ ગિરિ વંહતા, શિવરમણિ સંઘોગ. ૯

(૨) નવાળું યાત્રાનું ગણુણું

આ તીર્થનાં નવાળું નામે છે. તેની રોજ એક એક
નામની એક છુટી નવકારવાળી ગણુણી.

હિંસ	ગણુણું	હિંસ	ગણુણું
નમઃ		નમઃ	
૧ „ બાહુભળી	„	૧૬ „ પુષ્પરાશી	„
૩ „ મર્દેવી	„	૨૦ „ મહાઘળ	„
૪ „ પુંડ્રીક	„	૨૧ „ દલ્શાક્તિ	„
૫ „ રૈવત	„	૨૨ „ શતપત્ર	„
૬ „ વિમલ	„	૨૩ „ વિજયાનંદ	„
૭ „ સિદ્ધરાજ	„	૨૪ „ લદ્રંકર	„
૮ „ અગ્રિરથ	„	૨૫ „ મહાપીડ	„
૯ „ સિદ્ધકૃત	„	૨૬ „ સુર	„
૧૦ „ સહસ્રકલ્પ	„	૨૭ „ મહા	„
૧૧ „ સુક્રિતનિલય	„	૨૮ „ મહાનંદ	„
૧૨ „ સિદ્ધાચળ	„	૨૯ „ કર્મસૂહણ	„
૧૩ „ શતકુટ	„	૩૦ „ કૈલાસ	„
૧૪ „ દક્ષ	„	૩૧ „ પુણ્યદંત	„
૧૫ „ કદંબ	„	૩૨ „ જ્યાંત	„
૧૬ „ કોડિનિવાસ	„	૩૩ „ આનંદ	„
૧૭ „ લોહિત્ય	„	૩૪ શ્રીપદ ગિરિવરાય નમઃ	

૩૫ શ્રી હસ્ત ગિરિવિરાય

નમઃ

૩૬ ,,"	શાખેત	"
૩૭ ,,"	ભાવ્ય	"
૩૮ ,,"	સિદ્ધશેખર	"
૩૯ ,,"	મહાજશ	"
૪૦ ,,"	માલ્યવંત	"
૪૧ ,,"	પૃથ્વીપીઠ	"
૪૨ ,,"	હુઃખુર	"
૪૩ ,,"	સુક્રિતરાજ	"
૪૪ ,,"	મણ્ણુકાંત	"
૪૫ ,,"	મહિધર	"
૪૬ ,,"	કંચન	"
૪૭ ,,"	આનંધર	"
૪૮ ,,"	પુષ્ટયકંદ	"
૪૯ ,,"	જ્યાનંદ	"
૫૦ ,,"	પાતાળ મૂળ	"
૫૧ ,,"	વિલાસ	"
૫૨ ,,"	વિશાળ	"
૫૩ ,,"	જગતારણુ	"
૫૪ ,,"	અકુલંક	"
૫૫ ,,"	અકમ્ભક	"
૫૬ ,,"	મહાતીર્થ	"
૫૭ ,,"	હેમ	"

પદ શ્રી અનંતશક્તિ

ગિરિવિરાય નમઃ

૫૮ ,,"	પુરુષોત્તમ	"
૬૦ ,,"	પર્વતરાજ	"
૬૧ ,,"	જ્યોતિર્ણ	"
૬૨ ,,"	વિલાસલદ	"
૬૩ ,,"	સુલદ	"
૬૪ ,,"	અજરામર	"
૬૫ ,,"	ક્ષેમંકર	"
૬૬ ,,"	અમરકેતુ	"
૬૭ ,,"	શ્રીગુણુકંદ	"
૬૮ ,,"	સહુસ્રપત્ર	"
૬૯ ,,"	શિવંકર	"
૭૦ ,,"	કર્મક્ષય	"
૭૧ ,,"	તમેંકંદ	"
૭૨ ,,"	રાજરાજેશ્વર	"
૭૩ ,,"	ભવતારણુ	"
૭૪ ,,"	ગજચંદ્ર	"
૭૫ ,,"	મહોદ્ય	"
૭૬ ,,"	સુરકાંત	"
૭૭ ,,"	અચળી	"
૭૮ ,,"	અલિનંદન	"
૭૯ ,,"	સુમતિ	"
૮૦ ,,"	શ્રેણી	"

૬૧ શ્રી અલયકંહ ગિરિવિરાય

નમઃ

૬૨,, ઉજ્વ

,,

૬૩,, મહાપત્ર

,,

૬૪,, શ્રીવિશ્વાનંદ

,,

૬૫,, વિજયલદુ

,,

૬૬,, ધન્દ્રપ્રકાશ

,,

૬૭,, કૃપહિવાસ

,,

૬૮,, મુજિત નિકેતન

,,

૬૯,, કુવળાદાયક

,,

૭૦,, ચર્ચ

,,

૬૧ શ્રી અષ્ટોત્તરશતકુટ

ગિરિવિરાય નમઃ

૬૨,, સૌન્દર્ય

,,

૬૩,, યશોધર

,,

૬૪,, પ્રિતિમંડન

,,

૬૫,, કામહાયી

,,

૬૬,, સહજાનંદ

,,

૬૭,, મહેન્દ્રધ્વજ

,,

૬૮,, સર્વાર્થસિદ્ધ

,,

૬૯,, પ્રિયંકર

,,



(3) સિદ્ધગિરિજીના છહુ—અહુમ તપની વિધિ

આ તપમાં પહેલો તથા છેલ્દો અહુમ કરવો અને વચ્ચે સાત છહુ કરવા, આ રીતે વીશ ઉપવાસ તથા નવ પારણા મળી કુલ ૨૬ દિવસે તપ પૂર્ણ થાય છે. સાથીએ વગેરે ૨૧-૨૧ કરવા નવકારવાળી વીશ નીચે પ્રમાણે ગણુવી.

૧ અહુમમાં—શ્રી પુંડરીક ગણુધરાય નમઃ ॥

૨ છહુમાં—શ્રી ઋષલદૈવસર્વજાય નમઃ ॥

૩,, શ્રી વિમલગણુધરાય નમઃ ॥ ॥

૪,, શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ ॥

૫,, શ્રી હરિગણુધરાય નમઃ ॥

૬ , શ્રી બાહુભલિનાથાય નમઃ ..

૭ , શ્રી સહસ્રાદ્ધિગણધરાય નમઃ

૮ , શ્રી સહસ્રક્રમલકાય નમઃ .

૯ અહુમાં શ્રી ડેડીગણધરાય નમઃ ..

અથવા ખીલુ રીતે આ મુજબ ૨૦ નવકારવાળો ગણવી—

૧ બન્ને અહુમે શ્રી સિદ્ધાદ્ધિશ્રુંજ્ય સિદ્ધગિરિવરાય નમઃ

૨ છકુમાં શ્રી આદીશ્વરપરમેષ્ઠિને નમઃ ..

૩ , શ્રી આદીશ્વરાર્થાતે નમઃ ..

૪ , શ્રી આદીશ્વરનાથાય નમઃ .

૫ ,, શ્રી આદીશ્વરસર્વજ્ઞાય નમઃ .

૬ ,, શ્રી આદીશ્વરપારંગતાય નમઃ ..

૭ ,, શ્રી શત્રુંજ્યસિદ્ધક્ષેત્રપુંડ્રીકાય નમઃ ..

૮ ,, શ્રી સિદ્ધક્ષેત્રપુંડ્રીકિર્તિમલગિરયે નમઃ ..

અથવા શ્રી શત્રુંજ્યપર્વતાય નમઃ ..

આ જાપ હુંમેશા ૨૦ નવકારવાળીથી કરવો.

(૪) ૨૧ અમાસમાણું આ પ્રમાણે દેવાં—

૧ શ્રી શત્રુંજ્યપર્વતાય નમઃ ..

૨ ,, પુંડ્રીકપર્વતાય નમઃ ..

૩ ,, સિદ્ધક્ષેત્રપર્વતાય નમઃ .

૪ ,, વિમલાચરણાય નમઃ ..

૫ ,, સુરગિરયે નમઃ ..

૬ ,, મહાગિરયે નમઃ ..

૭ ,, પુષ્યરાશયે નમઃ ..

૮ ,, પર્વતાય નમઃ ..

- ૯ „ પર્વતેન્દ્રાય નમઃ ..
 ૧૦ „ મહાતીર્થાય નમઃ ..
 ૧૧ „ સારસ્વતાય નમઃ ..
 ૧૨ „ દશક્તિપર્વતાય નમ ..
 ૧૩ „ સુક્તિનિલયાય નમઃ ..
 ૧૪ „ પુષ્પદંતાય નમઃ ..
 ૧૫ „ મહાપદ્માય નમઃ ..
 ૧૬ „ પૃથ્વીપીડાય નમ ..
 ૧૭ „ સુલદગિરિપર્વતાય નમઃ ..
 ૧૮ „ કેલાસગિરિપર્વતાય નમઃ ..
 ૧૯ „ પાતાલમૂલાય નમઃ ..
 ૨૦ „ અક્રમકાય નમઃ ..
 ૨૧ „ સર્વકામપૂરણાય નમઃ ..

પારણે નવાણું પ્રકારી પૂજા ભણુંનાં, તપમાં એકાશનાં
 કરવા, યાગાંશે કરવી, સુપાત્ર લક્ષ્મિ-સાધર્મિક લક્ષ્મિ આંદિ
 કરવી.

૨૧ અમાસમણુના દુહા.

- સિદ્ધાચલ સમર્ન સદા સોરડ દેશ મોઝાર,
 મનુષ્ય જન્મ પાસી કરી, વંદુ વાર હળાર, ૧
 અંગ વસન મન ભૂમિકા, પૂનેપગરણ સાર;
 ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધ સાત પ્રકાર. ૨
 કાર્તિક સુહિ પુનમ હિને, દશ કોટિ પરિવાર,
 દ્રાવિડ વારિભિલભુ, સિધ્ય થયા નિરધાર. ૩
 તેણે કારણુ કાર્તિકી હિને, સંઘ સયલ પરિવાર;
 આદિજિન જનમુખ રહી, અમાસમણુ બહુ વાર. ૪

એકવીશ નામે વરણુંથો, તિહાં પહેલું અલિધાન;
શાનુંજય શુકરાયથી, જનક વચન વહુમાન. ૫
સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઆર
મનુષ્ય જનમ પામી કરી, વંદુ વાર હજર. (૧)
આ હુંડા પ્રત્યેક અમાસમણુના હુંડા બોલ્યા ખાદ બોલવો
અને પછી અમાસમણુ હેવું.

સમોસર્યા સિદ્ધાચલે, પુંડરીક ગણુધાર;
લાખ સવા માહાતમ કલું, સુર નર સલા મોઆર. ૬

શૈત્રી પુનમ હિને કરી, અણુસણ એક માસ.
પાંચ કોડિ મુનિ સાથશું મુક્તિનિલયમાં વાસ. ૭

તિણે કારણ પુંડરીકગિરિ, નાથ થયું વિખ્યાત;
મન વચન કાચે વંદિયે; ઉઠી નિલ્ય પ્રલાત.

સિદ્ધાચલ૦ ૮ (૨)

વીશ ડોડીશું પાંડવા; મોક્ષ ગયા ધણે ઠામ;
એમ અનંત મુક્તે ગયા; સિદ્ધક્ષેત્ર તિણે નામ સિદ્ધા૦ ૯ (૩)
અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ધરી એક,
તુંધીજલ સ્નાને કરી, જગ્યો ચિત્ત વિવેક; ૧૦
ચંદ્રશોખર રાજ પ્રમુખ, કર્મકઠિન મલધામ;
અચલ પડે વિમલા થયા, તેણે વિમલગિરિ નામ.

સિદ્ધાચલ૦ ૧૧ (૪)

ધર્મતમાં સુરગિરિ વડો, જિન અલિંષેક કરાય;
સિદ્ધ હુચા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨
ભરતાદિ ઘૌટ ક્ષેત્રમાં, એ સમો તીરથ ન એક;
તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવસુ અનેક.

સિદ્ધાચલ૦ ૧૩ (૫)

૧૪૬

એંસી યોજન પૂરુલ છે, ઉંચપણે છુંવીશ;
મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ.

સિદ્ધાચલ૦ ૧૪ (૬)

ગણુધર શુણુવાંતા મુનિ, વિશ્વમાણે વંદનિક.
જેહવો તેહવો સંયમી, વિમલાચલે પૂજનિક. ૧૫
વિપ્રલોક વિષધર સમા, હુંમીયા ભૂતલ માન;
દ્રવ્યલિંગી કણુ ક્ષેત્ર સમ, મુનિવર છીય સમાન. ૧૬
આવક મેઘ સમા કદ્યા, કરતા પુષ્યનું કામ;
પુષ્યની રાશિ વધે ધણી, તિણે પુષ્યરાશિ નામ.

સિદ્ધાચલ૦ ૧૭

સંયમધર મુનિવર ધણા, તપ તપતા એક ધ્યાન;
કર્મ વિયોગ પામીયા, ડેવલ લક્ષમી નિધાન. ૧૮
લાખ એકાણું શિવ વર્યા. નારદશું અણુગાર;
નામ નમો તિણે આડમું, શ્રીપદગિરિ નિરધાર.

સિદ્ધાચલ૦ ૧૯ (૮)

શ્રી સીમંધર સ્વામીએ એ ગિરિ મહિમા વિવાસ,
ઈદ્રની આગે વર્ણિયો, તિણે એ ઈંદ્રપ્રકાશ

સિદ્ધાચલ૦ ૨૦ (૯)

દથ કેટી અણુપતધરા, લક્તે જમાડે સાર;
જૈન તીર્થ યાત્રા કરે, લાલતણો નહીં પાર. ૨૧
તેહ થડી સિદ્ધાચલે, એક મુનિને દાન;
દેતાં લાલ ધણો હુને, મહાતીરથ અલિમાન.

સિદ્ધાચલ૦ ૨૨ (૧૦)

પ્રાચે એ ગિરિ શાંકતો, રહેશે ધાલ અનંત;
શત્રુંજ્ય મહાતમ સુણ્ણી, નમો શાંકતગિરિ સંત.

સિદ્ધાચલ૦ ૨૩ (૧૧)

ગૌ નારી બાલક મુનિ, અઉ હૃત્યા કરનાર;
યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાય લગાર. ૨૪
જે પરદારા લંઘી, ચોરીના કરનાર;
દેવદ્રવ્ય-ગુરુદ્રવ્યના, જે વળી ચોરણુંહાર. ૨૪
ચૈત્રી કાર્તિકી પૂજાને, કરે યાત્રા દણે હામ;
તપ્ય તપતાં પાતિક ગળે, તિણે દદ્દશાંસિનામ.

સિદ્ધાચલ૦ ૨૬ (૧૨)

ભવભય પામી નીકાર્યા, થાન્ચયાસુત જેણ;
સહસ મુનિશુ શિવ વર્યા. સુક્રિતનિલયગિરિ તેણ

સિદ્ધાચલ૦ ૨૭ (૧૩)

ચંદ્ર સૂરજ ષિદું જણ્ણા ઉલા દણે ગિરિ શૃંગ;
વધાવિયો વર્ણન કરી, પુંયદંતગિરિ રંગ.

સિદ્ધાચલ૦ ૨૮ (૧૪)

કર્મકલણુ ભવજલ તણુ ધહાં પામ્યા શિવ સર્જા;
આણ્ણી પદ્મ નિરંજની, વંદો ગિરિ મહાપદ્મ

સિદ્ધાચલ૦ ૨૯ (૧૫)

શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચિયો સાર;
મુનિવર વર બેડક આણ્ણી, પૃથ્વીપીઠ મનોહાર.

સિદ્ધાચલ૦ ૩૦ (૧૬)

શ્રી સુલદ્રગિરિ નમો, લદ્ર તે મંગલ ઇય;
જલ તરુ ૨૯ ગિરિસ્વર તાણ્ણી શિષ ચડાવે ભૂય.

સિદ્ધાચલ૦ ૩૧ (૧૭)

વિદ્યાધર સુર અપચ્છરા, નહી શેનું જુ વિલાસ;
 કરતા હૃતા પાપને, લળ્યે ભરી કૈલાસ. સિદ્ધાંત ૩૨ (૧૮)
 થીજા નિર્વાણી પ્રલુ, ગઠ ચાવીશી મોઝાર;
 તસ ગણુધર મુનિમાં વડા, નામે કઢણ અનગાર, (૩૩)
 પ્રલુ વચ્ચને આણુસણુ કરી, મુક્તિ પુરીમાં વાસ;
 નામે કદમ્બગિરિ નમો, તો હોથ લીલ વિલાસ.

સિદ્ધાચલ૦ ૩૪ (૧૯)

પાતાલે જસ મૂલ છે. ઉકળવલગિરિનું સાર;
 ત્રિકરણ ચોગે વંહતા, અદ્ય હોયે સંસાર.

સિદ્ધાચલ૦ ૩૫ (૨૦)

તન-મન ધન સુત વદ્વલા, સ્વગૌદિક સુખ લોગ;
 જે વાંછે તે સંપને; શિવરમણી સંઘોગ. ૩૬
 વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ધર માસ;
 તેજ અપૂરવ વિસ્તરે, પૂરે (પૂરો) સધણી આશ. ૩૭
 ત્રીજે લવ લિદ્ધિ લહે, એ પણ આયિક વાચ;
 ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમુહૂર્ત સાચ; ૩૮
 સ્વર્વ કામહાયક નમો, નામ-કરી ઓળખાણ;
 શ્રી શુભનીરવિજય પ્રલુ, નમતા કોડ કલ્યાણ.

સિદ્ધાચલ૦ ૩૯ (૨૧)

(૫) ૧૦૮ ખમાસમણાના દુહા

શ્રી આહીંદુર અજર અમર, અવ્યાખાય અહેનિથ;
 પરમાત્મ પરમેશ્વર પ્રણુમું પરમ મુનીથ. ૧
 જય જય જગપતિ જ્ઞાન ભાન, ભાસિત લોકાલોક;
 શુદ્ધ સ્વરૂપ સમાધિમય નમિત સુરાસુર ચોક. ૨

શ્રી સિદ્ધાચલ મંડળો, નાલિ નરેસર નંદ;	
મિથ્યામતિ ભત લંજણો, લ વિકુમુદાકરચંદ.	૩
પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ;	
તે સિદ્ધાચલ પ્રણુમિયે, અક્તે નેરી હાથ.	૪
અનંત જીવ ઈણ ગિરિવરે, પામ્યા લવનો પાર;	
તે સિદ્ધાચલ પ્રણુમિયે લહિયે મંગળમાળ.	૫
જસ શિરેમુકુટ મનોહરુ, મરુદેવીનો નંદ;	
તે સિદ્ધાચલ પ્રણુમિયે, અદ્વિ સહા સુખવૃંદ.	૬
મહિમા જેહનો દાખવા, સુરયુરુ પણ મતિમંદ;	
તે તીર્થેશ્વર પ્રણુમિયે, પ્રગટે સહજાનંદ.	૭
સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પદૂર;	
તે તીર્થેશ્વર પ્રણુમિયે, નાસે અધ સવિ દૂર.	૮
કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાથ,	
તે તીર્થેશ્વર પ્રણુમિયે, પામીને સુખવાસ.	૯
પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય;	
તે તીર્થેશ્વર પ્રણુમિયે પાતિક દૂર પલાય.	૧૦
શ્રેધ્યા લાસન રમણુતા, રતનત્રયીને છેતુ;	
તે તીર્થેશ્વર પ્રણુમિયે, ભવ-મકરાકર-સેતુ.	૧૧
મહુાપાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સહાય;	
તે તીર્થેશ્વર પ્રણુમિયે, સુર નર જસ ગુણ ગાય.	૧૨
પુંડીક ગણુધર પ્રમુખ, સિદ્ધા સાધુ અનેક;	
તે તીર્થેશ્વર પ્રણુમિયે, આણી હૃદય વિવેક.	૧૩
ચંદ્રશેખર સ્વસાપતિ, જેહને સંગે સિદ્ધધ;	
તે તીર્થેશ્વર પ્રણુમિયે, પામીને નિજ જુદ્ધા.	૧૪

જલયર ખેચર તિરિય સુવે, પાંચા આતમ ભાવ;
 તે તીર્થેશર પ્રણુભિયે, ભવજલ તારક નાવ. ૧૫
 સંધ્યાત્રા જેણે કરી, કીધા જેણે ઉધ્વાર;
 તે તીર્થેશર પ્રણુભિયે, છેદીને ગતિ ચાર. ૧૬
 પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય;
 તે તીર્થેશર પ્રણુભિયે, મિથ્યામતિ સવિ નય. ૧૭
 સુરતડ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ હ્યાવ;
 તે તીર્થેશર પ્રણુભિયે, અગટે શુદ્ધ સ્વભાવ. ૧૮
 સુરદોડ સુરસુંદરી મળી, મળી થોડે થોક;
 તે તીર્થેશર પ્રણુભિયે, ગાવે જેહના શોડ. ૧૯
 થોળીસર જસ દર્શને ધ્યાન સમાધિ લીન;
 તે તીર્થેશર પ્રણુભિયે, હુવા અનુભવ રસ લીન. ૨૦
 માનું ગગને સૂર્ય થરી, દીઘે પ્રદક્ષિણા નિત;
 તે તીર્થેશર પ્રણુભિયે, મહિમા દેખણુ ચિત્ત. ૨૧
 સુર અસુર નર કિશારા, રહે છે જેહની પાસ;
 તે તીર્થેશર પ્રણુભિયે, પામે લીલ વિલાસ. ૨૨
 માંગલકારી જેહની, મુસ્તિકા હારી લેટ;
 તે તીર્થેશર પ્રણુભિયે, કુમતિ કદાચણ મેટ. ૨૩
 કુમતિ-કૌશિક જેહને, દેખી આંખા થાય,
 તે તીર્થેશર પ્રણુભિયે, સવિ તસ મહિમા ગાય. ૨૪
 સુરજકુંઠા નીરથી, આધિ વ્યાધિ પલાય;
 તે તીર્થેશર પ્રણુભિયે, જસ મહિમા ન કહાય. ૨૫
 સુરદર ટૂંક સોહામણી, મેઝ સમ પ્રાસાદ;
 તે તીર્થેશર પ્રણુભિયે, હર ટળે વિખવાદ. ૨૬

દ્રોય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યે હોય શાંત;
તે તીર્થેશ્વર પ્રણુમિયે, જાય લવની ભાંત. ૨૭
જગહિતકારી જિનવરા, આવ્યા ઈણે ઠામ;
તે તીર્થેશ્વર પ્રણુમિયે, જસ મહિમા ઉદ્દામ. ૨૮
નદી શેત્રું લુસ્થાનશી મિથ્યાં મળ ધોવાય,
તે તીર્થેશ્વર પ્રણુમિયે, સવિ જનને સુખદાય. ૨૯
આડ કર્મ ને સિદ્ધગિરે, ન હીથે તીવ્ર વિપાક;
તે તીર્થેશ્વર પ્રણુમિયે, જિહાં નવિ આવે કાક. ૩૦
સિદ્ધશિલા તપનીયમય રત્ન સ્કુટિક આણ,
તે તીર્થેશ્વર પ્રણુમિયે, પામ્યા કેવલનાણ. ૩૧
સોવન-રુપા-રત્નની, ઔષધિ જાત અનેક;
તે તીર્થેશ્વર પ્રણુમિયે, ન રહે પાતક એક. ૩૨
સંયમધારી સંયમે, પાવન હોય જિણુ ક્ષેત્ર;
તે તીર્થેશ્વર પ્રણુમિયે, દેવા નિર્મણ નેત્ર. ૩૩
શ્રાવક જિહાં શુલ દ્રોયથી, ઉત્સવ પૂજા સ્નાત;
તે તીર્થેશ્વર પ્રણુમિયે, પોષે પાત્ર સુપાત્ર. ૩૪
સાહિત્યત્સલ પુષ્ય જિહાં; અનંતગણું કહેવાય;
તે તીર્થેશ્વર પ્રણુમિયે, સોવન કૂલ વધાય. ૩૫
સુંદર જન્મા જેહની; દેખી હરણે ચિત્ત;
તે તીર્થેશ્વર પ્રણુમિયે ત્રિભુવનમાંહે વિદ્ધિત. ૩૬
પાલીતાળું પુર લદું સરોવર સુંદર પાલ;
તે તીર્થેશ્વર પ્રણુમિયે જાયે સકલ જંલવ. ૩૭
મનમોહન પાગે ચઢે પગ પગ કર્મ અપાય;
તે તીર્થેશ્વર પ્રણુમિયે ગુણુ ગુણી ભાવ લંખાય. ૩૮
જેણે જિરિ રુખ સાહમણા કુંડે નિર્મલ નીર;

તે તીર્થશ્વર પ્રણભિયે, ઉતારે ભવ-તીર. ૩૬
 મુક્તિ મંહિર સોપાન સમ, સુંદર ગિરિવર પાજ;
 તે તીર્થશ્વર પ્રણભિયે, લહિયે શિવપુર રાજ. ૪૦
 કર્મ કોડી અધ વિકટ લટ, હેઠી કુને અંગ;
 તે તીર્થશ્વર પ્રણભિયે, હિન હિન ચઢતે રંગ. ૪૧
 ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત;
 તે તીર્થશ્વર પ્રણભિયે, સુખે શાસન રીત. ૪૨
 કૃવડજ્ઞ રખવાલ જસ, અહેનિશ રહે હજૂર;
 તે તીર્થશ્વર પ્રણભિયે, અસુર રાખે હુર. ૪૩
 ચિત્ત ચાતુરી ચક્કેસરી, વિક્ષ વિનાસાધુંદાર;
 તે તીર્થશ્વર પ્રણભિયે, સંધ તણી કરે સાર. ૪૪
 સુરવરમાં મધવા યથા અહુગણુમાં જિમ ચંદ,
 તે તીર્થશ્વર પ્રણભિયે તિમ સવી તીરથ ઈન્દ. ૪૫
 દીઠ હુર્ગતિવારણ્ણે, સમર્થી સારે કાજ,
 તે તીર્થશ્વર પ્રણભિયે, સવિ તીરથ શીરતાજ. ૪૬
 હુંડરીક પંચ કોડીશું, પાભ્યા. કેવલનાણુ,
 તે તીર્થશ્વર પ્રણભિયે, કર્મતણી હોય હાણુ. ૪૭
 સુનિવર કોડી હસ સહિત, દ્રાવિડ ને વારિખેણુ;
 તે તીર્થશ્વર પ્રણભિયે, ચઢિયા શિવનીશ્રેણુ. ૪૮
 નમિ વિનમિ વિદાધરા, હોય કોડી મુનિ સાથ;
 તે તીર્થશ્વર પ્રણભિયે, પાભ્યા સિવપુર આથ. ૪૯
 શુષ્ણ વર્ણિય નરપતિ ઘણું, ઈણે ગિરિ પહોતા મોક્ષ;
 તે તીર્થશ્વર પ્રણભિયે, ટાલ્યા ધાતિક હોષ; ૫૦
 રામ ભરત બિહું બાધવા, ત્રણ કોડી મુનિ સુતા;

તે તીર્થોદર પ્રણમિયે, ઈણે ગિરિ શિવ સંપત્ત. ૫૧
 નારદ મુનિવર નિર્મલેલા, સાધુ એકાણુ લાખ;
 તે તીર્થોદર પ્રણમિયે, પ્રવચન પ્રગટ એ લાખ. ૫૨
 શાંખ પ્ર મ્ન રૂષિ કહ્યા સાડી આઠ ડેડી;
 તે તીર્થોદર પ્રણમિયે, પૂરવ કર્મ વિષેડી. ૫૩
 થાવચ્છાસુત સહસ્રાં, અણુસણુ રંગે કીધ;
 તે તીર્થોદર પ્રણમિયે, વેગે શિવપદ લીધ. ૫૪
 શુકે પરિત્રાજક લણી, એક સહસ અણુગાર;
 તે તીર્થોદર પ્રણમિયે, પામ્યા શિવપુર દ્વાર. ૫૫
 સેલગસ્તુરિ મુનિ પાંચસે. સહિત હુઆ શિવનાહ;
 તે તીર્થોદર પ્રણમિયે, અંગે ધરી ઉત્સાહ. ૫૬
 ઈમ ખહુ સિદ્ધા ઈણે ગિરિ. કહેતા નાવે પાર,
 તે તીર્થોદર પ્રણમિયે, શાખ માંહ અધિકાર. ૫૭
 ઝીજ ઈણાં સમકિતતણું, રેખે આતમ લોમ;
 તે તીર્થોદર પ્રણમિયે, ટાલે પાતક સ્તોમ. ૫૮
 ઘણું સ્ત્રી ભૂણુ ગો હત્યા, પાપે લારિત જોહ;
 તે તીર્થોદર પ્રણમિયે, પહેલાતા શિવપુર ગેહ ૫૯
 જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન હીઠ,
 તે તીર્થોદર પ્રણમિયે, તીર્થ માંહ ઉકિકુ. ૬૦
 ધન્ય ધન્ય સેારઠ હેશ જિહાં, તીરથ માંહ સાર,
 તે તીર્થોદર પ્રણમિયે, જનપદમાં શિરહાર. ૬૧
 અહેનિશ આવત દુંકડા, તે પણ જેહને સંગ;
 તે તીર્થોદર પ્રણમિયે, પામ્યા શિવવધુ રંગ. ૬૨
 વિરાધક જિન આણુના, તે પણ હુવા વિશુદ્ધ;
 તે તીર્થોદર પ્રણમિયે, પામ્યા નિર્મલ બુદ્ધ. ૬૩

મહામૈચ્છ શાસનરિપુ, તે પણ હુવા ઉપસંત;
 તે તીર્થેખર પ્રણુભિયે, મહિમ હેઠી અનંત ૬૪
 મંત્ર યોગ અંજન સવે સિદ્ધ હુવે જિલ્લા ઇમ.
 તે તીર્થેશ્વર પ્રણુભિયે, પાતકહારી નામ. ૬૫
 સુમતિ સુધારસ વરસતે, કર્મહાવાનદ સંત.
 તે તીર્થેશ્વર પ્રણુભિયે, ઉપશમ તસ ઉલસંત. ૬૬
 શ્રુતધર નિતુ નિતુ ઉપદિશો, તત્વાત્ત્વ વિચાર;
 તે તીર્થેશ્વર પ્રણુભિયે, અહે ગુણયુન શ્રોતાર ૬૭
 પ્રિયમેલક ગુણગળ તણું, કીરતિકમલા સિંહુ;
 તે તીર્થેશ્વર પ્રણુભિયે, કલિકારે જગધનું. ૬૮
 શ્રી શાંતિ તારણુ તરણુ, જેહની લક્ષિત વિશાળ;
 તે તીર્થેશ્વર પ્રણુભિયે, દિન દિન મંગલમાલ ૬૯
 શ્રેવત ધ્વજ જસ લટકની; લાગે લવિને એમ;
 તે તીર્થેશ્વર પ્રણુભિયે, ભ્રમણુ કરે એ એ ? ૭૦
 સાધક સિંહદરશ ભાણી, આધારે એડ ચિત.
 તે તીર્થેશ્વર પ્રણુભિયે, સાધન પરમ પવિત; ૭૧
 સંધ્યપતિ થધ એહની, જે કરે લાવે યાત;
 તે તીર્થેશ્વર પ્રણુભિયે, તસ હોય નિર્મલ ગાત્ર. ૭૨
 શુદ્ધાનમગુણરમણુતા, પ્રગરે જેહને જુંગ;
 તે તીર્થેશ્વર પ્રણુભિયે, જેહનો જસ અલંગ ૭૩
 રાયણવૃક્ષ સોઢામળું. જિહાં જિનેશ્વર પાથ;
 તે તીર્થેશ્વર પ્રણુભિયે, સેવે સુર નર રાય ૭૪
 પગલાં પૂજુ ઋપલાં ઉપશમ જેહને ચંગ;
 તે તીર્થેશ્વર પ્રણુભિયે, સમતા પદ્ધતન અંગ. ૭૫

विद्याधर ज मिले अहु, विचरे गिरिवर शृंग;
 ते तीर्थीवर प्रणुभिये, अठते नवरस रंग. ૭૬
 मालती मोगर देतडी परिमल मोहे भुंग;
 ते तीर्थीवरे प्रणुभिये, पूजे लवी जिन आंग. ૭૭
 अन्नित जिनेश्वर लहां रह्या, चामाचुं गुणु गेह;
 ते तीर्थीवर प्रणुभिये, आळी अविहु नेह ૭૮
 शांति जिनेश्वर सोलमा, सोण कषाय करी अंत;
 ते तीर्थीवर प्रणुभिये, चातुर्मास रहुंत. ૭૯
 नेम विना जिनवर सर्वे, आव्या छे जिणे हाम;
 ते तीर्थीवर प्रणुभिये, शुद्ध करे परिणाम. ૮૦
 नमिनेभिन्न अंतरे, अन्नित शांतिस्तव कीध;
 ते तीर्थीवर प्रणुभिये, नहिंये प्रसिद्ध. ૮૧
 गणुधर मुनि उवलजाय तिम, लाल लह्या कोइ लाख.
 ते तीर्थीवर प्रणुभिये, ज्ञान असृतरस चाख. ૮૨
 नित्य धंट टंकारवे, रणुअणे अद्वरी नाढ;
 ते तीर्थीवर प्रणुभिये, हुंहुलि मादल वाढ; ૮૩
 जेणे जिरि लरत नरेसरे, कीघो प्रथम उद्धार;
 ते तीर्थीवर प्रणुभिये, मणिभय भूरति सार. ૮૪
 चौमुख अउगति हुःअ हुरे, सोल उद्धार सुविहार
 ते तीर्थीवर प्रणुभिये, अक्षय सुख हातार. ૮૫
 ईणु तीरथ महोदा कह्या, सोल उद्धार सुद्धार,
 ते तीर्थीवर प्रणुभिये, लघु असंग्य विचार. ૮૬
 द्रूप लाव वैरी तणो, जेहुथी थाये अंत;
 ते तीर्थीवर प्रणुभिये, शत्रुंजय समरंत, ૮૭

પુંડરીક ગણુધર હુવા, પ્રથમ સિદ્ધ ધિણે ડામ;	
તે તીથેંશ્વર પ્રણુમિયે, પુંડરીકગિરિ નામ.	૮૮
કાંકરે કાંકરે ધણુ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિતા;	
તે તીથેંશ્વર પ્રણુમિયે, સિદ્ધક્ષેત્ર સમવિતા.	૮૯
મલ દ્રચ ભાવ વિશેષથી, જેહથી જાયે હુર;	
તે તીથેંશ્વર પ્રણુમિયે, વિમલાચલ સુખ પૂર.	૯૦
સુરવરા બહુ જે ગિરે, નિઃસે નિરમલ ડાણુ:	
તે તીથેંશ્વર પ્રણુમિયે, સુરગિરિ નામ માણુ.	૯૧
પરવત સહુ માણે વડો, મહાગિર તિણે કહાંત;	
તે તીથેંશ્વર પ્રણુમિયે, દરશન લહે પુણ્યવાંત.	૯૨
પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાસ;	
તે તીથેંશ્વર પ્રણુમિયે, નામ ભલું પુણ્યરાશ.	૯૩
લક્ષ્મીદ્વીપીએ કર્યો, કુંડે કમલ નિવાસ;	
તે તીથેંશ્વર પ્રણુમિયે, પદ્મનામ સુવાસ.	૯૪
સંવિ ગિરિમાં સુરપતિ સમો, પાતક પંક વિલાત;	
તે તીથેંશ્વર પ્રણુમિયે, પર્વતઈન્દ્ર વિઘ્નાત..	૯૫
ન્રિલુલનમાં તીરથ સવે, તેછાં મોટો ઓહ;	
તે તીથેંશ્વર પ્રણુમિયે, મહાતીરથ જસ રેહ.	૯૬
આહિ અંત નહિ જેહનોા, કોઈ કાલે ન વિલાય;	
તે તીથેંશ્વર પ્રણુમિયે, શાર્ધતગિરિ કહેવાય.	૯૭
લદ્ર લલા જે ગિરિવરે, આવે હોય અપાર;	
તે તીથેંશ્વર પ્રણુમિયે, નામ સુલદ્ર સંભાર.	૯૮
વીર્ય વધે શુલ સાધુને, પામી તીરથ લક્ષ્મિા;	
તે તીથેંશ્વર પ્રણુમિયે, નામે જે દ્રદ્ધાક્તિ.	૯૯

શીવગતિ સાથે કે ગિરે, તે માટે અભિધાન;	
તે તીર્થશર પ્રણુમિયે, સુકિતનિતય શુણુખાણુ.	૧૦૦
ચંદ્ર સૂરજ સમકિતધરા, સેવ કરે શુલચિતા;	
તે તીર્થશર પ્રણુમિયે, પુષ્પદંત વિહિત.	૧૦૧
લિન્ન રહે લવજલ થકી, કે ગિરિ લહે નિવાસ	
તે તીર્થશર પ્રણુમિયે, મહાપદ્મ સુવિલાસ.	૧૦૨
ભૂમિ ધરી કે ગિરિવરે ઉદ્ઘિ ન લોપે લીહ;	
તે તીર્થશર પ્રણુમિયે, પૃથ્વીપીડ અનીહ.	૧૦૩
મંગલ સવિ મલવાતાળું, પીડ એહ અલિરામ;	
તે તીર્થશર પ્રણુમિયે, લદ્રપીડ જસ નામ.	૧૦૪
મૂલ જસ પાતાલમાં, રતનમય મનોહાર;	
તે તીર્થશર પ્રણુમિયે, પાતાલમૂલ વિચાર.	૧૦૫
કર્મક્ષય હોયે જિહ્વાં, હોય સિદ્ધ સુખકેલ;	
તે તીર્થશર પ્રણુમિયે, અકર્મક મનમેલ.	૧૦૬
કામિત સવિ પૂરણુ હોયે, જેહનું દરિસન પામ,	
તે તીર્થશર પ્રણુમિયે સર્વકામ મન ઢામ.	૧૦૭
ઇન્દ્રાદિક એકવીશ ભલાં, નિરુપમ નામ ઉદાર;	
કે સમર્યાં પાતક હરે, આતમ શક્તિ અનુસાર.	૧૦૮

: કણીશા :

ઇમ તીર્થ નાયક, સ્તવન યાયક, સંશુદ્ધયો શ્રી સિદ્ધગિરિ,
અહોતરસય ગાહુ સ્તવને, પ્રેમ-લક્ષ્મિ મન ધરી;
શ્રી કલ્યાણસાગરસૂરિ શિષ્યે શુલ જગીરો સુખકરી,
પુષ્પ મહોદ્ય સકલ મંગલ વેકી ઝુજસે જય જયસિરિ ..૧..

(૬) શ્રી ગિરિજાજીની પાઠો

પાજ એટલે પાજ-ગિરિજ ઉપર ચઢવાના રસ્તા-
મુખ્ય ચાર છે.

(૧)-પાદીતાણા પાજ-જ્યતલાટીએ હૈત્યવંદન
કરી ચઢાય છે. આ પાજ ઉત્તર દિશાની.

(૨)-શત્રુંજ્યનહોની પાજ-પાડીતાણાં શહેરથી
નીકળી નહાર ભીટીંગથી ડાળી ખાનુની સરુકે લગગલ ચાર
માઈલ જવાથી શત્રુંજ્ય નહી આવે છે. ત્યા જઈ શત્રુંજ્ય
નહીનું પાણી ગાળીને બુઢા વાસણુમાં લઈ ઉપરોગ પૂર્વક
સ્લાન કરી, પૂઝનાં કપડા પહેરી, ત્યા શ્રી આહિનિથ
લગવાનનાં પગદાંની પૂજા કરી, જ્યણુંપૂર્વક શ્રી ગિરિજ
ઉપર ચઢી યાત્રા કર્યી.

જત્રુંજ્ય નહીએ નાહીને, મુખાંધી મુખકોષ;
દેવયુગાદિ પૂજાએ, આણી મન સંતોષ.”

શત્રુંય નહીમાં બંધ બંધાયેલો હોઈ હવે તે પગલાં
મૂળ જ્યાથી ખસેડી ગામ પાસે સ્થાપન કરવામાં આવનાર
છે. આ પાજ પૂર્વદિશાની છે.

૩. રોહીશાળાની પાજ રોહીશાળાથી ચઢાય છે.
વચમાં એક કુંડ આવે છે. રોહીશાળા ગામ પાસે એક
જિનમંહિર છે. તે પણ બંધ બંધાયાના કારણે ઉપાડી લઈ
શત્રુંજ્ય નહીના ડેમ ઉપર બંધાવવામાં આવનાર છે. રોહી-
શાળા ગામ પાસે એક ગામ છે, ત્યા શ્રી આહીશ્વર લગ-
વાનનાં પગલાં છે. ત્યા ફર્શન કરી શરૂઆત પશ્ચિમ દિશા-
માંથી ચઢવાની થાય છે. અને પણ ઉત્તર દિશા તરફ

જવાય છે. તે રસ્તે રામપોળની બારો પાસે જવાય છે. છ ગાઉની પ્રદક્ષિણામાં, દાહાના દર્શન કરી રાહિશાળાની પાગે ઉતરી પાછા આવવાનું હોય છે. આ પાજ પ્રદક્ષિણ દિશાની છે. આ પાજને વણું ગાઉમાં ગણુવામાં આવે છે. કિલ્વાંક રાહિશાળાએ દર્શન કરી, સાધા ગામમાં આવે છે.

૪. ઘેરીની પાજ આદિપુર (આથપર) ગામથી ચઢવાનું હોય છે. આથપરમાં એક ચુંદર ધર્મશાલા બાંધવામાં આવી છે. ત્યાંથી થોડું ચઢતાં શ્રી જ્ઞાનસંહન આદિ ર૪ તીર્થકર ભગવંતોનાં પગલાં છે. ત્યાં જૈયવંહન કરી ઉપર ચઢતાં અડધામાં એક હેરી આરંધ છે તેનાં પણ ર૪ તીર્થકર ભગવંતોનાં પગલાં છે. ગાન્ધુમાં એક કુંડ છે. ઘેરીની આરીએથી દાહાની દુંકમાં જાવાય છે. દાહાની વાવા ઘેરીની પાગે ઉતરી દેર ઉપર ચડી યાત્રા કરવાથી જ યાત્રા ગણ્યાય છે.

રસ્તામાં વણું ઠેકાણું મરે જેપર તથા નીચે એમ પાંચ જગ્યાએ ઉકાળેલા તથા હાજરી જગ્યાની સગરડ રામવામાં આવે છે. આ પાજ પર્દિન દિશાની છે.

૭ પ્રદક્ષિણાએ

૧-૨-૩ ગાઉ, ૨- જીપર્દી, અંદર ઉ- વાર ગાઉની હોઠ ગાઉની પ્રદક્ષિણા; દાહાની હર્ષાન ચૈત્યવંહનાદિકરી, શમપોળની બારીથી જમાની સાથું બહારના લાગમાં કિલ્વાની આણુભગુના રસ્તે વોની પાજને રસ્તા ઓળંગી કુટુમબાનદ્રાર નાળુક એક રાતાંદી છે, ત્યાં ચોમુખળની હુંક તરફ ચૈત્યવંહન કરી રાતુમાનદ્રારે થઈ રામપોળના હર-

વાજેથી દાખલ થઈ કરીથી દાદાના દર્શન કરવાથી દોઢ ગાઉની પ્રદક્ષિણા સંપૂર્ણ થાય છે.

૨. છ ગાઉની પ્રદક્ષિણા:- રસ્તો બહુ લાંબો અને જાચો નીચો હોવાથી સવારે વહેલા ચઢી દાદાના દર્શન ચૈત્યવંદનાદિ કરી રામપોળની બારીથી જમણી ખાનુ મોખરી એકરી ઉપર દેવકીલુના છ પુત્રોની દેરી આવે છે.

દેવકીના છ પુત્રો

વસુદેવને અનેક પત્નીઓ હતી; તેમાં દેવકીના સાત ગર્ભો કંસે વચનથી માગી લીધા હતા. કેમકે કંસને જાણવામાં આંધુ' હતુ' કે,- 'દેવકીના સાતમો ગર્ભો પોતાના નાશ કરનાર છે.' દેવકીના પહેલા છ પુત્રોનું આયુષ્ય ખળવાન હોવાથી જન્મ પામતાં ટેવે તેના પુત્રોને લઈને લદીલુપુર નગરમાં નાગસાર્થવાડુની પત્ની સુલસાની પાસે મૂકી હીધા. હતા અને તેના મરેલા સંતાન દેવકી પાંસે સુક્યાં હતાં કંસ એ છ મરેલાને લુષ્ટા ધારી પત્થર ઉપર પટકીને મારી નાણ્યાનો આનંદ પામતો. સાતમો પુત્ર કૃષ્ણ થયો તે. ગોકુળમાં મોટા થયા, અને કંસનો તેમણે વધ કર્યો. લાવી કોઈ મિથ્યા કરી શકતું. નથી.

સુલસાને ત્યાં મોટા થતા દેવકીએ છાંચે પુત્રોને બગ્રીસ બગ્રીસ સ્ત્રીઓ સાથે લઘ થયાં અને બગ્રીસ બગ્રીસ કોડ સૌનૈયાના માલીક ભન્યા-ભગવાન શ્રી નેમનાથલુની દેશના સાંલળી છાંચે લાઇએઓએ હીક્ષા લીધી. હુમેશા છકુને પારણે છડ કરવા લાગ્યા. એક વખતે દ્વારીકા નગરીમાં દેવકીના વેર બણાણેની જોડમાં છાંચે ગોચરી ગયા. દેવકીએ લાનથી ગોચરી વહોરાવી

છેલ્ખા યુગલને પુછ્યું ત્યારે છએ ભાઈઓ જણ્યા. લગવાનને
પૂછ્યતા છએ પોતાના પુત્રો છે. એની યાત્રી થઈ.

છએ મુનિવરો શ્રી સિદ્ધગિરિજી ઉપર અનશન કરી
મોક્ષ સુખને પામ્યા.

ત્યાં દર્શાન કરી અડધો ગાડો જતાં ઊંલડા જલ' નામે સ્થળ
આવે છે, અહીં હાઠાના નમનનું જલ આવે છે, અહીં એક 'નાની
દેરીમાં શ્રી આદિનાથ લગવાનનાં પગવાં છે, ચૈત્યવંદન કરી
પોણો ગાડો જતાં 'ચિલ્લણું તળાવડી' આવે છે, અહીં
એ નાની દેરીએ છે. તેમાં શ્રી અજિતનાથ લગવાન અને
શ્રી શાંતિનાથ લગવાનનાં પગવાં છે. અહીં પણું કહેવાય
છે કે શ્રી અજિતનાથ લગવાન અને શ્રી શાંતિનાથ લગવાને
અહીં ચાતુર્માસ કરેલું તેની યાતી માટે બન્ને દેરીએ
સામસામી સ્થાપન કરવામાં આવેલ. એક નાદિપેણું નામણા
મુનિ મહારાજ કે જેએ એક મતે શ્રી નેમિનાથસંઘસીતા
અને ખીજા મતે શ્રી મહાવીરસ્વામીના શાસનમાં થાં. સેએ
આ ગિરિજાજની યાત્રા કરવા આવ્યા ત્યારે આં અન્ને
દેરીએ સામસામી હોવાથી એકની સામે એસી ચૈત્યવંદન
કરે તો સામેના ખીજ લગવાનને પુંઢ આવે; જેશી એવી
રીતે સ્તુતિ કરી કે જેથી બન્ને દેરીએ જોડાનેડ થઈ ગઈ
અને આ સ્તુતિ તે અજિત શાંતિ સ્તવન રૂપે પ્રગટ થઈ
આ દેરીએની પાસે અતિશય મહિમાવાળી ચિલ્લણું તળાવડી
તથા સિદ્ધશિલા (કાઉસસગ કરવાની) છે.

અહીં ચૈત્યવંદન કરવું. ચિલ્લણું તળાવડી પાસે
સિદ્ધશિલા છે ત્યાં ૧૦૮-૨૭-૨૧-૬ (યથાશક્તિ). દોગ-
સનો કાઉસસગ કરવામાં આવે છે.

ચિહ્નથું તળાવડી માટે કહેવાય કે છે ‘શ્રી સુધર્મા-સ્વામી ગણુધરના મહાતપસ્વી શિષ્ય શ્રી ચિહ્નથુ મુનિ મોટા સંધ સાથે શ્રી સિદ્ધગિરિજી આવતા હતા, રસ્તામાં સંધ તૃપાતુર થયો, આખોય સંધ તરસથી તરફડવા લાગ્યો ત્યારે સંધે પ્રાર્થના કરી કે ‘હે તપસ્વી! પ્રભુના દર્શન વિના અમારા પ્રાણ ચાલ્યા જશે.’ સંધને પીડિત લેઈ મુનિવરે પાણી દેખાડ્યું, તપશક્તિથી મોટું તળાવ પાણીથી છલ-કાવી દીધું, સંધની તરસ છીપી ગઈ, ત્યારથી આ તળાવ ચિહ્નથું તલાવડી નામે ઓળખાય છે.

(૨)

શ્રી શત્રુંજય મહાત્મ્યના ટમાં સર્ગમાં, શ્રી અજિતનાથ ભગવાને દેખનામાં જણાવ્યું છે કે ‘એક વખત શ્રી સુવતા-ગ્રાંથ મુનિ પાત્રમાં પાણી લઈને જ્વાનપણ્યાથી ધીમે ધીમે ચડતાં પહેલા શિખર પર આવ્યા, ત્યાં કોઈ વૃક્ષ નીચે વિસામે દેવા બેઠા અને પાણીનું પાત્ર બાળુમાં સુર્કયું, એટલામાં કોઈ કાગડાએ આપી તે જળપાત્ર ઢોળી નાખ્યું, મુનિનું ગળું તાપ અને તૃપાથી સુકાતુ હતું લાં જળપાત્ર ઢોળાયેલું લેઈ કોઈ આંદ્યો અને બોલ્યા કે ‘હે કાકપક્ષી! પ્રાણુ રક્ષક જળને તે ઢોળી નાખ્યું તે કુકૃત્યથી હવે આ તીર્થમાં તારી સંતતિનું આપણું થશે નહિ અને આ ડેકાણે મારા તપના પ્રભાવે સર્વ મુનિ જનોને સંતોષ આપે એવું નિર્જીવ અને પ્રાસુક જળ સહા થશે.’ આવા મુનિના ડોપ ચુક્તા વચ્ચનથી કાગડાએ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારથી આ સિદ્ધગિરિજી ઉપર કાગડાએ આવતા નથી. જો કહી હુંકાગ અને વિરોધ થવાનો હોય ત્યારે કાગડાએ અહીં આવે તો વિધનને શાંત કરવા

માટે શાંતિકર્મ કરવું. શ્રી સુવતાચાર્યના તપોભગ્યી નૈર્દ્રય ઝુણું તરફ જળ પ્રવત્સું છે તે જળ અનેક સુખને આપે છે. તે જળના સ્પર્શથી રોગ, શોક, પીડા, વેતાલ અને અહુ સંબંધી પાપજન્ય હુઃએ નાશ પામે છે.'

આ ચિહ્નણું તળાવડી નામનો અપભંશ થતા આજે કેટલાક લોકો આને 'ચંદ્રન તળાવડી' કહે છે.

પછી આગળ એ માઈલ જતાં 'લાઠવાનો ડુંગર' આવે છે. આ શિખર ઉપર શાંખ અને પ્રધુભનું માર આદિ ક્રાગણું સુદ ૧૩ ના દિવસે સાડા આઠ કોડ સાથે મોક્ષ ગયા હતા તેમના પગલાની એક દેરી છે, અહીં ચૈત્યવંદન કરી ચાર માઈલ ઉત્તરતા નીચે 'સિંદ્રબદ' (બુની તળેટી) આવે છે, અહીં વડ નીચે દેરીમાં શ્રી આદીનાથ પ્રભુના પગલાં છે. અહીં ચૈત્યવંદન કરવું, પ્રદક્ષિણા પુરી થાય છે. નજિકમાં આથપર ગામ છે ત્યાં ક્રાગણું સુદ ૧૩ ના દિવસે તંખુંએ નંખાય છે અને બુદા બુદા સંઘો-મંડળો વગેરે તરફથી આવેલા યાત્રાગુમ્યેની દઢી, ઠેણરા, રસ વગેરેથી લક્ષિત કરવામાં આવે છે. અહીંથી પાછીતાણું શહેર ચાર માઈલ થાય છે, સડક છે.

ભારગાઉની પ્રદક્ષિણા-આ પ્રદક્ષિણા પાલીતાણુંથી શરૂ થાય છે, દક્ષિણ પૂર્વ તરફ ૪ માઈલ દૂર થેનુંલ નહીના કીનારે રોહિશાળા ગામ છે. ત્યાં સ્વરૂપ આચાર્ય વિજય નેમિસૂરીશ્વરલુ મહારાજના ઉપરેશથી એક સુંદર શ્રી આદીશ્વર ભગવાનનું જિનાલય અને ધર્મશાળા બંધાવવામાં આવી હતી.

૧-હવે શોનુંજુનદીનો બંધ થયો હોવાથી તે જિનાલય ઉપાડી લઈ તેમ ઉપર બંધવામાં આવનાર છે,) લાંથી અઠી. માઈલ લંડારીઆ ગામ છે. તેમાં એક દેરાસર શ્રી આદીનાથ પ્રલુનું છે. ત્રણું પ્રતિમાળુંઓ છે. ત્યાંથી એ માઈલ 'મોદાના નેસ' ગામ, જેનું પ્રાચીન નામ કદંભપુર છે. તે ગામમાં દક્ષિણ દિશાએ શ્રી મહાવીરસ્વામીલુનું ભાવણું જિનાલયવાળું (૭૫ જેટલી દેરીએ) વિશાળ જિનમંદિર સ્વરૂપ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપરેશથી સંવત ૧૯૮૮ માં બંધવાવામાં આવ્યું છે. ત્રણું માળનો સુંદર ઉપાશ્રય અને એ ધર્મશાળાએ છે, તથા જિનદાસ ધર્મદાસની પેઢી તરફથી લોજનશાળા ચાલે છે.

કદંખગિરિ વે શ્રી જિરિસાજનું શિખર મનાય છે. આનો ચડાવ લગભગ ર માઈલનો છે. ગાઈ ચોવીશીના શ્રી

૨-આજના કાળમાં માન, મોલા અને પૈસા માટે આપણું મોવડીએને જૈનશાસનના સિદ્ધાંતો કે જુના સ્થાપત્યોનું ગમે તે થાય તે જેવાની દુરસદ પણ નથી, એ એક ઐદનો વિષય છે. વાચકો શેનુંજી બંધની હુક્મકેત લાણુંતા હશે. આજે ચોક ગામ, હજરો વર્ષોથી શેનુંજી નદી ઉપર આવેલા શ્રી નંદભાઈન લગનાનના પગળાની હૃતી અને રોડીશાળામાં બંધવાવામાં આવેલું દેરાસર વગેરે બંધના કારણે ઉપાડી લેવા પડ્યાં છે અને પડશે.

આવા બંધોની ચોજનાથી પોતાના ધર્મસ્થાનો લુટે થતાં નેછને થોડા દાધમ પહેલા સનાતનીએ તથા મુસ્લિમાનોના વિરોધથી સરકારને તેમનો ખાન ડેરવજા પડ્યા હતા, જ્યારે આપણું મોષીએએ આરગાજની શાસ્ત્રીય 'પ્રદક્ષિણાનો' લોપ થવા દ્વારા રેનુંજુનદી

કદમ્બ ગણુધરના નિર્વાણુની જગ્યાએ એક દેરી ખાંધવામાં આવેલી છે તેમાં શ્રીઆદીનાથ અને શ્રી કદમ્બ ગણુધરના પગલાં છે. તાગાટીએ યાત્રાળુંએને લાતુ અપાય છે. ઉપર જતાં વચમાં વાવ આવે છે. શ્રી ઋષભદેવ લગવાનનું લન્ય જિના-લય ખાંધવામાં આંધું છે તેની અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સંબત ૨૦૧૬ વૈશાખ વઢ ૬ ના દિવસે થયેલ છે અહૃતના લાગમાં ૨૬ દેરીએ છે. ઉપર એક દેરાસરમાં શ્રી નેમનાથ લગવાનની પ્રતિમા છે.

વાવડી ખ્લોટમાં શ્રી નેમનાથ લગવાનનું મંહિર છે. નીચે પરોણું તરીકે અનેક લન્ય પ્રતિમાણુંએ છે.

ખોદાના નેસથી એ માઈલ હૂર ‘ચોક’ ગામ છે, તેમાં શ્રાવકના દશ ધર, દેરાસર, ઉંપાશ્રય હુતો. (હાલમાં ખાંધના કારણે તે ઉપાડી લેવામાં આંધું છે.) શેન્નુંણ નંદીને ચોળંગીને હુસ્તગિરિ જવાય છે, અહીંથા લરત મહારાજના હાથીએ મરણું પામી સ્વર્ગે ગયેલા હોવાથી હુસ્તગિરિ તીર્થ કહેવાય છે. ઉપરના લાગમાં શ્રી આદીશ્વર લગવાનનાં પગલાં છે. અહીં યાત્રા કરી ચોક જણીયા વગેરે થઈ પાછા પાલી-તાણું આવતાં આર ગાઉની યાત્રા પુરી થાય છે.

ઉપર ખાંધ ખાંધવામાં, તેનાથી ઐશ્વરમાર માછવાની હિસા વગેરે થાય તે માટે ડાઇ જતનો વિરોધ કરેં સંભળાયો નથી. ઉલ્લંઘ અભુક્ત ઇન્દ્રિયાનું સાઢુ થયાનું સંભળવા મળે છે, જે તે સત્ય હોય તો તે શાસનની દાજ વિનાનું કેટલું શોચનીય છે? તે વાચ્કા રવયં વિચારી લેશો.

પરંતુ હવે બંધના કારણુથી આ પ્રાચીન શાસ્ત્રીય આર ગાઉની પ્રદક્ષિણાનો અંત આવી ગયો છે. ચોક ગામ આખું ખાલી થઈ ગયું છે. જુના રસ્તા હવે રહ્યા નથી.

કદમ્બગિરિ જવા માટે તેમ ઉપર થઈને રસ્તો ચાલુ થયો છે. રાહિશાળાનું દેરાસર, ધર્મશાળા બાંધવા માટે તેમ ઉપર શેડ જિનદાસ ધર્મમદાસની પેઢી તરફથી જમીન લેવામાં આવેલી છે. ત્યાં નવું દેરાસર, ધર્મશાળા બાંધારો. જ્યારે શ્રી શૈનુંજુ નહીં ઉપરના પગલાં ઉડાવીને બીજે સ્થળે સ્થાપનામાં આવનાર છે.

(C) તીર્થ પર થતાં કાર્યોના નકરા

તીર્થમાળ પહેરવાના ઇ. ૫૧, રથયાત્રા કઠાવવાના ઇ. ૨૫, પૂજા ભાષ્યાવંચા ઇ. ૫ સમવસરણુમાં પ્રતિમાળ રથાપવાના ઇ. ૧ સમવસરણ મંડાવવાના ઇ. ૨, આસિવાય આંગી, રોશાની, મુકુટ વગેરે બઢાવવાના નકરા અદગ સમજવા.

સંઘના જમણવારોના લેવાતા નકરા.

વિગત	નકરો-દ્વ.	વિગત	નકરો-દ્વ.
નવકારશીને	૩૫	વરસિતપના એક	
સ્વામિવાત્સદ્ય ,	૨૧	વખતનાં પારણુંના	૩।
મુંગી નંબાળું ટેણી ૧૨		છઠું અંદુમ ,	૩।
ખોલતી , , ૧૧		સિદ્ધિ ૧૫ ,	૨
ચોમાસી , , ૫।		માસક્ષમણુત્પ ,	૨
ચોસઠ પહેારી પારણુંના ૮		ઓળીનાનવ	
પર્યુષણુમાં સવારનાં પારણું ૨૧		આયંબીલ જમણુના	૧૮

વિગત ૩.

ઉપધાનના એકાસણુના	૬૨	ટોળીના	૫૧
ઉપધાનમાં ૬૨ આયણીલની		ટોળીના-	૩
શાંતિસ્નાત્રના	૨૫૦	અષ્ટોત્તરીના	૧૫૦
૩૫ાની નાંદના	૧૧	લાકડાની જરીકાખડનાંદના	૫૦ (વરધોડામાં)
ઉપધાન-પહેલા પ્રવેશમાં ૧૨		સોનાચાંદીના રથના-૩૫	
,, પૂજા „ ૬		ઇન્દ્ર ધનના	૫૧
,, ત્રીજ „ ૪		મેનાનો	૧૧
પહેલા અલુરીઓના	૨૧	લાકડાના હાથીનો	૧૧
નવાળુંધાત્રાના પાસના	૧૧	કેતલ ઘોડાનો	૨
ચોમાસી કરવાના „	૧૧	સાઢા „	૧
ભવપૂજના	„ ૨૧	ઘોકાવાળા સીપાઈનો	૧૩૩
છકુ અફુમના	„	૧૧=૧	
વરસીતપના	„ ૧૧		

વિગત ૩૦.

ધીની બોલી-આરતી, પૂજા, પખાળ, વરધોડા વગેરેના	
ચઠાવાના એક મણુ ધીનો ભાવ રૂ. ૫ છે.	
પર્યુષણુમાં સુપન તથા પ્રતિકમણુમાં બોલાતા સૂત્રોના	
ચઠાવાના એક મણુ ધીનો ભાવ રૂ. ૨૧ છે. આંગી; પૂજા	
જમણુવાર, વરધોડા, વગેરેની ટેલ પડાવાની શ્રી ચાર આના છે.	



વિભાગ ચોથો

(૧) પ્રલુ સન્મુખ એલવાની રતુતિએ।

પૂણુનન્દમયં મહેદયમયં, કૈવલ્યચિહૃહુન્મયં,
રૂપાતીતમયં સ્વરૂપરમણું, સ્વાલાવિકીશ્રીમયં;
જાનોધોતમયં કૃપારસમયં, સ્યાદ્રાવિદ્યાદૈયં,
શ્રીસિદ્ધાચલતીર્થરાજમનિશં, વન્દેઽહુમાહીથરમ् ..૧..

નેત્રાનન્દકરી અવોદ્ધિતરી, શ્રેયસ્તરોમંજરી,
શ્રીમદ્રમ્બાનરેન્દ્રનગરી, વ્યાપ્તલતાધૂમરી;
હરોત્કર્ષશુભપ્રલાવલહરી, રાગદ્વિષાં જિત્વરી,
મૂર્તિઃ શ્રીજિનપુંગવસ્ય ભવતુ, શ્રેયસ્તરીહેણિનામ् ..૨..

અદ્ય મે સફ્લાં જન્મ, અદ્ય મે સફ્લા કિયા;
અદ્ય મે સફ્લાં ગાત્ર, જિનેન્દ્ર તવ દર્શનાત् ..૩..
કિને લક્ષ્મિન્દ્રાલ્કિતન્દ્રનેલકિતહિને દિને .
સદા મેડસ્તુ સદા મેડસ્તુ સદા મેડસ્તુ ભવે ભવે ..૪..

દર્શનં હેવહેવસ્ય, દર્શનં પાપનાશનમ् .
દર્શનં સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનમ् ..૫..
દર્શનાતહૃતિધ્વંસી, વન્દનાત્ વાંછિતંપ્રદઃ .
પૂજનાતપૂરકઃ શ્રીષું, જિનઃ સાક્ષાત્ સુરહૃમઃ ..૬..

જીક્ષાગ્રહી પ્રથમતીર્થ તમેજ સ્થાયું,

કેં લવ્યનું કઠણું હુઃખ અનંત કાયું;

એવા પ્રભુ પ્રણગીયે પ્રણયે તમેને;

મેવા પ્રભુશિવતણું અરપો અમોને. ..૭..

સુષ્ણયા હશે મૂળયા હશે નિરણયા હશે પણ કે ક્ષણે,

હે જગતદ્યુ! ચિત્તમાં ધાર્યા નહિ લક્ષ્ણિપણે;

જનર્થો પ્રભુ તે કારણે હુઃખપાત્ર હું સંસારમાં,

હા! લક્ષ્ણ તે ઇણતી નથી કે લાવ શૂન્યાચારમાં ..૮..

છે પ્રતિમા મનોહારિણી હુઃખહારણી વીરજિણુંદની,

લક્તોને છે સર્વદા સુખકરી જણે ઐંકી ચાંદની;

આ પ્રતિમાના ગુણું લાવ ધરીને કે માણુસો ગાય છે,

પામી સધગાસુખ તે જગતમાં મુક્તિલાણી જાય છે ..૯..

આયો શરણે તમારે જિનતર! કરલે આશ પૂરી અમારી,

નાન્યો લવપાર મહારા તુમ વિષુ જગતમાં સાર લે કોણું મહારી;

ગાયો જિનરાજ આજે હુરષ અધિકથી પરમ આનંદકારી,

પાયો તુમ દર્શા નાસે લવોલત ભ્રમણું નાથ! સર્વો અમહારી

..૧૦..

શ્રી આહીન્દ્ર શાંતિ નેમિજિનને, શ્રી યાર્થ વીર પ્રલો;

એ પાંચે જિનરાજ આજ પ્રણસું; હેતે કરી હે વિલે!

કલ્યાણે કમળા સહૈવ નિમલા, વૃદ્ધ પમાડો અતિ;

એહવા જૌતમસ્તવામી લહિધલરીઓ, આપો સદા સન્મતિ

..૧૧..

(૨) સિદ્ધાચૈત્યલુનાં પાંચ ચૈત્યવંદનો વિધિ-સહિત
ચૈત્યવંદનનો પ્રારંભિક વિધિ

પ્રથમ અમાસમણું હઈ ઇન્દ્રિયાવહી પદિક્ષમી, યાવત
પ્રગટ (સંપૂર્ણ) લોગસ્સ કહી, તણું અમાસમણું હઈ, ઇંદ્રિય-
કારેણું સંદિસ્ક લગ્જાના ચૈત્યવનન્દન કરું? ઇંદ્રિય કહી ચૈત્ય-
વનનું કરવું!

સક્કલકુશલવહલી—પુઃકરાવત્તમેવો,
હુરિતનિમિરકાનુઃ કલપવૃક્ષોપમાનઃ
ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિહેતુઃ,
સ લગ્નતુ સતત વઃ શ્રેયસે શાંતિનાથઃ ..૧..

ચૈત્યવંદન ઘણેલું

(તવારીએ કરવાનું)

શ્રી શાનુંજ્ય સિદ્ધક્ષેત્ર, દીઠે હુર્ગતિવારે;
ભાવ ધરીને કે ચઢે, તેને લવપાર ઉતારે ..૧..
અનંતસિદ્ધનો એહુ ઠામ, સક્કલતીર્થનો રાય;
પૂર્વ નવાળું ઋષલદેવ, જયાં હવિયા પ્રલુ પાયઃ ..૨..
સૂરજકુંડ સૌહામણો, કવડજલ્લા અલિરામ;
નાલિરાય કુલ મંડળો, જિનવર કરું પ્રણામ. ..૩..

જંકિચિ

જંકિચિ નામ તિત્થં સંગે પાયાલિ માણુસે લોાએ;
જંજું જિણુંબિભાઈ, તાઈ સર્વાઈ વંદામિ ..૧..

નમુત્થુણું અથવા શકુસ્તવ

નમુત્થુણું, અરિહંતાણું, લગવંતાણું. આઈગરાણું; તિત્થયરાણું, સયંસંખુદ્વાષું. પુરિસુતમાણું, પુરિસસીહાણું, પુરિસવરપુંડ્રીઆણું, પુરિસવરગંધહથીણું. લોગુતમાણું. લોગનાહાણું, લોગહિઆણું, લોગપઠવાણું લોગપજ્ઞનેઅગરાણું. અલયહયાણું, ચક્કુહયાણું મગગહયાણું, સરણુહયાણું, પોહિયાણું. ધર્મમહયાણું, ધર્મમનાયગાણું, ધર્મ-સારહીણું, ધર્મવરચાઉરંતચક્કવટીણું. અપડીહયવરનાણું-સણુહરાણું, વિઅહૃદઉમાણું. જિણુણું જાવયાણું, તિજાણું તારયાખું, ખુદ્વાણું ઘોહયાણું, મુત્તાણું મોઅગાણું. સંવન્ધાણું, સંવદરસિણું, સિવ-મયદ-મરુઅ-મણુંતમકખ્ય-મંવાખાહ-મપુણુરાવિત્તિ, સિદ્ધિગધનામધ્યે ડાણું સંપત્તાણું, નમો જિણુણું જિઅલયાણું. જેએ અઈઓ સિદ્ધા, જેએ લવિસસંતિણુગણે કાલે; સંપદીઅ વટુમાણુા, સંવે તિવિહેણ વંદામિ ..૧..

જવંતિ ચૈદીઆઈ

જવંતિ ચૈદીઆઈ, ઉડૂઠે અ અહે અ તિરિઅ લોએ અ; સંવાઈ તાઈ વંહે, ઈહ સંતો તત્થ સંતાઈ ..૧..

ખમાસમણ

ધુઢ્છામિ ખમાસમણે. વંદિં જવણિજનાએ નિસિ-હિઆએ મત્થઅણુ વંદામિ .

જવંત કે વિ સાહુ

જવંત કે વિ સાહુ, લરહેરવયમહાવિહેહે અ; સંવેસિં તેસિં પણુએ, તિવિહેણ તિદંડવિરયાણું ..૧..

નમેડહોંત

નમેડહોંતસિદ્ગાચારોપાધ્યાયસર્વસાધુભ્યઃ.

શ્રી સિદ્ગાચારલલનું સ્તવન

વિમલાચલ નિતુ વંદીએ, કુને એહની સેવા,
માતું હાથ એ ધર્મનો શિવતરુ ઇણ દેવા. વિમલાચલ૦ ૧
ઉચ્ચવલ જિનગૃહ મંડળી, તિંદાં દીપે ઉત્તાંગા,
માતું ડિમગિરિ વિષ્ટ્રમે, આઈ અંખરગંગા. વિમલાચલ૦ ૨
કોઈ અનેરું જગ નહિં, એ તીરથ તેણે,
એમશ્રીમુખ હરિ આગળે, શ્રી સીમંધર એલે. વિમલાચલ૦ ૩
જે સધળાં તીરથ કર્યા યાત્રા ઇણ કણીએ;
તેહથી એ ગિરિ લેટા શતગણુ ઇણ લહીએ. વિમલાચલ૦ ૪
જનમ સર્ઝણ હોય તેહનો જે એ ગિરિ વંદે;
સુજ્ઞશ વિજ્ઞેય સંપદ લહે તે નર ચિર નંદે. વિમલાચલ૦ ૫

જય વીયરાય

જય વીયરાય ! જગણુરુ ! હોઉ ભમ તુહ પલાવએ લયવં !
લવનિવેચો મગગાળુસારિએ ધંકુરેલસિદ્ધિ ..૧..
દોગવિરુદ્ધચાએ શુરુજણપૂઆપરથકરણુંચ;
સુહશ્રુણેગો તબવણું-સેવણાચાલવમણંડા ..૨..
વારિજજઈ જઈવિનિઆણુણધણું વીયરાય ! તુહ સમયે;
તહદિ ભમ હુજા સેવા લવે ભવે તુહુ ચદણાણ ..૩..
હુકુમકુમચો કરુમકુમચો, સમાહિમરણું ચ એહિલાલો અ;
સંપજ્ઞા મહાયેઅં તુહ નાહ પણમકરણેણું ..૪..
સર્વમંગલ માંગલ્યં; સર્વકલ્યાણુકારણુમં;
પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમુ ..૫..

આરિહંત—ચેહાણું

આરિહંત ચેહાણું, કરેમિ કાઉસગાં! વંદળુવત્તિ-
આએ પૂઅણુવત્તિઆએ, સક્કારનતીઆએ, સમ્માણુવત્તિઆએ,
બોહિ જાખવત્તિઆએ નિરૂપસગાવત્તિઆએ સદ્ગાએ મેહાએ,
ધીઈએ, ધારણાએ આણુપેહાએ વહુમાણીએ ડામિ કાઉસગાં

અન્તથ—ઉસસિએણું

અન્તથ ઉસસિએણું, નીસસિએણું, ખાસિએણું, છીએણું
અંભાઇએણું ઉડુએણું. વાયનિસગેણું. લાલિએ પિત્તમુ-
ચાણાએ ! સુહુમેહિ અંગસંચાલેહિ સુહુમેહિ જેલવં-
ચાલેહિ” સુહુમેહિ દિદૃસંચાલેહિ એવમાઈએહિ આગારેહિ
અભગો અવિરાહિએ, હુનજ મે કાઉસગો જાવ અરિહતાણું
ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ. તાવકાયં ડાણેણું,
મોણેણું, આણેણું અપાણું વોસિરામિ.

[પછી એક નવકારનો કાઉસગા કરવો. કાઉસગા
પારી નમોજહુંત કહી સ્તુતિ કહેવી.]

શ્રી શત્રુંજ્ય-સ્તુતિ

શ્રી શત્રુંજ્ય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદ્દાર,
ઠાકુર રામ અપાર ! મંત્ર માંહે નવકાર જ જાણું,
તારામાં જેમ ચંદ્ર વણાણું, જલધર જલમાં જાણું .
પાંધીમાંહે જેમ ઉત્તમ હંસ, કુળ માંહે જેમ ઋપલનો વંશ,
નાલિતણો એ અંશ, ક્ષમાવંતમાં શ્રી અરિહંત,
તપશ્ચરા સુનિવર મહંત, શત્રુંજ્યગિરિ ગુણવંત ..૧..

શૈતયવંદન અલ્ગુ

(ઉપર શાંતિનાથ ભગવાનના દેરાસરે કરવાતું)

શી શાંતિ જિનેશ્વર સોલમાં, અચિરાસુત વદ્દે;

વિશ્વસેન કુલ તલોમણિ લવિજન સુખકંદ્રે; ૧

મૃગલંઘન જિન આહિએ, લાખ વરસ પ્રમાણિ;

હત્યિણાઉર નયરી ધણી, પ્રભુલ ગુણમણિ ખાણુ ૨..

આલીશ ધનુષની હેડીએ, સમચોરસ સંઠાણુ;

વદન પદ જયું ચંદ્રો, દીકે પરમ કલ્યાણુ ..૩..

[પછી જઈચિ-નમુટ્યુણુ-જાવંતિ કહી, ખમાસમણુ
દ્વારા જાવંત અને નમોડહર્ત કહી સ્તવન કહેવું.]

શી શાંતિનાથજિનરતવન

હમ મગન લયે પ્રભુ ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં

હમ મગન લયે પ્રભુ ધ્યાનમેં,

બિસર ગઈ દુવિધા તનમનકી, અચિરાસુત શુન ગાનમેં.

હમ૦૧

હરિહર પ્રક્ષ પુરંદરકી ઝડ્ઢિ, આવત નાહિ કોઈ માનમે;

ચિદાનંદકી મોજ મચી હૈ, લમતારસકે પાનમેં. હમ૦ ૨

ઇતને હિન તું નાહિ પિછાન્યો, મેરો જનમ ગાયો સો અજનમેં;

અખ તો અધિકારી હોઈ હોઈ, પ્રભુ શુન અખ્ય ખજન મેં.

હમ૦ ૩

ગઈ હીનતા સખી હમારી, પ્રભુ ! તુજ સમકિત હાનમેં;

પ્રભુ શુન અનુલબ રસકે આગે, આવત નાહિ કોઈ માનમેં.

હમ૦ ૪

જિનહી પાયા તિનહી છીપાયા, ન કહે કોઉકે કાનમેં;
તાવી લાગી જખ અનુભવકી, તથ જને કોઈ સાનમેં.

હુમ્બુ

પ્રભુ ગુન અનુભવ ચંદ્રહાસ જ્યોં. સો તો ન રહે મ્યાનમેં;
વાચક જથું કહે મોહુ મહાઅરિ, જીત લીધો હે મેદાનમેં.

હુમ્બુ

અષ્ટક

[ત્યારખાદ જ્યવીયરાય—અરિહંતચૈધયાણું—અનનતથ કહી
એક નવકારનો કાઉસળ કરવો, પારી—નમોડહુતું કહી સ્તુતિ
કહેવી.]

શ્રીશાંતિનાથ સ્વામીનીસ્તુતિ

શાંતિ જિનેશ્વર સમરીએ, જેની અચિરમાય,
વિશ્વસેનકુલ ઉપન્યા, મૃગલંઘન પાય;
ગજપુર નયરીનો ધણી, કંચનવરણી છે કાય,
ચાદીસ ધનુષની દેહડી, લાખ વરસતું આય ...૧..

ચંદ્રાંદન નીજું

[રાયણુપગલાતું.]

વિમલગિરિવર સયદાનધહુર, ભવિકજનમનરંજનો;
નિજરૂપધારી પાયહારી આદિજિનમહલંજનો,
જગણુવ તારે લસમ કારે સયદ અરિદ્દ્દિલ—ગંજનો,
પુંડરીક-ગિરિવર શૂંગશોલે આદિનાથ નિરંજનો...૧..
અજ અમર અચલ આનંદરૂપી, જન્મ-મરણ—વિહુંડનો,
સુર-અમુર ગાવે ભક્તિભાવે, વિમલગિરિ જગમંડનો,
પુંડરીક-ગણુધર રામપાંડવ, આહિ લે ખડુ મુનિવરા,
અહાં મુક્તિ રામા વર્યા રંગો કર્મકંટક સહુ જરા ..૨..

કોઈ તીર્થ જગમાં અન્ય નાંહી વિમલગિરિ સમ તારકં;
દુર જવિઆ કે અલજિઆ સહા દૃષ્ટિ નિવારકં;
એક ગીતે પાંચલે લવ વડે શિવ હુઃખ વારકં,
યહ આશાધારી શરણ ધારી આતમા હિતકારકં..૩..
[પછી જંકિયિ-નમુખ્યણ-નવંતિ-કહી, અમાસમણુ દ્દી,
નવંત અને નમોર્હ્ત કહી રત્વન દહેવું.]

રાયણ પગડાનું સ્તરન

નીલુડી રાયણુતરુતળે-સુણુસુંહરી
ઘીલુડા પ્રલુના પાયરે ગુણુમંજરી;
ઉજ્જીવધ્યાને ધ્યાએ .. સુણ .. એહુ જ સુફિત ઉપાયરે
.. સુણ .. ૧..
શીતલ છાયાએ એસીએ .. સુણ .. રતો કરી ને રંગરે
ગુણું
પૂજિએ સોવન કુલડે .. સુણ .. જેમ હોય પાવન અંગરે
.. સુણ .. ૩..
ઘીર ઝરે જેહ ઉપરે .. સુણ .. નેહ ધરને .. એહ રે
ગુણું
ગીતે લવે તે શિવ લહે. સુણ. થાયે નિર્મલ હેહ રે
ગુણું ૩
પ્રીત ધરી પ્રદક્ષિણા. સુણ. દીએ એહને કે સાર રે
ગુણું
અલંગ પ્રીતિ હોય જેહને સુણ. લવ સવ તુમ આધાર રે
ગુણું ૪
કુસુમ પત્ર રેખ મંજરે. સુણ. શાયા થડુને મૂલ રે
ગુણું

દેવ તણું વાસાય છી. સુણું. તીરથને અણુકુલ રે
ગુણું ૫.

તીરથ ધ્યાન ધરો સુદા. સુણું. સેવો એહની છાય રે
ગુણું ૬.

જ્ઞાનવિમલ ગુણું ભાખિઓ. સુણું. શત્રુંજય માહાત્મ્ય મણી રે
ગુણું ૬.

[ત્યારખાદ જ્યવીયરાય—અરિહંત ચૈદીઆણું—અનન્તથ
કહી, એક નવકારનો કાઉસળ્ણ કરી; નમોર્હત-કહી સ્તુતિ
કહેવી.]

સ્તુતિ

શ્રી શત્રુંજય આદિજીન આબ્યા પૂર્વ નવાણું વારણ,
અનંત લાલ ઠણું જિનવર જાણી સમોસર્યાનિરધારણ,
વિમગિરિકર મહિમા મોટો સિદ્ધાચલ એણું ઠામજી,
કાંકરે કાંકરે અનંતા સિધ્યા, એકસો ને આઠ જિરિ નામજી..૧..

ચૈત્યવંદન—ચૈદું

[શ્રી પુંડરીકિસામીતું ચૈત્યવંદન]

આહીશ્વર જિનરાયનો, ગણુધર ગુણવંત

પ્રગટ નામ પુંડરીકિસા, મહીમાંહે મહંત. ૧.

પંચ કોડી સાથે મુણ્ણિહ, અણુસણું તિહાં કીધ

શુકુલ ધ્યાન ધ્યાતાં અમૂલ કેવલ તિહાં લીધ ૨.

શૈત્રી પુનમને દીને એ, પાચ્યા પદ મહાનંદ

તે દિનથી પુંડરીકિરિ, નામ દાન સુખકંદ. ૩

[પછી જાકિચિં—નમુખુણું—જાવંતિ—કહી, ખરમાસમણું

જાવંત—અને નમોર્હત કહી સ્તવન કહેવું.]

શ્રીપુંડરીકસ્વામીનું સ્તવન

એક દિન પુંડરીક ગણુધરુ રે લાલ,

પૂર્ણ શ્રી આદિજિષુંદ સુખારી રે
કહીયે તે લવજલ ઉતરી રે લાલ,

પામિશ પરમાનંદ લવવારી રે. એક ૧
કહે જિન ઈણ ગિરિ પામશો રે લાલ,

શાન અને નિરવાણ જ્યકારી રે
તીરથ મહિમા વાધશો રે લાલ,

અધિક અધિક મંડાણ નિરધારી રે એક ૨
ઇમ નિસુણીને ઈહાં આવ્યા રે લાલ,

ધાતી કરમ કર્યો ફૂર તમવારી રે
પાંચ કોડ મુનિ પરિવર્યા રે લાલ,

હુંઆ સિદ્ધિ હળુર લવવારી રે. એક ૩
ગૌત્રી પૂરમ દિન કીળુયે રે લાલ,

પૂળ વિવિધ પ્રકાર હિલ ધારી રે
કુલ પ્રદક્ષિણા કાઉસગા રે લાલ,

લોગસ્સ થુઈ નમુક્કાર નરનારી રે. એક ૪
દ્શ વીશ વીશ ચાદીશ લલા રે લાલ,

પચાસ પુણ્યની માળ અતિસારી રે. ૫
નરશાવ લાહો લીળુયે રે લાલ,

જેમ હોય શાન વિશાલ મનોહારી રે. એક ૦
[ત્યારથાદ-જ્યનીયરાચ-અર્દિહંત ચેઠિયાણું-અનનત્ય કહી
એક નવકારનો કાઉસગા કરી પારી-નમોહંત કહી સ્તુતિ
કહેવી]

શ્રી પુંડરીકદ્વામીની સ્તુતિ

પુંડરીક મંડળું પાય પ્રણામીને, આદીશરજિનચંદ્રાલું
નેમિ વિના ત્રેવીશ તીર્થકર, જિરિ ચાઢિયા આણાંદાલું
આગમ માંહે પુંડરીક મહિમા, લાઘ્યો જાનછિંદાલું
શૈત્રી પૂત્રમહિન હેવી ચક્કેસરી, સૌભાગ્ય ધોસુખ કંદાલું ૧

શૈ યત્નંદન પાંચમું

(મૂલ નાયક પ્રભુનું)

વિમલ કેવલ જ્ઞાન કંમલા, કલિત-ત્રિલુલન હિતકરં;
સુરરાજ-સંસ્તુત-ચરણુપંકજ-નમો આદિ જિનેશ્વરં ૧
વિમલગિરિવરશ્રુંગમંદણુ, પ્રચર ગુણગણુ-ભૂધરં;
સુર-અસુર-કિનનર-કોડીસેવિત નમો આદિ જિનેશ્વરં ૨
કરતી નારક કિરીગણુ, ગાયજિનગુણુ મનહરં;
નિર્જરાચલી નમો અઢોનિશ-નમો આદિ જિનેશ્વરં ૩
પુંડરીક ગણુપતિ સિદ્ધિ સાધી, કોડી પણ મુનિ મનહરં;
શ્રી વિમલગિરિવરશ્રુંગસિદ્ધા-નમો આદિ જિનેશ્વર ૪
નિજ સાધ્ય સાધક સુર મુનિવર કોડીનંત એ ગિરિવર;
મુક્તિ રમણી વર્યા રંગે, નમો આદિ જિનેશ્વર ૫
પાતાલનર સુરલોકમાંહી, વિમલગિરિવર તો પરં;
નહિં અધિક તીરથ તીર્થપતિ કહેન-નમો આદિ જિનેશ્વર ૬
એમ વિમલગિરિવરશિખર મંડળુ, હુઃખ વિહુંડળુ ધ્યાધયે;
નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પરમ જ્યોતિ નિપાદયે ૭

જિત મોહકોઠ વિશ્વાદ નિદ્રા, પરમ પદ્ધસ્થિત જયકરં;
ગિરિરાજ સેવા કરણુતત્પર પદ્મવિજય શુહિતકર ૮
[પછી જંકિચિ નમુથુણું જવાંતિ કહી, અમાસમણું
દ્ધિ, જવાંત, અને નમોર્દીત કહી, સ્તવન કહેવું]

શ્રી ઋષલદેવસ્વામીનું રત્વન

માતા મરુદેવીના નંદ, હેખી તાહરી

મૂરતિ ભારું મન લોલાણું ૭

મારુ દિલ લોલાણું ૮ હેખી ૦

કરુણા નાગર કરુણા સાગર, કાયાકંચન વાન;

ઘારા લંછન પાઉલે કંઈ, ધનુષ પાંચસે માન. માતા૦ ૧

ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્વદાખાર;

નેજનગામિની વાણી મીઠી, વરસંતી જલધાર. માતા૦ ૨

ઉર્વશી રૂઢી અપસરાને, રામા છે મન રંગ,

ધારે નેજર રથુજણે કંઈ, કરતી નાટારંલ. માતા૦ ૩

તું હી અદ્વા તું હી વિધાતા, તું જગ તારણુહાર;

તુજ સરીએં નહી દેવ જગતમાં,

અરવડીયા આધાર. ..માતા૦ ..૪..

તું હી આતા તું હી ગ્રાતા, તું હી જગતનો દેવ

સુરનર કિન્નર વાસુદેવા,

કરતા તુજ પદ સેવ માતા. ..૫..

શ્રી સિદ્ધાચલ તીરથ કેરો, રાજ ઋષલ જિણું ૯;

કીર્તિ કરે માણેકમુનિ તાહરી,

દાળો લવ લય કેંદ્ર ..માતા૦ ૦૬..

[પછી જ્યવીયરાય૦-અરિહુંતચેઈઆણું૦-અનનથ૦-કહી,
એક નવકારનો કાઉસગ્ગ કરવો. કાઉસગ્ગ પારી, નમેડહુંત-
કહી સ્તુતિ કહેવી.]

શ્રી નાથભદેવસ્વામીની સ્તુતિ

શ્રી સિદ્ધાચલ મંદિર, નાથલ જિલ્લાં દ્વારા,
મરુદેવાનંદન, વંદન કરું ગણું કાળ;
એ તીરથ જાણી; પૂર્વ નવોળું વાર,
આદીસીર આવ્યા, જાણી લાલ અપાર .૧.

(3) શ્રી સિદ્ધગિરિજીનાં સ્તવનો

(૧)

શેનુંલ ગઢના વાસીરે, મુજરૈ માનજોરે,
સેવકની સુણી વાતો રે દીલમાં, ધારને રે
પ્રભુ મેં દીડી તુમ હેઠાર, આજ મને ઉપજયો હર્ષ અપાર,
સાહિયાની સેવા રે, લવહુઃખ લાંજશો રે .૧.
એક અરજ અમારી રે, દીલમાં ધારને રે, ચોરાશીલાખ ફેરારે,
ફર નિવારજોરે, પ્રભુ! મને હુર્ગતિ પડતો રાખ,
દરિસણ વહેલું રે દાખ, સાહિયાની સેવારે,
લવહુઃખ લાંજશો રે. ૨

દોલત સવાઈ રે, સોરઠ દેશની રે,
અલિહારી હું જાઉં રે તારા વેશની રે,
પ્રભુ! તારુ રૂકું હીકું રૂપ,

મોદ્યા સુરનરવું દને ભૂપ. સાઠ લવ ઉ
તીરથ કો નહિ રે શેખુંજ્ય સારખું રે,
પ્રવચન હેણી રે કીધું તારુ પારખું રે,
અધ્યક્ષને જેઠજેઠ હિરાએ કેહ વિભુવન લીલા પામે તેહ
સાઠ લવ ૪

અથો લવ માણું રે, પ્રભુ તારી સેવના રે,
લાવઠ ન લાંગેડે જગમાં તે વિના રે,
પ્રભુ ! મારા પૂરો મનના કોઠ, એમ કહે ઉદ્ઘરતન કરજેઠ
સા લવ૦ ૫

(૨)

(વીર કને જઈ વસીયે ચાલોને સખિ. એ દેશી)
વિમલાચલ જઈ વસીયે, ચાલોને સખિ !

વિમલાચલ જઈ વસીયે,
આહિ અનાહિ નિગોદમાં વસીયે, પુન્ય ઉદ્ઘે નીકસીયે,
ચાર ગતિમાં ભ્રમણુ કરીને, લાખ યોરાશી ઝરસીયે. ચાલો ૧
હેવ નારકી તિર્યાચમાંછી વળી, હુઃખ સંદ્યાં અહનિસીયે,
પુન્ય પ્રભાવે મનુષ્યભવ પામી દેશ આરજમાં વસીયે.
ચાલો ૨

હેવગુરુને કૈન ધર્મ પામી, આતમરૂપ્દ્વિ ઉલ્લસીયે;
શ્રી સિદ્ધાચલ નયણે નિહાળી, પાપ તિમિરથી અસીયે
ચાલો ૩

કાલ અનાહિના મોહરાચનાં; મરી લઈ મુખ ધસીયે;
શ્રી આદીશર ચરણ પસાયે; ક્ષમાખ્રદ્ગ લઈ ધસીયે
ચાલો ૪

મોહને ભારી આતમ તારી; શિવ પૂરમાં જઈ વસીયે;
જિન ઉત્તમ રૂપ નિહાલી, કેવલ લક્ષ્મી ફરસીયે ચાલો પ

(3)

શ્રી રે સિદ્ધાચલ લેટવા, સુજમન અધિક ઉમાણ્ણો;
ऋપલદેવ પૂજા કરી, લીને ભવ તણો લણાવો. શ્રીરે ૧
મણિમય મૃત્તિ શ્રી ઋપલની, નીપાઈ અલિરામ;
લવન કરાવ્યાં કનકનાં, રાગ્યાં ભરતે નામ. શ્રીરે ૨
નેમ વિના ત્રેણીસ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર બાળી;
શેન્નુંજાણ સમુ તીરથ નહીં, યોદ્યા સીમંધર વાણી. શ્રીરે ૩
પૂરવ નવાણું સમોસર્યા, સ્વામી શ્રી ઋપલ જિણાંદ;
રામ પાંડવ સુગતે ગયા, પાગ્યા પરમાનંદ. શ્રીરે ૪
પૂરવ પુણ્ય પસાઉલે, પુંડરીકગિરિ પાયો;
કાંતિવિજય હરએ કરી, શ્રી સિદ્ધાચલ ગાયો. શ્રીરે ૫

(4)

નગ્રા નવાણું કરીએ વિમલગિરિ જાત્રા નવાણું કરીએ
પૂરવ નવાણું વાર શેન્નુંજાગિરિ ઋપલ જિણાંદ સમોસરીયે
વિ ૦ જા ૦ ૧

કેઢી સહસ ભવ પાતક ત્રુટે; શન્નુંજય સમો ડગ ભરીયે
વિ ૦ જા ૦ ૨

સાત છઠ દોય અઠુમ તપસ્યાં; કરી ચઠિયે જિરિવરીયે
વિ ૦ જા ૦ ૩

પુંડરીક પદ જપીએ મન હરએ, અધ્યવસાય શુલધરીયે
વિ ૦ જા ૦ ૪

માપી અલવી નજરે ન હેઠે, હિસ્ક પણ ઉદ્ધરીએ
વિ૦ જા૦ ૫

ભૂમી સંથારો ને નારી તણો સંગ, દૂર થકી પરીડરીએ
વિ૦ જા૦ ૬

સચિત્ત પરિહારી ને એડલઆહારી શુરુ સાથે પહોંચીએ
વિ૦ જા૦ ૭

પડિકમણું દોય વિધિશું કરીએ, પાપ પડલ વિધરીએ.
વિ૦ જા૦ ૮

કલિકલે એ તીરથ મોટું, પ્રવહણ નિમ લર દરીએ.
વિ૦ જા૦ ૯

ઉત્તમ એ ગિરવિર સેવંતા, પર્ણ કહે લવતરીએ.
વિ૦ જા૦ ૧૦

(૪)

વિમલગિરિ કથું ન. લયે હુમ મોર, ૨

સિદ્ધવડ રાયણ રુખી શાખા, જુલત કરત ઝકોર, વિમલ ૧.

આવત સંધ રચાવત અંગિયાં, ગાવત શુણ ઘમધોર,

હુમ લી છત્ર કલા કરી નિરખત, કટને કર્મ કહોર. વિમલ. ૨

મૂરત હેખ સહા મનહુરાએ, જૈસે ચંદ ચકોર;

શ્રી રિસહેસર દાસ તિહારો, અરજ કરત કરનોર. વિમલ ૩

(૬)

સિદ્ધાચલ વહોરે નરનારી, નરનારી નરનારી સિદ્ધા.૦

નાલિસાયા મરુદેવાનંદન, ઋપલદેવ સુઅકારી.સિદ્ધા.૦ ૧

પુંડ્રીક મસુહા મુનિવર સિદ્ધા, આતમતત્ત્વવિચારી. સિદ્ધા.૦ ૨

શિવસુખકારણ ભવહુઃખવારણ, ત્રિજીવન જન હિતકારી.

સિદ્ધાંત

સમકિતશુદ્ધ કરણ એ તીરણ, મોહ મિથ્યાત્વ નિવારી. સિદ્ધાંત ૪
જ્ઞાનઉદ્ઘોત પ્રલુબ કેવલધારી, ભક્તિ કરું એકતારી. સિદ્ધાંત ૫

(૭)

સિદ્ધાચલનાવાસી, વિમલાચલનાવાસી,

જિનણુ જ્યારા, આદિનાથને વંદન હમારા;
પ્રલુલનું સુખડું મલકે, નયનોમાંથી વરસે અમિધારા—આદિ
પ્રલુલનું સુખડું મનકે મિલાકર,
દ્વિલમેં લક્ષિતની જ્યોત જગાકર;

ભજલે પ્રલુને લાવે, હુર્ગતિ કહિ નહિ આવે. જિનણુ—આદિ૦
લમીને લાખ ચોરાસી હું આયો,

સુન્યે દરિસણ તુમારું પાયો;
ધન્યહિન મારો, ભવનો ઝેરો ટાળો. જિનણુ—આદિ૦
અમે તો માયાના ચિલાસી,

તુમે તો સુકિતપુરીના વાસી;
કર્મખંધન કાપો, મોક્ષ સુખ આપો. જિનણુ. આદિ૦
અરણુ ઉરમાં ધરને અમારી,

કહે હર્ષ હવે સાચા રવામી તુમે,

પૂજન કરીએ અમે. જિનણુ. આદિ૦

(૮)

ગિરિરાજકા પરમ જથુ ગાવના, વીતરાગકા ગીતરસ ગાવના;
અતિ ખહુમાન ધ્યાન રસીદે, જિતપદ પદમ હેખાવના. ગિરિ૦ ૧
પ્રલુ તુમ છાડી અવરકે દ્વારે, મેરે કુખું ન જરના. ગિરિ૦ ૨

જયું ચાતકું જવદ સહીલવિષુ, સરોવર નીર ન ભાવના ગિરિ૦ ૩
 જયું અધ્યાત્મલખ વેહિકં કબુહું, એરકો ન ધ્યાવના. ગિરિ૦ ૪
 સામ્યલખન મનમંડપ માંહિ' આપ વસે પ્રભુ પાવના ગિરિ૦ ૫
 આહિ કારણુ કે આહીશર જિન, શત્રુંજય શિખર સુહાવના ગિરિ૦ ૬
 ભરતલૂપતિ વિરચિત ગિરિટટ, પાવીતાણાનગર દેખાડના. ગિરિ૦
 જ્ઞાનવિમલ પ્રભુ વ્યાન ધરત હે અરમાનંદ પદ પાડના. ગિરિ,

(૬)

હેઝો માઈ આજ ઋષસ ધર આવે

સ્નપ મનોહર જગઠાનંદન સખહિકો મન ભાવે હેઝો ૦ ૧;
 કેઈ સુકૃતાકુલ થાળ વિશાળા, કેઈ મણિ માણેક ભાવે હેઝો ૦ ૨;
 હૃથગથ રથ પાયક અહુ કન્યા, પ્રભુલુકું વેળો વધાવે. હેઝો ૦ ૩;
 શ્રી શ્રેયાંસકુમાર દાનેશર, ધક્કુરસ વહેલાવે. હેઝો ૦ ૪;
 ઉત્તમદાન દિયે અમૃત રસ. સાધુ કીર્તિ ગુણ ગાવે. હેઝો ૦ ૫

(૧૦)

તું ત્રિલુલન સુખકાર, ઋષલજિન ! તું ત્રિલુલન સુખકાર
 શત્રુંજયગિરિ શાણુગાર, ઋષલ૦ ભૂપણુ ભરતભાર ઋષલ૦

આહિ પુરુષ અવતાર ઋષલ૦

તુમ ચરણે પાવન કર્યું રે, પૂર્વ નવાણું વાર;

તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર ઋષલ. ૧

અવર તે ગિરિ પર્વતે જડારે એહ થયો ગિરિશાન;

સિદ્ધ અનંત ઈંડાં થયારે વળી આવ્યા અવર જિનરાજ ઋષલ૦ ૨

સુંદરતા સુરસદનથીરે, અધિક જિહા પ્રાસાદ'

ખિંબ અનેક શોભતારે, દીઠ ટળે વિખવાદ. ઋષલ૦ ૩

लेटष्ट कोळे उमहुंरे; आवे सवि लवि वोळ;
 कलिमल तस अडके नाहुरे, जयुं सोवन धन रोळ. ऋषल०४
 ज्ञानविमल प्रभु जस शिरेरे, तस खसे लव परिवार;
 करतल शिव सुंदरीरे, मखे सहज उच्छांह. ऋषल०५

(११)

जिषुंदा तोरे यरणुकमलकीरे हुं चाहुं सेवा थारी;
 तो नासे कर्मकारी, लव-लांति भी गई सारी. जिषुंदा० २
 विमलगिरि राजेरे भहिमा अति गाजेरे, आजे जग डंका तेरा
 तुं सच्या साहिण भेरा, हुं बालक चेरा तेरा जिषुंदा० २
 करुणाकर स्वामीरे, तुं अंतर जमीरे, नामी जग पूनमयंदा
 तुं अजर-अमर सुणकंदा, तुं नालिराया कुल नंदा. जिष० ३
 धृष्णुगिरिसिद्धारे, मुनी अनंत प्रसिद्धारे; प्रभु पुंडरीक गणधारी;
 पुंडरीक गिरिनाम कहारी, यह सण भहिमा है थारी. जिष० ४
 तारक, जग दीडारे पापपंक सहु नीडारे, इच्छा भो मनमां लारी,
 भें कीनी सेवा थारी, हुं मास रहो शुलचारी. ७० ५
 अण मेहे तारोरे जिरुद निहालोरे, तीरथ जिनवर हो लेठी
 भें ७०-म जरा हुःए भेरी, हुं पायो गुणनी पेरी. जिषुंदा० ६
 द्रविड वारिभिदवारे; दशकोडी मुनि भिवारे;
 हुआ मुक्तिरमणुक्षरतारा कर्तिक पूनम हिन सारा,
 जिन शासन जग जयकारा. जिषुंदा० ७
 संवत शिखि चारारे, निधि ईहु उदारारे,
 आतमको आनंदकारी जिनशासनकी अदीडारी,
 पाच्छा लवजलधि पारी. जिषुंदा ८

અધિક જિનેથીર સવામીરે. અરજુ માહરી.

અવધારે। કાંઈ ગણુ ભુવનના દેવનો,

કરુણાનંદ અખંડરે જ્યોતિ સ્વરૂપ છો,

એહવા જોઈને મેં આહરી તુમ સેવનો....અધિક-૧

લાખ ચોરાશિરે યોનિરે વારો વાર હું ભર્યો,

ચ્યાવિશે હંડકે બોલગ્યુ મહારું મનનો,

નિંગોદાહિક ઝરસીરે સ્થાવર હું થયો,

એમરે લમતો આવ્યો વિકલેન્દ્ર ઉપનનો....અ-૨

તિર્યાંચ પંચન્દ્ર તથારે લવ મેં બહુ કર્યા,

ઝરસી ઝરસી ચૌદ્રરાજ મહારાજનો

દશ દષ્ટાંતે દોહિલા રે મનુષ્ય જન્મ અવતયો,

એમ રે ચડતો આવ્યો શોરીએ, શિવ કાજનો....અ-૩

જગતણું જગ બંધવા જગ સથથવાહ છો,

જગતગુરુ જગરકખણુ એ દેવનો,

અજ અમર અવિનાશીરે જ્યોતિ સ્વરૂપ છો,

સુરતર કરતા તુજ ચરણોની સેવનો....અ-૪

મહુદેવીના નંદનરે વંદના મહારી

અવધારે। કાંઈ પ્રભુજ મહારાજનો,

ચૌદ્રરાજનો ઉચ્છીષ્ઠો પ્રભુજ તારીએ,

દીલુએ કાંઈ વાંચિત ઝળ જિનરાજનો....અ-૫

વંદના માહરી નિસુણીરે પરમ સુખ દીલુએ,

કીળચેરે કાંઈ જન્મ ભરણુ હુઃખ હુરણે,
પદ્મવિજ્ય સુપ્રસાચેરે ઋષલજિન લેટીયા,
નિત વંદો કાંઈ પ્રહ ઉગમતે સૂરણે....૩-૬

૧૩

સિદ્ધગિરિ મંડન પાય નમીક્રે, રિસહેસર જિનરાય રે;
નાલિભૂપ મરુદેવી નંદન, જગત જંતુ સુખદાયરે....

સ્વામિ ! તુમ દરિસણુ સુખકાર રે....૧
લારે કર્મી પણુ તેં તાર્યો, લવજલધિથી ઉગાર્યો રે;
મુજ સારીખા કિમ નવિ સંલાર્યો, ચિતથી કિમ ઉતાર્યારે ર
પાપી અધમ પણુ તુમ પસારે, પામ્યા શુણુ સમુદ્દરાય રે;
અમે પણ તરણુ તુમ શરણ સ્વીકારી; મહેર કરો મહારાયરે ર
તરણુ તારણુ જગમાંહિ કહાવો, હું છું સેવક તારો રે
અવર આગળ જઈને કેમ જાયુ, મહિમા અધિક તુમારોરે ૪
મુજ અવગુણુ સામું મા જોણે, બિર્દદ તમાર્દ સંલાળો રે
પતિત પાવન તુમ નામ ધરાવો, મોહ વિદંધના ટાળોરે ૫
પૂર્વ નવાણું વાર પદ્મારી, પવિત્ર કથું શુલ ધામ રે
સાધુ અનંતા કર્મ અપાવી, પહોંચ્યા અવિયલ ઢામરે ૬
શ્રી નય વિજ્ય વિભુધ પથ સેવક, વાયક જસ્ત કહે સાચુંરે.
વિમલાયલ લૂપણુ સ્તવનથી આનંદ રસલાર યાચું, રે.

(૧૪)

ઓ....સિદ્ધગિરિમંડન સાહિખા, સાહિખા,
હું યાત્રા કરવા આવ્યો, મને લવજલ પાર ઉતારો. ઓ....
નાલિકુલકર વંશ દીપાવ્યો, મરુદેવી માતાએ હુલરાવ્યો.

શુગલાધર્મ નિવારીનેરે, ચલવિહ ધર્મ અતાયો.
 પહેલા રાજ પ્રથમ મુનિશ્રી આદિજિન કહાયો. મને૦ ૧.
 પૂર્વ નવાળુંવાર પધાર્યો; મહિમા તીર્થ ગવાયા,
 પુંડરીક ગણુધર મોક્ષ સિધાયા, પાંચ કોઠી મુનિરાયા;
 ભરતેશ્વર ઉદ્ઘારજ કીધ્યો, રત્નના બિમણ સ્થપાયા. મને૦ ૨
 દ્રાવિડને વારિભિદ્વલુરે, જલી મધ્યાદી સિદ્ધ થયા,
 હેવકીના છ પુત્રો સિદ્ધ ને પાંડવો મુક્તે ગયા;
 શામ ભરત ને શામ્ય પ્રદુમન વળી કેદ મોક્ષ ગયા. મને૦ ૩
 આ તીરથને મહિમા લારી, કેમે કીધ્યો ન જાય;
 અનંતા લંઘ્યો પાપ ખપાવી, કર્મથી રહિત થાય;
 લવસિંધુમાં દુખી રહીછે, મારી નૈયા કેમ પાર થાય મને૦ ૪
 પંદર ક્ષેત્રને ત્રણ ભુવનમાં, તીરથ જ્યજ્યકારી;
 વિવિધ નામે પ્રગત થયું, જિનથાસન સુખકારી;
 પ્રેમ-જમ્બૂસૂરી પાર ઉતારો નિત્યાનંદ પહ ધારી ! ૫ મને

(૧૫)

હૈતસમાનને અસિસમાનને, જે તારે હિલ આવેરે,
 નાગર સજજનારે કોઈ સિદ્ધગિરિરજ લેટાવેરે.
 પૂલવેરે કરસાવેરે, અતલાવેરે, હેખાવેરે ગવરાવેરે નાગર સજજ-
 નારે. કોઈ ૧
 અતિહિ ઉમૈયોને અહુદિન વહિયોરે,
 માનવના વૃંદ આવેરે. નાગર સ. કોઈ સિ ૪
 ધવલ હેવકીઅંને, સુરપતિ ભલિયારે,
 કોઈ ચારે પાંજે ચઢાવેરે, નાગર સ. કોઈ ૦ સિ ૩

શ્રી જિત નિરાખિત, હરભીત હોવેરે,

તૃષ્ણિત ચાતક ધન પાવેરે. નાગર સ. કોઈઠો સિં ૪
નારિક ગીતને વાળુંન્ન વાગેરે.

કોઈ મનગમતા નાદ સુણુવેરે. નાગર. સ. કોઈ. સિ. ૫
ધન્ય ધન્ય તે બૃહપતિને નરપતિ,

કોઈ સંધપતિ તિલા કરાવેરે. નાગર સં ૦ કોઈ સિં ૬
સકલ તીરથમાંણી સમરથ એ ગિરિ,

કોઈ આગમના પાઠ સુણુવેરે. નાગર સં ૦ કોઈ સિં ૭
ઘેર બેડાં પણ એ ગિરિ ગાવેરે,

શ્રી જ્ઞાન વિમલ સુખ પાવેરે નાગર સ. કોઈઠો સિં ૮

(૧૬)

જાતા નવાણું કરીએ વિમલગિરિ, જાતા નવાણું કરીએ.

મૂર્વ નવાણું વાર શન્નુંજયગિરિ, ઋષભજિણુંં સમોસરીએ.

વિં ૦ યાં ૧

કોઈ સહસ ભવ પાતક તુટે, શૈનુંંલ સામો ડગ ભરીએ.

વિં ૦ યાં ૨

સાત છટુ દોય અટૂમ તપસ્યા, કરી અઢીએ ગિરિવરીએ.

વિં ૦ યાં ૩

પુંડરીક પદ જીપીએ મન હરાએ, અધ્યવસ્થાય શુલ ધરીએ.

વિં ૦ યાં ૪

ચ્યાપી અલબ્ય ન નજરે હેએ, હિંસક પણ ઉદ્ધરીએ.

સૂમિ સંથારોને નારી તણો સંગ હુદ્ધથડી પરિહદીએ. વિં ૦ યાં ૬

સચિત પરિહારી ને એકલ આહારી, ગુરુ સાથે પદ્યરીએ
વિ૦ યા૦ ૭

પડિકમણું દોય વિધિશું કરીએ, પાપ પહોળ પરિહરીએ.
કલિકાંને એ તીથર મોટું પ્રવહણ જેમ લરદરીએ વિ૦ યા૦ ૮
ઉત્તમ એ ગિરિવર સેવંતા, જી કહે લવ તરંએ
વિ૦ યા૦

(૪) ચૈત્યવંદનો।

(૧) શ્રી આદીકૃત ભગવાનનું ચૈત્યવંદન
જ્ય જ્ય નાલિનરિંદ નંદ, સિદ્ધાચલ મંણ
જ્ય જ્ય પ્રથમ જિણુંદ્યંદ, લવહાખ વિહંદણ. ૧
જ્ય જ્ય સાધુ સુરિંદ વૃંદ, વંદીએ પરમેશ્વર
જ્ય જ્ય જગદાનંદ કંદ, શ્રી રૂપલ જિણુસર. ૨
અમૃત સમ જિન ધર્મનો એ દ્વારાક જગમા જાણ,
તું જ પદ પંકજ પ્રીતધર, નિશદિન કલ્યાણ જાણ ૩

(૨) શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન
જ્ય જ્ય શાંતિ જિણુંદ દેવ, હૃતિનાઉર સ્વામિ;
વિશ્વસેન કુલ ચંદ સમ, પ્રભુ અંતરજલમિ. ૧
આચિરા ઉર સુર હંસદો, જિનવર જ્યકારી;
મારી રોગ નિવારકે, કૃતિં જગ વિસ્તારી, ૨
સોદમા જિનવર પ્રણમીએ એ, નિત્ય ઉડી નામી શિશ;
સુર નર પ્રસન્ન મન, નમતાં વધે ન. ગીસ, ૩

(3) श्री नेमनाथ भगवान्तुः चौत्यवंहनः

नेमिनाथ बावीसमां, शिवादेवी भाय;

ससुद्र विजय पृथ्वीपति, वे प्रलुना ताय.

दश धनुषनी हेडी, आयु वरस छलेर;

शंख लंछनधर स्वामील, तल राङ्गुल नार.

सौरीपुरी नयनी लदी, अह्माचारी भगवान्;

जिन उत्तम पद पद्मने, नमतां अविचल थान.

(4) श्री पार्श्वनाथ भगवान्तुः चौत्यवंहनः

आश्रुरे प्रलु आसल, तोडे लव पास;

वामाभाता जनभीआ, अहि लंछन जास.

अख्सेन सुत सुभकर, नवहाथनी काया,

काशी देश वण्णारसी, पुष्टे प्रलु आया.

ऐक्सो वरसनु आउभुं ए, पाणी पासकुमार,

पद्म कडे मुगते गया, नमतां सुभ निरधार.

(5) श्री महावीर स्वामि भगवान्तुः चौत्यवंहनः

सिंधारथ सुत वंहीये, त्रिश्वानो जायो;

क्षत्रियकुंडमां अवतर्यो, सुरनरपति गायो.

भृगपति लंछन पाउयो, सात हाथनी काया,

बहृतेर वर्षनु आउभु, वीरजिनेश्वर राया.

क्षमाविजय जिनराजनो ए, उत्तम शुण्य अवहात;

सातभालथी वर्णव्यो, पद्मविजय विघ्यात.

(૫) સ્તવનો

શ્રી આદીકર ભગવાનનું સ્તવન

જાનરચયણુયરુરે, સ્વામી શ્રી ઋપલ જિષુંડ;
 ઉખગારી અરિહા પ્રલુ, રૈ લોક લોકેતાર નંદરે,
 ભવિયા લાવે ભને ભગવંત, મહિમા અતુલ અનંતરે. ભવિયા ૧
 તિગ તિગ આરક સાજરુરે, કોડા કોડી અથાર,
 જુગતા ધર્મ નિવારીથેરે, ધર્મ પ્રવર્તન હારરે. ભવિયા ૨
 જાનાતિશયે લંઘનારે, સંશ્યય છેઠનહાર,
 હેલ નરતિરિ સમળ્યાંરે, વચ્ચનાતિશય વિચારરે. ભવિયા ૩
 ચાર ધને ભધવા સ્તવેરે, પૂજાતિશય મહંત,
 પંચ ધને ચોજન ટળેરે, કષ્ટ એ તુર્ય પ્રસંતરે. ભવિયા ૪
 ચોગ ક્રેમંકર જિનવરુરે, ઉપશમ ગંગાનીર,
 પ્રીતિ ભક્તિપણે કરીરે, નિત્ય નમે શુલવીર રે. ભવિયા ૫

૨

શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન.

મહારો મુજરો લ્યોને રાજ, સાહિખ શાંતિ સલૂણા.
 અચિરાલુના નંદન તોરે, દર્શન હેતે આવ્યો,
 સમકિત દિઝ કરેને સ્વામી, ભક્તિલેટણું લાવ્યો.

મહારો ૧

હુઃઅ લંજન છે જિરુદ તમારું, અમને આસ તુમારી,
 તુમે નિરાગી થઈને ધૂટો, શ્રી ગતિ હોશે અમારી.

મહારો ૨

૧૯૫

કલેશો દ્વોક ન તાણી કલેવું, એવડું સ્વામી આગે,
પણ બાલક જો બોલી ન જાણે, તો કેમ ઠહાલો લાગે
મહારો ૩

ઠહારે તો તું સમરથ સાહિય, તો કિમ ચોછું માતું
ચિંતામણી જેણે ગાઠે ખાંધ્યું, તેણે કામ કિસ્યાનું.
મહારો ૪

અદ્યાતમ રવિ ઉભ્યો મુજ ધટ, મોહ તિમિર હર્યું જુગતે
વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુલ બગતે.

મહારો ૫

શ્રી નેમનાથ ભગવાનનું રત્નવન

૩

નેમિ નિરંજન નાથ રે, અંજનવણું શરીર
પણ અજ્ઞાનતિમિરને રણે જીત્યો મનમથવીર....રે
પ્રષામો ગ્રેમ ધરીને પાયા પામો પરમાનંદા રે
યદુકુલચંદા રાયા રે, માત શિવાઢે નંદા નેમિ ૧
રાજુમતિશુ, પૂરવલસવની પ્રીત લડી પેરે પાળારે
પાણિયહણુ સંકેતે આવી તોરણુથી, રથ વાળીરે. નેમિ ૦ ૩
અભળા સાથે પ્રીત ન જોડો એ પણ ખંચ કહાણીરે
એકરસે ઓહું પ્રીત થઈ તો કીર્તિ કોડ ગવાણીરે. નેમિ ૦ ૪
ચંદન પરિમલ જિમ જિમ ઘીરે ધૃત એકર્ષ્ય નહિ અળગા
દુમિ જે પ્રીત નિર્વાહિ નિશાહિન, ગુણશુંરે વળઅં. નેમિ ૪
દુમિ એકંગી જે નર કરસે તે ભવસાયર તરશોરે,
જાનવિમલ લીલા તે ધરશે શિવસુંદ્રિ તસ વરશોરે. નેમિ ૫

श्री पार्थ्यनाथ लगवान्तुं स्तवन

कौयल टहुड़ी रही मधुभनमें,
पार्थ्य शामलीया वसो मेरे दीलमें,
कारी देश वण्णारसी नगरी,
जन्म लीयो प्रबु क्षत्रीयकुलमें, कौयल० १
आलपण्णामां प्रबु अद्भुत ज्ञानी,
कमठड़ो मान होयो एक पक्षमें. कौयल० २
नाग नीकाला काष्ठ चीराकर,
नागड़ो कीयो सुरपती एक छीनमें, कौयल० ३
संयम लाई प्रबु वीचरवा लाज्या,
संयमे लींज गयो एक रंगमें. कौयल० ४
समेतरीभर प्रबु भोक्ते सीधाया,
पार्थ्यकुड़ो महीमा ग्राण लुवनमें. कौयल० ५
उद्यरतनकी एही अरज है,
दील अटकयो तोरा यरणु कमलमें. कौयल० ६

श्री महावीर त्वामीनुं स्तवन

वंहो वीर जिनेश्वरराया, प्रिश्वताहेवी जयारे,
हरिलंघन कंचनवर्णु काया, अमरवधु लहरायारे. वंहो १
आलपण्णु सुरगिरि डालाया, अहि वैताल हराया रे;
ईदू कहणु व्याकरणु निपाया, पंडितविस्मय पायारे. वंहो २

त्रीय वरथ धरवास वसाया, संयमश्यु लय लायारे;
 आर वरस तप कर्म अपाया, केवणनाणु उपायारे. वहो ३
 भायक ऋद्धि अनंती पाया, अतिशय अधिक सुखायारे;
 चार रुप करी धर्म वताया, यज्ञिक सुरगणु गायारे. वहो ४
 तीन लुवनमें आण भनाया, दश होय छन्न धरायारे,
 रुप कनक भणुगठ विरचाया, निर्णय नाम धरायारे. वहो ५
 रथशु सिंहासन ऐसणु ढाया, हुंहुलि नाट अजयारे,
 दानव मानव वासव आया, अक्तो शीस नभायारे. वहो ६
 प्रबु गुणु गणु गंगा जल नाह्या, पावन तेहनी कायारे,
 पंडित क्षमाविज्ञय सुपसाया, सेवक जिन सुख दायारे. वहो ७

(६) स्तुतिओ।

१

श्री आहिनाथ भगवाननी स्तुति

आहि जिनवरराया, जस सोवन काया,
 भरहेवी भाया, धोरी लंछन पाया,
 जगत स्थिति निपाया, सुख यारिति पाया;
 केवलसिरि राया, भौक्ष नगरे सधाया. १

२

श्री शांतिनाथ भगवाननी स्तुति

गजपुर अवतारा, विध्यसेनकुमारा
 अवनितदे उदारा, यज्ञविलङ्घी धारा;
 प्रति द्विष्ट सवारा सेविये शांति सारा;
 लपज्जलधि पारा, पाभीये क्रेम पारा. १

(૨) શ્રી નેમિનાથ જિન સુતિ

સજુલવર તારી રૂપથી રતિહારી,
 રેખાના પરિહારી ભાલથી ઘ્રણયારી
 પણુચાં ઉગારી હુઅા ચારિત્રધારી;
 કેવળસિરી સારી પારીયા ધાતીયાનારી—૧

(૩) શ્રી પાર્થિનાથ જિન સુતિ

શાખેશર પાસળુ પૂલુએ, નરભવનો લાડો લીલુએ;
 મન વંધિત પૂરણુ સુરતલ, જયવામા સુત અહવેસઠ ૧

(૪) શ્રી મહાનીર જિન સુતિ

મહાનીર જિણુંદા રાય સિદ્ધાર્થનંદા
 લંછન મૃગઈન્દા જાસ પાચે સોહંદા;
 સુરિનર વરધન્દા, નિત્ય સેવા કરંદા,
 ટાળે લલ ઇંદ્ર, સુખ આપે અમંદા ૧



વિભાગ પાંચમો

નવાણું પ્રકારની પૂજા

શ્રી શાનુંજય મહિમા ગર્ભિત

(શ્રી વીરવિજયલુ મહારાજ કૃત.)

પૂજાની વિધિ

જ્વલનથી નવ આવડો અને ઉત્કૃષ્ટથી નવાણું આવડો છળથ
લઘુને ઉલા રહેલું. તથા નવ જાતિના અગિઆર અગિઆર ઇણ,
નવ જાતિના અગિઆર અગિઆર નૈવેદ, લાવવા દરેક પૂજા બખ્રતે
નવ નવ નંબ મૂકવા. નવ નર દીપક અને નવ સાધિયા કરવા. કુલ
નવાણું-નવાણું થાય. પ્રથમ સ્નાત પૂજા લખાવીને હાથમાં ઝળા,
નૈવેદ, ઇણ, વગેરે લઈને ઉલા રહેતું.

પહેલી પૂજા

હાંડા

શ્રી શાંખેશ્વર પાસળુ, પ્રણામી શુલ્ક ગુરુ પાય;
વિભાગાચલ ગુણ ગાધશું, સમરી શરદ માય. ૧
આચે એ ગિરિ શાશ્વતો, મહિમાનો નહિ પાર;
પ્રથમ જિણુંદ સમોચયો, પૂર્વ નવાણું વાર. ૨
અહીય દીપમાં ચો સમો, તીર્થ નહિ દુલદામાં

કલિયુગે કદ્વપતરૂ લઈ, સુક્રતાઇલશુ' વધાય. ૩

યાત્રા નવાણુ' કે કરે, ઉત્કૃષ્ટે પરિણ્યામ;

પૂજા નવાણુ' પ્રકારની, રચયતાં અવિચલ ધામ. ૪

નવ કલશો' અલિષેક નવ, એમ એકાદશ વાર;

પૂજાદીઠ શ્રીકૃલ પ્રમુખ એમ નવાણુ' પ્રકાર. ૫

દાળ જુંભાડાની દેશી

યાત્રા નવાણુ' કરીએ સહુણ્ણા, કરીએ પંચ સનાત. સુનંદાનો

કંત નમો.

ગણાણુ' લાખ નવકાર ગળ્ણાજે, હોય અદ્દુમ છકુ સાત. સું ૧

રથયાત્રા પ્રદક્ષિણા ઢીલે, પૂજા નવાણુ' પ્રકાર. સું ૨

ધૂપ દીપ ઇલ નિવેદ મૂકી, નમીએ નામ હજાર સું ૨

આઠ અધિક શાત દુંક લલેરી, મહેણી તિંહાં એકવીશ; સું ૩

શત્રુંજ્ય ગિરિ દુંક એ પહેલી. નામ નમો નિશદ્ધિશ, સું ૩

સહસ અધિક આઠ મુનિવર સાથે, બાહુભલિ શિવ ઠામ; સું ૩

બાહુભલી દુંક નામ એ બીજું, ત્રીજું મર્દહેવી નામ. સું ૪

પુંડરીકગિરિ નામ એ ચોથું, પાંચ ડેડી મુની સિદ્ધ; સું ૪

પાંચગી દુંક રૈવતગિરિ, કહીએ તેણે એ નામ પ્રસિદ્ધ સું ૫

વિમલાચલ સિદ્ધરાજ ભગીરથ. પ્રણુમીને સિદ્ધક્ષેત્ર; સું ૫

છરી પાલી એણે ગિરિ આવી; કરીએ જનમ પવિત્ર. સું ૬

પૂજાએ પ્રલુ રીજવુંડ, સાધું કાર્ય અનેક સું ૬

શ્રી શુલવીર હૃદ્યમાં વસને; અદ્યેલા ધડી એક. સું ૭

કાવ્યદુતવિવાનિતકૃતમ्

ગિરિચરં વિમલાચલ નામક; ઋષભમુખ્ય ગિરિનાંગ્રિ પવિત્રિતમ્

હૃદિ નિવેશ્ય જલૈ જીન પૂજન; વિમલામાધ્યકરોમિ નિજતમકમ્

મંત્ર:

ઓં ઈં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃતયુ
નિવારણાય શ્રીમતે જિનેંદ્રાય જલાદિકિ યજ્ઞમહે સ્વાહા।
(કાવ્ય અને મંત્ર પ્રત્યેક પૂજા દીઠ કહેવાના)

ખીલ પૂજા

દોહા

અકેકું ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજ્ઝ્વાલ;
કોડિ સહસ ભવનાં કથ્યોં, પાપ અપે તત્કાલ. ૧
દાલ (રાગ પૂર્વી-ધરી ધરી સાંલરો શાંતિ સલુણા)
ગિરિવર દરિસણુ વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ અપાવે; ગિરિ૦
અધ્યક્ષ જિનેશ્વર પૂજા રચાવે, નવ નવ નમે ગિરિ ગુણ
ગાવે. ગિરિ૧

સહસ્રક્રમલ ને સુક્રિનિષ્ઠાય ગિરિ, સિદ્ધાચલ શતકૂટ
કહાવે; ગિરિ૦

દંક કહાયને કોડિનિવાસો, લોહિત્ય તાલદેવજ
સુરગાવે. ગિરિ૦ ૨
દંકાદિક પંચકૂટ સળુલન, સુર નર સુનિ મળી નામ થપાવેગિરિ૦
રયણુ ખાણુ જડી ખુટી ગુંડાઓ, રસ ફૂંપિકા ગુરુધાંહાં અતાવે.

ગિરિ૦ ૩
પણ પુષ્યવંતા પ્રાણી પાવે, પુષ્ય કારણુ પ્રભુ પૂજા રચાવે; ગિરિ૦
દશકોટી શ્રાવકને જમાડે, નૈનતીર્થ યાત્રા કરી આવો. ગિરિ૦ ૪
તેથી એક સુનિ દાન હિયંતા, લાલ ધણો સિદ્ધાચલ થાવે; ગિરિ૦

અંદ્રશોભર નિજ લગિની સોણી, તે પણ એ ગિરિ મોક્ષે જાવે.

ગિરિ૦ ૫

આર હત્યારા નર પરદારા, ડેવગુરુ દ્રવ્ય ચોરી આવે; ગિરિ.
ચૌત્રી કાર્તિકી પુનમ યાત્રા, તપ જ્યે ધ્યાનથી પાપ જલાવે.

ગિરિ૦ ૬

ઝડપસેન જિન આહિ અસંખ્યા, તીર્થંકર મુક્તિ સુખ પાવે;

ગિરિ૦

શિવ વધૂ વરવા મંડપ એ ગિરિ, શ્રીશુભવીર વચન રસ
ગાવે, ગિરિ૦ ૭

કાઠં ગિરિવરં૦

મંત્રઃ

ઓં હ્રી શ્રી પરમં .. જલાદિકંયો .. સ્વાહા ..



ત્રૈણ પૂજા

દોઢા

નેત્રી વિના તેવીશ પ્રલુ, આવ્યા વિમલ ગિરીંદ;
લાલી ચોણીશી આજાંશો, પદ્માનાભાહિ કિલ્લુંદ. ૧

દાશ મનમોહન મેરે-એ દેશી

ધન ધન તે જગ પ્રાણીઓ મન મોહન મેરે;

કરતા ભક્તિ પવિત્ર, મનમોહન મેરે

પુષુપરાશી મહાબલ ગિરિમ૦ હઠાકિત શતપત્ર. મ૦ ૧

ત્રિજ્ઞાનંદ વખાણીએ મ૦ કાદ્રંકર મહાપીઠ. મ૦

સુરગિરિ મહાગિરિ પુષ્પમારી મ૦ આજ મેં નજરે ઢીક.

મ૦ ૨

ઓશી ચોજન પ્રથમારડે, મ૦ જિતોર સાડ પચાશ. મ૦
આર ચોજન સાત હાથનો મ૦ છુંઠે પણોળો પ્રકાશ; મ૦ ઉ
પંચમ કાલે પામવો મ૦; દુલ્લહણ પ્રભુ દેહાર; મ૦ તૃ
એકાંદ્રિય વિકલેંદ્રિમાં મ૦ કાલ્યો અનંતો કાલ મ૦ ૪
પંચાંદ્રિય તિર્યાંબમાં; મ૦ નહીં સુખનો લબ્દેશ ૦
શુણ્ણા અક્ષર ન્યાયે લદ્ધો મ૦ નરલભ ગુરુ ઉપહેશ. મ૦ ૫
ખહુશુત ચરણની સેવના મ૦ વસ્તુ ધર્મ મોળખાણુ મ૦
આત્મસ્વરૂપ રમણે રમો; મ૦ ન કરે જુઠ ડંદાણુ મ૦ ૬
કારણે કારજ નીપજે; મ૦ દ્રવ્ય તે ભાવ નિમિત. મ૦
નિમિત વાસી આત્મા, મ૦ ખાવના ચંદ્ન રીત. મ૦ ૭
અન્વય વ્યતિરેક કરી મ૦ જિન સુખ દર્શાન રંગ. મ૦
શ્રી શુભવીર સુખી સહા, મ૦ સાધક કિરિયા અસંગ. મ૦ ૮

કાવ્ય ગિરિવરં

મંત્ર ઓં ઝી શ્રી પરમાણુદ્દિકં ય૦ સ્વાહા

ચાથી પૂજા

હોણા

શેનુંલ નહી નાહીને, સુખ બાંધી સુખ કોશા;
દેવ યુગાદિ પૂજુણો, આણ્ણી મન સંતોષ. ૧

દાળ

(અને હાંરે વહાલોળ વાય છે વાંસલીરે-એ દેશી)
 અને હાંરે વહાલો વસે વિમલાચલેરે; જુહાં હુઆ ઉદ્ધાર
 અનંત વાં ૨
 અં ૩ વહાલાથી, નહિ બેગલારે, મુને વહાલો લાગે
 સુનંદાનો કંત વાં ૧

અં ૪ આ અવસર્પિણી કાલમાંરે, કરે ભરત પ્રથમ ઉદ્ધાર; વાં ૫
 અં ૫ થીને ઉદ્ધાર પાટ આઠમેરે, કરે હંડીવિરજ ભૂપાલ વાં ૨
 અં ૬ સીમંધર વયખ્યા સુણીરે, નીને કરે ઈશાનેંદ્ર; વાં ૩
 અં ૭ સાગર એક કોડિ અંતરેરે, ચૈથ્યા ઉદ્ધાર માહેંદ્ર વાં ૩
 અં ૮ દશ કોડી વલી સાગરેરે, કરે પંચમ પંચમ ઈંદ્ર વાં ૪
 અં ૯ એક લાખ કોડિ સાગરેરે, ઉદ્ધાર કરે ચમરેંદ્ર. વાં ૫
 અં ૧૦ ચક્ર સગરઉદ્ધાર તે સાતમોરે, આઠમો વ્યાંતરેંદ્રનો સાર;
 અં ૧૧ તે અભિનંદન ચંદ્રપ્રભુ સમેરે, કરે ચંદ્રજસા ઉદ્ધાર. વાં ૬
 અં ૧૨ નંદન શાંતિજિષુંઢનારે, ચક્રાયુધ દશમ ઉદ્ધાર; વાં ૭
 અં ૧૩ અગીઆરમો રામચંદ્રનોરે, બારમો પાંડવનો ઉદ્ધાર. વાં ૮
 અં ૧૪ નીશ કોડી મુની સાથી પાંડવારે, ઈંહા વરીઆ પદ મહાનંદવાં ૯
 અં ૧૫ મહાનંદ કર્મસુદષુ કૈલાસ છે રે પુષ્પહંતજ્યંત

આનંદ. વાં ૧

અં ૧૬ શ્રીગુર હસ્તગિરિ શાંખતોર, એ નામ તે પરમ
 નિધાન વાં., શ્રી શુભવીરેની વાણીએરે, ધરી કાન
 કરો બહુમાન. વાં ૮

કાન્ય - ગીતિવર,

મંત્ર ઓં હી શ્રી પરમો જલાદિં ય૦ સ્વાહા

પાંચમી પૂજન

હોંડા

ચાથે આરે એ થયા, સવિ મોટા ઉદ્ધાર;
સૂક્ષ્મ ઉદ્ધાર વચ્ચે થયા, કહેતાં નાવે પાર. ૧

દાલ (તેને તરણિથી વડોરે-એ દેશી.)

સંવત એક અઠલાંતરે, જાવડશાનો ઉદ્ધાર. ઉદ્ધરને મુજ
સાહિયારે, નાવે કરી સંસાર હો જિનળું લક્ષ્ણ હૃદયમાં
ધારનેદે, અંતર ગૈરી વારનેરે, તારને દીનહયાળ. ૨

ખાહડ મંત્રીએ ચૌહમોરે, તીથેં કર્યો ઉદ્ધાર, બારતેરોત્તર
વર્ષમાંરે, વંશ શ્રીમાલી સાર. હો જિનળું લક્ષ્ણ ૩

સંવત તેર એકોતરેંરે, સમરાશા ઓસવાલ;

ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતારે, પન્નરમો ઉદ્ધાર. હો જિનળું
લક્ષ્ણ ૪

પન્નરસેં સત્યાસીએરે, સોલમો એહ ઉદ્ધાર; કર્મશાએ
કરાવીએરે, વરતે છે જય જયકાર. હો જિનળું લક્ષ્ણ ૪

સૂરિ હૃદ્યસહ ઉપહેશથીરે, વિમલ વાહન ભૂપાલ,
છેલ્લો ઉદ્ધાર કરાવશેરે, સાસય ગિરિ ઉનમાલ. હો
જિનળું લક્ષ્ણ ૫૦

ભાવચગિરિ સિદ્ધશેખરોરે, મહાજસ ને ભાવ્યવંત
પુથવીપીઠ હુઃખર ગિરિરે, મુક્તિરાજ મણિકંત.

હો જિનળું લક્ષ્ણ ૬

મેઢમહિધર એ ગિરિરે, નામે સદ્ગ સુખ થાય
શ્રીશુભવીરને ચિત્તથીરે, ધરીય ન મેલણ જય હો
જિનળું લક્ષ્ણ ૭

કાવ્ય-ગિત્તિરૂપ

મંત્ર-ઓં હી શ્રી પરમાં જલાહિકિં યો સ્વાહા.

છઠી પૂજા

હાણા

સિદ્ધાચલ સિદ્ધિવર્યાં ગૃહી મુનિલિંગ અનંત,
આમે અનંતા સીજશો, પૂજે લવિ ભગવંત. ૧

દાઢા

(રાગ-મતુરેમે ચતુરી ડાણ જગત કી મોહની)

સખરેમે સખરી ડાણ જગતકી મોહની કુપલ જિનંદકી
પદિમા, જગતકી મોહની રથથું મૂર્તિં લરાઈ જગતકી
મોહની હાંહારે જગત પ્યારે લાલ જગતકી મોહની. એ
આંકણી. લશ્ટે લરાઈ સોય પ્રમાણુલે કરી, કાંચનગિરિએ
એડાઈ દેખત હુનિયાં ડરી હાંહારે દેખતો પ્યાં દેખ
સખરે ૧ સાતમોકારમેં ચક્કી સગર સુરચિંતવી, દુઃખમ
કાલ વિચાર ગુજરામેં જાઠવી. હાંહારે ગુજરાં પ્યાં ગું
હેવહેવી હરશૈજ પૂજનકું લવતે, પૂજાકો ઠાડ બનાય સાંચું
ગુણ ગાવતે. હાંહારે સાંચું ૦ પ્યાં સાંચું ૨ સખરે ૦
અભસરા ધુંઘટ પોલકે આગેં નાચતે ગીત ગાન ઔર
તાન ખડા હરિ દેખતે. હાંહારે ખડા૦ પ્યાં ખ૦ જિન
ગુણ અમૃતપાનસે મગન લઈ ઘડી, ઠમ ઠમકે પાઉ
અલૈયાં લે ખડી. હાંહારે ખલૈ પ્યાં ખ૦ સખરે ૦ ૩
યા રીત લક્ષ્મિ મગનસેં, સુરસેવા કરે, સુર સાનિધ્ય
નરહર્ષન લવ ત્રીજે તરે. હાંહારે લવ૦ પ્યાં લ૦ પશ્ચિમ
હિશિ સોપન ગુજરામેં ન્હાલતે તીનેં કાંચનગિરિ નામ

કે ફુનિયાં બોલતે હાંહારે કે ફુનિયાંં ખ્યાં ફું સખરે
૪ આનંદધર પુણ્યકંદ જ્યાનંદ જનીએ પાતાલમૂલ
વિલમાસ

વિશાળવખાણીએ હાંહારે વિશાં ખ્યાં વિં જગતારણ
આકુલાંક એ તીરથ માનીએ શ્રી શુલવીશ વિવેકે પ્રશુક
પીછાનીએ હાંહારે પ્રલું ચ્યારે પ્ર૦ પ સખરે

કાંચ ગિરિવરં

મંત્રઃ એં હ્રી શ્રી પરમ૦ જગતાદિં થ૦ સ્વાહા।

સાતમી પૂજા

દોષ

નમિ વિનમિ વિદ્યાધરા ઢોય કોડિ મુનિરાય,
સાચે સિદ્ધિ વધુ વર્યો શશ્વતજ્ય સુપસાય. ૧

દાદ

(રાગ-સહસાવનમાં એક દિન શ્વામી)

આવ્યા છુ આશલર્યારે વાંલાળુ અમે આવ્યારે આશલર્યો.
એ આંકળ્ણી. નમિપુત્રી ચોસઠ મલીને કુષલ પાઉ પર્યો,
કરનેડી વિનચે પ્રલુ આગે, એમ વયણું ઉચ્ચચ્યારેવા ૧
નમિ વિનમિ ને પુત્ર તમારા રાજ્યલાગ વિસ્યો.
દીન દ્વારે દીધો પામી આજલગે વિચર્યારે. વાં ર
આદ્ય રાજ્ય ઉલ્લગી પ્રલુ પાસે, આવે કાજ સથ્યો,
અમે પણ તાતળુ કારજ સાંદું, સાનિદ્ધય આપકર્યારે. વાં ત
એમ વદંતી પાગે ચઠટી અનશન ધ્યાન ધર્યો,
કેવલ પામીકર્મને વામી જયોતિસેં જયોતિ મિલ્યારે વાં ૪

એક અવગાહને સિદ્ધ અનંત હુગ ઉપરોગ વર્ણી,
કૃતસિદ્ધેશ પ્રદેશ અસંખ્યિત ગુણુંકાર કર્યારે. વાં ૫
અકુર્માંક મહાતીરથ હેમગિરિ અનંત શક્તિ લયી
પુરુષોત્તમને

પર્વતરાજ જ્યોતિસ્ત્ર્ય વર્ણી વાં ૬ વિલાસભદ્ર સુભ-
દ્રવ્યો નામે સુષુપ્તાં ચિત્ત ડર્યી શ્રી શુલ્વવીર પ્રલુ અલિ-
ષેકે, પાતક હુર હુર્યારે. વાં ૭.

કાન્ચ-ગિરિવર-

મંત્ર ઓં હ્રી શ્રી પરમ૦ જલાદિક ય૦ સ્વાહા

આઠમી પૂન

દ્રાવિડને વારિભિલલા, દશ કોડિ અણુગાર;
સાથે સિદ્ધિ વધુ વર્ણી, વંદુ વારંવારે. ૧

દાસ (તે રણ અછું કયું યાદેરે-એ. દેશી)

લરતને પાટે ભૂપતિરે, સિદ્ધિ વર્ણી એણે ઠાય; સલૂણા
અસંખ્યાતા તિહા લગેરે, હુઆ અળુત જિનરાય. સલૂણા ૧
જેમ જેમ એગિર જેઠીએરે, તેમ તેમ પાપ પલાય સ૦
અજિત જિનેશ્વર સહિયોરે, ચોમાસુ રહી જાય સ૦ જે૦ ૨
સાગાર મુનિ એક કોડીશુરે, તોખ્યા કર્મના પાસ; સ૦
પાંચ કોડિ મુનિરાજશુરે લરત લદ્યા શિવવાતા. સ૦ જે૦ ૩
આઠીશ્વર ઉપકારથીરે, સાત્તર કોડી સાથ; સ૦
અજિતસેન સિદ્ધાચલેરે, આલ્યો શિવ વધુ હાથ સ૦ જે૦ ૪
અજિતનાથ મુનિ ચૈત્રનીરે પૂનમે દશ હુલર સ૦
આદિત્યશા મુક્તિ વર્ણારે એક લાખ અણુગાર સ૦ જે૦ ૫

અજરામર ક્ષેમંકડે અમરકેતુ ગુણુકંદ; સ૦
 સહસ્રપત્ર શિવંકડે કર્મક્ષયતમઃકંદ, સ૧૦ જો૧૦ દ
 રાજરાજેથીર એ ગિરિરે નામ છે મંગલ ઝૂપ; સ૦
 ગિરિવર રજ તરુ મંજરીરે, શિશ ચંડાવે ભૂપ. સ૧૦ જો૧૭
 દેવયુગાહિ પૂજતાંરે કર્મ હોયે ચક્ષૂર સ૦
 શ્રી શુભવીરને સાહિબારે, રહેણે હુઠડા હજૂર. સ૧૦ જો૧૮
 કાવ્ય ગિરિવરં

મંત્ર ઓં હ્રીં શ્રીં પરમ૦ જલાહિકં ય૦ સ્વાહા

નવમી પૂજા

હોંડા

રામ લરત ગ્રણુ કોડિથું, કોડિ મુનિ શ્રીસાર;
 કોડિ સાડિ આઠ શિવ વર્યા, સાંખ પ્રધુભન કુમાર. ૧
 હાલ (ઉચ્ચા ને અથબેલોરે, હામણગારા કાનુડો-એ દેશી.)
 સિદ્ધાચલ શિખરે હીવોરે, આદીશર અલબેલો છે.
 દર્શન અમૃત પીવોરે; આ૧૦, શિવ સોમયશાની લારેરે આ૧૦
 તેર કોડિ મુનિ પરિવારેરે આ૧૦, સિ૧૦ ૧ કરે શિવસુદ્રીનું
 આણુરે, આ૧૦ નારદળ લાખ એકાણુરે આ૧૦
 વસુહેવની નારી પ્રસિદ્ધિરે આ૧૦ પાંત્રીશ હજાર તે
 સિદ્ધિરે. આ૧૦, સિ૧૦ ૨. લાખ ખાવનને એક કોડિરે આ૧૦,
 પંચાવન સહસ્રને જેડીરે, આ૧૦, સાતસેં સત્યોતેર સાધુરે આ૧૦,
 પ્રલુ શાંતિ ચ્ચામાસું કીધુરે આ૧૦, સિ૧૦ ૩
 તવ એ વરીઆ શિવનારીરે આ૧૦, ચૌદ સહસ મુનિ
 ઇમિતારીરે આ૧૦,

પ્રધુમનભિયા અચ્યાલીરે આ, ચૌઅાલીસસે વૈદ્યલીરે
આ૦, સિ૦ ૪.

થાવચ્ચાપુત્ર હુભરેરે આ૦, શુક્ર પરિવાજક એ ધારેરે
આ૦, સેલગ પણુસય નિખ્યાતરે, આ૦, સુલદ સુતિ સયા
સાતરે આ૦, સિ૦ ૫.

ભવતરીઆ તેણું ભવતારણુરે આ૦, ગજયંડ્ર મહોદ્ય
કારણુરે આ૦,

સુરકાંત અચ્યાલ અલિનંદ્રોરે આ૦ સુમતિ
અધ્રા લયકંદ્રોરે આ૦, સિ૦ ૬.

ઇહાં મોક્ષ ગયા કેઈ કોટિરે આ૦, અમને પણ આશા
શારીર આ૦, શ્રદ્ધા સંવેગે લરીએારે આ૦, મેં મોટે
કરીએા તરીએારે આ૦, સિ૦ ૭.

શ્રદ્ધા વિષુ કુણુ ઇહાં આવેરે આ૦, લધુજળમાં કેમ તે
નાવે રે આ૦,

તેણું હાથ હવે પ્રભુ જાલો રે આ૦ શુભવીરને હૃદ્દિ
વહાલો રે આ૦, સિ૦ ૮.

કાય ચિરિવરં

મંત્ર એં હું શ્રી પરમો જલાદિકં ય૦ સ્વાહા

દ્રામી પૂજા

હોંઠા

કદંબ ગણુધર કોડશું, વલી સંપ્રતિ જિનરાજ;
થાવચ્ચા તસ ગણુધરું, સાહુરાજું સ્વિદ્ધા કાજ. ૧

દાલ (બના ધન્ય જિનવાણી—એ દેશી)

એમ કેદ સિદ્ધિ વર્યા મુનિરાયા, નામથી નિર્મલ કાયા
રે, એ તીરથ તારુ.

જલી ભયાલી ને ઉવયાલી, સિદ્ધા અનશાન પાલી રે એ.
દેવકી ષટનંદન ઈહાં સિદ્ધા, આતમ ઉજ્જ્વલ કીધા રે, એ૦ ૧
ઉજ્જ્વલગિરિ મહાપત્ર પ્રમાણો, વિશ્વાનંદ વખાણો રે
એ૦ રે. ૨

વિજયભાડ ને ઈંગ્રેઝકાણો, કહીએ કુપહીવાસો રે એ૦,
સુક્રિતનિકૈતન કેવલહાયક, ચર્ચિગિરિ ગુણુલાયકરે એ૦ ૩
એ નામે લય સઘલા નાસે, જ્યકમલા ધરવાસે રે એ૦,
શુકરાળ નિજરાજ્ય વિલાસી, ધ્યાન ધરે ષટમાસીરે એ૦ ૪
દ્રવ્યસેવનથી સાળ તાળ, જેમ કુકડો ચંદ્રરાજરે એ૦,
ધ્યાતા ધ્યેય ધ્યાન પહ એકે લાવથી શિવઇલટેકે રે એ૦ ૫
દાલને છંડી અદ્વાને વલગો. જાણો ન થાયે અલગો રે૦
મૂલ ઉધ્વે અધશાખા ચારે છંદ્પૂરાણે વિચારે રે એ૦ ૬
ઈન્દ્રિયડાલાં વિષય પ્રવાલા જાણુંતા પણ બાળા રે એ૦,
અનુલબ અમૃત જાનની ધારા, જિનશાસન જ્યકારારે એ૦ ૭
ચાર હોષ કિરિયા છંડાણી, ચોગાવંચક પ્રાણી રે એ૦,
જિરિવર દર્શાન ઇરસન યોગે, સંવેહનને વિયોગેરે એ૦ ૮
નિર્જરતો ગુણુશ્રેણે ચડતો, ધ્યાનાંતર જર્જ અડતોરે એ૦,
શ્રી શુભબીર વસે સુખમેને, શિવસુંહરીની સેનેરે એ૦ ૯

કાંય ત્રિરિવરં૦

મંત્રાં: હીં શ્રીં પરમ૦ જંતાદિકં ય૦ રવાહો

અગ્રીચારમી પૂજા

હાડા

શતુંજયગિરિ મંણોણા, મરુદેવાનો નંદ;

ચુગલાધર્મ નિવારકોણ, નમો ચુગાદિ જિણુંદ ૧

ઢાલ (વારકુમારના વાતળી કેને કષીએ—એ દેશી)

તીરથની આશાતના નવિ કરીએ, નવિ કરીએ રે નવિ કરીએ;

ધૂપધ્યાનઘટા અનુસરીએ, તરીએ સંસાર તીરથ૦ ૧

આશાતના કરતાં થકાં ધનહાણી, ભૂખાં ન મણે અન્નનેપાણી;

કાય વલી રોગે લરાણી, આ લવમાં એમ તીરથ૦ ૨

પરલવ પરમાધારીને વશ પડશે, ગૌતરણી નહીમાં લદશે;

અગ્રિને કુંડે ખલશે, નહીં શરણું કોય તીરથ૦ ૩

પૂર્વ નવાળું નાથળું ઇહાં આવ્યા, સાધુ કેઇ મોશે સિધાવ્યા;

શ્રાવક પણ સિદ્ધ સુહાવ્યા, જપતાં ગિરિ નામ તી૦ ૪

અષ્ટોત્તરશતકુટ એ ગિરિધારે, સોંદર્ય યશોધર નારે;

પ્રાતિમંડન કાસુક કારે, વલી સહાજનંદ તી૦ ૫

મહેંદ્રદ્વબજ સરવારથ સિદ્ધ કહીએ, પ્રિયાંકર નામ;

એ લહીએ;

ગિરિ શીતલ છાંચે રહીએ, નિત્ય ધરીએ ધ્યાન તી૦ ૬

પૂજા નવાળું પ્રકારની એમ કીજે, નરલવને લાહો લીજે;

વળી દાન સુપાત્રે હીજે॥ અઠતે પરિણામ તી૦ ૭

સેવનક્ષત્ર સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર ભાલા;

શુભવીર વિનોદ વિશાલા, મંગલ શિવમાલ તીરથ૦ ૮

૨૧૩

કલશ.

(ધન્યાત્રી. રાગેણ ગીયતે)

ગાયો ગાયોરે વિમલાચલ તીરથ ગાયો
 પર્વતમાં જેમ મેઢ મહીધર, મુનિમંડળ જિનરાયો;
 તરુગણુમાં જેમ કદ્વપત્રવર, તેમ એ તીરથ સવાયોંડે. વિં ૧
 ચાત્રા નવાણું અમે ઠહું કીધી, રંગતરંગ ભરાયો;
 તીરથગુણુ મુક્તાફ્લ માલા, સંઘને કંઠે ઠવાયોરે. ગાં ૨
 શેઠ હેમાલાઈ હુકમલાઈ ને, પાલીતાણું શિર ઢાયો;
 મોતીચંદ મલૂકચંદ રાજ્યે, સંધ સકલ હરખાયોરે. વિં ૩
 તપગચ્છ સિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય સત્ય : પાયો;
 કપૂરવિજયહું ગુરુ બિમાવિજય તસ, જશવિજયો મુનિરા-
 યોરે, વિં ૪
 શ્રી શુલવિજય સુગુરુ સુપસાયે, શ્રુતચિતામણિ પાયો;
 વિજયહેયેંદ્ર સૂરીશ્વર રાજ્યે, પૂજા અધિકાર રચાયોરે. વિં ૫
 પૂજા નવાણું પ્રકારી રચાયો, ગાવો એ ગિરિરાયો,
 વિધિયોગે ફ્લ પૂરણ પ્રકટે, તવ હઠવાદ હઠાયોરે વિં ૬
 વેદવસુ ગાજ ચંદ્ર સંવત્સર, યૈત્રીપૂનમ દિન ગાયો;
 પંડિત વીરવિજય પ્રભુ ધ્યાને, આતમ આપ
 દરાયોરે વિં ૭

કાંચ ગિરિવરં

મંત્ર એં હીં શ્રી પરમો જલાદિક થ૦ સ્વાદો

શ્રી મહાવીર જિન પારણુ

[રાગ:- ભા તું આરાતે સુરની રાણી હો ભાત, અંભાળ
ગરબે ધૂમે છે.]

ત્રિશક્તાળુના નંદન હો લાલ, વીરજુ ગોચરી ધૂમે છે.		
નિત્ય નિત્ય કરીએ વંદન હો લાલ, વીરજુ ગોચરી ધૂમે છે.—૧		
ક્ષત્રિય કુંડમાં જામ્યા હો લાલણું;		
દેવે મહોત્સવ ઉજવ્યા હો લાલ, વીરજું — ૨		
નિર્મણ ત્રણ જાને „ „		
લોણને રોગ જાણે „ „ ૩		
ત્રીસ વરસ ગૃહવાસ „ „		
વાર્ષિકદાન જ દેખ આસ „ „ ૪		
સંયમ લઈને વિચરે „ „		
અલિથ્રહ આકરા કરે „ „ ૫		
કોસંખી નગરીમાં આવે „ „		
રોજ રોજ લિક્ષાએ જવે „ „ ૬		
આવે ને પાછા વળો „ „		
ભેદી લીક્ષા ન મળો „ „ ૭		
અલિથ્રહ પુરો ન થાયે „ „		
ચિંતાતુર સહુ થાયે „ „ ૮		
પાંચ દિન ઉના છ માસે „ „		
અંદના શેઠના ઘર વાસે „ „ ૯		
મૂલા શેઠાણીએ ભારી „ „		
માણું સુંડાંયુ એડી ભારી „ „ ૧૦		

સોંઘરે પુરી છે વળી	"	"	
ત્રણુ દિવસે લાળ મળી	"	"	૧૧
ખહાર કાઢી બાકુળા આપ્યા	"	"	
ખહાર પાસે શેઠ પહેંચ્ય	"	"	૧૨
ઉંબરે એઠી ચિતે ચંદના	"	"	
વીર પ્રલુને કરુ વંદના	"	"	૧૩
દાન હેવાના લાલ આવ્યા	"	"	
એવા ટાણુ પ્રલુ આવ્યા	"	"	૧૪
હર્ષ ધણે હૈથે પામી	"	"	
અલિંગહમાં આંસુની ખામી	"	"	૧૫
વીરળ આવી પાછા જય	"	"	
ચંદનને આંખે આંસૂભરાય	"	"	૧૬
અલિંગ પુરો તે ધારે	"	"	
મારણું કર્યું તે વારે	"	"	૧૭
એડી તૂરી ને વેળી થઈ	"	"	
પંચ દિવ્ય થયાં તે વાર	"	"	૧૮
અહે દાનની ધ્વની થઈ	"	"	
નિત્યાનંદ રણકાર	"	"	૧૯

શ્રી પાંચાજિન સ્તરબન

(રાગ-ખરમા મારા નંદજના લાલ)

વહાલું પ્રલુ પાસળજુનું નામ, માયા કેવી લગાડી (૨)

કણુ કણુમાં સો સો વાર સાંલણે,

વિસરે નહીં કોઈ કાળી માયા૦

અખસેનકુલ મંહિરે હીવો,

વામાદેવીના ખાળી માયા૦ (૧)

વાણુરસીમાં જન્મયા પ્રભુજી,
 નામ કુદુર્માર્યું પાચેકુમાર; માયા૦
 આળવયમાં અતુલ શાની,
 વૈરાગ્ય અપર્પાર. માયા૦ ૨
 માત પિતાના આશ્રથી,
 પરષ્યા પ્રલાવતી નાર; માયા૦
 ઘણાંચ્યા કુમાર કમઠ પાસે,
 અંધે એલાવતા ખંડાર. માયા૦ ૩
 નાગ ઉગાર્યો કાષ ચીરાવી,
 સંભળાય્યો નવકાર; માયા૦
 મંત્ર પ્રલાવે થથો ધરણુંદ્ર,
 મોક્ષદાયક નવકાર. માયા૦ ૪
 વાણીક દાન હઠ દીક્ષા જ લીધી,
 વિચરે વસુધાધાર; માયા૦
 મેધમાળી આવ્યો કેાપ કરીને,
 વરસાવે મેહુલાની ધાર. માયા૦ ૫
 ધરણુંદ્ર આવી મેધ નીવાર્યો,
 ગાવે પ્રભુના શુણુગાન; માયા૦
 રાગ નહિ ને રોષ નહિરે,
 સમલાવે એકતાન. માયા૦ ૬
 કમે ખપાવી કેવળ પાભ્યા,
 કીધા બહુ ઉપકાર; માયા૦
 સમેત શિખરે મોક્ષે સિધાંયા,
 નિત્યાનંદ શાણુગાર. માયા૦ ૭
 ઇંત ગારિરાજ સ્પર્શનીા

* * * * *
ઉપસંહાર
* * * * *

‘શ્રી ગિરિરાજ સ્વપ્નશિના’ આ ‘પુસ્તિકાનુ’ લખાણ ચૂણું કરતા પહેલાં આનું ઉત્થાન શી રીતે થયું, તે જણાવવું આપણું છે.

સિદ્ધાંતમહેદાધિ ગાંધાધિપતિ પૂજય આચાર્ય લગ્નવંત શ્રીમહુ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની આશારી તેઓશ્રીના પદૃપ્રલાવક-મારા “પૂજય શુકુદેવ-આચાર્યદેવ-શ્રીમદ્દિજયજી ખૂસૂરીશ્વરજી” મ૦ સાહેબ આદિશર આડ મુનિરાજેનું સં ૨૦૧૫નું ચાતુર્માસ પાલીતાણું (આરીસા-ભૂવન) માં થયું હતું. ત્યાં પૂરો ૫૦ શ્રી લક્ષ્મિવિજયજી ગણિવર, પૂરો મુનિરાજ શ્રી ગુણવિજયજી મ૦, પૂરો સુરો શ્રી લાવવિજયજી મ૦ આદિ ઠાણું < પણ ચાતુર્માસ રહેલા હતા.

પૂજયપાદ આચાર્ય ગુરુદેવશ્રીની નિશ્ચામાં ચાતુર્માસ દરમ્યાન વિવિધ તપશ્ચિર્યાએ અને સૂત્રોની વાચનાએ વગેરે આરાધનાએ ધણીજ થઈ હતી. પૂજય ગુરુદેવશ્રીએ વર્ધમાનતપની ઉજ મી એળી કરી હતી, પૂજય ૫૦ શ્રી વર્ધમાનવિજયજી ગણિવરે નવ ઉપવાસ, પૂજય ૫૦ શ્રી દૈવતવિજયજી ગણિવરે પીસ્તાલીસ ઉપવાસની મહાનતપશ્ચિર્યા, પૂરો સુરો શ્રી મનોગુપ્તવિજયજી આદિ મુનિરાજેએ લાગટ આયંખીલો અને શ્રી વર્ધમાનતપની

અનેક ઓળિઓ કરી હતી. ચાતુર્માસમાં શ્રી શાંતિસનાત્ર, શ્રી સિદ્ધયક મહાપૂજાન, આદિ શ્રી જિનેન્દ્ર લક્ષ્મિ મહેત્સવોને અનેક થયા હતા. છેલ્ખાં છએક વધોથી પાલીતાણુભાં ઉપધાન બીજુલ થયાંન હતાં, તે પણ પહેલ વહેલાં પૂજય-શ્રીની નિશ્ચામાં થયાં હતાં. આથી આખું ચાતુર્માસ શાસનની યાદગાર પ્રભાવનાપૂર્ણ ખુબ દીખ્યું હતું. ચાતુર્માસ પછી પણ માલારાપણુનો શ્રી અણોતારી બૃહત્શાંતિસનાત્રાદિ મહેત્સવ, એ બહેનોની લાગવતી દીક્ષાઓ, કદમ્બગિરિ તીર્થનો સંધ, શ્રી ગિરિરાજ ઉપર શ્રીજિનભિમાણેની પ્રતિષ્ઠા, સાધુ સાધી આદિની લક્ષ્મિવયાવર્ય માટેની ચોચ્ય વ્યવસ્થા, તથા પૂજય શુરૂદેવે શ્રી સૂરિમંત્રનાં પાંચે પ્રસ્થાનોની આરાધના સવિધિ સંપૂર્ણ કરી, તેનાં ઉજવણીનો શ્રી પંચાંગિકા મહાલિષેકાદિ મહેત્સવ, ઉપરાંત પૂજયશ્રી આદિ મુનિવરોને હદ યાત્રાઓ વગેરે ઘણી આરાધનાઓ થઈ હતી.

આ દરમ્યાન મારે ચૂડાથી ધર્મ ચાતુર્માસ પૂર્ણ કરી કારતક વહ ૧૧સે વિહાર કરી સુરેન્દ્રનગર પૂજયપાદ ગંધાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્બિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબને વંદનાદિ કરી પૂજય શુરૂભાતા પંચાસજી મહારાજ શ્રી જ્યાનત્વિજયજી ગણિયુવર આદિ સાથે વિહાર કરી અનુહક્મે પાલીતાણે પૂજયપાદ શુરૂદેવશ્રીની સેવામાં આવવાનું થયું હતું.

પૂજય શુરૂદેવશ્રીને સૂરિમંત્રનાં પાંચ પ્રસ્થાનની આરાધના ચાલતી ડેવાથી તે પૂર્ણ થાય ત્યાં સુધી મારે ત્યાં

રોકાવાનું હતું. તેથી શ્રી સિદ્ધગિરિલની નવાળું યાવા અભંડ
આયંધીલથી કરવાની શાવનાથી પૂજય શુરૂહેવના આરીવાંદ
લઈને યાનાંએ શરૂ કરી હતી.

શ્રી વર્ધમાનતપમી સો ઓળિ ખ્રીં કરનાર પૂજય
મુનિરાજ શ્રી લાવવિજયજી મહારાજે ચોમાસામાં
સિદ્ધમલાલી શ્રી સિદ્ધગિરિરાજ અંગે સાહિત્ય લખવાની
પૂજય આચાર્ય શુરૂહેવને વિનાંતિ કરી હતી, પરંતુ પૂજયશ્રીને
ને પ્રવચનો વાચનાંએ તથા શાસનની ખીલુ અનેકવિધ સ્વપર-
કલ્યાણુકરિ સેવા અને આરાધનાની પ્રવૃત્તિઓમાં ખાસ
ટાઇમ નહિ મલતવાથી પૂજય શુરૂહેવશ્રીએ તે લખવાની મને
આજ્ઞા ઝરમાવવાથી, પૂજયપાંદ શુરૂહેવના આરીવાંદથી મે
તે અંગે આ પહેલાં પ્રગટ થયેલું સાહિત્ય નેઈને તથા
કેટલીક પૂછપરછ કરીને આ બુક સરલ લાપામાં લખવી
શરૂ કરી. આ બુકમાં કે ચાર વિભાગો પાડવામાં આવેલ તેમાં
પહેલા વિભાગમાં શ્રી ગિરિરાજ અંગેની માહિતિ, ખીલ
વિભાગમાં પાલીતાણું સ્ટેશનથી માંડી આખા ગિરિરાજમાં
આવતા સ્થાનેની જરૂરી નોંધ, દહેરાસર અંગેની દુંકવિધિ,
તથા આવશ્યક સૂચનાઓ વગેરે, બ્રોક વિભાગમાં નવાળું
યાવા સંબંધી અધી વિધિ વગેરે અને ચોથા વિભાગમાં
માંચ ઠેકાણું કરવામાં આવતાં ચૈત્યનંદનો સૂત્રો સાથે તથા
શ્રી સિદ્ધાચલજી આદિ સ્તવનો, ચૈત્યનંદન, વગેરે ખાસ
હાખત કરેલ છે.

આ આખી બુક લખવામાં શ્રી શાનુંજ્યમાહાત્મ્ય,
શાનુંજ્યયાત્રાચિચાર, શાનુંજ્યતીર્થદર્શન જનતીર્થસર્વસંગ્રહ

સાગ હેઠો, આહિની અદ્ભુત લેવામાં આવી છે. તથા પૂજય શુરુદેવશ્રીના માર્ગદર્શનથી અને પૂજય પંન્યાસળુ મહારાજ શ્રી વર્ધમાનવિજયળુ ગણિષુવર, નાયાતિવિંડ પૂજય પંન્યાસળુ મહારાજ શ્રી રૈવતવિજયળુ ગણિષુવરાહિ શુરુલાઇએની સહાયથી ઘણા થોડા ટાઈમમાં આ ખુક લખી શક્યો છું. આ પુસ્તકનું નામ ‘ગિરિરાજ સ્પર્શના’ પૂજય શુરુદેવની સૂચનાને આભારી છે.

આ ખુક પૂર્ણ થવાની સાથે મારે આયંગીદથી ૬૬ ચાત્રા પૂર્ણ થવી, પૂજયશ્રી શુરુદેવને પાંચે પ્રસ્થાનની આરાધના સંપૂર્ણ થવી અને તે નિમિત્તે શ્રી પંચાંશ્કિંડા મહેતસવની ઉજવણી પૂર્ણ થવી, આ બધું સાથે પુરુષાય છે. તે સોનામાં સુગંધ મલવા જેવું બનેલ છે. આ થઈ પ્રથમાવૃત્તની વાત.

પ્રથમાવૃત્તિની નકળો વાચક વર્ગમાં જલ્દી ખપી જતાં તેની ઉપરા ઉપરી માંગ વધી રહી હતી. પૂર્ણ શુરુદેવશ્રીનું સં ૨૦૧૭ તું ચાતુર્મોસ ડલોએ સાગરના ઉપાશ્રેષ્ઠયું હતું. ચાતુર્મોસમાં ત્યાં પણ તપશ્ચયોએ, સૂત્રવાચનાએ, શાંતિસ્નાત-સિદ્ધ્યકપૂજનાદિ ઉત્સવ મહેતસવો, આગમમંહિરની પુસ્તક વ્યવસ્થા અને શાસન-સંધ-તથા સમાજ હિતનાં બીજાં અનેક ધર્મ કાર્યો થયાં હતાં. પૂજયશ્રીના ઉપદેશથી સ્થાપન થયેલ આર્ય જંખૂસવામિ જૈન સુકતા-ભાઈ આગમ મંહિરને ૨૫ વર્ષ થતાં હતાં તથા શાંતતપસ્વી-પ્રવર્ત્તિની જ્ઞાનવી કલ્યાણુશ્રીઝ ડલોએવાલાએ શ્રી નવડાર ગંગના ૬૮ ઉપરોક્ત કરેલા, શ્રી વર્ધમાનતપની ૫ એણીએ કરેલી, તે વરોરને અનુલક્ષીને પૂજયશ્રીની

નિશામાં ચોમાસા ખાદ ચાલુ સાહે આંખાના ધર્મપ્રેમી શેડ
 શ્રી છગનલાલ લક્ષ્મીચંદ મુંબદ્યવાલા તરફથી, તેમનાં
 ધર્મપત્ની અ. સૌ. મંનુલાલેને શ્રી નવપદળની ઓળિ
 વગેરે તપશ્ચર્યા કરેલ, એટલે આ નિમિત્તે કારતક વદ ૪ થી
 ૧૧ સુધી લારે નવછોડાનો રજતાદિ ઉધાપન અણાદ્વિકા
 મહેતસ્વ, સિદ્ધયક્ષાદિ પૂજનવિધિઓ સાથે, લારે અપૂર્વ ઠાડ-
 માડથી ઉજવાચેલ હતો. અને પૂજયશ્રીના ઉપદેશથી ત્યાં ફર્ણ-
 નોનો ઉપાશ્રય અતિ જિણું થઈ ગયેલ હોએ તેને જિણોદ્વાર
 કરવાનું સંઘે નક્કી કરી ક્ર. સુ. ૧ મે શેડ છગનલાલના
 શુભ હસ્તે ખાતમુદ્દર્દી કરાયું હતું.

ખાદ, આંખાગામમાં છગનલાલ તરફથી દેવાધિદેવ
 શ્રી વાસુપૂજય ભગવંત આદિ ત્રણ જિનભિન્નો
 વગેરે પ્રતિષ્ઠા કરાવવાની હોવાથી તેઓની તથા આંખા-
 સંઘની સાગ્રહ વિનાંતિથી ક્રાસ૦ વદ ૧ મે પૂજયશ્રીએ
 સપરિવાર ડસોએથી સૌરાષ્ટ્ર તરફ વિષાર કર્યો હતો. પૂજય-
 શ્રીની લાવના શ્રી સિદ્ધગિરિજીની શૈત્રીપુનમ-અખાત્રીજીની
 યાત્રાએ કરીને આંખા જવાની હતી, પરંતુ પૂજયપાદ પરમ
 ગુરુદેવ શ્રી ગંધ્રાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમહિંદ્રાધિ-
 પ્રેમસૂરીશ્વરજી મહારાજનો આહેરા મળતાં પૂજયશ્રી
 માતરથોજ અમહાવાદ તરફ પૂજયપાદ ગંધ્રાધિપતિ ગુરુ-
 દેવની સેવામાં પદ્ધાર્યા હતા. શૈત્રવદ ૫ ના શુભ દિને
 અમહાવાદ જ્ઞાનમંહિરના વ્યાખ્યાન હોલમાં પૂજયપાદ ગંધ્રાધિ-
 પતિ પરમ ગુરુદેવના અનુશ્રદ્ધથી ઘડાયેલું સામુદ્દાયિક
 એકતાનું નિવેદન વાંચી સંભળાવવાનો લાલ પૂજયશ્રીને

મહિયો હતો, પછી સામુદ્દરિક અંધારણું પૂજયપાદ શ્રી અદ્વિજયરામચંદ્રસૂરીશરળ મહારાજ સાહેબે વાંચી સંલગ્નિયું હતું. આથી સક્રિય શ્રી ચતુર્વિંદિ સંઘમાં આનંદ આનંદ વાપી ગયો હતો.

આ સમયે મારે પણ બોરસદથી ચાતુર્માસ ખાદ વિહૃાર કરી અહીં આવવાનું થયું હતું. ધર્મપ્રેમી શેડ અ મૃતલાલ ભવાનળુભાઈ પણ પૂજયશ્રીને માલણું પધારવાની વિનંતિ કરવા પાલનપુરથી આવ્યા હતા. હેઠે શ્રી સિધ્ધગિરિલુ તાત્કાલિક જવાય તેટલો સમય રહ્યો ન હતો. આ અન્થની દ્વિતીય આવૃત્તિ દ્વારા આત્માને શ્રી ગિરિરાજની ભાવસ્પર્શના થાય તેમજ વાચકોની ય માગણીને યથોચિત લાલ મળે એવી શુલ લાવનાથી ૫૦ જ્યોતિર્વિંદ પંન્યાસલ મહારાજ શ્રી રૈવતાંગન્યલુ ગણિયવરે આ કાર્યની પ્રેરણું કરી. સુશ્રાવક અમૃતલાલાઈએ આ શ્રુતજ્ઞાનલક્ષ્મિને પ્રકાશનદ્વારા પોતાને લાલ મળે અને સદર પુસ્તકમાં શ્રી સિધ્ધગિરિલુની નવાણું પ્રકારી પૂજન દાખલ કરાય એવી ઇચ્છા પૂજયશ્રીના ચરણુમાં પ્રકાશિત કરી. કહેવાની જરૂર નથી કે આ કારણોથી સુધારા વધારા સાથે આ બીજી આવૃત્તિ તૈયાર કરવાનો મને કે લાલ મળ્યો તેનો હું પૂર્ણ આનંદ અનુભવું છું. આ આવૃત્તિમાં ઉપરના ચાર વિલાગો ઉપરાંત એક પાંચમો વિલાગ ઉમેરવામાં આવ્યો છે અને તેમાં શ્રીશુલબીરવિજયલુ મહારાજની બનાવેલી શ્રી નવાણું પ્રકારી પૂજન સંપૂર્ણ દાખલ કરી છે. શ્રી ગિરિરાજ સૂપર્શનાની આ આવૃત્તિ

મારા ભવ્યતોદ્ધારણ પૂજય પરમોપકારિ ગુરુહેવશ્રીને કૃતશ
બાવે સમર્પણ કરી હું કિંચિતકૃતાર્થ થાડ છું.

ગ્રાન્તે આ પુસ્તક લખવામાં તથા સચેવાન કરવામાં
અદ્વયમતિ એવા મારાથી જે કાંઈશ્રીજિનાશાનિર્દ્ધલખાયું
હાય કે છદ્રસ્થભાવે ભૂલચૂક થઈ હાય તેનો મિચ્છામિ-
હુક્કડં દેવા પર્વક તેથી ભૂલો સુશ વાચકો મને જે જણા-
વશે તેનો સુધારા ત્રીજી આવૃત્તિમાં કરવા ધ્યાન રાખીશ,
એવી શુલ મનોકામના સાથે હું વિરમું છું:

ઈતિ પૂજય આગમ પ્રત્ય શાસનપ્રભાવક આચાર્ય ગુરુહેવ શ્રીમહ્રિ-
નયજન્યસુરીરથજ મહારાજ સાહેબના શિષ્યરત્નમુનિ શ્રી નિત્યા-
નંદ નિરાજ સચેવાનિત શ્રી ગિરિરાજસર્પર્ણના સમાપ્ત.

સં ૦ ૨૦૧૮ વૈશાખવદ ૭ મે આંખામાં પ્રલુબુ

પ્રતિષ્ઠાનું ગીત

[૨૨૦ મુનિ શ્રી જિદ્ધાચલવિજ્યજ]

વરસાવો મોતીઠાના મેહ પ્રતિષ્ઠા ઉમંગે કરી,
આજે પાવન થઈ આ દેહ; પ્રતિષ્ઠા ઉમંગે કરી.
સાધિ ! સોનાનો સૂરજ ઉઘ્યો આંગણિએ,
તન મન ઉદ્ઘસે આંતર પ્રાંગણિએ,
મેં તો સફળ કીધ્યા અવતાર; — પ્રતિષ્ઠા ૧
સૌરાજ દેશો આંખાગામ સોહામણું;
શ્રી વાસુપૂજય દેખી મન હરએ ધણું,
માકલી કંકાન્તી દેશો દેશ; — પ્રતિષ્ઠા ૨
વાંચો કંકાન્તી લાવિકો ઉદ્ઘસે આવે,

સકલ સંધનાં હુયે હું ન માયે,
 નિત્ય નવકારશી પુઅહિ થાય; — પ્રતિષ્ઠાં ૩
 સુહિ વૈશાખ દ્વાદશ અતિ સોહે,
 પધારે જંબૂસૂરિલુ સહુ મન સોહે,
 હિન હિન લાવોહ્રાસ થાય; — પ્રતિષ્ઠાં ૪
 ધળ-પૃતાકા બોર્ડ મંડપાહિ શોલે,
 નિરખી નિરખી સહુનાં મન લોલે,
 ઉત્સવ પ્રારંભ ચીછો થાય; — પ્રતિષ્ઠાં ૫
 ક્રવજ કલશ અહ્નાકિ પુજને,
 શાંતિ તુષિ પુણિ થાય તન મનને,
 અંદ્રુ વૃદ્ધિ સહા સુખદાય; — પ્રતિષ્ઠાં ૬
 લય્ય વરધોડો ચડે જલયાત્રાનો,
 કૃષ્ણ બષિ તિથી શુક્રવારનો,
 પ્રભુરથે ચઢે શાનદાર; — પ્રતિષ્ઠાં ૭
 પ્રભુ વાસુ પુજય બિરાજે ગાહીએ,
 મારાં હૃદ્ય નાચી ઉઠે, સૈતમીએ
 વર્તે છે જય જયકાર; — પ્રતિષ્ઠાં ૮
 પ્રતિષ્ઠા ઉત્સવ કરે શ્રીછિગનભાઈ,
 આમ જમણ કરે સંઘ સુખદાયી,
 આપે આમજન સહકાર — પ્રતિષ્ઠાં ૯
 આંખા સંધની વિનાતિ માન્ય કરી,
 પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યો જંબૂસૂરિ,
 સાથે શિષ્યાહિ સસુહાય; — પ્રતિષ્ઠાં ૧૦
 ગ્રેડ સંધને વર્ધમાન — રૈવતવિજય,
 હૈવબદ્ર - મનોગુણ - લાખધસેનવિજય,
 ગાવે સિંહાચળ - મહાશાલ; પ્રતિષ્ઠાં ૧૧